

જીવનપ્રેરક ચિંતન રણો

સંપાદન
મૂકેશ એમ. પટેલ
કૃતિ એસ. શાહ

जो स्वाज्ञ तभे सेवी शाऊ...
तो साडार खेने उरी शाऊ!







જીવનપ્રેરક ચિંતન રણો

INSPIRATIONAL GEMS TO EMPOWER YOUR LIFEનો ગુજરાતી ભાવાનુવાદ
© મૂકેશ એમ પટેલ

વ્યક્તિગત ઘડતર માટે સંચય

'ઈસ્પેશનસ અનલિમિટેડ'

ટેક્સ પ્લાનિંગ હાઉસ, ઉસ્માનપુરા અંડરબ્રીજ ઉપર, અમદાવાદ-૩૮૦૦૧૩, ભારત.

ફોન: (૦૭૯) ૨૭૫૫ ૧૫૬૪, ફેક્સ: ૨૭૫૫ ૨૧૧૦

E-mail: inspirations.unlimited.in@gmail.com

દ્વિત્ય ગુજરાતી આવૃત્તિ

જાન્યુઆરી, ૨૦૧૪

કિંમત

ભારતમાં: રૂ. ૨૦૦/-

વિદેશમાં: US \$ 10, UK £ 5

સાભાર સ્વીકૃતિ

સંપાદકો એ તમામ નામી તેમજ અનામી લેખકો તેમજ કવિઓનો ઊરો આભાર માને છે,
જે મના કાર્ય અને કૃતિઓનું આ વ્યક્તિગત ઘડતર સંચયમાં સંકલન કરાયું છે.

નામોલ્યેખ કરવામાં રહી ગયેલી કોઈ પણ ક્ષતિ પ્રતિ ધ્યાન ખેંચવામાં આવશે
તો તે સંબંધી યોગ્ય સુધારો આગામી આવૃત્તિઓમાં કરવામાં આવશે.

ફોટોગ્રાફ્સ

મૂકેશ એમ. પટેલ અને સૌમિલ યુ. શાહ

ઇઝાઈન અને લે-આઉટ

નીલેશ દવે, સ્ટેટ્સ ઈન્ક.

મુદ્રણ

સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ., કાંકરીયા, અમદાવાદ-૩૮૦ ૦૦૨૨.



જીવનપ્રેરક ચિંતન રણો

પ્રેરક કાવ્યો, બોધ કથાઓ
તેમજ મનનીય ચિંતનકણિકાઓનું
સુંદર અને કલાત્મક સંકલન
જે તમારા મન
તેમજ આત્માના પુષ્ટિકરણ સાથે
કલ્યાનાતીત ક્ષિતિજો ખોલી
તમારા જીવનને સદાભહાર બનાવશે!

સંપાદન

મૂકેશ એમ. પટેલ
કૃતિ એસ. શાહ

ગુજરાતી ભાવાનુવાદ સહકાર
મીરા બહુ





જોકો
તેમની પરિસ્થિતિ માટે
સંજોગોવે
દોષ આપ્યા કરે છે!

કું સંજોગોમાં
માનતો નથી!

કું માનું છું કે
આ દુનિયામાં
એવા જ લોકો
આગળ વધી રહે છે...

જો લોકો ઓબા થઈ
તેમના રીસ્થિત સંજોગોની
શોધ કરે છે...
અને જો તે મળે નહીં
તો તેવા સંજોગોનું
સ્વયં નિમાણ કરે છે!

જ્યોત્સ્ના બન્દી શાં

મૂકેશ એમ. પટેલ


જાણીતા આંતરરાષ્ટ્રીય કર-નિષ્ણાત, મખર મેરણાત્મક વક્તા, નિષ્ણાવાન પ્રાધ્યાપક, લોકપ્રિય કટાર લેખક, અનોખા પુસ્તકોના સર્જક, ફુશણ ટી.વી. એન્કર, વાપક વિશ્વ પ્રવાસી, સિદ્ધહસ્ત ફોટોગ્રાફર, શતક રક્તદાતા તેમજ અનેક હેતુલક્ષી પ્રવૃત્તિઓના સમર્થ પુરસ્કર્તા... એ મૂકેશ પટેલની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવે છે. વક્તૃત્વ કલા ક્ષેત્રે તેમની ઉલ્લેખનીય સિદ્ધિઓના સન્માન સ્વરૂપ તેમને અમેરીકાના ‘હોલ ઓફ ફેમ એક્લેમ ઓફ ધ વર્લ્ડ એક્ડમી ઓફ સ્પીકર્સ’નું બહુમાન તેમજ ઇંગ્લેન્ડના ‘આઉટસ્ટેન્ડિંગ અપીકર ઓફ ધ ટ્રેવેન્ટિઅથ સેન્ચ્યુરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તેમણે ‘મૂકેશ એમ. પટેલ - એ.એમ.એ. એકેડેમી ફોર પલ્બિક સ્પીકર્સ’ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ’ની સ્થાપનામાં મૂલ્યવાન સહયોગ આપ્યો છે. આ ઉપરાંત વ્યાવસાયિક તેમજ ઇતર પ્રવૃત્તિ ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સરે અનેક પ્રતિભાવંત એવોર્ડ અને સન્માન એનાયત થવાનું તેઓ અનેરું ગૌરવ અને સિદ્ધિ ધરાવે છે.



તેમની આગવી દ્રાષ્ટિ અને નેતૃત્વ શક્તિ દ્વારા તેમણે અનેક અગ્રણી સંસ્થાઓનું સંવર્ધન કર્યું છે. મેરણાત્મક વાચન અને સર્જનાત્મક ફોટોગ્રાફી તેમના પ્રિય શોખ રહ્યા છે અને વિશ્વના તમામ છ બંડોના ૮૦થી પણ વધુ દેશોમાં પ્રવાસ કરી તેમણે હજારો તસ્વીરો બેચવાનો આનંદ મેળવ્યો છે. ‘ઇન્સિપ્રેશન્સ અનલિમિટેડ’ના સંસ્થાપક તરીકે તેમણે અનેક મેરણાત્મક અને ચિંતનાત્મક પુસ્તકો તેમજ ફોટો કેલન્ડરો પ્રકાશિત કર્યા છે તેમજ વ્યાખ્યાનો રજૂ કર્યા છે. ‘અરાઉન્ડ ધ વર્લ્ડ થુ અ લેન્સ આઈ’ તેમજ ‘કલરકુલ જાપાન’ના તેમના ફોટોગ્રાફેશનના પ્રદર્શનોને પણ અદ્ભુત સરાહના મળી છે.

કૃતિ એસ. શાણ

માર્કાટિંગ અને કોમ્પ્યુનિકેશન્સ ક્ષેત્રે પ્રતિભાવંત વ્યાવસાયિક એવા કૃતિ શાહ તેમના કન્સલટન્સી આઉટફિટ ‘શિક્કિંગ ઇન્ક’ના સ્થાપક પ્રણોત્તા હોવા ઉપરાંત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે વિક્લિટિંગ ફેકલ્ટી તરીકે સંકળાપેલા છે. ટાટા મેક્યુના હિલ દ્વારા પ્રકાશિત ‘એડવર્ટાઇઝિંગ’ એન્ડ ઇન્ટિગ્રેટેડ માર્કાટિંગ કોમ્પ્યુનિકેશન્સ’ના તેઓ લેખિકા પણ છે. માર્કટ રીસર્ચ પ્રોડક્ટ લોન્ચ, બ્રાન્ડ મેનેજમેન્ટ તેમજ વેબસાઇટ કોમ્પ્યુનિકેશન્સના વિશિષ્ટ ક્ષેત્રોમાં અમેરિકા તેમજ ભારતમાં કામ કરવાનો તેઓ બહોળો અનુભવ ધરાવે છે. તથીબી ક્ષેત્રે કોર્પોરેટ શીલર એવી નવલક્ષ્ય ‘અકીલા ટ્રાયલ્સ’ના લેખિકા તરીકે પણ તેમણે સરાહનીય પ્રતિભાવ સંપાદન કર્યો છે.



નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ગોલ મેડલ સાથે એમ.બી.એ.ની ડિગ્રી મેળવીને, કૃતિએ શિકાગોની પ્રતિષ્ઠિત સ્ટુટ્ટર્ટ બિઝનેસ સ્ક્યુલમાંથી માર્કાટિંગ કોમ્પ્યુનિકેશન્સના વિષયમાં માર્ટર્સની સિદ્ધિ હાંસલ કરી. નાનપણાથી કૃતિના પ્રિય શોખ ભરતનાટ્યમ તેમજ કુચીપુરી નૃત્યકલા તથા પેઠિંગની તેમની કલાચે સર્જનાત્મકતાને અનોખી વાચા આપી છે. સર્જનાત્મક શોખને હેતુલક્ષી પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી કૃતિએ ‘ધ હાઇવ-હેર હોલીજ શ્રાઇવ’નું સંસ્થાપન કર્યું છે.

સર્જન પાછળાનું દર્શન

રજ્જસંગ્રહમાં સમાયેતાં પ્રેરણાખિન્દુ!

રચનાત્મક મનોવલાણ અને ટઠ શ્રદ્ધાને
દિશા મળે જો
હેતુલક્ષી જીવન ધ્યેય અને સમર્થ પ્રેરણાની
તથા મળે સમર્થન
અથાગ ઉદ્ઘાટ અને સ્નેહાળ કરુણાના
તો નિશ્ચિયત સિદ્ધ થાય
અદ્ભુત સફળતા અને સુખ અપાર
તેમજ
શાશ્વત સમય કાળ માટે જીવન યાત્રામાં
ધન્યતા મળે
સંસ્કારી ડાપડા અને અસીમ કૃપા પરમાત્માની!



સંપાદકોના હસ્તાક્ષરે...

તમારા જીવનમાં શક્તિ સીયવા...
આ ફૂટિ-સંચયમાં સંગ્રહિત જીવન પ્રેરક ચિંતન રત્નો
અમારાં સર્જન નથી...
અમે તો એને માત્ર સંપાદિત કર્યા છે
વિશ્વની નામાંડિત અને તેજસ્વી હસ્તીઓના
અદ્ભુત વિચારો અને ઉદ્ગારોના વાંચન-મનન થી!
આ મહામાનવોના અમૂલ્ય પ્રદાનનું
આપણે આનંદસભર રસપાન ન કરી શકીએ...
તો અન્ય કોના ઉપર આધાર રાખીશું?

Kruti

કૃતિ

Lunkerh b/n. patel

મૂકેશ એમ. પટેલ

ખજાનાની રત્નાવલી

મનોવલણાની અજાયબીઓ

મનોવલણા	૨
ચોકઠાની બહાર નીકળો!	૩
શુભ ઈંછો... શુભ પામો!	૪
જેવા તમે વિચાર કરશો	૬
ચાહો તેવા બનો!	૮
મહત્વની છે જીવનદાષ્ટિ!	૧૦
પ્રત્યક્ષની પેલે પારનું દર્શન!	૧૧
બધો દોર વલણના હાથમાં!	૧૩
સમર્થ વલણ અને સ્વખનું સામર્થ્ય	૧૪

શ્રદ્ધાના ચમત્કાર

તમે સમર્થ છો... જો તમે માનો તો!	૧૮
શ્રદ્ધા વિચરે છે ગિરીશૃંગોમાં!	૧૯
સર્જનાત્મક ચિંતન	૨૦
ભમરી	૨૦
‘અસંભવ’ને તડીપાર કરો!	૨૧
આત્મ-ધારણાની ચુંબક-શક્તિ!	૨૩
‘અશક્ય’ને ‘શક્ય’ કરી આણ્યું!	૨૪
શ્રદ્ધાનું પ્રેરકબળ!	૨૬
અજ્ઞાત મનની શક્તિ!	૨૭
ભીતરના આઈન્સ્ટાઇનનો શોધો!	૨૮
શીપલી	૨૮
તમારી સંકલ્પશક્તિનો સ્વીકાર કરો!	૩૦

ધ્યેયનું ગતિશાસ્ત્ર

મારા જીવનને પલટાવનારા પાંચ પ્રશ્નો!	38
ધ્યેય નક્કી કરવા માટે એક સુંદર દૃષ્ટિત!	34
સામે ઉભેલી ટેકરીઓ	36
સાચી દિશાનું મ્યાણ!	39
આટાપાટાની રમત	38
દોરી ખેંચો!	38
લક્ષ્યાંકો વગર ખેલ કેવો?	38
તમારું જીવન ધ્યેય	40
તમારા જીવનના કોલંબસ બનો	42
સરધસની ઈયણો	43
જે મણો સેતુ બાંધ્યા	44
ઇટકબારીઓનો નાશ કરો!	45
લક્ષ્ય એ ઈંધણ છે!	46
સર્વાંગી સ્વાસ્થ્યનું દર્શન!	49

પ્રેરણાનો જાદુ

પ્રેરણાની અદ્ભુત શક્તિ!	40
આશાવાદીનો જીવનમંત્ર!	49
જે કાંઈ છો, તેમાં સર્વોત્તમ બનો!	42
મન તેમજ આત્મા માટેનું પોખણ!	43
અંદરનો તાર રણજાળવો!	48
મોટામાં મોટી કરુણતા!	44
જોખમ	46
પ્રેરણાદ્યાયી વિચારો!	48
ઉત્સાહ હલાવી શકે... માનવી તેમજ પર્વતને	48
જાત સાથે ઉત્સાહપૂર્ણ વાત!	50
સાધનસંપન્નતા	59
અનુકૂલન અને આદતો	62
સફળ થવાની તીવ્ર ઝંખના!	63

ઉચ્ચમની શક્તિ

સંઘર્ષ વિના સફળતા નહીં!	૬૬
કુહાડીને ધારદાર રાખો!	૬૭
તરતા રહો!	૬૮
એક-એક ડગલે મંજિલ પહોંચાય!	૬૯
ધીરજ અને ખંત	૭૦
ઓકાયતા	૭૧
છોડશો ન મેદાન કદી!	૭૨
ખંખેરી નાંખો અને ઉપર ચઢો!	૭૪
તમારું ભાવિ તમારા જ હાથમાં!	૭૫
ખંત	૭૬
સદાસર્વદા સર્વોત્તમની ઝંખના!	૭૬
સમસ્ત વસુંધરા તમારી જ છે!	૭૭
ભયનો સામનો કરો!	૭૮

કલાણાની ઉષા

ધર એ, જ્યાં પ્રેમનો પોકાર!	૮૨
કોઈક માટે કશુંક તો કરો!	૮૩
કોઈનું સર્વાધિક ભલું	૮૪
આપીને હું પામું છું!	૮૪
બીજાને મદદ કરો	૮૬
ક્ષમા શું કામ?	૮૭
પરસ્પર હુંફ અને ભાગીદારી	૮૮
બીજામાં પ્રમાણિક રસ લેવો!	૯૦
બીજાની નજરે જોતાં શીખો!	૯૧
કટુ વચન મત બોલ રે!	૯૨
નાની શી વાત!	૯૨
અર્પણ અને ક્ષમાપન	૯૩
હદ્ય તૂટતું બચાવો!	૯૩
માનવીય સંબંધોના પારંગત બનો!	૯૪
ટીમમાં આત્મ-વિશ્વાસનું નિર્માણ	૯૪

સફળતાનું રહસ્ય

વિજયી વિરુદ્ધ પરાજયી	૮૮
સીચી દો સર્વોત્તમ... અને જીત છે તમારી!	૮૮
આ જ છે સાચી સફળતા	૮૮
આ સફળતા-નિષ્ફળતા શું છે?	૧૦૦
સફળતાનું રહસ્ય	૧૦૧
હાર માને તે બીજા!.....	૧૦૨
નિષ્ફળતાના માર્ગની બહાર નીકળો!	૧૦૩
સફળતા	૧૦૪
કરચલાથી દૂર રહો!	૧૦૬
જન્મયા જીતવા માટે, જીવ્યા ગુમાવવા માટે!	૧૦૭
સ્વ-સંચાલન માટે રચનાત્મક તનાવ!	૧૦૮
આગળ વધવા માટેની નિષ્ફળતા!.....	૧૦૮
સફળતા અનુભવતાં	૧૧૦

સુખનું ઝરણું

સુખ યાત્રામાં છે... મંજિલમાં નહીં!	૧૧૪
સુખી ભવ!.....	૧૧૫
સ્થિત જાય સર્વત્ર!.....	૧૧૬
આપણે કેટલા ગરીબ છીએ!.....	૧૧૭
લોભ ન જાણો થોભ!.....	૧૧૮
મનની શાંતિ કાજે	૧૧૯
સુખમાં શ્રદ્ધા	૧૨૦
તમારો મિજાજ	૧૨૨
પ્રસન્નચિત માનવ	૧૨૩
આફતોને ટોંગાડો જાડ પર!	૧૨૪
છે બધું તમારા હાથમાં!	૧૨૪
સુખ છે એક મનોવલાણ!	૧૨૫
આપણી નજરવિહોણી આંખો!	૧૨૬

સમયનો ખજાનો

એક સાથે એક દિવસ!	૧૩૦
કરો અત્યારે જ!	૧૩૧
સમયનું મૂલ્ય સમજો!	૧૩૨
જીવનનું ઘડિયાળ	૧૩૨
રોજના રૂપિયા ૮૬,૪૦૦!	૧૩૩
મૂલ્ય-નિષ્ઠ જીવનશૈલી... સમય કૌશલ્યની કળા!	૧૩૪
સમય કાઢો	૧૩૬
તમામ સંપત્તિમાં સૌથી મૂલ્યવાન!	૧૩૮
આજ છે ગઈકાલની આવતીકાલ!	૧૩૯
સમય સર્વોત્તમ સદાકાળનો!	૧૪૦
મનથી સદા યુવા!	૧૪૧
સદ્ગુરૂજી કે દુર્ભાગ્ય	૧૪૨
આવેગાને શમાવ... હે નાથ!	૧૪૩

જીવનની દસ્તિ

જીવન એક દર્પણ	૧૪૬
માનપાત્ર માનવ!	૧૪૭
સુવર્ણની શોધ	૧૪૮
મકાન અને તેનો ઘડવૈયો	૧૪૯
માંગો તેટલું જીવન આપે!	૧૫૦
યથાર્થ જીવનનું વ્યાકરણ	૧૫૦
સારા માર્ગદર્શકના સાથમાં	૧૫૧
જીવન તો જેવું બનાવીએ તે!	૧૫૨
હુનિયા બદલવા જતાં	૧૫૪
બહેતર 'તું' થી આરંભ કર!	૧૫૪
પ્રભુ, આપ આવા માનવ!	૧૫૪
માનવ નિર્મણ	૧૫૪
તમે ફરક પાડી શકો!	૧૫૬
તડવાળો ઘડો	૧૫૭
પાડ માનો!	૧૫૮
મિત્રોની સોગાદ!	૧૫૮
તમે ટોચ ઉપર, જ્યારે	૧૫૯

ઢાપણો બંડાર

સંઘ-ભાવના	૧૬૨
ગુણવત્તાની ચાવી	૧૬૩
બાળક શીખે આ રીતે!	૧૬૪
જવાબદાર કોણો?	૧૬૪
નાનકડી આંખો જૂએ છે તમને!	૧૬૫
પુસ્તકોની હુનિયા	૧૬૬
સદ્ગ્રંથોનો સ્વાધ્યાય કરો!	૧૬૬
વસાવો ઘરનું પુસ્તકાલય!	૧૬૭
અહંકાર	૧૬૮
નિંદ્રા તો સુવર્ણમુદ્રા!	૧૭૦
માનસપટનો નકશો	૧૭૧
શબ્દાની અદ્ભુત શક્તિ!	૧૭૨
સ્વાધ્યાયની કણા	૧૭૩
શાળાના આચાર્યને અભ્રાહમ લિંકનનો પત્ર	૧૭૪
અમર આત્માની તખ્તી પર	૧૭૪

કૃપા પરમાત્માની

વાત છે તમારી અને પરમાત્મા વચ્ચે!	૧૭૮
પ્રેરણામૂર્તિ ગણોશ	૧૭૯
જગાડ મારા દેશને, હે તાત!	૧૮૦
વૈશિક પ્રાર્થના	૧૮૦
ભીતરમાં ડોક્ફિયુ	૧૮૧
અનંત શક્તિ... અનંત સાથે એકતાર થકી!	૧૮૨
પાદચિહ્ન!	૧૮૪
ફેર પાડયો મારો પ્રાર્થનાએ!	૧૮૬
પ્રાર્થનાના ચમત્કાર!	૧૮૭
પરમ સૌભાગ્યની અનુભૂતિ!	૧૮૮
સહન કરનાર માટે જીવન-સંદેશ!	૧૮૯
નિષ્ઠળતાનો ભાસ થાય ત્યારે	૧૯૦
પ્રારંભ	૧૯૧

મનોવિદાની અજ્ઞાયબીઓ

જેવું
તમે ચાછશો
તેવા જ
તમે થવાના!

તમારું મનોવિદા
ઊંડારશો
તમારા જીવનની
ઉદ્ઘેરણ શિષ્યરો!





મનોવિજ્ઞાની અજ્ઞાયબીઓ

સારા સમાચાર
એ છે કે...

માઠા ખખર

પણ

સારામાં પલટાઈ શકે...

જો

તમે

બદળો તમાંસ

મનોવિજ્ઞાન!

મનોવલણ

જેમ જેમ, વધુને વધુ મોટો થતો આઉં છું
વધુને વધુ અનુભવતો રહું છું...
પ્રભાવ વલણોનો જિંદગી પર.

ભાષતર, પૈસા કે સંજોગો કરતાં પણ,
વળી સફળતા-નિષ્ફળતા કે બીજાં કશાંય કરતાં...
વૃત્તિ-વલણ જ
વધુ અગત્યનાં થઈ પડે છે.

દેખાવ, પ્રતિભા કે બુદ્ધિ કૌશલ્ય કરતાં પણ
વૃત્તિ-વલણ ચઢિયાતાં છે.

સોબત, ઘર કે સંબંધોને પણ
એ જોડી શકે અને તોડી પણ શકે.

ખૂબીની વાત આટલી જ કે
આજ જેવું મનોવલણ જોઈએ
તેવું કેળવવાની પસંદગી
આપણી પાસે જ હોય છે.

ભૂતકાળ તો આપણે બદલી ન શકીએ,
લોકોના રીતરસમ પણ ન બદલી શકીએ...
ન બદલી શકીએ નિયતિને.

બદલી શકીએ તેવી એક જ ચીજ છે આપણી પાસે,
જેના પર આપણે કાબૂ ધરાવી શકીએ...
તે છે આપણાં મનોવલણ!

મારા અંતરમાં ગાંડ વળી ગઈ છે કે, જીવનમાં આપણી
સાથે જે ઘટે છે, તે તો છે માત્ર ૧૦ ટકા. બાકીના ૮૦ ટકાનું
જીવન તો, ઘટના પ્રત્યેની માત્ર આપણી પ્રતિક્રિયા જ છે.

- ચાર્સ્સ સ્વીન્ડોલ

૪૮૮


જગતભરનાં
તમામ લાવ-લશકર કરતાં
પ્રબળ છે... વિચાર...
જેનો સમય પાકી ગયો છે!

- વિકટર હુગો

૪૯૧


ઓઝઠાની બહાર નીકળો!

તાજેતરમાં જ મારા એક ગ્રાહકનું નિમંત્રણ આવ્યું કે એમની પચાસ લાખ ડૉલરની એક યોજના અંગે વિચારવાની બેઠકમાં મારે હાજર રહેવું. ઇન્ફીનકોમ નામની આ કંપનીના પ્રમુખ બોબ કોઅથર હતા. સભાના પ્રારંભે જ એમણે પોતાના સંભાવ્ય ગ્રાહકો પાસે કાગળનો એક ટુકડો પહોંચાડ્યો, જેમાં નવ મીંડાં દોર્યાં હતાં. કદાચ આ કોયડો તમને ખબર હશે. ત્રણ ત્રણ મીંડાંની હાર આ રીતે દોરી હતી.



આ કોયડો ઉકેલવા કોઅથરે ગ્રાહકોને એક કે બે ભિન્નિટ આપી. કાગળ પરથી કલમ ઉઠાવ્યા વગર બધાં મીંડાંને જોડતી ચાર સીધી લીટી દોરવાનું તેમણે કહ્યું. ગ્રાહકોએ આડાઅવળા આમ તેમ ખૂબ લીટા કરી અંતે હાર સ્વીકારી લીધી.

ઉકેલ સાવ સહેલોસ્ટ છે, પરંતુ તે માટે તમારા દિમાગને મીંડાઓના ચોકઠામાંથી બહાર કાઢવાની જ જરૂર હતી.



જ્યારે કોયડાનો ઉકેલ હાથમાં આવ્યો ત્યારે કેટલાક ગ્રાહકોએ વિરોધ ઊરાબ્યો કે, “તમે તો ચોકઠામાંથી બહાર નીકળી શકાય તેવું કાંઈ કહ્યું નહોતું!”

ત્યારે બોખ કોઅથરે પૂછ્યું, “કયું ચોકહું?” ગ્રાહકો ચૂપ. તરત એમના ધ્યાનમાં આવ્યું કે મીંડાની આસપાસ કોઈ ચોકહું તો હતું જ નહીં, માત્ર નવ મીંડા એક હારમાં હતાં એટલે કાલ્યનિક ચોકઠાનો ભાસ થતો હતો. પરંતુ હકીકતે, એ માત્ર કાલ્યનિક ચોકહું જ હતું.

કોઅથરે આગળ કહ્યું, ‘તમે ચોકઠાની બહાર નીકળી ન શકો, તેવું કાંઈ કોઈએ કહ્યું નહોતું. જે રીતે તમે ‘ચોકઠા’ને ધારી લીધું એ જ રીતે તમે આ નિયમને પણ ધારી લીધો. આપણે આપણા જીવનમાં અને વેપારધંધામાં પણ રોજ આવું જ કરીએ છીએ. સાવ અકારણ જ આપણે આપણા વિચારોને સીમાબદ્ધ કરી દઈએ છીએ. હંમેશા આવું કરતાં આવ્યા છીએ એટલે એ જ ધરેડમાં આપણે વરતા રહીએ છીએ.

કંપનીને સેવા આપવાની તમારી નિષ્ઠામાં તમે આટલું સમજ લો કે તમારી સમક્ષ ઊભી થતી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે ‘ચોકઠા’ની બહાર જોવાનું રાખો. આટલી જ વાત મારે તમને કહેવાની છે.”

- સ્ટીવ શેન્ડલર

શુભ હુદ્ધો... શુભ પામો!

થોડાં વર્ષો પહેલાં, સાન ફાંસિસ્કોના અખાત વિસ્તારમાંની એક નિશાળમાં એક પ્રયોગ થયો હતો. આચાર્યશ્રીએ પોતાના ત્રણ શિક્ષકોને બોલાવીને કહ્યું, “આપણી શાળાના તમે સર્વોત્તમ શિક્ષકો છો અને ભાણવવાનો તમારી પાસે બહોળો અનુભવ છે એટલે અમે તમને ઊંચી ગુણવત્તા ધરાવનારા નેવું તેજસ્વી ચુંનંદા વિદ્યાર્થીઓ સૌંપવાના છીએ. તમારે આખું વર્ષ આ વિદ્યાર્થીઓને ભણાવી તેઓ કેટલું હીર દાખવી શકે તેમ છે તે જોવાનું છે.”

ત્રણેય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ વિચાર ઉત્તમ લાગ્યો. અને આ સૌંદર્ય આખું વર્ષ વિશેષ આનંદ અનુભવ્યો. શાળાંત પરિણામોમાં, સમગ્ર વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ કરતાં આ વિદ્યાર્થીઓએ વીસથી ત્રીસ ટકા વધારે ગુણ મેળવ્યા હતા.

વર્ષાન્ને, આચાર્ય ત્રણેય શિક્ષકોને બોલાવીને કહ્યું, “મારે તમારી પાસે એક કબૂલાત કરવાની છે. તમને સૌંપેલા વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંના નેવું વિદ્યાર્થીઓ નહોતા, તેઓ સર્વસાધારણા, સરેરાશ કક્ષાના વિદ્યાર્થીઓ જ હતા. અમે તો કુલ વિદ્યાર્થીઓમાંથી આડેઘડ ગમે તે નેવું જણાને પસંદ કરીને તમને સૌંચ્યા હતા.”

શિક્ષકોએ સ્વાભાવિક રીતે તારવી લીધેલું કે વિદ્યાર્થીઓની આવી ઝળહળતી પ્રગતિ માટે એમની પોતાની શૈક્ષણિક યોગ્યતા જ આભારી છે. ત્યાં તો આચાર્ય આગળ બોલ્યા, “મારે એક બીજી કબૂલાત પણ કરવાની છે. તમે સર્વોત્તમ શિક્ષકો પડા નથી. તમારાં ત્રણેયનાં નામ તો ટોપીમાંની ચબરખીઓમાંથી વીજાયેલાં નામ હતાં.”

તો પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આખું વર્ષ, આવી સુંદર રીતે, અપવાદ જ ગણવો પડે એ રીતે, શિક્ષણકાર્ય કેવી રીતે કર્યું?

આનો જવાબ એ કે આ સફળતા માટે સૌંદર્યેલું મનોવલણ કારણાભૂત છે. સૌંદર્યે રચનાત્મક અપેક્ષા સેવી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાની જાતમાં અને પરસ્પર એકમેકમાં પણ, આ વાત સ્વીકારી લીધી હતી અને તેમની આ રચનાત્મક અપેક્ષાઓ જ આવાં રચનાત્મક પરિણામો લાવી શકી!

જેવા તમે વિચાર કરશો...

માણસ જેવું વિચારે તેવો એ થાય છે. માણસનાં આંતરિક વલણો મુજબ જ એના બાબ્ય ચારિન્યનું કલેવર ઘડાય છે.. આ પ્રાચીન વિચારસરહીથી જેમસ અંલન ભારે પ્રમાણિત હતા. આ વિચારધારાનું પગેરું શોધતાં શોધતાં એ ઠંડ ઉપનિષદો સુધી પહોંચી ગયા હતા, જે કહે છે કે 'મન એવ મનુષ્યાણાં જન્મમોક્ષસ્ય કારણમ् ।' માણસની બંધન-મુક્તિ માટે એનું પોતાનું મન જ મુખ્ય કારણભૂત છે. ભગવાન બુદ્ધના ઉપદેશમાં, માર્કસ આંગ્રેઝિયસની ધ્યાનપોથીમાં, કન્ફૂશિયસ, મહામદ સાહેબ, એરિસ્ટોટલ, સ્ઓક્ટેસ અને બીજા અનેકોનાં કથનોમાં પણ એમને આ મૂળભૂત વિચાર સાંપડચો હતો. બાઇબલની પડા જગતાણીતી વાત - "માણસ અંતરમાં જે વિચારે છે તેવો જ એ પ્રગટરુપે બહાર હોય છે." આ બધા પ્રમાણને કારણો જ એમનું અત્યંત વિખ્યાત પુસ્તક એ સર્જ શક્યા, જેનું નામ છે, "As a Man Thinketh.' એ જ પુસ્તકમાંથી નીચેના આ અત્યંત પ્રમાણક અને પ્રેરણાદારી ફકરા ઉત્પાદ્ય છે.

બીજ વગર કોઈ અંકુર ફૂટી ન શકે એ જ રીતે માણસનું પ્રત્યેક ફૂટ્ય એના વિચારના ગુપ્ત દટાયેલા બીજમાંથી ફૂટે છે. જો એ વિચારો ન હોય તો એનાં આ કાર્યો સંભવી જ ન શકે. ફૂટિ એ વિચારનો અંકુર છે, અને આનંદ તથા પીડા બંને એનાં ફળ છે. માણસ પોતાના જ ભેતરમાં ઊગાડેલા મીઠાં કે કડવાં ફળ પોતાના કોઢારમાં ભરે છે.

માણસનું મન એક બગીચા જેવું છે. જેને મહેનત કરીને ફળદૂપ પણ બનાવી શકાય અને વેરાન જંગલ જેવું પણ રાખી શકાય. પરંતુ એને ખેડો કે ના ખેડો, એ અંદર જે કાંઈ છે તેને બહાર લાવશે જ. એમાં જો ઉપયોગી બીની વાવણી નહીં થઈ હોય અને નકામા ઘાસનાં બી અંદર વેરાયેલાં પડ્યાં હશે, તો તેમાંથી એવું જ ઘાસ પાણું ઊગી નીકળશે.

માળી જે રીતે પોતાના આંગણાને ખેડે છે, જમીનમાંથી નકામાં બી દૂર કરે છે અને પોતાને જોઈતાં ફળ-ફૂલ ઊગાડે છે, એ જ રીતે માણસ પોતાના મનની માવજત કરતો રહે, મનમાંથી ખોટા, નકામા, અશુદ્ધ વિચારો ખેંચી કાઢે અને સાચા, ઉપયોગી, શુદ્ધ વિચારોનાં ફળ-ફૂલ ઊગાડવા પ્રયત્નશીલ રહે, એવું થઈ શકે છે. આ જ પ્રક્રિયાને વાર્ણવાર કરતાં રહેવાથી માણસને સમજાય છે કે એ પોતે જ પોતાનો સર્વોત્તમ વનમાળી છે, એના જીવનનું સૂક્ષ્માન એના પોતાના જ હાથમાં છે.

બાધ પરિસ્થિતિનો એ શિકાર છે, અવું જ્યાં સુધી માણસ માનતો રહેશે ત્યાં સુધી સંજોગોનો માર એ વેઠતો રહેશે. પરંતુ જ્યારે એ સમજશો કે એ પોતે જ પોતાનો સર્જક છે અને પોતાની ભીતરની ભૌયમાં રહેલાં બીયારણ પર એ વર્ચ્સ્વ ધરાવી શકે તેમ છે, ત્યારે એ પોતે જ પોતાનો સાચો માલિક, કર્તાહત બની શકશે.

સદ્ગ્વિચારો સારાં ફળ પેદા કરે, દુર્વિચારો ખરાબ ફળ ઉગાડે છે. કોઈ પણ બાબત કે વ્યક્તિ પરત્વેના આપણા વિચારો બદલાય તો સામેથી એ બાબતો કે વ્યક્તિઓ પણ આપણા પ્રત્યેનું વલણ બદલશે. પોતાના વિચારોને ઉન્ત બનાવીને જ માણસ ઉત્થાન, વિજય અને સિદ્ધિ હાંસલ કરી શકે. પોતાના વિચારોને કેળવવા એ તત્પર ન રહે તો એ હારેલો-થાકેલો અને સદા દુઃખી જ રહેવાનો.

માણસે પોતાના અંતરમાં કોઈ સદ્ગ્રહેતુને વાવીને પછી અનું જતન કરવું જોઈએ. આ સદ્ગ્રહેતુને પોતાના તમામ વિચારોનું મધ્યવર્તી કેન્દ્ર બનાવવું જોઈએ. પોતાના વિચારો આમતેમ, ગમે તે દિશામાં ફળોળાતા ન રહે, ખોટા ભામક શેખચલ્લીના તરંગોમાં અથડાતા-કૂટાતા ન રહે એ અંગે એઝો સાવધાની રાખવી પડશે. જાત પરનો કાબૂ મેળવવા માટે અને વિચારોની સાચી એકાગ્રતા કેળવવા માટે આ જ એક રાજમાર્ગ છે. પોતાના આ ધ્યેયને સિદ્ધ કરવા માટે ભલેને એ વારંવાર હાર ખાતો રહે (જ્યાં સુધી નબળાઈને જતી ન લેવાય ત્યાં સુધી આવું તો થતું રહેવાનું) પણ અંતે એની સાચી સફળતારૂપે એના વ્યક્તિત્વનું સામર્થ્ય પ્રગટ થશે અને એના ભવિષ્યના વિજય તથા સામર્થ્યને પામવાનું એક નવું ઉગમબિન્દુ નિર્માણ થઈ જશે.

તમારા હાથોમાં તમારા પોતાના જ વિચારોનો પરિપાક આવી મળશે. તમારી જ કમાણી તમે મેળવી શકશો. જરા પણ વધુ કે ઓછી નહીં. તમારી વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારા વિચારો, આદર્શો અને જીવનદાસ્તિ અનુસાર જ તમે પડશો, આખડશો કે ઊંચે ચઢશો. તમારી સીમિત ઈચ્છા તમને વામણા રાખશે, તમારી ઉન્ત અભીષ્ટા તમને મહાન બનાવશે!

તમારા અંતરતરમાં જે દર્શનને તમે પ્રગટાવશો, તમારા હદ્યમાં જે આદર્શોને ધારણ કરશો એ જ તમારા જીવનનું ધરતર કરશો... એ જ તમારું વ્યક્તિત્વ બનાવશો. માણસ જેવું વિચારે તેવો જ એ થવાનો. માનવીનું ચારિત્ર એ એના પોતાના વિચારપુંજનો સમગ્ર સરવાળો છે!

— જેમસ અંલન

ચાહો તેવા બનો!

ચાહો તેવા તમે થઈ શકશો;
પછી ભલે ને,
નિષ્ણળતા પેલા ગરીબડા શબ્દ ‘સંજોગો’ પર...
પોતાનો સધળો દોષ ઢોળી જૂઠો સંતોષ મેળવે!
પરંતુ માંદ્યલો આત્મા
આ સંતોષને વખોડી તેમાંથી મુક્ત થાય છે.

પછી તો, એ સમયને નાથે છે, અવકાશને જીતે છે;
‘તક’ નામની મદ્દોન્ભત્ત યુક્તિબાજને...
ગરીબડી રાંક બનાવી મૂકે છે!
જૂલ્ભી સંજોગોને પણ એ પડકારી જાણો છે.
ભલે તાજવિહોણો
તો ય એક સેવક બનીને નિજપદ ગ્રહે છે.

મનુષ્યનો સંકલ્પ અદીઠને પણ જૂકાવી શકે,
અજર-અમર આત્માનું ફરજંદ બનીને...
એ ગમે તે નિશાનને તાકી શકે,
પછી ભલેને આડી સુરંગોની દિવાલો કેમ ન હોય!

મોદું થયું તેથી અધીરા ન બનો...
સમજુ-શાખા થઈ રાહ જોતાં શીખો.
જ્યારે અંતરાત્મા જાગીને દોર હાથમાં લે છે,
ત્યારે દેવાધિદેવો પણ...
પડ્યો બોલ જીવવા તત્પર થઈ ઉઠે છે!

- જેમ્સ ઇલિયટ



આવું કેમ બની શકે ?

કે

નયન જેવાં નવલખાં રણ
પામીને...

કે

કર્ણ જેવાં સુમધુર, સંગીતમય
ઉપાદાન મેળવી...

વળી

કલ્પનાઓનાં ફૂલ ખીલવવા
મસ્તિષ્ક સમી
જ્ઞાનતંત્રાઓની ભૂમિ
સાંપડી હોય ત્યારે...

પોતાને

પરમ પ્રભુથી લગીરે ઉણાં
કેવી રીતે
અનુભવી શકાય ?

- અંલન વોટ્સ

મહત્વની છે જીવનદ્રષ્ટિ!

તમે જીવનને કઈ દૃષ્ટિથી જુઓ છો, જગતને કેમ સમજો છો અને તેને શી પ્રતિક્રિયા આપો છો, એ અત્યંત અગત્યનું છે. આપણે જે રીતે જગતને મૂલવીએ એ જ જગતના રૂપરંગની વ્યાખ્યા કરશે. આપણી આશાઓ અને આપણા ભયને પણ એ જ રેખાંકિત કરશે, અને જીવનમાં આપણી આકાંક્ષાઓની સરહદો પણ એ જ બાંધી દેશે. માણસને જીવનબોધ, જીવન અંગેની સમજ જ ચોમેરથી ઘેરી વળે છે અને એ જ સર્વાકિતમાન પૂરવાર થાય છે. આપણે સૌ માનસિક પ્રદેશમાં જીવનારાં ગ્રાંડી છીએ. આપણી સ્થ્વણ ઈન્દ્રિયોમાં નહીં, બલ્કે આપણા માનસમાં જ સમજ ઉત્પન્ન થાય છે. એટલે સામે જે કાંઈ પ્રસ્તુત થાય, તેનું જે કાંઈ અર્થધટન આપણા મનમાં થાય, એ જ આપણાને દોરતું રહે છે.

ઘણીવાર દૃષ્ટિભરને કારણે જ તમે કોઈ વિચારને અવગાણો છો, એનો એક દાખલો છે. નીચેની બે આકૃતિઓ સરખાવો અને એ બે લીટીમાંથી કઈ લીટી મોટી છે તે નક્કી કરો.



સુવિષ્યાત મૂલવર-લાયરની આ અમણા-જાળ છે અને એણે વર્ષો સુધી સંશોધકોને ભટકાવ્યા છે. આકૃતિ Bમાં જે લીટી છે તે આકૃતિ A કરતાં લાંબી દેખાય છે. પરંતુ વાસ્તવમાં બંને એકસરખી જ છે. ચિત્રો એ રીતે દોરાયાં છે કે દૃષ્ટિભર થાય. આ આકૃતિઓમાં લીટીના છેડાના સૂચ્યકોની દિશા જ માત્ર જુદી જુદી છે. એક અંદર તરફ જાય છે તો બીજામાં એ બહાર ભાડી જાય છે.

આ જ રીતે તમે તમારી પોતાની અસ્તિત્વને પણ ખોટી રીતે મૂલવતા હો, તેવું ન બને? વાસ્તવમાં હોય જ નહીં તેવા મિથ્યા આરોપણો કરી તમારા પોતાના વિષેની ખોટી સમજ મેળવતા હો તેવું બની શકે. તમારાં માતાપિતા, શિક્ષકો કે તમારા ઉપરી અધિકારીઓએ તમારા વિષે, તમારી શક્તિ વિષે જે કાંઈ કહ્યું હોય તે જ શું અંતિમ સત્ય હોઈ શકે? નહીં, જરીકે નહીં! એમાંનું મોટા ભાગનું નર્યું અપ્રસ્તુત છે અને ટોપલીમાં ફેંકી દેવા જેવું છે. તમારા ભૂતકાળમાંથી આવાં બિનઉપ્યોગી ભામક દિશાસૂચનોને તમે જ્યારે ફંગોળી દેશો ત્યાર પછી જ જે કાંઈ શોષ રહેશે, તૈની તમારું સાચું સ્વરૂપ હશો!

— ◊◊ —
નવા વિચાર પર્યત પહોંચેનું માનવ-મન...
કદીય પોતાના મૂળ પરિમાળમાં પાછું ફરી ન શકે!

- આંલિવર વેન્ડલ હોમ્સ

— ◊◊ —

પ્રત્યક્ષની પેલે પારનું દર્શન!

નીચે તમને કેટલા ચોરસ દેખાય છે?

જો તમે ૧૬ ચોરસ કહ્યા તો તમે અનેકોમાંના એક ગણાશો.
જો તમે ૧૭ કહ્યા તો તમે વિશિષ્ટોમાંના એક ગણાશો. તેમ છતાંય
તમે હજુ પણ ખોટા જ છો. આ આદૃતિમાં ચિત્રકારે કેવી લીલા
કરી છે તે તપાસવા તમે આ પાનું ફેરવો તે પહેલાં, તમે જ જરા
ધ્યાનથી જોઈ લોને કે કુલ કેટલા ચોરસ છે! હવે, પાનું ફેરવો.

૧	૨	૩	૪
૫	૬	૭	૮
૯	૧૦	૧૧	૧૨
૧૩	૧૪	૧૫	૧૬

૧૭	૧૮	

	૧૯	
૨૨		૨૦
	૨૧	

	૨૩	
૨૪		૨૬

૨૭		
		૨૮

		૨૯
૩૦		

તમે પોતે જ હવે જોઈ શકો છો કે અહીં કુલ ૩૦ ચોરસ છે. ચોપડી તો તમારા જ હાથમાં છે એટલે કોઈએ વધારાના ચોરસ ઉમેરી દીધા હોય, તેવું તો બને જ નહીં. અહીં તો એ ક્યાં હતા એ જ દેખાડ્યું છે.

આ ઉપરથી બે મહત્વના સિદ્ધાંત ફિલિત થાય છે. પહેલો એ, કે ઊરતી નજર કરતાં જીણી નજરે જોવાયેલું દશ્ય કાંઈક વધુ સ્પષ્ટ દર્શાવે છે. બરાબરને? જેટલું આ ચોરસની બાબતમાં આ સાચું તથ્ય છે તેટલું જ તમારા પોતાની બાબતમાં તથા તમારી ક્ષમતા અને ભવિષ્યની બાબતમાં પણ સાચું છે. બીજી વાત એ, કે આપણામાંના ઘણાંને સાવ સીધીસટ બાબત પણ ચીંધી બતાવનાર કોઈ જોઈએ છીએ... વળી ઘણીવાર તો એ એટલું સીધું-સરળ હોતું પણ નથી.

એટલે યાદ રાખો કે નરી નજરે દેખાતા દશ્યને પેલે પાર જોવું તે એક કૌશલ્ય છે, જે તમને તમારા જીવનની પ્રગતિ અને સિદ્ધિના પંથે વહે દૂર સુધી પહોંચાડી શકે!

બધો દોર વલણાના છાથમાં!

બેઠ જણ સણિયાની ભીતર હતા...
એકની નજર હતી ભૌય ઉપરના કાદવ પર...
તો બીજાની ઊંચે તારલા ભણી!

તમને અદેખાઈ આવી જાય એવું જેરીનું વ્યક્તિત્વ હતું.
હંમેશાં એ મસ્ત રહે અને કાંઈક સારી સારી વાતો જ કર્યા કરે.
કોઈ એને પૂછે કે આજકાલ શા હાલ છે? તો એ તરત બોલી
ઉઠે, “દરિયા-શી મોજમાં છું રે!”

એની આ મનમોજ મસ્તીથી આકર્ષાઈ એક દિવસ એની
પાસે પહોંચીને મેં પૂછજું, “મને કાઈ સમજાતું નથી, જેરી! માણસ
ચોવીસે કલાક પ્રસન્ન કેવી રીતે રહી શકે? તને હંમેશાં બધું સમુસૂતરું
જ કેવી રીતે દેખાય છે?”

જેરી બોલ્યો, “જૂઓ, રોજ સવારે ઉંહું છું ત્યારે હું મારી
જાતને કહું છું, ‘જેરી, આજે તારી પાસે બે વિકલ્પ છે. કાં તો તું
પ્રસન્ન રહે, કાં શોક-સંતાપમાં.’ હું હંમેશાં મસ્તીમાં રહેવાનું પસંદ
કરું છું. જ્યારે જ્યારે કશુંક અણઘટતું બને ત્યારે કાં તો હું નાસીપાસ
થઈ જાઉં, કાં તો એમાંથી કશોક બોધપાઠ શીખું! હું શીખવા પર
કળશ ઢોળું છું. મારી પાસે જ્યારે જ્યારે કોઈ દાદ-ફરિયાદ લઈને
આવે છે, ત્યારે કાં તો હું એમની ફરિયાદ નીચે સંમતિની લીટી દોરી
શકું, કાં તો જીવનનું કોઈ વિધાયક પાસું પણ બતાવી શકું. હું
જીવનનું વિધાયક પાસું પસંદ કરું છું!”

“વાત તો તારી સાચી છે, પરંતુ એમ કાઈ સાવ સહેલું નથી,”
મેં વિરોધી સૂર ઉડાયો. તો કહે, “હા, આ સહેલું છે. જીવન
પસંદગીઓ પર નિર્ભર છે. તમે બધા વાંધા-વચ્ચા હટાવી લો તો
ગમે તે પરિસ્થિતિ સ્વીકારી શકાય. પરિસ્થિતિને કેવી રીતે પડકારવી
એની પસંદગી તમારી પાસે છે. લોકો તમને સુખી કરશે કે દુઃખી...
એની પસંદગી તમારે હસ્તક છે! પ્રસન્ન રહેવું કે દુઃખી એ વિકલ્પ
આપણા પોતાના હાથમાં છે. મુખ્ય વાત આ જ છે કે જીવન કેવી
રીતે જીવું. એની પસંદગી... તમારા પોતાના જ હાથમાં છે!”

જેરીએ જ કાઈ કશું તે પર હું વિચારતો રહ્યો. એની પાસેથી
હું શીખ્યો કે – જીંદગીને ભરપૂરપણે જીવવાની તક રોજેરોજ આપણાને
મળે છે. આખરે તો, આપણો અભિગમ, આપણું વલણ જ સર્વકાંઈ છે!

- બ્રાયન કેવનાહ

સમર્થ વલણ અને સ્વભાવનું સામર્થ્ય...

તમે કોઈ એવા માણસને જાણો છો જેને પોતાના જીવનમાં શું જોઈએ છે તેની ખબર નથી અને છતાંય એને મોટી સફળતાઓ વરી હોય? મને તો એવું કોઈ જરૂર નથી. અને શરત પર કહેવા હું તૈયાર હું કે તમને પણ આવા કોઈ માણસનો ભેટો થયો નહીં હોય. દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક મનોવાચિત ધ્યેય હોય જ! આપણાં સપનાં આપણામાં આવાં લક્ષ્ય સૂચવી શકે. સપનું પેલા હોકાયંત્ર જેવું છે, જે આપણી યાત્રાની દિશા ચીધી શકે. જ્યાં સુધી આપણાને ધ્યેય તરફની સાચી દિશા મળતી નથી ત્યાં સુધી આપણી ગતિવિધિની યોગ્યતા આપણે નક્કી નથી કરી શકતા.

જીવનમાં કોઈક સ્વભાવ હોય તો આપણી સમક્ષ જાણો કશોક નવો ઉધાડ થાય છે. કશોક શક્તિસંચાર થતાં, સ્વભાવને સિદ્ધ કરવા તરફ આપણે આગળ વધતા હોઈએ તેવો અનુભવ થાય છે. પછી તો આપણી સંભૂભ તકો જ તકો ઊભી થાય છે, કાંઈ કેટલાય ઉપાયો આપણાને જડી જાય છે અને આપણામાં નવું કાર્યકૌશલ્ય જાણો પ્રગટે છે. આપણું ધ્યેય જેટલું વિશાળ હશે, તેટલી વિશાળ થશે આપણી ક્ષમતા. કોઈ અંધ મનુષ્ય પોતાના સ્પર્શના આધારે જ પોતાની દુનિયાની ભૂગોળ રચશે, કોઈ અજ્ઞાની માણસ પોતાના જ્ઞાનની સીમાઓમાં બંધ રહેશે; જ્યારે કોઈ મહાન વ્યક્તિત્વનું વિશ્વ એના પોતાના વ્યાપક દર્શનથી સીમાબદ્ધ થશે. તમારું જીવનદર્શન, તમારું સ્વભાવ... જો મહાન હશે, તો તેને સફળ કરવા માટેની તમારી ક્ષમતા પડા... એટલી જ તાકતવર હશે.

સ્વભાવ આપણાને ભવિષ્ય માટેની આશા અને વર્તમાન માટે શક્તિ પણ પૂરી પાડે છે. જીવનમાં કઈ ચીજને અગ્રીમતા આપવી એની આપણાને સમજ પડે છે. સ્વભાવીલ મનુષ્ય સ્વભાવ સિદ્ધ કરવા માટે શું છોડી ઢેવું તે સારી રીતે જાણો છે. એની પાસે મૂલવવાના તમામ માપદંડ આવી જાય છે. પોતાની સ્વભાવસિદ્ધ માટે કઈ વાત પર કેટલા કેન્દ્રિત થવું કે નહીં, તે સમજી શકે છે.

નજર સમક્ષ જો ધ્યેય હોય તો આપણે જે કાંઈ કરીએ તે બધું એના પરિપ્રેક્ષયમાં જ હોય. ક્યારેક તો ઉત્સાહપ્રેરક કામ ન પડા હોય, અથવા તો તાત્કાલિક પરિણામ લાવે તેવાં ન પણ લાગે, છતાંય છેવટે તો લક્ષ્યપ્રાપ્તિ માટે મદદ પહોંચાડનારાં જ એ સાબિત થતાં હોય છે. લાંબી નજરે જોઈએ ત્યારે સમજાય છે કે ઝીણી ઝીણી બાબતોની પણ ભારે મોટી અગત્યતા હોય છે.

તમને હું એક કિસ્સો કહું. છાપાનો એક પ્રતિનિધિ કોઈ ઈમારત બંધાતી હતી ત્યાં કામ કરતા ગજ મજૂરોને ભણ્યો.

પહેલા માણસને એષો પૂછ્યું, “તમે અહીં શું કરો છો?” તો પેલાએ કહ્યું, “હું મારી રોજરોટી રણું છું.”

બીજાને પણ એ જ પ્રશ્ન પૂછ્યો તો એ બોલ્યો, “તમને શું દેખાય છે? હું સીમેન્ટ ટેચાર કરું છું એ જોતા નથી?”

પછી એ ત્રીજા માણસ પાસે પહોંચ્યો, જે સીટી વગાડતાં વગાડતાં પ્રસન્ન ચહેરે કામ કરતો હતો. તેણે થોડા વટ સાથે જવાબ આપ્યો, “હું અનાથો માટેનું આશ્રયઘર બાંધી રહ્યો છું?” મસોતાથી પોતાના હાથ લૂછતાં, સામેની દિશા ચીધીને એ બોલ્યો, “જૂઓ, ત્યાં રસોડું બનશે. એની પાછળ બાળકોનાં નિવાસસ્થાન બનશે. અને અહીં....”

ત્રીજા પણ પાસે કામ એકસરખું હતું. પરંતુ માત્ર ત્રીજા માણસ સમક્ષ વિશાળ દર્શન હોવાને લીધે એ પ્રોત્સાહિત હતો. એનો શ્રમ કોઈ સપનું સિદ્ધ કરતું હતું અને એ બાબત એના પ્રયત્નોમાં મૂલ્યવૃદ્ધિ કરતી હતી.

વિન્સ લોઝાર્ડીએ કહ્યું છે, “કોઈ પણ માણસની સર્વોત્તમ ક્ષણ, એની પરમ ફૂટફૂત્યતા એ ક્ષણમાં સમાયેલી હોય છે... જ્યારે તે કોઈ ઉમદા ધ્યેય માટે પોતાનું દિલ તેમાં રેડી, સંઘર્ષના ક્ષેત્રમાં પોતાની તમામ શક્તિ ખર્ચી અંતે વિજયી બનીને એ થાક્યોપાક્યો સૂતો હોય છે.” આવો પ્રયાસ શક્ય બનાવવા માટે જરૂરી દર્શિ કોઈ ધ્યેયલક્ષી સ્વખન દ્વારા જ પૂરી પડાતી હોય છે.

પરંતુ એકલું સ્વખન-સેવન ન ચાલે. એની સાથે સમર્થ વલણ પણ જોઈએ. એક સિવાયનું બીજું હોય, તો સફળતાની દિશામાં ન જવાય. જીવનમાં આગળ વધવા માટે, બંને ચીજનું મહત્વ છે:

- * રચનાત્મક વલણ વગરનું સ્વખન, દિવારસ્વખન બની શકે છે.
- * સ્વખ વગરનું રચનાત્મક વલણ, વ્યક્તિની પ્રગતિ કુંઠિત કરે છે.
- * રચનાત્મક વલણ સાથે સેવાનું સ્વખનદર્શન, વ્યક્તિમાં અસીમ સંભાવનાઓ અને ક્ષમતા પ્રેરે છે.

તમારી બુદ્ધિ, કુશળતા, શિક્ષણ, કળા કારીગરી કે તક નહીં, બલ્કે તમારું મનોવલણ જ તમારું સ્વખ પાર પડશો કે નહીં તે નક્કી કરશો. તમારું વૃત્તિ-વલણ, તમારી માનસિકતા જ... તમારા જીવનની ઉદ્ઘીદિશા કંડારશો... આટલું હુંમેશાં યાદ રાખશો!

- જહોન સી. મેક્સવેલ

શ્રદ્ધાજા યમત્કાર



કશુંભ કરવા
તમે સમર્થ છો
એવું તમે માનતા છો...

અથવા

કશુંભ કરવા
તમે અસમર્થ છો
એવું તમે માનતા છો...

તો
બનો રીતે
તમે સાવ સાચા છો!







શ્રદ્ધાળા યમત્કાર

ગુલાબને કાંટા છોય છે...
ખેનો તમે વસવસો
પણ તરી શકો...

અથવા
તમે ઘુશીથી
ઝૂમી પણ શકો...

કારણ કે...
કાંટા બચ્ચે પણ
ગુલાબ ઘીલે છે!

તમે સમર્થ છો... જો તમે માનો તો!

તમે માર ખાઈ બેઠા છો એવું જો ધારશો
 તો સાચે જ, તમે હાર્યા છો!
 તમે હામ ભીડી ન શકો એવું માની બેઠા,
 તો સાચે જ હિમત હારી બેસશો.
 જતવું તમને ગમે, છતાંય હારશો તેવું લાગે,
 તો સાચે જ, પરાજ્ય નિષ્ઠિત છે.
 ખોટ ખાધાનું વિચારશો, તો ખોવાયું જ સમજો
 કારણ કે જગતભરમાં તમે જોશો કે,
 સફળતા અને જ વરે છે, જે અને જંખે છે.
 સફળતા ધૂપાયેલી છે, માણસના ચિત્તમાં!

હજુ ડગલું માંડયુ ન માંડયું ત્યાં,
 ઘણીખરી દોડો હારી જવાય છે,
 હજુ કામ આરંભાયું, ન આરંભાયું,
 ત્યાં ઘડા કાયરો હાથ ઊંચા કરી મૂકે છે.
 વિશાળ ચિંતન રાખો, એથી તમારાં કાર્યો પણ વિકસશે,
 વામણું ચિંતન તમને પાછા જ પાડશે
 તમે સર્વસમર્થ છો... બસ, આટલું વિચારો
 અને તમારું બધું પાર પડશે,
 કારણ કે સફળતા ધૂપાયેલી છે, માણસના ચિત્તમાં!

તમે ફેંકાઈ ગયાનું ધારી બેસો, તો તેવું જ થશે,
 ઊંચે ચઢવા ચિંતન પણ ઊંચુ જોઈએ;
 કોઈ પણ પુરસ્કાર પામતાં પહેલાં,
 તમારા પોતાનામાં અખૂટ વિશ્વાસ જોઈએ!

જવનસંગ્રામમાં જીત હંમેશાં
 શક્તિશાળી કે વેગમાનની નથી થતી.
 પરંતુ વહેલા કે મોડા, એ માણસ જરૂર જતી જાય છે,
 જે માને છે કે પોતે જરૂર જતવાનો જ છે!

- એડવિન માર્કહેડ

શ્રદ્ધા વિચારે છે નિરીશંગોમાં!

પુરુષાર્થી માણસે પોતાનામાં આખૂટ શક્તિનો ભંડાર ભરેલો છે તેવી શ્રદ્ધા સાથે બહાર પડવું જોઈએ. પોતાની ધ્યેયસિદ્ધિ માટે પોતાનું સધણું કૌવત જે-તે કામમાં ખર્ચી નાંખવું જોઈએ... સામે આવીને ઊભેલાં વિન્ધોને સતત પડકારતા રહી, પોતાની એકધારી પ્રગતિ સાધતા રહેવું જોઈએ.

બીજા લોકોને જે અશક્ય કે અતિમુશ્કેલ લાગતું હોય, તેવું કામ કરી શકવાની જે માણસમાં શ્રદ્ધા હોય, એ હકીકિત જ સૂચવે છે કે એ માણસની અંદર ઓવું કશુંક ભર્યું પડ્યું છે, જે એણે ઉપાડેલા ભગીરથ કાર્યની બરોબરીનું હોય!

શ્રદ્ધા કહો કે વિશ્વાસ... માણસને એ અનંત સાથે જોડે છે. અનંત સાથે એકતાર થયા વગર દુનિયામાં કોઈ મહાન સિદ્ધિ પાર પાડી શકાઈ નથી. માણસ જ્યારે પરમસત્તાની સમીપે જીવતો થઈ જાય છે ત્યારે એ દિવ્યતાની સદૈવ ઉપસ્થિતિ અનુભવે છે અને ત્યારે જ એ પોતાની આંતરિક શક્તિ પ્રગટ કરી શકે છે.

માણસનું સામર્થ્ય વધારવા આત્મવિશ્વાસ સમું બીજું કોઈ સાધન નથી. એકાવધાની માણસ આત્મવિશ્વાસપૂર્વક સફળ બની શકે, જ્યારે આત્મશ્રદ્ધા વગર દશાવધાની મનુષ્ય પણ હાર ખાઈ શકે.

આત્મવિશ્વાસ નિરીશિખરો પર વિચારે છે, એટલે એનું દર્શન સર્વોચ્ચ છે. શ્રદ્ધાને અનુસરનારા લોકોના અદશ્ય જગતને પણ એ જોઈ શકે છે. બસ, માણસમાં કદીય પીછેછા કરીને પાછું ફરીને ન જોવાનો, કદી ય હાર ન ખાવાનો આત્મવિશ્વાસ જોઈએ. આવો આત્મનિર્ધાર જ પોતાની પાછળના તમામ સેતુઓ સળગાવી મુકે છે અને પુરુષાર્થ આદરવા પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનાવે છે!

માણસ જ્યારે પોતાની આત્મશ્રદ્ધા ગુમાવી બેસે છે અને હિંમત હારી જઈ મેદાન છોડી દે છે, ત્યારે તેવા માણસને આ ખોવાયેલો ભરોસો પાછો મેળવી આપવા સિવાય બીજી કોઈ મોટી મદદ નથી. પોતે જીતશો કે હારશો એનો આધાર રહસ્યમયી વિધાતા પર છે આવા વિચારથી એને મુક્ત કરવો જોઈએ. પોતે કોઈ પણ નસીબ કે વિધાનીથી ચઢિયાતો છે આવી શ્રદ્ધા એનામાં ન સ્થપાય, ત્યાં સુધી એના માટે જાણું તમે કશું ન કરી શકો. એનામાં શ્રદ્ધા જગાવવી જ પડે કે બહારના કોઈ પણ પરિબળ કરતાં વિશેષ શક્તિસભર સામર્થ્ય... તેની પોતાની અંદર જ ભર્યું પડ્યું છે!

- ઓરિસન સ્વેટ માર્ડિન

સર્જનાત્મક ચિંતક

કોઈ પણ બાબત અંગે સર્જનાત્મક રીતે વિચારવું હોય તો તમારે પહેલાં તો પરંપરાગત, ઘસાઈ ગયેલી ઘરડમાંથી બહાર નીકળી આવવું પડે.

#પ્રશ્ન : **FIVE**ને **FOUR**માં બદલવા શું કરવું જોઈએ, તે એક ક્ષણમાં કહો.

તમને આ કોયડો કદાચ મુજજીવી મારે!

#જવાબ : **FIVE**માંથી **F** અને **E** કાઢી નાંખો તો બાકી રહેશે **IV**, મતલબ કે ચાર માટેનો રોમન આંકડો. આ પ્રશ્નમાં, સૂચન તો લખેલા શર્ધાઓ અંગે વિચારવાનું હતું, નહીં કે રોમન આંકડા વિષે.

જે લોકો જડ માળખામાં રહીને જ વિચાર કરવાનું જાણે છે, ચીલા ચાલુ અને સલામત રીતો જ અનુસરતા રહે છે તેવા લોકોને આવો વિસમયકારક જવાબ કદી પ્રાપ્ત ન થઈ શકે.

જે કાંઈ અવનવું કલ્પના રહો, તેને ઉત્કટતાપૂર્વક ઝંખો,
નિષ્ઠાપૂર્વક એને માનો અને ધગશાપૂર્વક એના પર કામ કરો,
તો અંતે એ કલ્પના સાકાર થઈને જ રહેવાની!

- પાંચ જે. માયર

ભમરી

કુદરત પાસેથી આપણો શીખવાની જરૂર છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ભમરી માખીનું શરીર ખૂબ ભારે હોય છે અને એની પાંખો ખૂબ નાની હોય છે. ઉડ્યનવિજ્ઞાન મુજબ તો આ ભમરી ઊડી જ ન શકે. પરંતુ આ વાત એ માખીઓ જાણતી નથી અને એ નિરંતર ઊડતી જ રહે છે.

તમે જ્યારે તમારી મર્યાદા જાળતા નથી, ત્યારે તેમાંથી બહાર નીકળી આવાં અવનવાં આશ્ચર્યો અનુભવી શકો! બદલામાં તમને નવાઈ લાગશે કે તમારામાં કશી મર્યાદા હતી જ નહીં! માણસની તમામ મર્યાદાઓ એડો પોતે જ લાટેલી, સ્વયંનિર્મિત હોય છે!

‘અસંભવ’ને તડીપાર કરો!

જ્યારે જ્યારે ‘અશક્ય’ કે ‘અસંભવ’ શબ્દ મોટેથી ઉચ્ચારાય છે ત્યારે અંતર્મન પર એની વિધાતક અસર પડે છે. પછી તો માણસનું વિચારવાનું જ બંધ પડી જાય છે. પ્રગતિ રુંધાય છે. બારણાં જ બંધ. પછી શું કરો? સંશોધન-પ્રક્રિયા જ અટકી પડે છે. નવા પ્રયોગો અભરાઈ પર; યોજનાઓ કચરા ટોપલીમાં; સપનાં બધાં ફંગોણી જાય છે. સર્જનાત્મક જ્ઞાનતંત્રોમાંના સર્વોત્તમ અને તેજસ્વી કોશો પણ રુંધાઈને ગુંગળામણ અનુભવવા માંડે છે.

પરંતુ ચાલો હવે આ જાહ્યુઈ શબ્દો ઉચ્ચારીએ – “કદાચ શક્ય બને પણ ખરું! કેવી રીતે તેની કશી ખબર નથી, પરંતુ આ સંભવ તો છે!”

આવા હૃદયદ્રાવક શબ્દો આગેકૂચ કરતા સરધસના બ્યૂગલની ઘોષજા સમા ઉત્સાહવર્ધક બનીને અંતર્મનના અજ્ઞાત પ્રદેશને ભેદે છે અને ભીતરની પેલી મહાન શક્તિઓને બહાર પ્રગટ થવા પડકારે અને પોકારે છે. પછી તો ડટાયલાં સ્વખો પણ સળવળી ઉઠે છે. નવા ઉત્સાહના તણખા જરવા લાગે છે અને જોતજોતામાં નવી જ્વાળાઓ સળગવા માંડે છે. ફાઈલો પરની ધૂળ ખંખેરાય છે. લાંબી અંધારી પ્રયોગશાળાની બજીઓ પાછી સળગવા લાગે છે. ફોન રણકવા માંડે છે. કોમ્પ્યુટર ચાલતાં થાય છે. નવાં બજારો ખૂલે છે. હવે મંદીનું નામ નહીં. સાહસ, પ્રયોગો, વિસ્તરીકરણ અને સમૃદ્ધિનો જાણો કોઈ નવો મહાન યુગ આરંભાયો છે!

તમે કહેશો, “પરંતુ ડૉ. શુલર, તમે તો માત્ર વાણીવિલાસ કરો છો. આમાં શબ્દો સિવાય બીજું શું છે?” તો હું ભારપૂર્વક કહેવા માંગું છું કે, “બિલકુલ નહીં! મારો આ વાણીવિલાસ કે શબ્દજ્ઞાન નથી. હું તો એ ભ્યાનક, બિનજવાબદાર, વિનાશક પરિબળો સામે યુદ્ધની હાકલ કરું છું, જે ઉપર-ઉપરથી નિર્દોષ અને બુદ્ધિસંગત દલીલોપૂર્વક રજૂ થતાં હોય છે.”

સાચો મુદ્દો છે મનોવલાણ. બસ, પ્રગતિ આડેના આ નકારાત્મક વલાણ ‘કે આ અશક્ય છે,’ પર જો વિજય મેળવીએ તો, જીવનમાં આપણે પ્રગતિ સાથી શકીશું અને પરિસ્થિતિઓને આરાપાર ભેદતી સુરંગો ચંપાશે. ચાલો આપણો આપણા શબ્દકોશમાંથી ‘અશક્ય’ શબ્દને કાઢી નાંખીએ!

- ડૉ. રોબર્ટ શુલર

આત્મ-ધારણાની ચુંબક-શક્તિ!

તમારી પોતાની નજરે તમે જે કાંઈ છો તે પરથી તમારા જીવનની સિદ્ધિ નક્કી થશે. આત્મ-ધારણા એ તમારા વિષેની તમારી સ્વયં-કલ્પના છે. તમે કોણ છો, કેવા છો અને તમે શેનું પ્રતિનિધિત્વ કરો છો તે વિષે તમારા પોતાના ચિત્રમાં જે માનસિક અને ભાવનાત્મક છબી ઉઠતી હોય, તે છે તમારું પોતાનું પ્રતિબિંબ! આ સ્વ-પ્રતિબિંબ મહત્વનું છે, કારણ કે તમારા સ્વાનુભવોનું એ પ્રારંભિક બિન્દુ છે. તમારું સ્વ-પ્રતિબિંબ એક મહાપાત્ર જેવું છે, જેમાં તમારા તમામ અનુભવો રેડાય છે અને ઘોળાય છે.

જો તમારું સ્વ-પ્રતિબિંબ તમારા વિષેની, અજ્ઞાનતા-ભય-શંકા અને અસલામતીના પાયા પર ઉભું થયેલું અલ્ય અને મર્યાદાઓથી ભરેલું હશે તો તમારા તમામ અનુભવો આ નકારાત્મક વલણોમાંથી ગળાઈને પ્રગટ થશે.

બીજુ બાજુ, જો તમારું સ્વ-પ્રતિબિંબ જ્ઞાન, પ્રેમ, હિંમત, આદર, શ્રદ્ધા અને આત્મવિશ્વાસના પાયા પર ઉભું થયેલું હશે તો તમારા અનુભવો આ વિધાયક વલણોમાંથી ગળાઈને બહાર આવશે.

સ્વ-પ્રતિબિંબ તમારી આપ-હેની શક્તિ ઘડે છે, જીવન સાથેના અને વિવિધ અનુભવો તથા સંભાવનાઓ સાથેના વ્યવહારમાં તમે કેવી રીતે વર્તશો તે નક્કી કરે છે. તમારી આત્મ-ધારણા એ ચુંબકની જેમ તમારા જીવનના અનુભવમાં આકર્ષણ-વિકર્ષણ, ગમા-અણગમા ઉભા કરશે.

તમારા પોતાના વિષે તમે જે માનો કે ધારો, તેને અનુરૂપ વિચારો, લોકો અને અનુભવોને તમે આકર્ષણો. જો તમારે તંદુરસ્તી, સમૃદ્ધિ અને સુખને આકર્ષવાં હોય, તો તમારે એવું સ્વ-પ્રતિબિંબ સાકારવું પડે જે તંદુરસ્તી, સમૃદ્ધિ અને સુખની કલ્પનાને અનુરૂપ હોય!

તમારા પોતાના વિષેની કલ્પના કે ધારણા સાથે અનુરૂપ ન હોય તેવી પ્રતિકુળતામાં તમે સાતત્યપૂર્વક કશું કરી ન શકો.

તમારી આત્મ-ધારણા તમને સીડીની ટોચ પર પહોંચાડી દેશો અથવા તો ભૌયતળિયે પહોંચાડતી યાંત્રિક સીડી પર ધકેલી દેશો. મિલ્ડ્રેડ ન્યૂમેન અને ડૉ. બન્નાઈ બર્કોવિન્ઝ એમના ‘તમારા પોતાના શ્રેષ્ઠ મિત્ર કેવી રીતે બનશો?’ પુસ્તકમાં આ માર્ભિક પ્રશ્ન પૂછે છે કે – “જે આપણે આપણી જ જાતને ચાહી શકતા ન હોઈએ તો બીજા માટેનો પ્રેમ આપણે ક્યાંથી લાવીશું?” તમારી પોતાની પાસે જે ન હોય, તે તમે બીજાને કેવી રીતે આપી શકો?

ભલે ભૂતકાળમાં તમે તમારા વિષે ગમે તે ધારી લીધું હોય. કોઈ ચિંતા નહીં. સદ્ગ્રાહ્યે હવે તમારી પાસે પરિવર્તન કરવા માટેની ધગશા, પદ્ધતિ અને યોગ્યતા છે અને આ પરિવર્તન બહેતર માટેનું છે! આપણા સર્જનહારે આપણને જે વરદાન આપ્યાં છે, તેમાં આપણી ઈચ્છા મુજબની આપણી પરંદગી એ મહાન બદ્ધિસ છે.

આપણી પોતાની પ્રતિકૃતિ સર્જએ ત્યારે આપણે આ વાત યાદ રાખીએ કે આપણા મનમાં આપણે જે ચિત્ર ધારીએ તે પૂર્ણપણે ઉપસે છે. દાખલા તરીકે, જમીન પર પડેલા બાર હંચ પહેલા એક પાટિયા ઉપર તો સહેલાઈથી ચાલી શકાય. પરંતુ એ જ પાટિયાને બે દશમાળી મકાનો વચ્ચે ગોઠવો અને પછી એના પર ચાલવું... તે કંઈક જુદી જ બાબત બને છે. જમીન પર તમે તમારી જાતને સહેલાઈથી અને સહીસલામત ચાલતા જુઓ છો. જ્યારે પેલી ઈમારતો વચ્ચેના પાટિયા પરથી તો તમારી જાતને તમે નીચે પડતા જ જુઓ છો. મન એ ધારણ કરેલા ચિત્રને પૂરું કરે છે, એટલે તમારો ભય સાચો ઠરે છે.

સારો બેલાડી બેઝ-બોલમાં દડાને ફટકરે તે પહેલાં, દડાને બેઝ-હિટમાં જતો નિહાળી શકે છે. એ જ રીતે, સફળ વેપારી પ્રસ્તાવ મુકતા પહેલાં, ગ્રાહકને ખરીદી કરતો જોઈ શકે છે. માઇક્રો ઓન્જલોએ પોતાનું પહેલું ટાંકણું માર્યું તે પહેલાં, આરસના એ પથ્થરમાં તેણે ‘વિરાટ મોઝીઝ’નાં દર્શન કર્યા હતાં!

- લિંગ લિંગલર

‘અશક્ય’ને ‘શક્ય’ તરી જાણ્યું!

કોઈકે કહ્યું કે એવું થઈ જ ન શકે,
પરંતુ એણે મલકાઈને જવાબ વાણ્યો,
‘એવું ભલે થયું ન હોય’, પરંતુ એ પોતે
પ્રયત્ન ન કરી લે ત્યાં સુધી
કદીય એવું નહ્યો કહે કે તે અશક્ય છે!
પછી ચહેરા પર કાંઈક મંદ સ્મિત સાથે
એણે કમર કસી. ચિંતાને ધૂપાવી.
ખંતપૂર્વક કામ કરતાં... ગીત ગાતાં,
‘અશક્ય’ કહેવાયેલું, પણ એણે શક્ય કરી જાણ્યું!

કોઈએ મશકરી કરી, “અરે, તું શું કરવાનો?
આજ લગી કોઈ આવું કરી જ નથી શક્યો.”
પરંતુ એણે તો પોતાનાં ડગલા-ટોપી ઉતાર્યા, અને
હડપચી ઊંચી કરી... વળી દબાતું સ્મિત,
ન કશી શંકા, ન કોઈ સંશય.
ખંતપૂર્વક કામ કરતાં... ગીત ગાતાં,
‘અશક્ય’ કહેવાયેલું, પણ એણે શક્ય કરી જાણ્યું!

આવું તો થઈ જ ન શકે તેવું કહેનારા હજારો મળશે,
નિષ્ફળતાને ભાખનારા પણ હજારો ભટકશે.
હજારો લોકો... એકેક ગણી-ગણીને,
સામે નાટકનારા ભયોને ચીંઘતા રહેશે.
પરંતુ મલકાટભર્યા સ્મિત સાથે બસ, કમર કસો,
ડગલો ઉતારો અને કામ શરૂ કરો.
ખંતપૂર્વક કામ કરતાં... ગીત ગાતાં,
અશક્ય કહેવાએલું, પણ તમે શક્ય કરી જાણશો!

- અડગાર એ. ગેસ્ટ



આપણા પોતાના વિષેની
આપણી સમજ જ
આપણું ઘડતર કરે છે!

આપણી દાઢા મુજબ
આપણી જાતના
આપણે ધાર્યા ધાટ ઊતારી શકીએ,
કારણ કે
જગત વિશ્વાસના આધાર પર ખડું છે!

મનુષ્ય અંગો
કશું જ પૂર્વનિયોજિત કે સીમાબદ્ધ
નથી જ નથી.
વિશ્વની તમામ સત્તા
આપણી ભીતર જ સમાયલી છે!

આપણે
આપણા વિષે જે કાંઈ ધારીએ
તે, અને તે જ
આપણે બનવાના
અને આમ,
આપણી પાસે શક્તિ છે
ગમે તે ક્ષણે બદલાવાની!

- વોલ્ટર સ્ટેપલ્સ

શ્રદ્ધાનું પ્રેરણબળ!

તમામ તથ્યો અને બાબતોનું મૂળ છે – શ્રદ્ધા. આપણે જે ને અટલ નિષ્ઠા સાથે સ્વીકારીએ છીએ, તેને ઘડીવાર બૌદ્ધિક સમજાણનો કોઈ પાયો, કે કોઈ પ્રમાણ પણ નથી હોતું. આપણે ધારી લીધું છે કે ગ્રહ હંમેશાં ફરતાં રહેશે, સૂરજ સદા તપતો રહેશે, ફૂલો હંમેશાં ખીલતાં રહેશે. આપણે જીવતાં છીએ એ પણ આપણી માન્યતા જ છે. પરંતુ અગાઉ આપણે કદી જીવ્યા કે મર્યાદા ન હોઈએ તો એ અંગે પાંકુ કેવી રીતે કહી શકીએ? પરંતુ આપણે એવું ધારી લઈએ છીએ કારણ કે બીજા લોકો કહે છે કે આપણે જીવતાં છીએ. પરંતુ મૂળ બાબત અંગે તેઓ પણ આપણા જેટલા જ બેખબર છે.

માન્યતા આંધળી છે. આશા જેવા તત્ત્વથી એ ટકે છે અને કશું જ પ્રમાણ ન હોય તેમ છતાંય મહાન સ્ત્રીપુરુષો પોતાનાં સ્વભોને અનુસરતાં અજ્ઞાણ સફરે ઉપડી જાય છે. સંશોધકો શોધે છે, સાહસિકો ખેડતા રહે છે, ઈમારતો બાંધનારા મકાનો બાંધ્યા કરે છે, લેખકો લખે છે, ગાયકો ગાય છે, નૃત્યકાર નાચે છે. જેમનામાં શ્રદ્ધા છે... તે સૌ સિદ્ધો છે. તેઓ પોતાના ધ્યેયને શ્રદ્ધા અને કેવળ શ્રદ્ધાના આધારે વળળી રહે છે.

આપણા તમામ વિચારો સાકાર નથી થતા, કારણ કે આપણા અંતરાત્માએ એને નિષ્ઠારૂપે સ્વીકાર્યા નથી. જો તે નિષ્ઠારૂપ હોત તો મૂર્તિમંત થવા માટે તે જરૂર અંતર્મન પાસે પહોંચ્યા હોત. આમ, આપણી તમામ નિષ્ઠા કે દૃઢ માન્યતાઓ સાકાર થાય છે. આપણે પોતે એમાં કશું ન કરી શકીએ. એ આપોઆપ થાય છે. આપણું અંતર્મન હંમેશાં સર્જતું રહે છે. એનો એ સ્વભાવ છે. હંમેશાં રૂપાંતરના મોરચે જ એ હોય છે. આપણા વિચારોને કે આપણી માન્યતાઓને... રાખવી કે નહીં, માત્ર તે અંગે જ આપણા જાગૃત મનનો કાબૂ હોઈ શકે છે.

હવે સમજાશે કે જીવતાં શ્રદ્ધા આટલી બધી મહત્વની કેમ છે. શ્રદ્ધા... વિચારને નિષ્ઠામાં ફેરવાની પ્રેરણ આપે છે અને પદ્ધી અજ્ઞાત મન પાસે એ નિષ્ઠાને પહોંચાડી એને સાકારવા મથે છે. એટલે જે વિષે આપણે પૂરેપૂરા શ્રદ્ધાવાન હોઈએ, તે બાબતો કણાનુક્રમે આપણા જીવનમાં હકીકત બનીને રહેવાની!

- ડૉ. વોલ્ટર સ્ટેપલ્સ

અજ્ઞાત મનની શક્તિ!

તમારી આસપાસ અપાર સમૃદ્ધિનો ભંડાર ભર્યો પડ્યો છે. જો તમે તમારાં માનસિક ચક્ષુ ખોલી નાંખો, તો તમારી ભીતર અનંતનો મોટો ભંડાર તમને જોવા મળશે. તમારી અંદર સોનાની એક ખાડા છે... જેમાંથી જીવનને આનંદપૂર્વક, પ્રેમપૂર્વક અને પ્રતિષ્ઠાપૂર્વક જીવા જે કંઈ જોઈએ તે બધું, તમે તેમાંથી મેળવી શકો તેમ છો!

ઘણા લોકો ધોર નિદ્રામાં છે, કારણ કે આ અસીમ જ્ઞાનની અને અનંત પ્રેમની સુવર્ણખાડા તેમની જ અંદર છે, તે જાગતા નથી. એમાંથી તમારે જે જોઈએ, તે તમે બહાર ખેંચી કાઢી શકો. લોહચુંબકનો એક નાનકડો ટુકડો એના વજન કરતાં બાર ગણી વધારે વજનદાર ચીજને ઊઠાવી શકશે. પરંતુ એ જ લોખંડના ટુકડામાંથી ચુંબક શક્તિ કાઢી લો તો એક પોંથું પણ એ ઊંચકી નહીં શકે.

આ જ રીતે, માણસો પણ બે પ્રકારના હોય છે. ચુંબકીય શક્તિથી સમૃદ્ધ એવો માણસ, જે આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી છલકાતો હોય છે. વિજય અને સફળતાને વરવા જ પોતે નિર્માણ્યો છે, અનું એ જાણો છે. બીજો એવો માણસ, જે ચુંબકશક્તિ-વિહીન છે. એ ભયભીત અને શંકાશીલ છે. તકો સામે આવીને ઊભી રહે ત્યારે એ કહે છે, “હું હારી જઈશ. મારા પૈસા ખોવાઈ જશે. લોકો મારી સામું હસશે.” આવા માણસો જિંદગીમાં કંઈ કરી શકતા નથી, કારણ કે એ આગળ ધ્યપતાં જ ડરે છે. એ તો જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેશે. એટલે તમારી ચુંબક-શક્તિ જાગૃત કરો અને યુગોપુરાણા જીવન-રહસ્યને પામો!

તમારા પોતાના જ અજ્ઞાત મનમાં આ અદ્ભુત, ચમત્કારિક શક્તિ ધૂપાયેલી છે! ભાગ્યે જ કોઈ માણસ શોધી શકે તેવું સ્થાન!

તમારી જીવનમાં તમે વધુ શક્તિ, વધુ સમૃદ્ધિ, વધુ આરોગ્ય, વધુ સુખ અને વધુ આનંદ પામી શકો, જો તમે તમારા આંતર્મન સાથે સંપર્ક સાધી એની અગ્રણ શક્તિને પ્રગટ કરો તો! તમારે મનની આ આંતરિક શક્તિ મેળવવાની મહેનત કરવાની નથી, તમારી પાસે એ છે જ!

- ડૉ. જોસેફ મર્ફી

ભીતરના આઈબ્સ્ટાઇનને શોધો!

ફરી વાર જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ચિત્ર જૂઓ,
અનુભવો કે એ સાક્ષાત તમે જ છો!

દરેકેદરેક મનુષ્યમાં પોતાની પ્રતિભા પ્રગટાવવાની તાકાત હોય છે. તમારા ચિંતનની પ્રતિભા કક્ષાએ પહોંચવા માટે તમારે ગણીતશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્ર સાથે ગૂચાવવાની કશી જરૂર નથી. આઇન્સ્ટાઇનની ચિંતનક્ષત્રનો અનુભવ લેવા માટે તમારે માત્ર તમારી રચનાત્મક કલ્પનાશક્તિને અજમાવવાની છે.

જે લોકોને માત્ર ચિંતા કરવામાં જ પોતાની કલ્પનાશક્તિને વાપરવાની ટેવ પડી ગઈ છે, તેમના માટે મારી આ ભલામણને અનુસરવું મુશ્કેલ છે. આવા લોકો દિવસભર ખરાબમાં ખરાબ દશ્યો જ જોયા કરે છે. પોતાની સાથે કેવું કેવું ખરાબ ઘટી શકે તેની જાતજાતની ખોટી કલ્પનાઓ કરતા રહેવામાં જ તેમની બધી શક્તિ ખર્ચાઈ જાય છે. આવી ચિંતા એ કલ્પના-શક્તિનો દુરૂપ્યોગ છે એટલું પણ તેઓ સમજી શકતા નથી. માણસને કશુંક વધારે ઉદાત મેળવવા માટે આ કલ્પનાશક્તિ મળેલી છે.

આપણા સૌમાં આ પ્રતિભા-શક્તિ પડેલી જ છે એની સભાનતાને કારણે તો નેપોલિયન બોલી ઊઠવા પ્રેરાયેલો કે, “કલ્પના જ જગત પર શાસન કરે છે!”

આપણી કલ્પનાનો સક્રિય ઉપયોગ કરતાં આપણે શ્રીભવાની જરૂર છે. એકવાર આટલું આવડી જાય પછી પહેલું કામ આપણે શું બનવા માંગીએ છીએ તેના પર સ્થિર વિચાર કરવાનું છે. ફેડ નાઈપ નામના ગીતકારે નવજવાનો માટે તૈયાર કરાયવી એક વિરીયોના સંગીત માટે એક ગીત લખેલું, જેમાં પોતે ભવિષ્યમાં શું બનવા માંગે છે તે સમજવા કલ્પનાશક્તિનો આધાર કેવી રીતે લેવો તે સમજાવ્યું છે:

તમારાં અદ્ભુત સ્વભાવોમાં, અદ્ભુત કાર્યો સિદ્ધ કરતાં...
તમે પોતે જ છો! સ્વયં તમે!

જો તમે ચાહતા રહો અને પછી સેવતા રહો
એ જ ઉન્મતા સ્વભાવો... તો તમે પ્રજ્વલિત કરશો...
તમારા ભીતરના સાચા સામર્થ્યને!

- સ્ત્રીબ શેન્ડલર

છીપલી

કહાણી કહું છું તમને એક છીપલી જેવી માછલીની
જેને થયું કે એની અંદર રેતીનું કષ ભરાઈ ગયું છે.
હતું તો એ ઝીણુંક કષા, પણ ભારે પીડા પહોંચાડતું હતું.
છીપલાંને પણ સુખદુઃખ હોય છે, ભલેને બહારથી એ નિર્જવ લાગે.

તો શું હવે એ નસીબને દોષ દેવા બેઠી,
જેના વાંકે એને આવી પીડા વેઠવાનું આવ્યું?
કે પછી સરકારની કરી નિંદા અથવા ચુંટણીની માંગાડી,
કે નારો પોકાર્યો કે સાગરને સંરક્ષણ મળવું જોઈએ?

“નહીં!” પોતાની જાતને કહી, એ એક ખડક પર સૂતી.
“રજકષા નહીં હટાવી શકું, તો એને પલટાવીને જ જંપીશ.”

વર્ષોનાં વહાણાં વીતી ગયાં, કાળે કાળનું કામ કર્યું.
અને હવે એના અંતિમ ભાવિના આરે આવી ઊભી,
અજિનપરીક્ષા જ સમજ લો!

પેલું રેતીનું નાનકડું રજકષા, જેણે પીડા જ પીડા પહોંચાડી હતી,
તે હવે એક સુંદર મોતી બનીને જગહળ જગહળ ચમકતું હતું!

કહાણીમાં કશોક સંદેશ છે.
એક નાનકડી છીપલી રેતીના કષમાંથી શું નીપજાવે છે...
તે ભવ્યાતિભવ્ય નથી?

બસ, જો હું માત્ર આરંભ કરું!
તો મારી ત્વચા હેઠળ ખૂંચતી તમામ ચીજોનું...
ન કરી શકું હું મોતીસમું રૂપાંતર?

- ઓલિજાબેથ બ્રાઉનિંગ

સહાચના રણની તૃપાસહ... જેને માટે પણ તમે જંખો...

તેવી કોઈ પણ ચીજ તમે જરૂર પ્રાપ્ત કરી શકો!

બસ! તમારા દેહની આરપાર નીકળી આવે
એવી પ્રચૂર જંખના એ હોવી જોઈએ...

જ જગતને સર્જનારી મહાશક્તિ સાથે એકરૂપ થઈ જાય!

- શીલા શ્રેષ્ઠમ



તમારી સંકલ્પશક્તિનો સ્વીકાર હરો!

હું જ છું મારો ભાગ્યવિધાતા!
હું જ છું મારા આત્માનો કર્તાહતા!

- હેણ્ણલી

તમારામાં સંકલ્પશક્તિ નથી એવું જો તમે ધારી બેસો, તો તમારી પોતાની સફળતાનું તમે અવમૂલ્યન કરો છો!

દરેકમાં સંકલ્પશક્તિ હોય જ છે. તમારી સંકલ્પશક્તિને વધારવાનો આ જ ઉપાય છે કે એના અસ્તિત્વનો સ્વીકાર કરો. જે રીતે તમને જીવન મળ્યું છે, એ જ રીતે તમને સંકલ્પશક્તિ પણ સ્વયંપ્રાપ્ત જ છે.

કોઈ તમારી સામે ભારે વજનદાર વસ્તુ મૂકી એને ઊંચકવાનું કહે અને જો તમને લાગે કે તમે એ નહીં ઊઠાવી શકો તો તમે એમ નહીં કહો કે “મારામાં તો શક્તિ જ નથી.” તમે કદેશો કે “હું એટલો શક્તિશાળી નથી.” આ વધારે સાચી ભાષા છે, કારણ કે તમે સ્વીકારો છો કે તમારામાં શક્તિ તો છે અને જો તમે શક્તિ મેળવવા પ્રયત્નશીલ રહ્યા હોત, તો સંભવ છે કે તમે એટલા શક્તિશાળી બની શક્યા હોત.

સંકલ્પશક્તિ નિર્માણ કરવાનું પ્રથમ પગલું એ છે કે તમારી પાસે આ શક્તિ છે તેની ખૂશી માણવી. જે રીતે તમને હાથ-પગ છે, એ જ રીતે સંકલ્પશક્તિ પણ મળેલી જ છે. ભલેને આપણા હાથ એટલા મજબૂત ન હોય, પણ સાવ હાથ વિનાના તો આપણે નથી જ ને?

બીજા પગલે એ જાણવાનું છે કે તમને જે સંકલ્પશક્તિ મળેલી છે, એને મજબૂત પણ કરી શકાય અથવા તો એને ઢીલી પણ પાડી દેવાય. માત્ર ધૂટાછવાયા બાધ્ય સંજોગોને ભરોસે એને એટલી મજબૂત ન કરી શકાય. સંકલ્પશક્તિ તો આંતરિક કીડા છે.

કોઈ તમને સંકલ્પશક્તિ અને સ્વયંશિસ્ત ઉધાર ન આપી શકે. કાંઈક કરવાની પ્રેરણા તમને બીજા કોઈ પાસેથી મળી શકે, પરંતુ જ્યાં સુધી તમારો સ્વયં આત્મનિર્ણય ન હોય, ત્યાં સુધી કોઈ તમારી પાસે કશું કરાવી શકે નહીં.

જ્યાં સુધી કશુંક કરવાની સંકલ્પશક્તિ ન જાગે ત્યાં સુધી કંઈ પણ થઈ શકે નહીં!

શા માટે આપણે કહી બેસીએ છીએ કે મારામાં સંકલ્પશક્તિ નથી? પોતાની જાતનો બચાવ કરવા માટેની એ ખોટી વૃત્તિ છે. મારામાં સંકલ્પશક્તિ નથી એવું કહેવામાં છાની છટકબારી છે. કારણ કે જો સંકલ્પશક્તિ છે જ નહીં, એવું સ્થાપિત કરી દઈએ તો પછી એને વધારવાની જંજાળમાં પડવું ન પડે. મારા જીવન માટે એ અપ્રસ્તુત છે, એવું કહી દીધું! બસ, થઈ ગયો ધૂટકારો!

ઘણા લોકોને સ્વયંશિસ્ત સ્વયંસજ્ઞ જેવી લાગે છે. એને આમ નકારાત્મક રીતે લઈ લેવાથી, એને વિકસાવવા માટે જરીકે ઉત્સાહ કે ધગશ રહેતાં નથી. પરંતુ વિલિયમ બેનેટ નામના લેખક આપણને જુદી રીતે વિચારવા કહે છે. ‘ધ બુક ઓફ વર્ચ્યુઝ’માં તેઓ કહે છે કે ‘સ્વયંશિસ્ત’ અર્થાત્ ‘Self- Discipline’ શબ્દ, ‘Disciple’ અર્થાત્ ‘શિષ્ય’ પરથી ઉત્તરી આવ્યો છે. તમે જ્યારે સ્વયંશિસ્ત સ્વીકારો છો ત્યારે, સંકલ્પશક્તિના વિષયમાં તમે પોતે જ તમારા ‘શિષ્ય’ બનો છો! એકવાર આ નિર્જય થઈ જાય પછી જીવનનું સાહસ એક રસપદ ચીજ બની જાય છે. તમે તમારી જાતને વધુ મજબૂત માણસ તરીકે જોતાં થઈ જાઓ છો! તમે આત્મ-ગૌરવ અનુભવો છો. માનસશાસ્ત્રી અભ્રાહમ હર્ષોલે કહ્યું છે કે “આત્મગૌરવ એ સ્વયંશિસ્તનું ફળ છે. પોતાની જાતને ના કહેવાની શક્તિ સાથે આત્મગૌરવની સભાનતા પણ વધતી જાય છે.”

અમેરિકાના તત્ત્વજ્ઞાની રાલ્ફ વાલ્ડો ઇમર્સને સેન્ડવીચ ટાપુના યોદ્ધાઓ વિષે વાત કરતાં કહ્યું છે કે આ યોદ્ધાઓ માનતા કે તેઓ જ્યારે દુશ્મન આદિવાસીને મારી નાંખે ત્યારે એ મૃત દુશ્મનની શક્તિ એને મારનારના શરીરમાં પ્રવેશે છે. જ્યારે આપણે કોઈ પ્રલોભનનો અસ્વીકાર કરીએ છીએ, ત્યારે આવી જ કંઈક પ્રક્રિયા થતી અનુભવાય છે. તે પ્રલોભનની શક્તિ આપણી સંકલ્પશક્તિમાં પ્રવેશે છે. નાનકડી ચીજનો લોભ છોડીએ, તો થોડીક શક્તિ મળો! મોટા પ્રલોભનને હન્કારીએ, તો વિશાળ શક્તિ સાંપડે!

વિલિયમ જેમ્સ સૂચવે છે કે આપણે દરરોજ એવી બે વસ્તુ કરવી જોઈએ, જે આપણે કરવી જરૂરી છે પરંતુ નથી કરતા. આમ કરીશું તો આપણે આપણી સંકલ્પશક્તિને સતેજ રાખી શકીશું!

- સ્ટીવ શૉનલર

ધ્યેયકું ગતિશાસ્ત્ર

તમે કેટલી ઊંચાઈઓ
સર ઊરી શાડો
એ હોઈ ભાઘી ન શકે...

તમે પોતે પણ
એ
અનુભવી નહીં શાડો...

...જ્યાં સુધી
તમારી પાંઘોને
તમે ફેલાવો નહીં!





ધ્યેયનું ગતિશાસ્ત્ર



અક્ષય રાખો...
તો સિતારા પર પહોંચવાનું!

કારણ

તમારું નિશાન ચૂકશો
તો પણ...

...તમે
ચંડ્ર ઉપર તો
જરૂર પહોંચશો જ!

મારા જીવનને પલટાવનારા પંચ પ્રશ્નો!

૧૯૮૮માં ખ્યાતનામ પ્રશિક્ષક ટોમ હોપ્કીન્સના એક પરિસંવાદમાં મારે જવાનું થયેલું, જ્યાં હું જીવનનો એક અણમોલ પાઠ શીખ્યો -- ‘આ જીવનનું મૂલ્ય.’ પરિસંવાદમાં લગભગ બે હજાર સહભાગીઓ હતા. ટોમે અમને સૌને, આપણે જો સામી કિંમત ચૂકવવા તૈયાર હોઈએ, તો આપણનું આ જીવન આપણને શું શું આપવા સક્ષમ છે તે અંગે વિચારવા પ્રેર્યા. એક વહેલી સવારની બેઠકમાં એણે કહ્યું, “જીવનમાં સફળતા મેળવવા માટે આ વર્ગમાં બેઠેલા તમે સૌ સક્ષમ છો. પરંતુ એ માટે સૌથી આવશ્યક બાબત યોગ્ય આયોજન છે.”

ત્યાર પછી એમણે અમારી સમક્ષ મુકેલી પ્રશ્નાવલીના મારા ઉત્તર નીચે મુજબ હતા :

૧. તમારા માટે તમારું જીવન કેટલું કીમતી છે? અત્યંત.
૨. તમારા જીવનના સમયનું મહત્વ કેટલું છે? ખૂબ જ.
૩. કોનું મૂલ્ય વધારે, તમે બેઠાં છો એ મકાનનું કે તમારા જીવનનું? મારા જીવનનું.
૪. આ મકાન બાંધવાનો નકશો બનાવતાં કેટલો સમય લાગ્યો હશે? અધાર મહિના.
૫. તો પછી શું છે તમારો નિર્જખ્લ? બસ, આ જ કે આ મકાન કરતાં મારા જીવનનું મૂલ્ય વધારે છે, તો પછી એનું આયોજન કરવા મેં અધાર મહિના પણ કેમ ગાળ્યા નથી? અરે, અધાર મહિના શું, અધાર દિવસ પણ મેં ક્યાં આપ્યા છે? અથવા તો અધાર કલાક પણ...

મારાં તારણો સ્વયંસ્પષ્ટ હતાં. જો હું મારા જીવનમાં પ્રગતિ ઈચ્છતો હોઈ અને એ માટે મારી સાચી તત્પરતા હોય, તો તે માટેના આયોજનની મારે જરૂર હતી. હું કાંઈક સફળ તો થયો, પરંતુ મારી પૂર્ણ જ્ઞમતાને હંસલ કરવામાં હું હજુ ઘણ્યો દૂર હતો. ટોમને સાંભળ્યા બાદ મારા જીવનનું આયોજન કરવા કેટલાંક નક્કર પગલાં ભરવાનો મેં નિર્ધાર કર્યો.

- ટોડ ડિકન

ધ્યેય નક્કી કરવા માટે એક સુંદર દૃષ્ટાંત!

જીવનનું ધ્યેય કેવી રીતે નક્કી કરવું અને લક્ષ્યપ્રાપ્તિ માટે એ કેટલું ઉપયોગી છે તે વિષેની એક સરસ વાત ૧૯૭૨ના ‘લાઈફ’ સામયિકમાં જહોં ગોડાર્ડ દ્વારા કહેવાઈ છે. એ જ્યારે પંદર વર્ષની વયનો હતો ત્યારે એની દાદીમાને આવું કહેતાં એ સાંભળી ગયો કે “મારી યુવાનીમાં આ બધું હું ઘણી વધારે સારી રીતે કરી શકી હોત!” ત્યારે જ ગોડાર્ડ નક્કી કર્યું કે પોતાના જીવનમાં આવા ‘જો’ અને ‘તો’ના પસ્તાવા કરવા પડે એવું એ નહીં થવા દે.

એટલે પોતે શું શું સિદ્ધ કરવા માંગે છે તેની યાદી કરવા એ બેસી ગયો. એણે ૧૨૭ વિશિષ્ટ ધ્યેય વિગતે લખી નાખ્યાં. જે દસ નદીઓ અને ખેડવી હતી અને જે સતત પર્વત અને ખૂંદવા હતા, તેની યાદી બનાવી દીધી. દુનિયાના તમામ દેશોનો પ્રવાસ અને કરવો હતો, વિમાન ઊડાડતાં શીખવું હતું, માર્કો પોલોના પ્રવાસના પગલે પગલે ચાલવું હતું, પસારીના રોંગ બાઉલ પરેડમાં ઘોડેસ્વારી કરવી હતી અને તબીબી શાખામાં અભ્યાસ પણ કરવો હતો. ગોડાર્ડને બાઇબલ ઉપરાંત ખેટો, એરિસ્ટોટલ, ડિકન્સ, શેક્સપીઅર, ચર્ચિલ, જેવા અનેક સર્જફોના મહાગ્રંથો વાંચવા હતા.

અને સબમરીનમાં દૂબકી મારવી હતી, વાંસળી અને વાયોલિન વગાડવાં હતાં, ઇગલ સ્કાઉટ બનવું હતું, ચર્ચનાં સેવાકાર્યો પણ કરવાં હતાં, પરણીને છીયાં-છોકરાં પણ પેદા કરવાં હતાં અને આખ્યાં એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા વાંચી જવું હતું. એણે પોતાની આ લાંબી યાદી મોઢે કરી લીધી હતી અને વિનંતી કરીએ તો એ કહી પણ બતાવતો.

આપણામાંના થોડાક જ લોકોને ૧૨૭ ધ્યેય યાદ રહી શકે કે જેની પ્રાપ્તિના પ્રયાસો આપણો કર્યા હોય. ખેર, એની વાત જવા દો. પણ તમારા જીવનમાં કેટલાં ધ્યેય છે અને તમને પૂછીએ તો તમે મોઢે કેટલાં કહી શકો?

કમ સે કમ, તમારા જીવનનું અગ્રીમ લક્ષ્ય તો તમારી જીબે હોવું જોઈએ! રોજ સવારે આ જ લક્ષ્યને યાદ કરતાં તમે જાગો, તેવું ન થઈ શકે? જો એવું ન હોય, તો આ જ તમારા જીવનનું સૌથી પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ!

સામે ઉભેલી ટેકરીઓ

સામે ઉભેલી ટેકરીઓ....

ચઠવામાં આકરી, સીધી અને વળી ઊંચી પણ લાગે છે.
ત્યારે એમની સામું જોઈને, અનાયાસ નિસાસો મૂકાઈ જાય છે.

પરંતુ જેમ જેમ એની નજીક સરતાં જઈએ,
દરેક ઢાળે એનાં ચઢાણ ઊંચા થતાં જાય છે.

પણ ચઢાણ એટલું સીધું નથી અને શિખર પણ એટલું દૂર નથી,
ઝુંગરા દૂરથી ચઠવા આકરા લાગે, હકીકતે તેટલા હોતા નથી.

આવું જ મુશ્કેલીઓ વિષે છે, દૂરથી એ એટલી આકરી લાગે,
કે માણસો ફરિયાદ કરતા, ડરતા અને સતત ડગમગતા રહે.

ધાર્યા કરતાં સફર ધણી ઓછી કપરી હોય છે,
અગાઉ લાગતી તેટલી કપરી, તો એ હોતી જ નથી.

કોઈ પણ કામ, ચઢાણ કે હિવસ ધાર્યા તેટલાં કપરાં હોતાં નથી,
જેમ જેમ નજીક સરીએ, રસ્તો સરળ લાગતો જાય છે.

- ડગલાસ મલોંક



માણસને રસ્તા પરના સફાઈકારનું કામ સૌંપવામાં આવે,
તો એણો રસ્તા એવી રીતે વાળવા જોઈએ...

જેમ માઇકલ એન્જેલોએ ચિત્રો દોર્યા,
કે બીથોવને સંગીતના સૂર વહેવડાવ્યા,
કે શેક્સપિયરે કવિતા રચી.
એણો શેરીઓ વાળીજૂડીને એવી ચોખ્ખીયટ બનાવવી જોઈએ
કે સ્વર્ગ અને પૃથ્વીના તમામ આગંતુકો ઘડીભર થોભી કહે
કે અહીં એક મહાન સફાઈકાર રહેતો હતો,
જેણો પોતાનું કામ શ્રેષ્ઠપણો બજાવ્યું!

- માર્ટિન લ્યુથર કિંગ, જૂનિયર

સાચી દિશાબું પ્રયાણ!

આ બને કહાણીઓનો સંદેશ યાદ રાખવા જેવો છે.

એક યુવા-દંપતી ગામડાની વાટ ચૂકી ગયું અને એક વૃદ્ધ ખેડૂત પાસે પહોંચ્યું. પોતાની ગાડી રોકીને અને પૂછ્યું, “ભાઈ, આ રસ્તો કઈ તરફ જશે?”

ઘડીભર પણ થોભ્યા વિના એ વૃદ્ધ ખેડૂતે કહ્યું, “બેટા, જો તમે સાચી દિશા પકડી રાખશો, તો આ રસ્તો દુનિયામાં તમે જ્યાં જવા હશ્યશો, ત્યાં તમને પહોંચાડશો.”

તમે સાચી વાટ પકડી હોય, પરંતુ
જ્યાં છો ત્યાં જ જીભા રહો,
તો કોઈ વાહન નીચે કચડાઈ પણ જઈ શકો!



એક યુવા અધિકારી બીજા દિવસની એક મહત્વની સભા અંગેનું કામ પોતાને ઘેર લઈને ગયો. પરંતુ અનો પાંચ વર્ષનો દીકરો, અને દર પાંચ-પાંચ મિનિટે ઉખલ પહોંચાડી અની વિચારશુંખલાને તોડતો રહ્યો. થોડીવાર આવું ચાલ્યા કર્યું. એ જોઈને અધિકારીએ સાંજનું એક છાપું શોધી કાઢ્યું, જેના પર દુનિયાનો નકશો હતો. એ નકશો હાથમાં લઈને, એણે એના દુકડે દુકડા કરી નાંખ્યા અને પછી દીકરાને એ ફરી વ્યવસ્થિત ગોઠવી આપવા કહ્યું. અને થયું કે તેનો છોકરો આ કામમાં એવો વસ્ત થઈ જશે કે તે દરમ્યાન એ પોતાનું કામ પતાવી શકશે.

પરંતુ, ગ્રણેક મિનિટમાં તો છોકરાએ પિતાને ઉત્સાહભેર કહ્યું કે એણે નકશો ગોઠવી લીધો છે. પિતાને તો ભારે નવાઈ લાગી અને આટલી જડપથી એ કેવી રીતે કરી શક્યો તે અંગે પૂછ્યું. પેલા નાનકડા બારકસે જવાબ આપ્યો, “આની પાછળની બાજુએ એક માણસનું ચિત્ર હતું, એટલે મેં કાગળને ઊલટાવીને આખો માણસ બનાવી દીધો. માણસ બરાબર ગોઠવાઈ ગયો, તો દુનિયા પણ આખી બરાબર ગોઠવાઈ ગઈ.”

કહેવાની કશી જરૂર છે કે, તમારી જાતને બરાબર ગોઠવો...
તો તમારી દુનિયા પણ બરાબર ગોઠવાઈ જશે!

આટાપાટાની રમત

તમારે આટાપાટાની રમત રમવી હોય અને કોઈ કહે કે એમાં પાટાના કોઈ લીટા દોરવાના નહીં, તો આટાપાટા રમી શકાય? પાટા વગર આટાપાટા રમવાની વાત કહેનારો મૂરખમાં જ ઠરે.

એ જ રીતે, જિંદગીમાં ‘ધ્યેય’નું મહત્વ છે. પાટા દોરાયા હોય તો જ રમનારને આગળ-પાછળ જવાની દિશા મળે છે. જેવી રીતે બાળકને ચિત્ર દોરેલાં ચોકઠાં આપો, પરંતુ એ ચોકઠાંને ગોઠવવાની ડાઢાપેટી ન આપો, તો એ ગુંચવાયા જ કરશે. એટલે રમતમાં પણ સંકેત આપનારાં સાધનોની જરૂર પડે છે.

જીવનધ્યેય ધૂવતારક બનીને આપણાને દિશા-સંકેત કરતાં રહે છે!

અત્યાર સુધી કશા આયોજન વગર, કોઈ પણ લક્ષ્ય નક્કી કર્યા વગર, આડેઘડ જીવન જીવીને, તમે આજે જે પરિસ્થિતિમાં છો... તેના કરતાં જો તમારી મંજિલ અંગે પૂર્વાયોજન કર્યું હોત તો કલ્યાન કરો કે તમે ક્યાં ના ક્યાં પહોંચો શક્યા હોત!

દોરી ખેંચો!

વિમાનમાંથી ફંગોળાતા પોરેશૂટ અંગેનું એક ગીત છે —

‘જો દોરી ન ખેંચો તો...
એનો કશો જ ઉપયોગ નથી.’

ઘણા યુવાનો પણ આ બંધ પોરેશૂટ જેવા હોય છે. એમનામાં શક્તિઓ ઘણી બધી પડી છે, પરંતુ એને પ્રગટ કરવા માટે એ કદી દોરી ખેંચતા જ નથી.

હંમેશાં ધ્યાનમાં રાખો કે અંગેજ શબ્દ ‘talent’ (પ્રતિભા), ‘latent’ (સુષુપ્ત) શબ્દમાં છૂપાયેલો છે અને તમારે માત્ર ‘ા’ અને ‘ાની’ અદલાભદલી કરવાની છે.

લક્ષ્યાંડો વગર ખેલ કેવો?

બાસ્કેટબોલની ચેમ્પિયનશિપની રમતનું એક દૃશ્ય નજર સામે ખુલ્લું કરીએ. બંને ટુકડીઓએ પોતાપોતાનાં નિશાનો અજમાવી લીધાં છે અને હવે બંને રમત રમવા તૈયાર થઈને ઉભા છે. ખેલાડીઓના ઉત્સાહ અને ઉત્સેજનાનો કોઈ પાર નથી.

તેઓ પોતપોતાની છાવશીમાં ઢોડી જાય છે, જ્યાં એમના પ્રશિક્ષક એમને છેલ્લો આદેશ આપે છે, “સાથીઓ, આ જ ક્ષાળ છે. હમજાં પાર પાડો, નહીંતર કદી તક નહીં મળો. આજે રાત્રે જ આપણે જીતીશું અથવા હારીશું. અત્યારે કોઈ આડાઅવળા વિચારો નહીં, આજની રાત... તમારે તમારા લક્ષ્ય પર જ નજર રાખવાની છે.”

ખેલાડીઓ ખીલી ઉઠ્યા. એમનામાં એવો થનગનાટ થયો કે જોરથી તે બારણાં ધશધ્વણાવતાં રમતના મેદાન પર ધસી ગયા. જેવા તેઓ મેદાને પહોંચ્યા અને ત્યાં જઈને જે જોયું, તેનાથી તેમના પગ ત્યાં ને ત્યાં જ થંભી ગયા. નિરાશા અને કોધમાં ફેરવાઈ જાય એવી ગુંગળામજા વચ્ચે તેઓ પોકારી ઉઠ્યા કે “ગોલ જ કાઢી નાંખ્યા છે... દઢા નાંખવાની ટોપલીઓ જ ગુલ! તો પછી રમીએ શી રીતે?”

એમણે ગુસ્સાભર પોકાર કર્યો કે ગોલ વગર રમત કેવી રીતે રમાય? ગોલ ન હોય તો સ્કોર ખબર ન પડે. એમણે ક્યારે ગોલ કર્યો કે ક્યારે ચૂકી ગયા, સ્પર્ધામાં ક્યારે પાછળ પડી ગયા કે ક્યારે લક્ષ્યાંક આંબી ગયા... આ બધું ગોલ વગર કેવી રીતે સમજાય? હકીકતમાં તો ગોલ વગર બાસ્કેટબોલ રમવાનો પણ કોઈ અર્થ ન હતો!

બાસ્કેટબોલમાં તો ગોલ (લક્ષ્યાંક) મહત્વના છે, બરાબરને? તો પછી તમારા જીવનનું શું? તમારા જીવનનો ખેલ તમે લક્ષ્યાંક વગર જ રમી રહ્યા છો? જો એમ હોય તો, તમારી સિદ્ધિનો આંકડો શું છે?

- લિંગ જિંબલર

તમારું જીવન ધ્યેય

ભલે તમે ગાંડાતુર મોજાંની હારોહાર
 તમારું વહાણ હંકારી ન શકો,
 ભલે ઘોડાપૂરના મદોન્મત મોજાની ટોચે ઊભી
 ઝંજાવાતો સામે હસી ન શકો.
 પરંતુ, લંગર નાંખીને કાંઠે રહેલા
 ખલાસીઓની સાથે ઉભા રહીને...
 તમે મદદનો એક હાથ તો લાંબો કરી શકો
 જેથી તેઓ સાગરમાં પોતાનાં વહાણ હંકારી શકે.

હુકમ કર્યો અને અમલ થાય તે માટે
 ભલે, તમારી પાસે સોનું-ચાંદી ન હોય,
 જેમના હાથ મદદ માટે લંબાયેલા હોય
 તેવા જરૂરતમંદોને ભલે કોઈ ચીજ ન પહોંચાડી શકો.
 પીડિત લોકો પાસે પહોંચીને
 તેમના દુઃખમાં સમભાગી તો થઈ શકો,
 કોઈ તારણહારનાં ચરણોમાં બેસી
 એના સાચા શિષ્ય તો બની જ શકો.

યુદ્ધના મોરચે પહોંચેલા
 કોઈ શૂર સૈનિક ભલે સિદ્ધ ન થઈ શકો,
 જ્યાં આગ કે ગાઢ ધૂમ્મસ છવાયેલું હોય
 ત્યાં ભલે કશું તમે ન કરી શકો.
 પરંતુ જ્યારે રણભૂમિ સૂભમસામ હોય
 ત્યારે જરૂરી સામાન સાથે પહોંચીને,
 ધાયલોને પીઠ પર ઉપાડી શકો
 તમે મૃતો પર માટી તો ઢાંકી શકો.

એટલે કોઈ મહાનકાર્ય કરવા મળશે એ આશામાં
 રાહ જોતાં બેકાર ન બેસી રહેશો.
 વિધાતા તો એવી પ્રમાણી દેવી છે કે
 જાતે ચાલીને ક્યારેય તમારી પાસે નહીં આવે.
 ઊઠો અને પહોંચી જાઓ કોઈ પણ આંગણો,
 કશુંય કરતાં ડરશો કે અચકાશો નહીં.
 પરસેવાનાં બે બુંદ પાડવા ભૌંય જોઈએ,
 તે તો ગમે ત્યાં તમને મળી જ જશે.

- ઔલન એમ. હંટિંગન ગેટ્સ



પોતાનાં સપનાં પાર પાડવાની દિશામાં
જે કોઈ આત્મવિશ્વાસભર્યા ડગ ભરે...

અને

ધાર્યા મુજબનું જીવન
જીવવાનો એ પ્રયાસ કરે
તો

ન ધારેલી સફળતા
સામેથી આવીને એના પગ ચૂમશે.

ભલે ને,
તમે હવાઈ કિલ્લા બાંધ્યા હોય...
તેથી કશું બેકાર નથી જવાનું.

હવાઈ કિલ્લા તો હવામાં જ હોય,
બસ હવે આટલું જ કરો... કે...
એ કિલ્લા નીચેના
પાયા પણ રચવા માંડો.

- હેનરી ડેવિડ થોર્નો

તમારા જીવનના કોલંબસ બનો!

આજે નવું વર્ષ!

આજે, તમે નવો પુનર્જન્મ પામી શકો...

ઓ તમે, તમારા સાચા સ્વરૂપને આણી શકો!

જગત આખામાં તમે જ સૌથી મહત્વના માણસ છો!

ધણા લોકોને હજુ પોતાના જીવનનું આ સત્ય સમજાયું નથી. પૃથ્વી પરનો વિશાળ માનવ સમુદ્ધાય, પોતાના અસ્તિત્વના સાચા સ્વરૂપની ઓળખ વગર જ ટિકસો પસાર કરતો રહે છે.

સર્વજ્ઞ પરમાત્માની માનવી નામની આ ફૂતિ, સફળ જીવન જીવવા પૃથ્વી પર પ્રગટ કરાઈ છે. આપણે સફળ થવા માટે પેદા થયા છીએ. કુદરતના બીજા કોઈ સર્જન પાસે નથી, એવી શક્તિઓ આપણાને જન્મસિદ્ધ પ્રાપ્ત થઈ છે. આવી પ્રચંડ શક્તિનો આપણે ઉપયોગ ન કરીએ અને આપણાને મળેલાં સાધનો વણવાપર્યો જ પડ્યાં રહે, તો આપણે એ મહાન શિલ્પકારનો દ્રોહ કરીએ છીએ. સફળતા એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પોતાના જીવનકાળ દરમ્યાન ધણા જૂજ લોકો પોતાના આ જન્મસિદ્ધ અધિકારનો ઉપયોગ કરે છે.

વૈજ્ઞાનિકો અને માનસશાસ્ત્રીઓ કહે છે કે સરેરાશ માણસ અના મનની શક્તિઓનો સાવ થોડી ટકાવારીમાં ઉપયોગ કરી જાણો છે. આ ટકાવારી લગભગ ત્રણથી દસ ટકા સુધી જ પહોંચે છે.

આપણે આપણી રસરૂપી કે શોખો અંગે, આપણી રમતો કે આસપાસની અનેક ભૌતિક બાબતો અંગે ઘણું બધું જાણીએ છીએ. પરંતુ આપણી પોતાની ઊંઠગીના કોલંબસ બનીને પોતાની જાતને શોધવામાં, આપણે હજુ નિષ્ફળ નીવડ્યા છીએ.

માનવ સંસ્કૃતિના પ્રારંભથી, જગતનાં તમામ મહાન સ્ત્રી-પુરુષોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં જ વિશિષ્ટ પ્રતિભાસિદ્ધી હાંસલ કરી, તેમણે સૌપ્રથમ પોતાની જાતની ઓળખ મેળવી હતી!

- નેપોલિયન હિલ

સરધસની ઈયળો

ધ્યેયવિહોષણાં નર કે નારી
 સૂકાન વગરનાં વહાણ સમાં છે!
 એવું વહાણ, જે દ્વસાયા કરે... હંકારી ન શકાય!
 નિરાશા, ઉદાસી અને પરાજ્યના કિનારા જ
 તેમના સમાધિસ્થાન બને!

જહોન હેનરી ફેબર નામના એક મહાન હેંચ નિર્સર્ગવાદી થઈ ગયા. પોતાના પ્રયોગોમાં એ સરધસ આકારે ચાલતી કતારબંધ ઈયળોનો ઉપયોગ કરતા. આવી ઈયળો હંમેશાં તેમની આગળની ઈયળને જ અનુસરે, એ એમની લાક્ષણિકતા.

એક ફૂલદાનીની આસપાસ વર્તુળમાં એમણે આ ઈયળોને ગોઠવી અને એવી રીતે ચાલતી કરી કે પહેલી અને છેલ્લી ઈયળ સાથે-સાથે થઈ જાય અને એક પૂરું વર્તુળ બની જાય. ફૂલદાનીના મધ્યબિંદુમાં એમણે ઈયળો માટેનો ખોરાક ગોઠવ્યો. ફૂલદાનીની ગોળ-ગોળ ધૂમવાનું શરૂ કરીને આ ઈયળો, કલાકો જ નહીં, દિવસોના દિવસો, રાતોની રાતો નિરંતર ધૂમતી જ રહી. પૂરા સાત દિવસ અને રાત સુધી પેલી ફૂલદાનીની આસપાસ ગોળ-ગોળ ચક્કર કાપીને, અંતે ભૂખ અને થાકની મારી ત્યાં જ અટકીને તે બધી મરણ પામી. એમનો ખોરાક તો એમનાથી માત્ર છ હેંચ જ દૂર હતો, પરંતુ તે ભૂખે મરી, કારણ કે તેમણે પોતાની રગશિયા પ્રવૃત્તિ સિવાય બીજું કશું જ જોયું નહીં.

ધણા લોકો આવી જ ભૂલ કરી બેસે છે અને પરિણામે જીવનમાં કાંઈક થોડું-અમથું જ પામે છે. ‘બસ, આગે સે ચલી આતી હૈ’નું રટણ કરતાં કરતાં, તેઓ ચીલાચાલુ રીતરસમોને જ વળગી રહે છે અને એક ઘરેડમાં કેદ થઈ જાય છે.

ન જાણું-સાંભળ્યું હોય તેવું કેટલુંય ધન આપણી આસપાસ, આપણી પહોંચમાં જ પડેલું હોય છે. પરંતુ એનો કશો જ લાભ આપણો લઈ શકતા નથી, કારણ કે પેલી સરધસની ઈયળોની જેમ અંધ અનુકરણ કરતાં, કયાંય ન પહોંચાય તેવા વર્તુળમાં આપણો ગોળ-ગોળ ફર્યા જ કરીએ છીએ!

જેમણો સેતુ બાંધ્યા

એક વૃદ્ધજન, એકાંત વાટે આગળ વધતાં,
ઠંડી, ધુમસહરી સાંજે, એક ખીણ પાસે આવી પહોંચ્યા.
પહોળી, ઉંડી અને વિશાળ ખીણ
જેમાં ધસમસતાં પૂર ઉછળતાં હતાં.

સમી સાંજના જાંખા ઉજાસમાં, વૃદ્ધે પાણીમાં જંપલાવ્યું.
ધસમસતા પૂરનો એમને લગીરે ડર નહોતો,
અને સહીસલામત એ પહોંચી ગયા સામા કાંઠે,
પછી ખીણને પાર કરવા સેતુ બાંધવાનું શરૂ કર્યું.

ત્યારે સહીયાત્રીએ ટકોર કરી,
“દાદા, શા માટે શક્તિ વેડફો છો?
સાંજ નમતાં તો તમારી યાત્રા પૂરી થશે
અને ફરી કદી તો તમે અહીં આવવાના નથી!
તમે પોતે તો ઉંડી-પહોળી ખીણ પાર કરી ચૂક્યા છો,
તો પછી હવે આ સેતુ બાંધવો શા માટે?”

ત્યારે શેતકેશી દાદાએ માથું ઉંચુ કરી કહ્યું,
“દોસ્ત, જે રસ્તો પાર કરીને હું આવ્યો
તે વાટે મારી પાછળ એક યુવાન પણ હતો,
જે હવે અહીં આવી પહોંચવામાં જ છે.
આ ખીણ ઓળંગવી તે મારા માટે તો રમત વાત,
પણ એ શ્યામ-કેશી યુવાન માટે કદાચ કૂવા-સમી બની શકે.
સાંજના આછા અજવાળામાં એ પણ ખીણ સહજ ઓળંગી શકે,
તે માટે મારા ભિત્ર, હું આ સેતુ બાંધી રહ્યો છું.”

- વિલ અંલન રોમગુલ

છટકબારીઓનો નાશ હરો!

લક્ષ્યને હાંસલ કરવા માટે તમારી સમસ્ત પ્રતિબદ્ધતા જોઈએ!
આ સંદેશને સમજવા માટે સન ત્યુએ લખેલી ‘ધ આઈ ઓફ
વોર’માંની બે હજાર વર્ષ જૂની ચીની વાર્તા ખૂબ ઉપયોગી નીવડશે.

પોતાના આ પુસ્તકમાં, સન ત્યુ એક ટાપુ પર ચઢાઈ કરવાની
તૈયારી સાથે નીકળેલ યોદ્ધાઓ અને તેમના સરદારની વાત કહે
છે. દસ નાની હોડીઓમાં બેસીને તેઓ સૌ ટાપુ પાસે આવી પહોંચે
છે. શત્રુ પર વાર કરવા સૌ યોદ્ધા તત્પર અને તૈયાર છે. ટાપુની
નગરી સુધી પહોંચવા એમને એક નાનકડી ટેકરી ચઢીને પેલે પાર
પહોંચવાનું છે.

ટેકરાની ટોચે પહોંચતાં સૌ આગળ વધે તે પહેલાં ૪,
એમના સરદારે પાછા ફરીને એમની હોડીઓનું શું થયું છે તે
જોવા કહ્યું. પોતાની હોડીઓને સણગતી જોઈ સૌ થથરી ઊઠચા.
એમના સરદારે ૪ બધી હોડીઓ સણગાવી દીધી હતી અને નાસી
છૂટવાના એમના એક માત્ર સાધનનો ખાત્મો બોલાવી દીધો હતો.

આ લોકો હવે કેવી રીતે હુમલો કરશે એમ તમે માનો છો?
લડાઈ વખતે સામેથી થતા પ્રહારોનો તેઓ કેટલી મક્કમતાથી સામનો
કરશો?

તમારા કોઈ સંબંધની વાત હોય કે કારકિર્દીની અથવા તો
બીજ કોઈ પણ બાબત હોય, જો તમે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતા
અંગે ગંભીર હો, તો તમારા જીવનમાં ભાગી છૂટવા માટેની છટકબારી
સમી હોડીઓ સણગાવવાનો નિર્ણય લેવો ૪ જોઈએ. કારણ કે જો
છટકવાનો રસ્તો રાખ્યો હશે, તો કોઈ પણ આફત આવી પહોંચતાં
૪ એ છટકબારીમાંથી નાસી છૂટવાનો તમને લોભ જાગશે અને
તમારી ધ્યેયસિદ્ધ તરફની મજલમાંથી તમે પીછેહઠ કરશો.

૭૮

જેના માટે પ્રાણ આપી શકાય
તેવું પ્રયોજન માણસ શોધી ન લે...
ન્યાં સુધી જીવન જીવવા માટે એ યોગ્ય નથી!

- માર્ટિન લ્યુથર કિંગ

૭૯

લક્ષ્ય એ હુંધણ છે!

ધ્યેય વગરનો માનવી સૂકાન વગરના વહાણ જેવો છે, જે આડેધડ ફંગોળાતું રહે છે અને ગમે ત્યારે ખડક સાથે અથડાઈને ભાંગી પડવાના સતત ભયમાં રહે છે. ધ્યેયુક્ત માનવી સૂકાન સાથેના વહાણ સમો છે, જેમાં કપ્તાનની દોરવણી છે, સાથે નકશો પણ છે અને વળી હોકાયંત્ર પણ છે. આ બધાની મદદ સાથે વહાણને મંજિલ તરફ સીધા સડસડાટ હંકારી લઈ જઈ પોતાના મનપસંદ બંદરે તેને લાગરી શકાય છે.

થોમસ કાર્લાઇલ લખ્યું છે કે, “અધકચા નિર્જયવાળો માણસ સીધાસટ રસ્તે પણ આગળ-પાછળ, આડો-અવળો થતો રહે છે અને જરીકે પ્રગતિ સાધી શકતો નથી. જ્યારે દૃઢ સંકલ્પવાળો મનુષ્ય એકધારી ગતિથી આગળ વધતો રહે છે, પછી રસ્તો ભવેને ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય?”

આપણો સૌ માનવ, ધ્યેયવાળા પ્રાણી છીએ. જીવનમાં પ્રયોજનો હોય, ઇચ્છિત મુકામો હોય, તો જ આપણો કાર્યરત રહીએ છીએ. આપણી માનસિક સંરચના જ એવી છે કે આપણો મન જેનું મહત્વ હોય તેવા લક્ષ્યને સિદ્ધ કરવા તરફ આગળ વધતાં ન રહીએ, ત્યાં સુધી આપણને અંતરનું સુખ અને સંતોષ મળતાં જ નથી.

તમારા મગજમાં ધ્યેય શોધવાની એવી યાંત્રિક રચના છે, જે તમને તમારી ધ્યેયસિદ્ધ તરફ અચૂક દોરી જાય છે. જેવી રીતે મિસાઈલને માર્ગ ચીધનારી યંત્રરચના હોય છે, એ જ રીતે માનસિક સંરચનામાં તમારા ધ્યેય પાસેથી તમે સતત દોરવણી મેળવતા રહો છો અને તમારો પંથ પણ આપોઆપ નિર્વિઘ્ન થતો જાય છે. તમારા મનની આવી સંરચનાને કારણો જ, તમે તમારા માટે જો સ્પષ્ટ અને ચોક્કસ ધ્યેય નક્કી કરો, તો તે જરૂરથી સિદ્ધ કરી શકો. ધ્યેયસિદ્ધની પ્રક્રિયા તો લગભગ સ્વયંસંચાલિત છે, મોટાભાગના લોકો માટે ધ્યેયની પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરવી તે જ મોટામાં મોટી સમસ્યા હોય છે.

આપણો નક્કી કરેલા ધ્યેયને આપણો સિદ્ધ કરીએ જ છીએ, એ વાત સાવ સાચી છે. આજે તમે જે કાઈ છો અને જ્યાં છો, ત્યાં તમે એટલા માટે છો, કારણ કે ત્યાં તેવા રહેવાનો તમારો સંકલ્પ હતો. તમારા વિચારો, તમારાં કાર્યો અને તમારા વ્યવહારોએ જીવનના વર્તમાન મુકામે તમને પહોંચાડ્યા છે અને જો સાચું કહીએ તો આ સિવાય બીજા કોઈ મુકામે તમે પહોંચી પણ ન શક્યા હોત.

- બ્રાયન ટ્રેસી

સર્વાગી સ્વાસ્થ્યનું દર્શન!

ધ્યેય-નિર્ધાર કરવો અને એની સિદ્ધિ માટેનું આયોજન કરવું, એ સફળતાનું સર્વોત્તમ કળાકૌશલ્ય છે!

આ કૌશલ્યને વિકસાવવાથી બીજા કોઈ પણ ઉપાય કરતાં વધુ ખાગીપૂર્વક સફળતા પ્રાપ્ત થઈ શકશે. જીવનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ સ્ત્રી- પુરુષોએ ધ્યેયને તેમના જીવનની બુનિયાદ બનાવી છે.

તમારી ક્ષમતાની સભાનતા ત્યારે જ કેળવાય જ્યારે તમે ધ્યેયનો સંકલ્પ કરો. સવારના પહોરમાં ઊરીને દાંત સાફ કરવાની કે માથું ઓળવાની પ્રક્રિયા જેટલી જ સહજ પ્રક્રિયા આ ધ્યેય-નિર્ધારની છે.

એકવાર લક્ષ્ય નક્કી થાય, પછી અસરકારક આયોજન કરવાની ચાવી મળી જાય છે. જેવી રીતે, વિમાન જ્યારે નીચે ઉત્તરવાનું હોય, ત્યારે એના રનવેની બજીઓ એના ઉત્તરાંશ-પથ પર અજવાણું પાથરી હે છે, એ જ રીતે ધ્યેય-નિર્ધાર સફળતાના પથ પર અજવાણું પાથરી હે છે.

ધ્યેય-નિર્ધાર દ્વારા....

- * તમારી શક્તિ, સમય, બુદ્ધિ તેમજ કૌશલ્ય તમે એવી રીતે પ્રયોજ શકો છો, જેથી તાક્યું તીર સડસડાટ નિશાનને જ વીધે.
- * તમારી આનુષ્ઠાંગિક યોગ્યતાઓનો પણ તમે અસરકારક ઉપયોગ સિદ્ધ કરીને સફળતાને અર્થપૂર્ણ બનાવી શકો.
- * સિદ્ધ કરવાનાં પરિણામો તેમજ તે દિશામાં તમારી પ્રગતિનું માપ કાઢી, ધાર્યા નિશાન પાર પાડવા માટેના જરૂરી સુધારા-વધારાનું આયોજન કરી શકો.
- * સફળતાના પંથે આડે આવતાં વિન્ધાનો ઓળખી એને વધુ અસરકારક રીતે દૂર કરી શકો.

તમારી નજર તમારા જીવનના પ્રત્યેક પાસા પર ફરતી રહેવી જોઈએ, કારણ કે તમારા ભવિષ્યનો આધાર, જીવનનાં તમામ પાસાં પર અવલંબિત છે. એટલા માટે, જીવનનાં વિવિધ ક્ષેત્રનાં અલગ ધ્યોન તમારે નક્કી કરવાં જોઈએ.

તમારું જીવનદર્શન સર્વાગી હોયું ધટે, જેમાં તમારા શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સ્વાસ્થ્યનો સમાવેશ થતો હોય.

- નીરો આર. કૃષુભેન

પ્રેરણાનો જાદુ

તમારી સૌથી મોટી
નખળાઈ છુટ્ટ છે...
તે જાણો છો?

એ છે...
પોતાની શક્કિતાઓ વિષેની
તમારી
અભાનતા!





પ્રેરણાનો જાદુ

અંધકારને ધિક્કારવા કરતાં
દીપ પ્રગટાવવાનું
કામ કરવું જોઈએ...

કારણ કે
ગમે તેટલો અંધકાર પણા...

પ્રજીવલિને દીપની જ્યોત
કુચારેય
ખૂલ્હાવી ન શકે!

પ્રેરણાની અદ્ભુત શક્તિ!

એક નાનકડો છોકરો તેની સ્કૂલમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરવા નિયમિત આવે. પરંતુ સ્કૂલની ટીમમાં રીજર્વ બેલાડીથી આગળ તેનો ક્યારેય સમાવેશ થયેલો નહીં. એ રમતો ત્યારે એના પિતા એની રાહ જોતા મેદાનમાં ખૂણામાં બેસી રહેતા.

આંતર-શાળાકીય મેચો શરૂ થઈ, પરંતુ ચાર દિવસ સુધી એ બિલકુલ ડોકાયો જ નહીં. સેમી-ફાઇનલ પણ પતી ગઈ. ત્યાં અચાનક ફાઇનલ શરૂ થવાના દિવસે એ કોચ પાસે જઈને કહે, “સાહેબ, તમે મને હુંમેશાં રીજર્વમાં જ રાખતા આવ્યા છો. મહેરબાની કરીને આજે મને ટીમમાં રમવા દો.”

કોચ કહે, “બેટા, હું તને કેવી રીતે લઈ શકું? ટીમમાં તારા કરતા ઘડા ચઢિયાતા બેલાડી છે અને આ તો ફાઇનલ. એવું જોખમ હું ઊઠાવી ન શકું.” છોકરો કરગયો, “હું વચન આપું છું કે હું તમારો વટ રાખીશ, પણ ફૂપા કરીને મને રમવા દો.”

કોચે એને આ રીતે કરગરતો કદી જોયો નહોતો. એમણે કહ્યું, “ભલે, દીકરા, ત્યારે થઈ જાય! જ રમ, પણ યાદ રાખજ. આજે શાળાની આબરૂનો સવાલ છે, મને નીચો ન પાડશ.”

રમત શરૂ થઈ અને પેલા છોકરાએ તો જાણે ચમત્કાર જ સજ્યો. જેટલી વાર તેની પાસે ઢો આવે, તે ગોલ કરતો જ જાય. એની ટીમે જવલંત વિજય મેળવ્યો અને તે ‘મેચનો હીરો’ જાહેર થયો.

રમત પૂરી થતાં જ કોચે એને કહ્યું, “બેટા, આજે તે આવી કમાલ શી રીતે કરી? આવું તો આ પહેલાં તું ક્યારેય રમ્યો નથી.”

છોકરાએ જવાબ વાય્યો, “સાહેબ, આજે મારા પિતા મને જોઈ રહ્યા હતા.” કોચે પાછું વાળને જોયું. જ્યાં રોજ એના પિતા બેસતા, ત્યાં આજે કોઈ નહોતું. તેમણે કહ્યું, “બેટા, તારા પિતા તો પેલા ખૂંડો બેસતા હતા ને? પણ આજે તો ત્યાં કોઈ નથી!”

છોકરાએ કહ્યું, “સાહેબ, મારા પિતા અંધ હતા અને ચાર દિવસ પહેલાં જ તેઓ ગુજરી ગયા. આજે આ પહેલો દિવસ હતો, જ્યારે સ્વર્ગમાંથી તેઓ મને જોઈ રહ્યા હતા! મારે આજે એમને બતાવી આપવું હતું કે હું પણ જીતી શકું છું!”

પ્રેરણાની શક્તિ કેવાં અદ્ભુત પરિણામો લાવી શકે છે, એવું આ એક અનુપમ દૃષ્ટાંત છે! જીવનમાં સફળતા મેળવવા માટે, પ્રેરણા એ એક મહાન પ્રેરક બળ છે!

આશાવાદીનો જીવનમંત્ર!

આશાવાદી સભ્યોની એક કલબે ‘આશાવાદીનું મનોવલાણા,’
એ નામનો જીવનમંત્ર અપનાવ્યો છે.

સીધીસાદી પ્રાર્થના કે આમનિર્ધાર સમો આ મંત્ર...
તમારા જીવનમાં કાંતિ લાવી શકે તેવો બળવાન છે!

- * મજબૂત એટલા થવું કે... ડહોળી શકે ના કોઈ...
શાંતિ મારા મનની!
- * જે કોઈની સાથે ભેટો થાય... વાતો કરું...
આરોગ્ય, આનંદ અને ઐશ્વર્ય તણી!
- * મારા તમામ મિત્રોને અહેસાસ કરાવું કે...
એમનામાં કશુંક વિશેષ છે!
- * પ્રત્યેક ચીજની ઉજળી બાજુ જ જોવી...
જેથી કરીને મારો આશાવાદ ફળી શકે!
- * વિચારવું તો સવોત્તમ, કરવું પણ ઉત્તમોત્તમ...
અને સ્વીકાર પણ શ્રેષ્ઠતમનો જ!
- * મારી ફંતેહ પર જેટલો ઉત્સાહ દાખવું...
તેટલો જ ઉત્સાહ, અન્યના વિજય પર પણ દાખવું!
- * ભૂતકાળની ભૂલો વિસરી જવી...
અને ભવિષ્યની મહાન સિદ્ધિ કાજે મથવું!
- * સદા સર્વદા હસમુખા રહીને...
જે કોઈ મળે તેને પીરસવું... એક સિમત!
- * મારી જાતને સુધારવામાં જ એટલો સમય વાપરવો...
કે બીજાની ટીકા માટે ફૂરસદ જ ન મળે!
- * ચિંતા-ઉપાધિ વળળી ન શકે તેવું દરિયાવ દિલ...
ગુર્સો કદી સ્પર્શી ન શકે તેવી ઉમદા પ્રકૃતિ...
ભય હામ ભીડી ન શકે તેવું મજબૂત મન...
અને આફતોનું દબાણ ભીંસી ન શકે
તેવું આનંદી વ્યક્તિત્વ...
કેળવવાની હો મારી જીવનસાધના!

જે કાંઈ છો, તેમાં સર્વોત્તમ બનો!

ટેકરી પરનું ઝાડ ભલે તમે ન બની શકો,
ખીણાનું નાનું જાંખણું તો બનો, બસ બનો!
જરણા સમીપે સુંદર એવી જાડી,
ભલે વટવૃક્ષ ન સહી, નાનો છોડ તો બનો જ બનો!

કદાચ છોડ ન બની શકો તો બનો થોડુંક ઘાસ,
અને કોક રાજમાર્ગને હસતો કરો!
ભલે મૃગ-કસ્તૂરી ન બની શકો, બનો માત્ર પોયણી,
પરંતુ બનો સરોવરનું સૌથી જીવંત કમળ!

બધા કપ્તાન તો બની ન શકીએ, સેનામાં પણ જોડાવું રહ્યું,
સૌ માટે આહી કાંઈકને કાંઈક તો છે જ!
મોટાં કામો પણ અને વળી નાનાં પણ ખરાં જ,
સૌ હાથવગાં કામોને આપણે કરી છૂટીએ!

ભલે તમે રાજપંથ ન બની શકો, બનો માત્ર એક કેડી,
સૂરજ ભલે ન બની શકો, સિતારા હી સહી!
કદ-ધેરાવથી હાર-જીત અંકાતી નથી,
તમે જે કાંઈ છો, તેમાં તો સર્વોત્તમ બનો!

- ડાલાસ મલોક

અજબ અને મનોહર છે કલ્પનાશક્તિનો આ કસબ!
પોતાનું નાનકદું જગત
સુખવસ્થિત અને આનંદમય બનાવી દેવાનું
અનેં કૌવત આપે છે અને
માનવના સમસા શક્તિભંડારનો બની જય છે
એ આતિમૂલ્યવાન અદ્ભુત ખજાનો!

- ફુક બેન

મન તેમજ આત્મા માટેબું પોષણ!

એક પ્રશ્ન પૂછ્યું...

“ગયા મહિને તમે કાંઈ ખાયું?

ગયા અઠવાડિયે? ગઈ કાલે? ચાલો, આજે?

આ પ્રશ્ન સાંભળીને તમે જરૂર મુંજાઈ જવાના. ગયા મહિને, ગયા અઠવાડિયે, ગઈ કાલે અને આજે, તમે ખાયું તે વિષે ભાગ્યેજ કોઈ શંકા હોઈ શકે! તમે આવતી કાલે ખાવાના? જો ખાવાના હો તો એનો અર્થ એ છે કે આજે તમે જે ખાયું તે બરાબર નહોતું? ના સ્તો વળી! એનો અર્થ તો એટલો જ કે આજે જે કાંઈ ખાયું તે આજ માટે હતું.

સરેરાશ મનુષ્ય લગભગ રોજ ખાય છે અને તે પણ લગભગ ચોક્કસ સમયે. જો કોઈ માણસ કશાક કમ્મમાં અટવાઈ જાય અને ભોજનનો એકાદ્ય ટંક ચૂકી જાય, તો એ તરત કહેશે કે, “આજે તો યાર, હું એટલો વ્યસ્ત રહ્યો કે ખાવાનું પણ ચૂકી ગયો!” બે-ત્રણ વાર એના મોઢેથી આ વાત નીકળી જાય છે. એના માટે જમવાનો સમય ચૂકી જવાય, એ જાણે મોટી બાબત છે અને લાગતા-વળગતા સૌને એ જણાવવા ઈચ્છે છે કે તેણે આજે કેટલું મોટું બલિદાન આપ્યું છે!

પરંતુ આ જ માણસને કોઈએ એની માનસિક કે આધ્યાત્મિક ભૂખ અંગે પૂછ્યું હોત કે, “છેલ્યે તમે ક્યારે, અગાઉથી પ્રયોજેલા સમયે, તમારા દિલ-દિમાગ કે અંતરાત્માને ખોરાક પહોંચાડ્યો હતો?”

એનો જવાબ તમે શું ધારો છો? એની વાત મૂડો, તમારો પોતાનો જવાબ શું છે?

તમારા શરીરને પોષણ આપો... એટલું જ મહત્વાનું છે...

તમારા મન અને આત્માને પણ પોષવાનું!

જેમ તમારું શરીર માંગે છે આરોગ્યપ્રદ અને પોષણક્ષમ આહાર...

જેથી કરીને એ રહી શકે તંહુરસ્ત અને ચુસ્ત-દુરસ્ત...

એ જ રીતે તમારાં મન તેમજ આત્મા પડા માંગે છે પોષણ!

એમને વાસી કે કચરા સમા ખોરાક પર ન નભાવશો!

એમને માટે તમારે પ્રયોજન કરવા ઘટે...

પ્રેરણાદાયક અને પ્રોત્સાહજનક વાંચન, વાર્તાલાપો,

સંગીત અને અન્ય દર્શય-શાબ્દ ઉપાદાનો...

જે ચિત્તને પ્રસન્ન રાખે અને આત્માને યૈતન્યમય!

અંદરનો તાર રણકાળાવો!

શિનિથી સુજુકી આપાનનો એક એવો વિરલ વૈજ્ઞાનિક છે, જેણે વર્તમાન સંદર્ભમાં એક ચમત્કાર સજ્યો છે.

હજુ તો માંડ બે-ચાર અઠવાટિયાંની ઉંમર થઈ હોય તેવાં નાનકડાં ખૂલકાંઓને એ અપનાવે છે અને એમનાં પારણા પાસે રેકોર્ડ કરેલું સુંદર, કણ્ણપ્રિય સંગીત સંભળાવે છે. એકનો એક સૂર વારંવાર વગાડ્યા પછી ત્રીસ દિવસ બાદ તે બીજા રેકોર્ડિંગ સાથે આ જ પ્રમાણે કરે છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી એ પોતાનો આ કમ ચાલુ રાખે છે. ત્યાર બાદ એ બાળકની માતા માટે સંગીતના ત્રણ મહિનાનું શિક્ષણ ચાલુ કરે છે, જેમાં બાળક શ્રોતા બની રહે છે. ત્યાર પછી એ બાળકના હાથમાં નાનકડું વાયોલિન મૂકે છે, જેનો સ્પર્શ પામીને બાળક તેનો ઉપયોગ કરતાં શીખે છે. પહેલો પાઠ માત્ર બે કે ત્રણ મિનિટનો જ હોય છે. પછી ધીરે ધીરે એ કલાક સુધી પહોંચે છે. જે ઉંમરે બાળકને વાયોલિન વગાડવું ખૂબ અધરું લાગે, તે વયે પહોંચતા સુધીમાં તો આ બાળકને વાયોલિન વગાડવું સિદ્ધહસ્ત થઈ ચૂક્યું હોય છે. તાજેતરમાં જ તેમણે આવા ૧,૫૦૦ જાપાનીઝ બાળકોનો વાયોલિન કોન્સર્ટ ગોઠવ્યો હતો. આ બાળકોની સરેરાશ ઉંમર સાત વર્ષની હતી અને તેમણે બીથોવન, મોઝાર્ટ અને વિવાલ્ડીની તરજો ખૂબ સુંદર રીતે વગાડી બતાવી.

સુજુકીનું કહેવું છે કે દરેક બાળકમાં કાંઈક ને કાંઈક વિશિષ્ટ કળાકૌશલ્ય હોય છે, જેને વિકસાવી શકાય છે. બાળકને જે રીતે બોલતાં શીખવીએ, એ જ રીત આમાં પણ અપનાવી શકાય. મોટા લોકોથી ઘેરાયેલું બાળક તેમની વાતચીત સાંભળતું રહે છે. ત્યારબાદ, બાળક અનુકરણ કરીને બોલવા મથે છે. ઘરનાં સૌ સભ્યો બાળક ફરી-ફરીને બોલે તે માટે તેને પ્રોત્સાહિત કરતાં રહે છે. ત્યાર પછી બાળક તેનું શબ્દભંડોળ વધારતું જાય છે અને પછી નાનાં નાનાં વાક્યો બોલતું પણ થઈ જાય છે. ત્રીજા કે ચોથા વર્ષે તો બાળક પાસે ખાસસું શબ્દભંડોળ ભેગું થઈ જાય છે, ભલે એને એક અક્ષર વાંચતા પણ આવડતું ન હોય. મોફેસર સુજુકી કહે છે કે આ જ પદ્ધતિ દ્વારા બાળકને ગમે તે વિષય શીખવાડી શકાય છે.

તમારું જીવનની સિદ્ધિઓનો આધાર તમારી જન્મભાત સ્થિતિ પર નહીં, પરંતુ તમારી સ્વર્યાસ્થ આવતો ઉપર નિર્ભર છે, વળી તમે જે કાંઈ સિદ્ધ કરી શકો છો, તેનો આધાર પણ તમે કેળવેલી સોબત તેમજ તમારા મનના વિચારોના પ્રભાવ પર રહેલો છો!

મોટામાં મોટી કરુણાતા!

ઘણાં વખ્ઝો પહેલાં, ઓકલાહોમા પ્રદેશના એક વૃદ્ધ રેડ-ઇન્ડિયનની જમીનમાંથી તેલ મળી આવ્યું. આ રેડ-ઇન્ડિયન આખી જિન્દગી ગરીબાઈમાં બેહાલ રહેલ, પરંતુ તેલ મળી આવ્યું તેથી રાતોરાત મોટો ઘનાઢ્ય બની ગયો. એણે સૌથી પહેલા તો એક મોંઘીદાટ કેડીલેક ગાડી બરીદી. અખ્રાહન લિંકન જેવી હેટ લઈ, એને પીંછા-રીબનથી શાશગારી અને લાંબી કાળી સિગાર હોકે ધરીને તેણે નવો દેખાવ ધારણ કર્યો.

દરરોજ એ નજીકના ગરમ, ધૂળિયા અને નાનકડા નગરમાં ગાડી હંકારીને જતો. સૌ કોઈ એને જૂબે એવું તે ઈચ્છાતો. આમ તો એ મળતાવડો હતો, એટલે નગરમાંથી ગાડી પસાર થાય ત્યારે ડાબે-જમણો સૌ સાથે થોડીક વાતચીત પણ કરી લેતો.

રસપ્રદ બાબત એ હતી, કે તેણે કદી કોઈને તેની ગાડીની અડફેટે લીધા નહીં, કે ન તો કોઈને ઈજા કરી, કે ન કદી કોઈ અક્સમાત કર્યો! પણ તેનું કારણ સાવ સીધુસુટ હતું. તેણે મોટી, સુંદર ગાડીને ખેંચવા બે ઘોડા જોડવા હતા!

સ્થાનિક કારીગરોએ ગાડી તપાસીને કહ્યું કે તેના એન્જિનમાં કશો જ ખટકો નહોતો, પણ આ ભલા માણસને ચાવી નાંખી ગાડી શરૂ કરતાં જ આવડતું નહોતું. ગાડીમાં તો સો સો અશ્વશક્તિનું દંધણા ભર્યું હતું, સહેજ ચાલુ કરો અને ધસમસવા તત્પર. પરંતુ ઇન્ડિયને તો ગાડી હંકારવા બહાર બે ઘોડા મૂક્યા હતા.

ઘણો લોકો પણ આવી જ ભૂલ કરે છે! બહારથી બે ઘોડાની તાકાત મેળવવા મથે છે, પરંતુ અંદર જ્યાં સેંકડો અશ્વશક્તિ ભરી પડી છે ત્યાં નજર સુદ્ધા નથી કરતા. માનસશાસ્ત્રીઓ કહે છે કે આપણી કુલ શક્તિઓમાંથી આપણે માત્ર બે કે પાંચ ટકાનો જ ઉપયોગ કરીએ છીએ.

સરેરાશ મનુષ્ય પોતાની ભીતર સમાયેલા સંગીતની વણગાયેલી સુંદર ધૂનો સાથે જ સમશાને પહોંચે છે!

રાષ્ટ્ર માટે સૌથી મોટી કરુણાંતિકા એ નથી કે, તે કુદરતી સંસારનોના મોટો વય કરે છે. આ પણ કરુણા તો છે જ, તેમ છતાંય આથી વધુ કરુણ બાબત તો એ છે કે, આપણે માનવીય ઉર્જા-ખોતોને વેડફી રહ્યાં છીએ.

- જિગ જિગલર

જોખમ

હસવામાં મૂરખ દેખાવાનું જોખમ ભર્યું છે.

રડવામાં લાગણીશીલ વર્તિવાનું જોખમ રહ્યું છે.

કોઈની સાથે જોડાવામાં સંડોવાઈ જવાનું પણ જોખમ છે.

લાગણીઓ વ્યક્ત કરવામાં

તમારા સાચા વ્યક્તિત્વને ખુલ્લા પાડવાનું જોખમ છે.

તમારા વિચારો કે સ્વભાવ, સમૃદ્ધાય સમક્ષ રજૂ કરવામાં

તે ખોવાઈ જાય તેનું જોખમ રહેલું છે.

કોઈને પ્રેમ કરવામાં, બદલામાં પ્રેમ ન મળે તેનું જોખમ છે.

જીવનમાં મૃત્યુનું, આશામાં નિરાશાનું,
તેમજ પ્રયાસોમાં નિષ્ફળતા મળે તેનું પણ જોખમ રહેલું છે.

પરંતુ જોખમો તો લેવાં જ રહ્યાં...

... કારણ કે જીવનમાં સૌથી મોટું જોખમ છે,

કશું જોખમ ન ઉઠાવવું!

જે માનવી કઢી જોખમ ઉઠાવતો નથી...

... તે કશું કરતો નથી, કશું પામતો નથી

અને વાસ્તવમાં કશું જ નથી!

ભલે તેઓ સંકટો અને સંતાપોને પોતાનાથી દૂર રાખી શકે,

પરંતુ કશું શીખવા, અનુભવવા, વિકસવા, ચાહવા કે જીવવા

તેઓ ક્યારેય સક્ષમ નથી!

પોતાના જ વલણોની સાંકળોથી બંધાયેલા આવા ગુલામો

સ્વયં મુક્તિથી જ વંચિત રહી જાય છે!

જે જોખમ ઉઠાવી જાણે છે, તે જ માનવ મુક્ત છે!



હંમેશા યાદ રાખો કે...

પ્રત્યેક પડકાર કે આફતની સાથે
અવસરનું એક એવું બીજ
સમાયેલું હોય છે...
જેને સમૃદ્ધિમાં પલટી શકાય છે !

જે રીતે
પતંગ સામા પવને
આકાશમાં ઉંચે ચઢે છે...

એ જ રીતે
વિકટમાં વિકટ મુશ્કેલીઓ...
આપણને મજબૂત બનાવી શકે છે !

- વિન્સટન ચર્ચિલ

પ્રેરણાદ્યાયી વિચારો!

જવનમાં પ્રેરણા મળે છે વિચારમાંથી. આપણું પ્રત્યેક કૃત્ય કોઈ વિચાર દ્વારા પ્રેરિત થતું હોય છે. આપણે વિચારવાનું છોડી દઈએ, તો કર્મ કરવાની પ્રેરણા પણ મરી મીટે છે. આપણે નિરાશાવાદ, નકારાત્મકતા અને નિષ્ઠિતાની ઊંડી ખાઈમાં ગરકી જઈએ છીએ.

નીચેનું આ દષ્ટાંત દૃઢ વિચારશક્તિનું મહત્વ સમજાવે છે.

માનો કે કોઈ નિરાશાવાદી માણસ દર શનિવારે સવારે પોતાનું ગેરેજ સાફ કરવાનો નિર્ણય કરે છે. સવારે ઊઠીને ગેરેજ સુધી પહોંચીને એ બારણું તો ખોલે છે, પરંતુ અંદરનો ફૂડો-કચરો જોઈ ગમ્ભરાઈ જાય છે. “બાપ રે! પડતી મૂકો આ વાત. એક દિવસમાં આ સાફસૂઝી શક્ય જ ક્યાં છે?” નિરાશાવાદી કંટાળા સાથે આમ કહે છે અને એ જ ક્ષણો ગેરેજનું બારણું ધાડ દઈને બંધ કરી કાંઈક બીજું કરવા ઘરની અંદર ચાલ્યો જાય છે.

હવે કોઈ આશાવાદી વ્યક્તિ આ જ પરિસ્થિતિમાં શું કરે તે જોઈએ. એ પણ સવારે ઊઠી જ્યારે ગેરેજમાં પહોંચી કચરાના ઢગલાને જુએ છે ત્યારે પોતાની જાતને કહે છે, “અરે! એક દિવસમાં કોઈ આટલી સાફસૂઝી કેવી રીતે કરે!”

શબ્દો એના એ જ છે! પરંતુ ફરક ત્યારે પડે છે, જ્યારે ઘરમાં પાછા જવાને બદલે, આશાવાદી ચિંતન ચાલુ રાખે છે. “ભલે આજે આખી સાફસૂઝી થઈ ન શકે! પરંતુ હું કાંઈક તો કરી શકુંને!” એ વિચારવા માંડે છે અને અને સૂઝે છે કે ગેરેજના ચાર ભાગ કરી આજે ફક્ત એક ભાગની તો સાફસૂઝી કરવી. “આજ થી શરૂ કરીને, દર શનિવારે એક-એક ભાગ ચોખ્ખો કરીશ, તો મહિનો પૂરો થતાં તો આખું ગેરેજ સાફ થઈ જઈ શકશે.”

મહિના બાદ, પેલા નિરાશાવાદીનું ગેરેજ હજુ ગંદુગલીય અને આશાવાદીનું ગેરેજ ચોખ્ખુંચટ!

- સ્ટીવ શેન્ડલર

ઉત્સાહ હલાવી શકે...

માનવી તેમજ પર્વતને!

ખંત અને ઉદ્યમનો મૂળ ઓત છે ઉત્સાહ,
એ હલાવી શકે માનવ તેમજ પર્વતને!

જીવનમાં ઉત્સાહ ના અભાવે ઘણાં લોકો જરા સરખો વિરોધ
કે અવરોધ ઉભો થતાં જ મેદાન છોડીને ભાગી જાય છે, જ્યારે
થોડાક દૃઢનિશ્ચય સાથે આ જ લોકોને નજીકના વળાંક પર સફળતા
સાંપડી હોત.

ઉત્સાહ ચેપીલો પણ છે. ઉત્સાહી માણસ બીજા લોકોમાં
સહેલાઈથી ઉત્સાહ જન્માવી શકે છે. એ માત્ર પોતાના માટે શક્તિ
નિર્માણ નથી કરતો, બલ્કે પોતાના સાથીઓ અને કર્મચારીઓમાં
પણ ઉત્સાહનું મોજું પ્રસરાવી શકે છે. એ એક જીવતોજાગતો વિદ્યુત
ઉત્પન્ન કરનારો ડાયનેમો બની જાય છે, જે પોતાના આખા સંગઠનમાં
વીજસંચાર કરે છે. એ માત્ર હૂકમો છોડતો નથી, બલ્કે પોતાના
સંપર્કમાં આવતા તમામ લોકોમાં શક્તિ, સામર્થ્ય, આશા અને વિશ્વાસને
સંચારિત કરતો રહે છે. આમ કરીને એ તેમનું નૈતિક બળ ટકાવી
રાખે છે અને એમનામાં એવી આંતરિક ઉત્કંઠા જગાવે છે કે તેઓ
સૌના સહિયારા કામને પાર પાડવા પોતાનો હોંશીલો સહકાર અને
ટેકો સતત આપતા રહે છે.

બીજાને પ્રોત્સાહિત કરવા માટે પહેલા પોતે ઉત્સાહી હોવું
અનિવાર્ય છે. ઉત્સાહ યૌવનનું એક વિશિષ્ટ લક્ષણ છે અને તમે
જો એને ટકાવી રાખો, તો તમારું શરીર થાકવા લાગે ત્યારે પણ,
તમારી માનસિક શક્તિઓને તે સદાબદ્ધાર રાખી શકશો.

આટલું જરૂર યાદ રાખો કે અંગ્રેજુ “Enthusiasm” શબ્દ
બે ગ્રીક શબ્દોમાંથી ઉદ્ભવ્યો છે. ‘En’ એટલે ‘In’ (અંદર) અને
‘Theos’ એટલે ‘God’ (પરમેશ્વર). આમ ઉત્સાહનો સાચો અર્થ
થાય ‘અંતરનો પ્રભુ’. તમારી અંદરની આ અનંત શક્તિને સદા
અનુભવતા રહેવાની જરૂર છે!

પ્રત્યેક વિચારશીલ મનુષ્યે પોતાના જીવન તેમજ કાર્યને
ઉત્સાહ દ્વારા શક્તિશાળી બનાવવું જોઈએ!

- આંક્રે મૌરોઈસ

જાત સાથે ઉત્સાહપૂર્વી વાત!

આપણું મન પ્રબળ શક્તિતશાળી છે, પરતુ એ આપણું ગુલામ પણ છે. એને પોતાનો કોઈ પૂર્વગ્રહ હોતો નથી એટલે યોગ્યતા-અયોગ્યતાનો વિવેક કર્યા વગર એ હામાં હા ભરે છે. જો આપણી ભાષા નકારાત્મક હોય તો પૈસા મેળવવા કે વજન ઓછું કરવા, વસનોથી દૂર રહેવા કે સંબંધો જ્ઞાનવવા, ગમે તેટલી મથામણ કર્યા કરીશું, આપણે સફળ નહીં બનીએ.

આપણી સાચી અસ્તિત્વા તો આંતર-મનમાં ઘૂપાયેલી છે એને એ તો માને છે કે એને જે માહિતી પહોંચાડાય છે, તે સાચી જ છે, પછી ભલેને તેવું ન પણ હોય. એટલે આપણા મનને આપણે નિશ્ચયાત્મક ચિત્રો જ પહોંચાડવાં જોઈએ, પછી ભલેને તે વર્તમાન સાથે સુસંગત ન હોય! સૌ કોઈ જાણો છે કે માણસની વર્તણુંકનો આરંભ એના મનમાં થાય છે. પહેલાં ધારણા અને પછી તે મુજબ વવહારમાં પ્રત્યક્ષ આચરણ! જેવા વિચાર, તેવા સંજોગો અને પ્રાપ્તિ!

આપણે આપણા વિષે જે કાંઈ ધારતા હોઈએ, તેનું પ્રતિબિંબ આપણા મનમાં જીવાય છે અને એ અસ્તિત્વાની વ્યાસપીઠ પરથી જ આપણાં તમામ ફૂત્યો બહાર પડે છે. આપણા અંતરના આયનામાં જીવાતાં પ્રતિબિંબ ઉપર આપણાં બાબ્દ કર્મા, ભાવના અને વર્તણુંક આધાર રાખે છે.

મનોપટ પર સ્વસ્થ પ્રતિબિંબ જીવાય તે માટે સાચા વર્તન અને કાર્યોને વારંવાર દોહરાવ્યા કરવા પડે, પરંતુ આપણામાં ન તો એવી સાતત્યપૂર્વી શક્તિ છે, ન એવો વિશ્વાસ! પરંતુ આપણી જતને આપણે માની લીધી છે, તેના કરતાં એ વધુ શક્તિમાન છે અને તે શક્તિ પ્રગટ કરવા માટે સાચા વાણી-વર્તનને દોહરાવતાં રહેવું ખૂબ જરૂરી છે.

આપણી અંતર-પ્રતિમા ઘડવા તેમજ સુધારવા માટે આપણે આપણી જાત સાથે સંવાદ સ્થાપિત કરવો પડશે... એવાં શબ્દો અને ચિત્રો દ્વારા, જે રચનાત્મક પ્રતિકૃતિઓ સર્જ આપણાને સાચી દિશામાં આગળ વધવાની શક્તિ આપી શકે.

સમય જતાં, આ નવી દિશાઓ આપણાને આપણામાં પ્રતિષ્ઠિત કરશે, આપણા ચારિત્રયને ઊર્ધ્વ લાવશે અને આપણી ભીતર જે સર્વશ્રેષ્ઠ છે તેને પ્રગટ કરવા અંતર-શક્તિનો સ્તોત્ર પુરો પાડશે.

- ટૉડ કંકન

સાધનસંપન્તિ

તારી સાધનસંપન્તા તપાસી લે, મારા પુત્ર,
વિભૂતિઓ પાસે જે હતું, તે બધું તારી પાસે છે.

બે બાવડાં, બે હાથ, બે પગ અને બે આંખ,
વળી જો તું સમજુ હો તો વાપરવા એક દિમાગ!

એ સૌઅં આટલાથી જ આરંભ કર્યો હતો ને!
તું પણ શિખરેથી યાત્રા આરંભી કહે કે, “હું પણ કરી શકું!”

એમના ભાડી જો, એ શાણા અને મહાન લોકો,
તારા જેવી યાણીમાંથી જ પોતાનો કોળિયો ભરતા હતા.

છરી કાંટા અને ચમચા પણ એ જ,
જૂતાં પરની દોરી પણ તારા જેવી જ!

દુનિયા તેમને માને છે નીડર અને ચપળ,
તેમની પાસે હતું તે તમામ છે તારી પાસે.

તું પણ જીતી શકે, વળી દક્ષતા દાખવી શકે,
તું પણ મહાન બની શકે, જો તું ધારે તો.

ગમે તેવી લડાઈ લડવા તું શસ્ત્રસજ્જ છે,
તારી પાસે હાથ-પગ અને વળી દિમાગ પણ છે જ!

અને જીવનમાં મહાન કાર્યો કરવા જેણે કમર કસી,
તેમની પાસે પણ જીવનારંભે તારા કરતાં વધારે કશું નહોતું.

હવે જો કાંઈ વિઘ્ન આવે તો તે તું જ છું,
તારે જ તારું સ્થાન પસંદ કરવાનું છે!

ક્યાં જવું છે, કેટલું ભાણવું છે અને કેટલું જાણવું છે,
તેનો નિર્ણય તારે પોતાને જ કરવાનો છે.

ઈશ્વરે તો તને જીવન જીવવા સાધનો આચ્યાં,
પરંતુ શું થવું તેનો નિર્ણય તેણે તને જ સોંઘ્યો છે!

હિમત તો ભાઈ, અંદરથી આવવી જોઈએ,
જીત હાંસલ કરવાની તમન્ના પોતે જ પ્રગટાવવી રહી.

એટલે હવે તો મારા પુત્ર, તારો જીવનપંથ તું જ કંડાર!
તને જન્મથી જ બધું મળ્યું છે, જે સૌ મહાનુભવો પાસે હતું!

તારાં સંસાધનો વડે જ એમણે આદર્યું,
તું પણ સંભાળ તારી જાતને અને કહે, “હા, હું પણ એવું કરી શકું!”

- એડગર ગેસ્ટ

અનુકૂળન અને આદતો

પેલા હાથીની કલ્યના કરો જે પોતાની સૂંઘ માત્રથી ટનબંધી સામાન ઉપાડી જાઓ છે! મહાવત આવા જબરદસ્ત હાથીને એક સામાન્ય દોરડાથી બાંધીને, એક જ સ્થળે રાખવાનું શક્ય કેવી રીતે બનાવે છે? એ હાથી જ્યારે નાનો હોય છે, ત્યારે તેને એક મજબૂત સાંકળ તેમજ તોતીંગ વૃક્ષ સાથે બાંધવામાં આવે છે. હાથીનું બચ્ચું તો નભણું હોય, પણ સાંકળ અને જાડ મજબૂત. બચ્ચું બંધાવા ટેવાયેલું નથી, એટલે એ સાંકળ ખેંચીને તોડવા મથે છે, પણ બધું વર્થ! એક દિવસ એ સમજ જાય છે કે એની કોઈ મહેનત બર આવવાની નથી. એટલે પછી ધીરે ધીરે એ શાંત પડીને સ્થિર થઈ જાય છે. હવે પરિસ્થિતિને અનુકૂળ થવાની સ્થિતિમાં એ છે.

પછી એ જ બાળ હાથી મોટો થઈને જ્યારે મહાકાય, જબરદસ્ત ગજરાજ બને છે, ત્યારે તેને નભળા દોરડાથી એક નાનકડા થાંભલે બાંધવામાં આવે છે. એક જ જાટકે એ હાથી પોતાનું બંધન કાપી, નાસી શકે તેમ છે. પરંતુ, હવે એ ક્યાંય જતો નથી, કારણ કે તેનું માનસ પરિસ્થિતિથી ટેવાઈ ગયું છે.

આપણા મોટા ભાગના વબહારો, આવી જ કોઈ ટેવો કે સ્થિતિબદ્ધતાને આધીન હોય છે. આપણો જો કશું સારું કરવું હોય તો આપોઆપ થતું રહેવું જોઈએ. એનો અર્થ એ છે કે આપણો એને આદતમાં પલટવી જોઈએ. આપણી જાતને વિધાયક રીતે કેળવવા, સારી ટેવો પાડવાની પ્રતિબદ્ધતા જોઈએ.

હમેશાં યાદ રાખો કે સારી આદતો પાડવી મુશ્કેલ છે, પણ એક વાર પરી જાય પછી તેની સાથે જીવવું સહજ છે!

ખરાબ ટેવો પાડવી તો ખૂબ સહેલી છે, પણ પછી તેની સાથે જીવન વીતાવવું આકર્ષું છે!

૭૮

એવા પણ લોકો છે, જે ઘટનાઓ ઘડે છે!

એવા પણ લોકો છે, જે ઘટનાના માત્ર સાક્ષી બની રહે છે.

એવા પણ લોકો છે, જે કાંઈ થયા બદલ આશ્વય અનુભવે છે.

તમે એવા માણસ બનજો, જે ઘટનાઓના ઘડવૈયા હોય!

સંઝોગોના સર્જનહાર બનો, નહીં કે સંઝોગોના શિકાર!

સરૂળ થવાની તીવ્ર ઝંખના!

જીવનમાં જત મેળવવાની પ્રેરણ પોતાનો હેતુ સિદ્ધ કરવાના તૃષ્ણાજિનમાંથી મળે છે. નેપોલિયન હિલના આ સોનેરી વાક્યમાં આ શાચત સત્ય સુંદર રીતે કહેવાયું છે, જે આપણા દિલ-દિમાગમાં અમીટ અંકાઈ જવું જોઈએ. એ છે, ‘માનવીનું મન જે કંઈ કલ્પના કરી શક્ષાપૂર્વક ધારણ કરે, તે સિદ્ધ થઈને જ રહે છે!’

એક યુવાને સૉકેટીસને સફળતાનું રહસ્ય પૂછ્યું. સૉકેટીસે એ યુવાનને બીજા દિવસે સવારે નદી પાસે મળવાનું કહ્યું. તેઓ મયા. સૉકેટીસે પેલા યુવાનને પોતાની સાથે નદીમાં ચાલવાનું કહ્યું. પાણી જ્યારે ગરદન સુધી પહોંચ્યું ત્યારે સૉકેટીસે પેલા યુવાનને પાણીમાં ઢૂબાડ્યો.

છોકરો બિચારો બહાર આવવા તરફડવા લાગ્યો, પણ સૉકેટીસ શક્તિશાળી હતો અને છોકરો ભૂરો પડવા લાગ્યો ત્યાં સુધી અને પાણીમાં ઢૂબાડી રાય્યો. સૉકેટીસે જેવો અને પાણી બહાર કાઢ્યો કે તેણે સૌથી પહેલા ડયકાં ખાતાં હવાનો ઊંડો શાસ લીધો.

સૉકેટીસે તેને પૂછ્યું, “જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તારી સૌથી તીવ્ર ઝંખના કઈ હતી?”

છોકરો બોલ્યો, “ચોક્કસ, હવા વળી!”

સૉકેટીસે કહ્યું, “બસ, આ જ છે સફળતાની ગુરુ ચાવી. જ્યારે તારું માથું પાણીની અંદર હતું અને તેને હવાની જેટલી તીવ્ર ઝંખના હતી, તેટલી જ તીવ્રતાથી તું સફળતા ઝંખીશ ત્યારે તે પ્રાપ્ત થશે!”

૭૮

નિષ્ફળતા જેવું કશું હોવું નથી,
હોય છે માત્ર પ્રયત્નોનું છોરી દેવું...

૭૯

હાર જેવું પણ કશું હોવું નથી,
સિવાય કે અંદરની એક લાગણી...

૮૦

પાર કરવી મુશ્કેલ એવી કોઈ વાડ નથી,
સિવાય કે આપણા જ આશયોની સ્વાભાવિક નિર્ભળતા!

ઉદ્ઘમની શાંકિત

કોઈ પણ કાર્ય,
એના ઊર્ધ્વની
સ્વયં-તર્સ્વીર છે.

તમારા પ્રત્યેક કાર્યની સાથે
ઉદ્ઘન્તાના
સ્વ-હસ્તાક્ષરની મહોર જગાવો!





ઉદ્યમની શક્તિ

મહારથીઓએ
સિદ્ધ તરીને ટકાવેલી
જિંચાઈઓ...

કોઈ છનુમાન-કૂદજાથી
સર નહોતી થઈ!

પરંતુ
જ્યારે એમના સાથીદારો
હુંફૂળી સોડ તાણી સૂતા હતા...

ત્યારે આ મહાનુભવો
રાતભર
કઠોર પરિશ્રમમાં જાગ્યા હતા!

સંઘર્ષ વિના સફળતા નહીં!

જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક છયણનું રૂપાતંર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કંધું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈ એ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા.

આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રવ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આવવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દ્યા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગાણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને જાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો ભરી ગયું.

શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે અને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું ભરણશરણ થયું.

આ કિરસાનો બોધપાઈ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ હુંધાય છે.

જીવનમાં આવતી કસોટીઓ કરુણાંતિકા કે વિજ્યોત્સવ, બન્ને હોઈ શકે, જે આપણે તેની સાથે કેવો બ્યવહાર કરીએ છીએ તેના ઉપર નિર્ભર છે. સફળતા પરિશ્રમ કે સંઘર્ષ વગર હાંસલ થઈ શકતી નથી!

કુહાડીને ધારદાર રાખો!

ગઈ કાલે સ્નાતક બનેલો યુવાન...
જો આજે નવું શીખવાનું છોડી છે,
તો આવતી કાલે, એ પુનઃ અશૈક્ષિત બની જવાનો!

જહોન નામનો એક કઠિયારો એક કંપનીમાં પાંચ વર્ષથી કામ કરતો હતો, પણ એને કદી બઢતી ન મળી. કંપનીએ બીલ નામના કર્મચારીને કામે રોક્યો અને એક વર્ષમાં તો એને બઢતી મળી ગઈ. આને કારણે જહોનને દુઃખ થયું અને એ પોતાના ઉપરી પાસે હૈયું ઠાલવવા ગયો. એના ઉપરીએ કહ્યું, “પાંચ વર્ષ પહેલા તું જેટલાં જાડ કાપતો હતો તેટલાં જ આજે પડા કાપે છે. અમારી તો પરિણામ-લક્ષી કંપની છે. એટલે જો તું તારું કામ વધારોશ તો અમે તને બઢતી આપવા રાજ થઈશું.”

જહોને પાછા ફરીને વધારે સમય આપીને સખત મહેનત આદરી, તેમ છતાંય એ વધુ જાડ કાપી ન શક્યો. પોતાના વડા પાસે પાછા પહોંચીને એણે પોતાની મુંજવણ રજૂ કરી. ઉપરીએ એને બીલ પાસે જઈ વાત કરવા કર્યું. “કદાચ એવું બને કે જે હું અને તું ન જાણતા હોઈએ, તેવું કશુંક એ જાણતો હોય!”

જહોને બીલને પૂછ્યું, તો બીલે જવાબ વાય્યો, “દરેક જાડ કાપી લીધા બાદ હું બે મિનિટ થોભી જઈ મારી કુહાડીની ધાર તેજ કરું છું. તેં તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે કાઢી હતી?”

આ પ્રશ્ને જાણો મર્મ પર વા કર્યો અને જહોનને એનો જવાબ મળી ગયો.

‘છેલ્લે તમારી કુહાડીની ધાર તમે ક્યારે કાઢી હતી?’ તમે જીવનમાં જો પ્રગતિ દરખતા હો તો પુરાણી પૂંજ પર કામ ન ચાલે. તમારે તમારા જ્ઞાન, બુદ્ધિ-કૌશલ્ય અને આવડતને નિરંતર ધારદાર બનાવતા રહેવું ઓઈએ, પછી ભલેને તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો!

જીવનમાં મહાન અને ઉદાત્ત કાર્યો કરવા હું આતુર છું. પરંતુ મારી મુખ્ય ફરજ એ છે કે મને મળેલાં નાનાં કામોને પડા મહાન અને ઉદાત્ત માનીને જ હું તેમને પાર પાડું.

- માર્ટ્ઝિન લ્યૂથર કિંગ, જૂનિયર

તરતा રહો!

બે દેડકાં મલાઈ ભરેલા વાડકામાં પડી ગયાં.

એમાંનો એક આશાવાદી જીવ હતો.

પરંતુ બીજાએ તો રોદણાં આદરી દીધાં.

“હવે આપણે દૂબી મરવાના!”

અને અંતિમ દર્દનાક ચીસ પાડીને

પોતાના પગ ઉડાડીને બોલ્યો, “આવજે મારા ભાઈ!”

પેલા બીજા દેડકાએ મક્કમ અવાજે કહ્યું,

“બહાર તો હું પણ નીકળી નથી શકતો, પણ હું હાર માનીશ નહીં.

શક્તિના છેલ્લા બુંદ સુધી હું તરતો રહીશ,

પછી મરીશ, તો પણ સંતોષથી.”

એણે પોતાની યોજના પાર પાડવા

હિમતથી ગોળ ગોળ તરવાનું ચાલુ રાખ્યું.

અને એની હલચલને પરિણામે મલાઈમાં

જાણે વલોણું ફરવા લાગ્યું.

જેમ જેમ એ તરતો ગયો, એના પગ ફરતા રહ્યા,

તેમ તેમ મેળવેલી મલાઈ માખણમાં વલોવાતી ગઈ.

અંતે માખણની ટોચ પર એ આવી ઊભો

અને જટ દઈને એ વાડકા બહાર ફૂંકી પડ્યો.

બોધપાઠ સ્વયંસ્પષ્ટ છે! સહેજે સમજાય તેવો!

જો બહાર ફૂંકી શકો તેમ ના હો,

તો કમ સે કમ તરવાનું ચાલુ રાખો!

જગતમાં ખંત અને ધીરજની તોલે કશ્યું ન આવે!

બુદ્ધિ તો નહીં જ, કારણ ઘણા બુદ્ધિશાળી લોકો

નિષ્ફળતાને વરે છે! તો પછી પ્રતિભા?

નહીં, નહીં! પ્રતિભાની પણ કદર થતી નથી...

એ તો જાણીતી કહેવત છે.

શિક્ષણ પણ નહીં...

કારણ કે દુનિયામાં ઘણા બાળિષ્ટત શિક્ષિતો છે.

એટલે માત્ર ખંત અને નિશ્ચય જ સર્વશક્તિમાન છે!

- પ્રેસિડન્ટ કાલ્યિન કુલિજ

એક-એક ડગલે મંજિલ પહોંચાય!

એક કિશોર જંગલમાં રખડતાં રખડતાં ભૂલો પડ્યો અને એને એનું ભાન થાય તે પહેલાં તો ખાસું અંધારું છવાઈ ગયું.

એ છોકરાએ ઝાડ નીચે એક વૃદ્ધને બેસેલા જોયા. એની પાસે જઈને તેણે કહ્યું, “હું જંગલમાં ભૂલો પડ્યો છું અને હવે તો રાત પડ્યા પડી ગઈ છે! તમે મને ઘરે પહોંચવાનો રસ્તો બતાવશો?”

પેલા વૃદ્ધ માણસ પાસે એક સળગતી મીણબતી હતી. એ છોકરાને આપીને તેણે કહ્યું, “લે આ મીણબતી. એના અજવાણે અજવાણે તું ઘેર પહોંચ્યો શકીશ.”

પેલા છોકરો બોલી ઉઠ્યો, “પણ દાદા, આ અજવાણું તો સાવ ઓછું અને ઝાંખું છે! આવા ગાડ જંગલને હું પાર કરી શકીશ?”

વૃદ્ધ દાદાએ કહ્યું, “હાલા બાળ! મીણબતીનું અજવાણું ભલે ઝાંખું અને ઓછું હોય, પરંતુ એક સાથે એક ડગલું ભરવા માટે પૂરતું છે. એક-એક ડગલું ભરતાં તું ઘેર પહોંચ્યો જઈશ.”

પેલા છોકરાએ દાદાજીની સલાહ માની અને ઘનઘોર જંગલમાં મીણબતીના અજવાણે એક-એક ડગલું ભરતાં, રસ્તાનાં વિધોનાં પાર કરતાં, તે અંતે સહીસલામત ઘેર પહોંચ્યો ગયો.

સફળ જીવનનો ચમત્કાર જ એ છે કે સફળતા તરફનું દરેક નાનકડું ડગલું, વધુને વધુ સફળતાને ખેંચ્યી લાવે છે.

સફળતા એ તો યાત્રા છે, એ કાંઈ મુકામ કે મંજિલ નથી!

જ્ઞાન અને વિદ્યાના ઉજાસનો સહારો લઈને, આપણે એક-એક ડગલું ભરતાં અને વાટમાં આડે આવતા અંતરાયોને પાર કરતાં જીવનયાત્રામાં આગળ વધી શકીએ!

પુરાણી થીની કહેવત યાદ રાખો:

‘હજારો માઈલોની યાત્રા પડા...

આરંભાય તો છે, કેવળ એક ડગથી!’

ધીરજ અને ખંત

ધીરજ અને ખંત અંગેની એક માન્યામાં ન આવે તેવી વાત જાણો છો? એક માણસે આ સાબિત કરી દેખાડ્યું.

એ જ્યારે સાત વર્ષનો હતો, ત્યારે કાયદાકીય ગુંચને કારણે એના માબાપને ઘરમાંથી બહાર ધકેલી મૂકવામાં આવ્યાં હતાં અને તેમને ટેકો કરવા એને કામ શોધવું પડ્યું હતું. નવ વર્ષની વયે, એની મા નું અવસાન થયું અને બાવીસમા વર્ષ, એક દુકાનના ગુમાસ્તા તરીકેની તેણે નોકરી ગુમાવી દીધી. એને કાયદાનો અભ્યાસ કરવાની ઢિંઢા હતી, પરંતુ એ સારો અભ્યાસ પણ ન કરી શક્યો.

ત્રેવીસ વર્ષનો થયો ત્યારે એક નાનકડી દુકાનમાં ભાગીદારીમાં જોડાવા તેણે દેવામાં ફસાવું પડ્યું. છબ્બીસમા વર્ષ એનો ભાગીદાર પાછળ મોટું દેવું મૂકીને ગુજરી જતા, તેને ચૂકવતા વર્ષો લાગ્યાં. અફ્ફાવીસમા વર્ષ, ચાર વર્ષથી પરિચયમાં આવેલી છોકરીને તેણે પરણવા માટે પુછ્યું, તો એણે નન્નો ભાડી દીધો!

સાડત્રીસ વર્ષની ઉમરે, ત્રીજા પ્રયત્ને એ કોંગ્રેસમાં ચૂંટાઈ આવ્યો, પરંતુ બે વર્ષે પછી ફરી પાછો હારી ગયો. એકતાલીસમા વર્ષ એનો ચાર વર્ષનો દીકરો ગુજરી ગયો. પિસ્તાલીસની વયે તે સેનેટ માટે ઊભો રહ્યો અને હાર્યો. સુડતાલીસમા વર્ષ, પોતાના પક્ષના ઉપમુખની ઉમેદવારીમાં હાર્યો. ઓગાણપચાસમા વર્ષ સંસદમાં જવા ઊભો રહ્યો, તેણે ફરી હાર ખાધી. એકાવનમા વર્ષ એ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયો.

અનું નામ અશ્વાહમ લિંકન! વિશ્વના મહાન નેતાઓમાંના એક!

ખંતપૂર્વક લાગ્યા રહેવાની કેવી પ્રેરક વાત? લિંકને પોતાના જીવનની અસફળતાઓને રસ્તા વચ્ચેના વિઘનરૂપ પથરા ન ગણ્યા, એણે તો એને પાયાના પથર રૂપે જોયા.

આમાં તમારા માટે શું બોધપાઠ છે? પ્રેરણ અને પ્રોત્સાહન દ્વારા તમે પોતે પણ સામે આવી ઊભેલી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢી, તમારાં વિઘ્નોને પાર કરી શકો અને પ્રભુની સહાયથી ઠેઠ ટોચ સુધી પહોંચી શકો!

એકાગ્રતા

ગમે તેટલી મહાન શક્તિ હોય, પરંતુ જો તે અનેક વિષયોમાં વેરવિભેર વાપરવામાં આવે તો એમાંથી કશું નીપજતું નથી. ભौતિકશાસ્ત્ર મુજબ, જો શક્તિને યોગ્ય માર્ગ વાળી કેન્દ્રિત કરવામાં આવે, તો એ મીણાબતીને પણ એક હુંચના પૂંડામાંથી આરપાર કરી શકે.

મનુષ્યનું મન પણ બિલોરી કાચ જેવું છે, જેના કિરણો જેમ જેમ કેન્દ્રિત થતાં જાય તેમ તેમ વધુ દાહક થતાં જાય. જેમ કાચમાંથી પસાર થતાં કિરણો કોઈ એક બિંદુ પર સઘનપણો કેન્દ્રિત થતાં તેને સળગાવી ઊઠે છે, એ જ રીતે મનની શક્તિ પણ જ્યારે કોઈ એક વિષય પર એકાગ્રતાથી કેન્દ્રિત થાય, ત્યારે એ વિજ્ઞાન, સાહિત્ય કે વ્યાપાર-વ્યવસાયના જગતને પ્રકાશથી રોશન કરે છે.

આકાશમાં ઊંચે ચઢતી વરાળનાં વાદળો કરતાં વધારે શક્તિહીન બીજું શું હોય? મોડી રાતે આકાશમાંથી પૃથ્વી પર પડતાં ઝાકળબિંદુ સમાં એ પણ શક્તિહીન છે. તેમ છતાં, એ વરાળનું સઘન કે ઘણ સ્વરૂપ જ્યારે સ્ટીમ બોર્ડલરમાંથી પ્રગટ થાય છે, ત્યારે પાકા ખડકને તોડવા, આણું જહાજોને ચલાવવા તેમજ દેખીતી રીતે અશક્ય એવા અનેક કામોને પાર પાડવા ઉપયોગી થાય છે.

લેસર એ ઊર્જાનો નબળો સ્ત્રોત છે. પ્રકાશના સીધા પ્રવાહમાં એનાં જ કિરણોને કેન્દ્રીભૂત કરવા લેસરને ખૂબ થોડી ઊર્જાની જરૂર પડે છે. પરંતુ એ જ લેસરથી, તમે હીરામાં છેદ પારી શકો અથવા તો કેન્સરને ભેદી શકો. આપણે પણ જ્યારે જીવનમાં એકાગ્રતા ધારણ કરીએ, ત્યારે આવાં જ પરિણામો લાવી શકીએ છીએ.

તમારે જો વજન ઓછું કરવું હોય તો એકાગ્ર થવું પડે! સંપત્તિ એકત્રિત કરવી હોય કે સફળ લગ્નજીવન જીવવું હોય તો પણ એકાગ્રતા કેળવવી પડે! ઈશ્વરની ઉપાસના માટે પણ એકાગ્ર થવું જરૂરી છે! એકાગ્રતા જ સમગ્રતા છે! ફોકસ કે કેન્દ્રીકરણ વગર તમે સાવ મામૂલી કક્ષાનું જીવન જીવી શકશો.

તમારા માટે જે મહત્વની બાબતો હોય, તેના પર જ્યારે તમે એકાગ્ર થાઓ છો ત્યારે તમારાં જીવનમૂલ્યો, મનોવલણા, પસંદગીઓ કે દૃઢ નિર્ધાર, તમામ એકસાથે કાર્યરત બની જાય છે!

- જેમ્સ બ્રાયન્ટ કોનન્ટ

છોડશો ન મેદાન કઢી!

ક્યારેક એવું બને પણ ખરું કે તમામ પાસાં અવળાં જ પડે,
આગળ વધવાની વાટ પર આકરાં ચઢાણ જ સામાં પડે!

આવક ઓછી હોય અને દેવાં વધતાં જાય,
હસવા તો ઘણુંય ઈચ્છો, પણ નિસાસા સિવાય કશું ન જડે!

ચિંતા માથે ચઢી ધગધગે, તમે હતાશ થઈ બેસી પડો,
ત્યારે ભવે થોડો વિસામો લઈ લો, પણ છોડવાનું નામ ન લો!

આનું જ નામ તો છે જુંગાં, વાંકી-ચૂંકી અને અટપટી,
આપણો સૌઅે ક્યારેક તો, આટલો પાઠ શીખવો જ રહ્યો.

પરંતુ ઘણા લોકો, આવે સમયે પીછેહઠ કરી દે છે.
થોડીક ધીરજ ધરી હોત તો, સફળતાના મુકામે પહોંચા હોત!

ઘણીવાર હારેલા-થાકેલાને દૂર લાગે,
તેથી વધુ નજીક હોય છે, અંતિમ મંજિલ!

ઘણીવાર લડવૈયો એ જ ક્ષણો હાર માને છે,
જે ક્ષણો એ વિજયને વર્યો હોત!

પરંતુ એ વાતની ખબર તો મોડી પડે છે,
કે પોતે સોનેરી તાજથી કેટલો નજીક હતો!

નિષ્ફળતાને સવળી કરો, એ જ છે સફળતા,
જેમ શંકાના વાદળોને રૂપેરી છાંટ હોય છે.

તમે કદી કહી ન શકો કે કેટલા સમીપ છો,
ઘણું દૂર ભાસે તો પણ તમે સાવ સમીપ હો!

એટલે ગમે તેટલું આકરું લાગે તો પણ લડે રાખો,
બાજુ હાથમાંથી સરી જતી લાગે,
તો પણ છોડશો ન મેદાન કઢી!

- અરૂવિન માર્કહમ



ભલે ને, સામો પર્વત આવીને ઉભો રહે!
હું પાછું પગાલું નહીં ભરું!

હું સતત પ્રયત્નશીલ રહીશા...

જ્યાં સુધી
ઉપર ચઠીને કે
આરપાર નીકળીને કે
નીચેથી બોગદું બનાવીને
પસાર થવાનો રસ્તો
શોધી ન લઉં...

અથવા ત્યાં જ અડગા રહીને...

પ્રભુની સહાયથી
આખા પર્વતને
સોનાની ખાણમાં ફેરવી ન દઉં!

- ડૉ. રોબર્ટ શુલર

ખંખેરી નાંખો અને ઉપર ચઢો!

એક ખેડૂત પાસે એક ઘરદું ખચ્ચર હતું. એક દિવસે એ ખચ્ચર ખેડૂતના કૂવામાં પડી ગયું. ખેડૂતે એની ચીસો સાંભળી. ખચ્ચર માટે સહાનુભૂતિ પણ થઈ, પરંતુ ખચ્ચર કે કૂવાને બચાવવાની તકલીફ લેવા જેવું ન લાગ્યું.

એના બદલે એણે પોતાના પાડોશીઓને બોલાવીને સૌને થોડી રેતી લઈ આવવા વિનંતી કરી, જેથી પેલા ખચ્ચરને કૂવામાં ડાટી અને પીડામુક્ત કરી શકાય.

આરંભે તો ખચ્ચર તોફાને ચઢ્યું! પરંતુ ઉપરથી રેતીનો મારો એની પીઠ પર પડવા લાગ્યો, ત્યાં તેને એક યુક્તિ સૂઝી. ઉપરથી તગારાની રેતી ઠલવાઈને જેવી એની પીઠ પર પડે, ત્યારે તરત જ અને ખંખેરી નાંખીને તેની ઉપર ચઢી જવું! આમ એણે દરેક વખત કર્યા કર્યું.

“ખંખેરી નાંખ અને એની ઉપર ચઢી જા” - પોતાને હિંમત આપવા એ આવું બોલતું રહ્યું. ઉપરથી રેતી ફેંકાય એનો માર તો જબરો લાગે. તેમ છતાંય એ ઘરડા ખચ્ચરે સંઘર્ષ જીવીને રેતી ખંખેરવાનું અને તેના ઉપર ચઢતાં જવાનું ચાલુ રાખ્યું.

તમારું અનુમાન સાચ્યું છે! આમ કરતાં, થાકીપાકીને પણ ખચ્ચર કૂવાની પાણ સુધી પહોંચી ગયું અને પછી તો કૂવાની દિવાલ કૂદીને ગૌરવબેર બહાર! અને દાટી દેવા માટેની જ વસ્તુ, એની તારાજાહાર બની. આફિત સામે જગ્યામવાની તેની હિંમતે તેને બચાવ્યું!

ઘણીવાર આપણા જીવનમાં જે થઈ રહ્યું હોય છે, તેને આપણા મનમાંથી આપણે ખંખેરી શકતાં નથી. આપણાં તમામ ખુશી, આનંદ અને મનની શાંતિ હણાઈ જાય છે. ભૂતકાળના વા મનમાં કડવાશ, વથા, ગુર્સો અને બદલાની ભાવના જગાડતા રહે છે. આ લાગણીઓના ભાર હેઠળ તો દુઃખના કૂવામાં આપણે દટાઈ જ મરીએ!

પરંતુ આપણી પાસે વિકલ્પ છે.... ખંખેરી નાંખવું અને ઉપર ચઢતા રહેવું. જે કાંઈ બન્યું તેને સ્વીકારીને, પરિસ્થિતિનો કયાસ કાઢી, તેમાંથી યોગ્ય પાઠ શીખી, ખંખેરી નાંખીને ઉપર ચઢતા રહો! તમને પહોંચેલી ઈજા તમને વધુ કડવા (bitter) કે વધુ બહેતર (better) બનાવે... શું પસંદ કરશો?

તમારું ભાવિ તમારા જ છાથમાં!

મનુષ્ય નિર્માંયો છે સિદ્ધિ માટે,
કંડારાયો છે સફળતા કાજે, અને
વિભૂષિત છે મહાનતાનાં બીજ થકી!

આ ઉક્તિમાં તમને શ્રદ્ધા બેસી જાય તો પછી તમારી કોઈ પણ સમસ્યા માટે તમારે ક્યારેય કોઈ બીજાનો વાંક કાઢવાનો ન રહે. ટૂકમાં, તમે પોતે જ તમારી સફળતાના પંથે ચડી ગયા હશો, કારણ કે તમને આટલી તો પ્રતીતિ થઈ જ ગઈ હશે કે તમારી બાંધના છેઠે આવેલો તમારો જ હાથ તમને સૌથી મોટી સહાય કરી શકે છે. જીવનમાં જે મને સફળતા ન મળી હોય તેવા લોકો તમને મળશે, પરંતુ જીવનમાં સફળતા પામી જ ન શકે તેવી કોઈ વ્યક્તિ ભાગ્યેજ મળે.

આ એક સરળ પરંતુ શાશ્વત સત્ય યાદ રાખો...

‘તમારું ભાવિ સમર્થ હાથમાં છે.... એ હાથ છે તમારા!’

કદાચ આને અનુરૂપ એક કથા આ મુદ્રો સમજવા મદદ કરશે.

ઈટાલીની સુંદર નગરી વેનિસની એક ઊંચી ટેકરીની ટોચ ઉપર એક વડીલ સજજન રહેતા હતા. એવું કહેવાતું કે એમને કોઈ પણ પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમને મળી રહે. બે સ્થાનિક છોકરાઓને થયું કે ચાલો, આ વડીલની મજાક ઉડાવીએ. એક નાનકંદું પંખી પકડીને તેઓ વડીલના ઘરે ચાલ્યા. એક છોકરાએ પોતાના બે હાથની વચ્ચે પંખી રાખીને પૂછ્યું કે, “કહો, આ પંખી જીવનું છે કે મરી ગયેલું?”

જરા પણ અચકાયા વગર વડીલે કહ્યું, ‘બેટા, જો હું તને કહું કે પંખી જીવનું છે, તો તું મને ખોટો ઠેરવચા તારા બે હાથ વચ્ચે અને દબાવીને મારી નાંખીશ. જો હું કહું કે પંખી મરી ગયેલું છે, તો તું તારા હાથ ખુલ્લા કરી દઈશ અને પંખી ઊડી જશે. એટલે બેટા, તારા જ હાથમાં જીવન અને મૃત્યુ બનેની તાકાત છે!’

કોઈ પણ પ્રકારના માનસિક સંકોચ વગર આટલી વાત સમજ લો કે, નિષ્ફળતાનાં કારણો કે મહાનતાની ક્ષમતા, બંનેનાં બીજ તમારા જ હાથમાં છે.’ તમારા હાથ સમર્થ છે અને તેનો ઉપયોગ સાચી રીતે કરવો જોઈએ, જેથી પ્રાપ્ત કરવા યોગ્ય તમામ સિદ્ધિઓ તમે હાંસલ કરી શકો.

ખંત

અસાધારણ પ્રતિભા, જે સામાન્ય જનની આંખો આંજ મૂકે છે,
તે વાસ્તવમાં તો ધૂપાયેલા ખંતનું પ્રતીક છે.

સેંકડો વાર પદ્ધતાયાં-કૂટાયાં ધતાં
અથાગ પ્રયાસ જ શક્તિ પ્રેરે છે ઊંચે ચઢવાની!

હાર-જીત વચ્ચેની બેદ-રેખા એટલી સુશ્મ હોય છે,
કે ક્યારેક તો મનુષ્ય તેને અડીને પણ પારખી નથી શકતો.

બસ, એક રૂબકી ઓર અને મોતી જ્યારે હાથમાં આવી શકે,
બસ એ જ ઘીરીએ કેટલાય જગૂમનાર હાથ ઊંચા કરી દે છે!

- એડવર્ડ હેલ

હામ કદી ન હારશો હામ જ છે રામ!

હિંમતે મર્દા તો મદદે ખુદા!

સમર્થ વૃક્ષો સહજ નથી ત્રિગતા,

ઝંજાવાતને જીલીને જ મજબૂત બને છે વૃક્ષો!

સદાસર્વદા સર્વોત્તમની ઝંખના!

માઈકલએન્જેલો એક પ્રતિમા ઘડવા દિવસોથી રચ્યા-પચ્યા હતા.
જીણી જીણી બાબતોને લક્ષ્યમાં લઈ કાંટછાંટની મથામણ કરતા.
એન્જલોને એમના એક શિષ્યે પૂછ્યું કે આવા મહાન શિલ્પકાર આવી
નજીવી જીણી બાબતોમાં શા માટે આટલો બધો સમય વેડફી રચ્યા
હતા.

માઈકલએન્જેલોએ જવાબ આપ્યો, ‘જીણી જીણી બાબતો જ
પૂર્ણતા લાવે છે, પણ પૂર્ણતા એ કોઈ જીણી બાબત નથી!

કોઈ પણ સર્જન ઉત્તમ ત્યારે જ બને છે જ્યારે એનો સર્જક
એને સર્વોત્તમ બનાવવા ગૌરવ અનુભવે છે. પ્રન્યેક કૃતિ એના સર્જનહારની
પ્રતિકૃતિ છે, પછી ભલેને એ સર્જન ગમે તેટલું નાનું કે મોટું હોય!
બસ, તમારી કૃતિ નીચે ‘સર્વોત્તમ’ના હસ્તાક્ષર માંડો! સદાસર્વદા સર્વોત્તમને
જ ઝંખતા રહો!

સમસ્ત વસુંધરા તમારી જ છે!

તમે જાળવી શકો સમતુલન જ્યારે તમારી આસપાસના સૌ,
તે ગુમાવીને તમને ગુનેગાર ઠેરવે.

તમે આત્મવિશ્વાસ રાખી શકો જરાય ડયા વગર,
જ્યારે બધા લોકો તમારા વિશે શંકા કરે.

સ્વખ તમે જોતા રહો, પણ ન થવા દો એને તમારા પર હાવિ,
વિચારતાં રહો તમે, પણ વિચારો જ ન બની જાય લક્ષ્ય.

જીવનમાં સુખ અને દુઃખને ભેટીને,
તમે એ બંને છદ્મ-વેશીને એક સમાન ગણી શકો.

જો તમે તમારી તમામ જીવનની કમાણીનો ઢગલો કરી,
એને સિક્કા-ઉધાળના દાવમાં મૂકી શકો.

અને બધું ગુમાવી બેસી, ફરી એકડ એકથી આરંભો,
છતાં તમારી ખોટ અંગે હરફેય ન ઉચ્ચારો.

તમારા હૈયા, રગેરગ અને સ્નાયુની શક્તિ,
તમારી સેવામાં લગાડેલા રાખી શકો.

અને જ્યારે તમારામાં કશું જ શેષ ન રહે,
ત્યારે સંકલ્પશક્તિ એમને કહે ‘વળગી રહો!’

ભીડમાં રહીને પણ તમારા મૂલ્યોને જો તમે જાળવી શકો,
રાજાઓની સંગતમાં પણ, સાધારણ જનને ભૂલો નહીં.

ન વેરી, ન વહાલાં દુઃખ કરી તમને પહોંચાડી શકે,
સૌ લોકોની તમે ગણના કરો, પણ કોઈ અતિ વિશેષ નહીં.

જીવનની દોટની હરેક ભિનિટમાં,
સાઠ સેકંડના અર્થપૂર્ણ અંતર ને ભરી શકો.

તો એના તમામ વૈભવ સમેત, સમસ્ત વસુંધરા તમારી જ છે,
એટલું જ નહીં, મારા લાલ તું સિદ્ધ કરીશ તારું મનુષ્યત્વ!

- રડયાર્ડ કિલ્લિંગ

ભયનો સામનો છરો!

આપણો કશાયથી પણ ડરવાનું હોય તો 'ડર' થી જ!

- ફેલ્લિન રી. રૂજવેલ્ટ

સફળતાની વાટે ભય વિદ્ધ બની શકે. જો ભય માથા પર ચરી બેસે તો આપણી વિજયયાત્રાના ડગલેને પગલે એ કાયમી અંતરાય બનીને આપણને આગળ જ વધવા ન દે. માણસના જીવનમાં ભય ડેવો મોટો ભાગ ભજવી શકે તેને સમજો.

ભય નિષ્ક્રિયતાને પોષે છે. નિષ્ક્રિયતાને કારણે બિનઅનુભવી રહેવાય છે. અનુભવોથી વંચિત થવાથી યોગ્યતા કેળવાતી નથી અને અયોગ્યતાને કારણે ભય પેદા થાય છે. ભય સામો આવીને ઉભો રહે ત્યારે તમારી સમક્ષ ત્રિભેટાના ગ્રાણ રસ્તા ખૂલે છે.

પહેલો રસ્તો એ કે તમે એની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરી શકો. પરંતુ એનો અર્થ તો એ થાય કે તમારે કેટકેટલા માણસ, સ્થાન, વસ્તુ કે પરિસ્થિતિથી સતત દૂર ભાગતા રહેવું પડે! આમ કરવું અવ્યવહાર કે લાભદાયી નથી.

બીજો રસ્તો એ છે કે ડર જતો રહેશે એવી આશા સેવ્યા કરો. પરંતુ આ તો કોઈ આકાશપરી આવીને તમને બચાવી લેશે એવી કપોળકલ્યના થઈ!

પણ સદભાગ્યે, ભયનો સામનો કરવાનો એક ત્રીજો રસ્તો પણ છે, અને તે છે એનો સામનો કરી એને જીતી લેવો. અંતે તો આ જ એક માત્ર કારગર ઉપાય છે.

આપણા રોજેરોજના મોટા ભાગના ભયો હકીકતો પર ટકેલા નથી હોતા, પરંતુ આપણી લાગણીઓને કારણે ઉદ્ભવેલા હોય છે. દાખલા તરીકે, મિશિગન યુનિવર્સિટીએ એક અભ્યાસ દ્વારા કાઢેલાં તારણો તપાસીએ.

- * આપણા ભયોના ૬૦ ટકા સાવ ભામક હોય છે. અને તે કદ્દી સાચા ઠરતા નથી.
- * આપણા ભયોના ૨૦ ટકા ભૂતકાળ સાથે જોડાયેલા છે, જેના પર આપણો કોઈ અંકુશ નથી.
- * આપણા ભયોના ૧૦ ટકા એવા કુલ્લક હોય છે કે જેથી આપણા જીવનમાં કોઈ ફરક પડતો નથી.
- * ભાકીના ૧૦ ટકામાંથી ફક્ત ૪ કે ૫ ટકા જ ભય યોગ્ય કહી શકાય તેવા હોય છે.

ઉપરોક્ત આંકડા સૂચવે છે કે ભય પાછળ તમે ૮૫ ટકાનો જે સમય અને શક્તિ બર્ચો છો, તે નર્થો વ્યય છે.

તમને પાણીમાં તરવાની, વિમાનમાં ઉડવાની કે ઈન્ટરવ્યુ આપવાની બીક લાગે છે? તો નીચેનો ઉપાય અજમાવી જૂઓ જે કદાચ આશ્ર્યર્જનક પરિણામો લાવી શકે:

જો તરવાનો ડર લાગતો હોય તો દિવસમાં ત્રણથી ચાર વાર પાંચથી દસ મિનિટ શાંત બેસી રહેવાનું શરૂ કરો અને ધારી લો કે તમે તરી રહ્યા છો. આ એક પરોક્ષ અનુભવ છે. તમે માનસિક રીતે પાણીમાં પડ્યા છો. તમે પાણીનો સ્પર્શ પણ અનુભવો છો અને તમારા હાથ-પગ ઉધળી રહ્યા છે તેવી હલચલનો પણ!

આ બધી મનની સાચી, વૈવિધ્યપૂર્ણ અને આનંદદાયી પ્રવૃત્તિઓ છે. આ કાંઈ પ્રમાણી દીવાસ્વાન નથી, કારણ કે તમે જાણો છો કે આજે જે તમે કલ્યાણ દ્વારા ધારણ કરો છો તે આગળ જતાં તમારા અજ્ઞાત મનમાં દાખલ થશે. પછી એ અજ્ઞાત મનમાં કંડારાયેલા છબીચિત્રો પ્રત્યક્ષપણે પ્રગટ થવા તત્પર બનશે. અજ્ઞાત મનનો આ નિયમ જ છે.

સુવિષ્યાત ફિલસૂફ અને કવિ રાદ્ધ વાલ્ડો ઈમર્સને કહ્યું છે, “જેનાથી બીતા હો તે જરૂર કરો, એથી ભયનું મોત નિષ્ઠિત છે.” જ્યારે તમે હકારાત્મક રીતે ભયોને જીતવા અંગે વિશ્વાસ ધરાવતા હો અને તમારા જગૃત મનમાં ચોક્કસ નિર્ણય પર આવતા હો ત્યારે તમારી અંતરચેતનામાંથી સર્વશક્તિમાન શક્તિ પ્રગટ કરો છો, જે તમારા વિચારના પ્રતિસાદ રૂપે વહેતી થાય છે. આટલું હંમેશાં યાદ રાખો કે તમને જે બાબતોનો ડર લાગે છે તે વાસ્તવમાં હોતો જ નથી, હોય છે માત્ર મનના વિચારોની ભૂતાવળ!

-જાહીન સી. મેઝસવેલ

આપણી મહાન યશગાથા...ક્યારેય નિષ્ફળ ન થવું તેમાં નહીં,
પરંતુ પડ્યા પછી પણ ઉભા થઈને આગળ વધવામાં રહેલી છે!

- આંદિવર ગોલ્ડસ્ટિમથ

કલાણી ઉષા



મહાન થાય છે,
હાથથી...

પણ

ઘર રચાય છે,
હુદયથી!

વસ્તુઓ વગર પણ
તમે જીવી શકો...

જો જીવનમાં
એવું હોઈ હોય...
જેના માટે
જીવવાનું મન થાય!







કરુણાની ઉષા

સિમત...
વળાંકવાળી
એક એવી
સૌમ્ય રેખા છે...

જે...

અટપટી બાબતોને પણ,
સણજતાપૂર્વક
સીધી હરી શકે છે!

ઘર એ, જ્યાં પ્રેમનો પોકાર!

ઘર એ કાંઈ કેવળ ચાર ચોરસ દિવાલો નથી,
જેના પર સોને મહેલાં ચિત્રો ટીંગાયલાં હોય.
ઘર તો એ છે, જ્યાં પ્રેમનો પોકાર છે,
જેમાં હદ્ય દારા નિર્મિત જીવનમંદિર છે!

ઘર! જઈને જૂઓ પેલું વફાદાર પારેવું,
જે સ્વર્ગથી સીધું અહીં ઉત્તરી આવ્યું છે!
ઘર એ સ્થાન છે, જ્યાં કોઈને ચાહવાનું છે!
ઘર એ મંદિર છે, જ્યાં કોઈ આપણને ચાહે છે!

ઘર એ કાંઈ માત્ર છત કે ઓરડો નથી,
આપણને એ વહાલું લાગે તે માટે ત્યાં કોઈ જોઈએ.
ઘર એ છે, જ્યાં હદ્ય-કમળ ખીલી ઊઠે,
જ્યાં સ્નેહાળ હોઠ પ્રસન્નતા પ્રસરાવે!

કોઈ મળવા આતુર ન હોય,
ન આવકારવા, ન સત્કારવા, તે ઘર કેવું?
ઘર તો નર્યુ મધુરું સુમધુરું ધામ,
જ્યાં એવું કોઈ, જેને મળવાની આપણી ઉત્સુક ચાહત હોય!

- ચાલ્સ સ્વેન

ઘરનો આનંદ મળી શકે નાનીશી બાબતોમાં,
ચાની ઘાલીમાં ભાગ પડાવતા મિત્રોમાં!
યુગ-યુગ જૂનાં સપનાં જગાડતાં ગ્રંથોમાં,
અને સ્મરણોના સ્પર્ધન સળવળાવતાં ગીતોમાં!

- આલ્ફેડ ટેનીસન

કોઈક માટે કશુંક તો કરો!

જવનમાર્ગ ચાલતાં ચાલતાં,
કોઈને માટે ક્યાંક કશુંક તો કરો!
કોઈ ભાર ખેચનારાને ટેકો કરો,
અને જૂઝો કે તમે થયાં હળવા-કૂલ!

કોઈને માટે કશુંક કરો, રાજ્યપુશીથી,
તમારી તમામ ચિંતાને એ મીઠી બનાવશો.
બીજાનાં દુઃખોમાં સમભાગી બનીને,
તમારાં કષ્ટો સુસ્વધ બની જશે.

રસ્તો લાંબી રજળપાટ લાગે ત્યારે
મદદ જંખતા કોઈક માટે કશુંક કરો,
તડપતાં કોઈ શોક-સંતપ્ત હૈયાને,
નાનકડું ગીત ગાઈ પ્રસન્ન કરો.

ભલે તમારી નાતજાત ગમે તે હોય,
કોઈ માટે કશુંક કરતાં રહો, સદાસર્વદા,
તમારી વહારે આવે તેવું અન્ય કશું ના, આ જગે,
જેવું છે આ કરુણા-કાર્ય!

- હેરોલ્ડ ઓફોટ

જગતમાં લોકોના બે પ્રકાર છે...
એક છે આપનારા!
અને બીજા છે લેનારા!
લેનારા પામીને પેટ ભરે...
જ્યારે આપનારાને મીઠી ઊંઘ મળે!

કોઈનું સર્વાધિક ભલું...

ન્યુયોર્કનો એક વેપારી પેન્સીલ વેચતા એક ફરિયાના પાત્રમાં ડૉલર નાંખીને સબ-વે ટ્રેનમાં બેસવા ઉતાવળે આગળ વધ્યો. પરંતુ મનમાં અચાનક કશુંક સૂઝતા એ ગાડીમાંથી નીચે ઉતરી પેલા ફરિયા પાસે પહોંચ્યો અને એના પાત્રમાંથી કેટલીક પેન્સીલ લીધી.

ઓઝે માફી માગતા ફરિયાને ખુલાસો કર્યો કે ઉતાવળમાં પેન્સીલ લેવાનું રહી ગયું અને તેથી તેણે ખોટું નહીં લગાડ્યું હોય! “ગમે તેમ તોય તું પણ મારા જેવો જ એક વેપારી છે. તારી પાસે વેચવાનો માલ છે અને એ પણ વ્યાજબી કિંમતે!” એમ કહીને વેપારીએ બીજી ગાડી પકડી.

થોડાક મહિના પછીના એક સમારંભમાં, એક સ્વચ્છ-સુધડ સેલ્સમેને પેલા વેપારી પાસે જઈને કહ્યું. “કદાચ તમને હું યાદ નહીં હોઉં. તમારું નામ પણ હું જાણતો નથી. છતાંય હું તમને ક્યારેય નહીં ભૂલું. તમે મારું આત્મ-સન્માન મને પાછું અપાવ્યું. તમે મને મળ્યા નહોતા, ત્યાં સુધી હું પેન્સીલ વેચીને ગુજરાઓ કરતો એક બિખારી માત્ર હતો, પરંતુ તમે મને ‘વેપારી’ કહ્યો!”

એક શાંખા માણસે કહ્યું છે - “ધણા લોકો જીવનમાં તેમણે ધાર્યું હોય તેથી પણ વધુ આગળ નીકળી શક્યા છે, કારણ કે ભલે એમણે નહીં, પણ એમના વતી બીજાએ ધાર્યું હતું કે તેઓ આમ કરી શકશે.”

કોઈનું સૌથી મોટું ભલું, એ માત્ર આપણી સંપત્તિ એની સાથે વહેંચવામાં જ નથી, પરંતુ એની પોતાની સંપત્તિના મૂલ્યનું એને ભાન કરાવવામાં રહેલું છે!

૭૮

બીજાના ભલા માટે તમે જે પણ આપશો!

સમય... પ્રેમ... કે ધન!
ઇથર તેના બદલામાં તમને,
કષણનાં મણ કરીને આપતા જ રહેશે.

- ધ યુનીવર્સલ લો ઓફ ગીવીંગ

આપીને હું પામું છું!

જીવનના ધૂઘવતા વિશાળ સાગરપટ પર

મેં મારા સિમતને વહેતું કર્યું,

એ તો દૂર... સુદૂર રેલાંતું રહ્યું!

અને હું ગણી શકું તેના કરતાં પણ વધુ
બદલામાં મારી પાસે વહેતાં આવ્યાં.

‘વાદળ અવશ્ય વિખરાશે’ એમ ગણગણી

મેં એનો હાથ સ્નેહથી હાથમાં લીધો.

અને એ આખા હિવસ દરમ્યાન,

મેં મારા જીવનની ધન્યતા સતત અનુભવી.

જ્યાં તાતી જરૂર હતી ત્યાં

પ્રસન્નતા ભર્યો એક વિચાર રેલાવ્યો,

તરત જ મેં જોયું કે,

મારો આનંદ અનેકગણો વધી ગયો.

મહેનતથી કમાયેલા સોનાના સિક્કાના

મારા અલ્ય શા સંગ્રહની વહેંચણી કરી.

અને એમાં સો ગણા વધારા સાથે

એ જડપભેર મારી પાસે પાછી ફરી.

મેં અન્યને ટેકરી ચડવામાં મદદ કરી,

કેવી નાનકડી એવી બાબત.

તેમ છતાં અમૂલ્ય એનું ફળ મળ્યું,

મળી નવી દોસ્તીની દોલત.

હર પ્રભાતે ઉઠતાં હું વિચારું

કેમ કરીને કાંઈ સિદ્ધ કરી શકું.

સેવા કરીને ઉત્ત્રતિ કરું હું,

કાંઈક આપીને જ હું પામી શકું!

- થોમસ ગેરીન્સ

બીજાને મદ્દદ હરો!

એક માણસને પોતે છેવટે ક્યાં જવાનું પસંદ કરશે તેનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય, તે માટે સ્વર્ગ અને નરક બંને સ્થળનો પ્રવાસ ગોઠવાયો. નરકનું પહેલું દૃશ્ય જ ખૂબ અજબ હતું, કારણ કે ત્યાં ભોજનના મેજ આસપાસ જમવા બેઠેલા લોકો સામે જાતજાતનાં વિવિધ પકવાન પીરસાયાં હતાં. પરંતુ પેલા માણસે જ્યારે દરેકના ચહેરા તરફ ઝીણવટથી જોયું તો કોઈના મુખ પર પ્રસન્નતા નહોતી. મેજ સામે બેઠેલા લોકો નિસ્તેજ અને ઉદાસીન હતા. યાત્રીએ જોયું કે દરેકના જમણા હાથમાં લાંબા કડછા જેવા ચમચા કોઇઓ સુધી બાંધા હતા. દરેક ચમચાના હાથા ચાર ફૂટ જેટલા લાંબા હતા, જે મોં સુધી વળી શકે તેવા નહોતા. આમ, ભાતભાતનાં ભાવતાં ભોજન સામે ધરાયાં હોવા છતાં, તેઓ ભૂખે મરતા હતા.

હવે સ્વર્ગ જવાનો સમય આવ્યો. ત્યાં પડ્યા યાત્રિકે નરક જેવું જ દૃશ્ય જોયું! એ જ ભાતભાતના ભોજન અને ચાર ફૂટના હાથાવાળા મોટા કડછા! પરંતુ ફેર એટલો હતો કે અહીનાં સૌ રહેવાસી હસતાં-ગતા હતા અને ખૂબ પ્રસન્ન હતા. યાત્રિક તો ઘડીભર મુંજાઈ ગયો. અને થયું કે બેઉં સ્થળે બાધ્ય પરિસ્થિતિ સાવ એક સરખી, અને છતાંય પરિણામમાં આટલો બધો તફાવત? નરકમાં લોકો ભૂખે ટળવળતાં દુખિયારાં જન હતાં, જ્યારે સ્વર્ગના લોકો ખાદ્ય-પીધે સુખી અને આનંદી લોકો જણાતાં હતાં.

પરંતુ એટલામાં જ અને જવાબ મળી ગયો. નરકમાં દરેક જણ ચમચામાં કોળિયો લઈ પોતાના મોંમાં નાખવા મથતો હતો. કોણીથી હાથ વળે જ નહીં, કોળિયો મોંઢે સુધી પહોંચે કેવી રીતે? જ્યારે સ્વર્ગમાં સૌ જમનારા મેજ ઉપર સામસામા ગોઠવાઈ, પોતાની સામે બેઠેલા માણસના મોંઢામાં કોળિયો ધરતા હતા. આમ એકમેકને સહાય કરીને તેઓ પોતાની વ્હારે ધાયા હતા. સૌ પેટ ભરીને જમ્યા હતા અને એથી સૌ પ્રસન્ન હતા.

જવનમાં જે જંખો તે બધું જ તમે મેળવી શકો,
અને બીજા જે ઈચ્છા હોય,
તે મેળવી આપવામાં તમે પોતે મદદરૂપ થઈ શકો!

ક્ષમા શું હામ?

તમારી સાથે ખોટું કરનારાને માફ કરી દો. એ માણસ જરાય માઝીને લાયક નથી એવું કદાચ તમે તારવ્યું પણ હોય. તેમ છતાંય, એ વાત પરમાત્મા પર છોડી દો. કોણ માઝી માટે લાયક છે કે નાલાયક, તે પ્રભુને જ નક્કી કરવા દો!

સામેનો માણસ માઝીને લાયક હોય કે ન હોય, પરંતુ તમારે તો એને ક્ષમા કરવી એટલે જરૂરી છે કારણ કે જ્યાં સુધી તમે એવું નહીં કરો ત્યાં સુધી સામેનો માણસ તમારા જીવન પર કાબૂ ધરાવ્યા કરશે. એ માણસે ભૂતકાળમાં તો તમારા સામે નકારાત્મક વલણ દાખલ્યું જ છે. પરંતુ હવે તમારા વર્તમાન કે ભવિષ્ય પર એના પડછાયા પડે તેવું તમે નહીં જ ઈંદ્રાણો.

અને યાદ રાખો. પર્વતારોહકો પોતાની સાથે હંટો લઈ જતા નથી. એ જ રીતે તમારે પણ ક્ષમા દ્વારા કોથ, તિરસ્કાર અને વિરોધની હંટોના ભારને હળવો કરવો પડશે. જેટલો બોજો ઓછો હશે, તેટલું જ ઊંચે તેમજ આગળ જવા માટેની તમારી ગતિ વધારી શકાશે.

તમને એ પણ સમજશો કે ક્ષમા આપીને તમે ભૂતકાળ સાથે મિત્રતા બાંધી શકશો અને વર્તમાન ઉપર લક્ષ્ય સેવી શકશો. આવા વલણને પરિણામે તમારો વિકાસ થશે અને તમારી ક્ષમતા મુજબની યોગ્યતા તમે સિદ્ધ કરી શકશો. એથી તમારું ભાવિ ઉજ્જવળ બનશો અને તમે પૂર્ણતાની દિશામાં આગળ વધી શકશો.

જ માણસ અન્યને માફ કરી નથી શકતો, તે એવા સેતુને તોડી પડે છે, જેના પરથી કદાચ એને પોતાને ચાલવાનું થાય!

કોઈનો પ્રેમ મેળવવાની આશા ત્યારે જ પૂરી થાય

જ્યારે તમે માંગવાનું બંધ કરો...

અને આપવાનું શરૂ કરો!

તમે પ્રેમ ત્યારે જ પામો છો,

જ્યારે તમે બીજાને પ્રેમ આપો છો.

- તેલ કાર્ણગી

પરસ્પર છુંદુ અને ભાગીદારી

જો આપણો કોઈક નાનકડો શબ્દ,
કોઈના જીવનમાં અજવાળાં પાથરી શકે.
આપણું કોઈક નાનકદું ગીત,
કોઈના હૈયાને હળવું કરી શકે.
ઈશ્વર આપણાને એવો શબ્દ બોલવા સહાય કરે
અને આપણા નાનકડા ગાનને વહેતું કરે...
અને કોઈ એકાંત ખીણમાં એને ફેંકે
જેના પડધા ચોમેર રણકી ઊઠે!

જો આપણો થોડોક પ્રેમ,
કોઈના જીવનને મીઠદું કરી શકે.
આપણી જરીક અમથી કાળજી
બીજાનાં ડગલાંમાં જોમ પૂરી શકે.
સ્વેજ સરખી મદદ હળવો કરે
અન્ય કોઈનો મબલખ ભાર,
તો પ્રભુ અમને એ પ્રેમ, કાળજી અને શક્તિ આપ
જેથી અમે પરસ્પર સહાય કરી શકીએ!

જો આપણો કોઈ નાનકડો વિચાર
કોઈ એકનું જીવન સમૃદ્ધ બનાવી શકે.
આપણું કોઈક આનંદી સ્થિત
પ્રસંગતા પ્રસરાવી શકે.
તો પછી એ વિચારને આજે જ વાચા આપીએ
મૃદુ આંખોને ચમકાવીને,
એટલે પ્રભુ, કોઈ થાક્યાપાક્યાના જીવનબાગમાં
પ્રસંગતાનાં બીજ વાવી શકે!



જીવન-યાત્રામાં
પસાર થવાનું
તો
એક જ વાર છે!

તો પણી
જે કાંઈ સ્નેહ અને સદ્ભાવ
હું દર્શાવી શકું...
અથવા
બીજું કાંઈ પણ સદ્કાર્ય
જે હું મારા બંધુઓ માટે કરી શકું...

કાલે નહીં...
મને આજે જ અને
હમણાં જ તે કરવા દો!

તેમાં કોઈ જ વિલંબ કે અવગાળના ન થાય!

કારણ કે
આ જીવનવાટે
ફરી કોઈવાર
હું પસાર થવાનો નથી!

- વિલિયમ પેન

બીજામાં પ્રમાણિક રસ લેવો!

‘મિત્રોને કેવી રીતે જીતવા અને લોકોને કેવી રીતે પ્રભાવિત કરવા?’ આ પુસ્તક શા માટે વાંચવું? એના કરતાં જગતે ‘મિત્રોના મહાન વિજેતા’ તરીકે જેને જોયો-જાળ્યો છે તેની જ પદ્ધતિ શા માટે ન અપનાવવી?

એ કોણ છે? કદાચ કાલે તમે એને શેરીમાંથી પાછો ફરતો જૂઓ. એનાથી દશ ફૂટ દૂર તમે હો, ત્યાં એ પોતાની પૂછડી પટપટાવા માંડશે. તમે રોકાઈને એને સહેજ અમથો પંપાળશો તો જાણો પોતાની ચામડી ચીરીને બહાર આવતો હોય એ રીતે તમારા તરફ ફૂદીને, એ બતાવવાનો પ્રયત્ન કરશે કે તમે એને કેટલા ગમો છો! અને તમે જાણો છો કે એના પ્રેમના આ પ્રદર્શન પાછળ બીજા કોઈ ગુપ્ત હેતુઓ નથી. એને ન તો કોઈ સ્થાવર મિલકત તમને વેચવી છે કે ન તો એ તમને પરાણવા માંગે છે.

તમને ક્યારેય આવો વિચાર આવ્યો છે કે ફૂતરો જ માત્ર એવું પ્રાણી છે, જેને પોતાની આજીવિકા માટે કામ નથી કરવું પડતું. ભરધીને તો ઈંડાં મૂકવાં પડે. ગાયને દૂધ આપવું પડે અને કંનરી પક્ષીને તો ગાવું પડે. પરંતુ ફૂતરો તો પોતાની આજીવિકા માત્ર પ્રેમ આપીને જ મેળવી લે છે!

બીજા લોકોને તમારામાં રસ લેતા કરી, બે વર્ષમાં તમે જેટલા મિત્રો કરી શકો તેના કરતાં વધારે મિત્રો, તમે બીજા લોકોમાં પ્રમાણિક રસ દાખવી માત્ર બે મહિનામાં જ બનાવી શકો.

છતાંય તમે અને હું એવા લોકોને જાણીએ છીએ કે જે બીજા લોકો પોતાનામાં રસ લે, તે માટે આખી જિંદગી તેમનો જીવ ખાતા રહેવાની મૂખ્યમી કરતા રહે છે. અલબત્ત, તેથી કશું વળતું નથી. લોકોને તમારામાં રસ પડતો નથી. તેમને મારામાં પણ રસ નથી. તેમને તો પોતાનામાં રસ છે, સવાર, બાપોર અને સાંજ, આખો વખત!

એટલે બીજા લોકોમાં પ્રમાણિક રસ લેવો એથી વધારે અસરકારક અને પરિણામદાયી બીજું કશું જ નથી.

- ડેલ કાર્નેગી

બીજાની કજરે જોતાં શીખો!

ગયા વર્ષે મારે એક અંગત મદદનીશની જરૂર હતી, અને મેં છાપામાં બોક્સ નંબર દ્વારા જાહેરાત આપી. મને ત્રણ હજાર અરજીઓ મળી! મોટા ભાગની અરજીઓના આરંભે આવું કાંઈક લખેલું હતું - “બોક્સ નં. ૨૮૮માં સન્ડ ટાઈભ્સમાં છપાયેલી તમારી જાહેરાતના અનુસંધાનમાં આ પત્ર છે. તમે સૂચયવેલા સ્થાન પર હું જોડાવા માંગુ છું. મારી વય છિવીસ વર્ષની છે... વગેરે... વગેરે.”

પણ એક સ્ત્રી ચાલાક હતી. ઓણે પોતાની શી માંગ છે, તે વિષે કશું ન લખ્યું. ઓણે તો મારી જરૂરિયાત અંગે જ લખ્યું હતું. એનો પત્ર આ મુજબ હતો -

“સાહેબશ્રી,

તમારી જાહેરાતના જવાબમાં તમને કદાચ બસોથી ત્રણસો પત્રો મળશે. તમે વ્યસ્ત વ્યક્તિ છો. તમે કાંઈ એ બધા વાંચી નહીં શકો. એટલે આ વાંચીને તરત જ જો વેન્ડરબીલ્ટ ૩૦૧-૫૨૭૮ પર ફોન કરશો, તો તમારી પાસે આવી, પત્રો ખોલી, નકામા પત્રો કચરાટોપલીમાં પદ્ધરાવીને, બાકીના તમારા મેજ પર મૂકી શકીશ. મને પંદર વર્ષના કામનો અનુભવ છે...”

પછી જે મહત્વની વ્યક્તિઓ સાથે ઓણે કામ કરેલું તેમના વિષે લખેલું. એ પત્ર મળ્યો કે તરત જ મને ટેબલ ઉપર નાચવાનું મન થયું. મેં તરત જ ફોન નંબર જોડીને, એને આવવાનું જણાવ્યું, પરંતુ હું મોડો પડ્યો હતો. બીજા કોઈએ એને રોકી લીધી હતી. આવી સ્ત્રીને તો સમગ્ર વેપારી આલમ પગે પડે.

તમારા ગ્રાહકો, તમારા કુટુંબીજન કે તમારા મિત્રો સાથે તમારે વધારે સફળ સંબંધો બાંધવા હોય તો હંમેશાં બીજા લોકોના દાઢિકોણથી જોતાં શીખો.

બીજા લોકોને મન શું મહત્વનું છે એ જાણવા સમજવા માટે સૌથી પહેલા તમારી જાતમાંથી બહાર આવો!

- ડેઇલ કાર્નેગી

કંદુ વચ્ચન મત ખોલ રે!

અવિચારી શબ્દ સંઘર્ષને જન્માવી શકે,
નિષ્કૂર વાણી જીવન વિનાશ સર્જી શકે.

કડવો શબ્દ તિરસ્કારને પોષી શકે,
નિર્દ્ય વાચા તો સંહાર પણ કરી શકે.

માયાળુ શબ્દ માર્ગને અડચણ મુક્ત બનાવી શકે,
પ્રસન્ન વાણી કોઈ જીવનને આનંદમય કરી શકે.

સમયસરનો શબ્દ તાજા ઘટાડી શકે,
પ્રેમાળ વાચા દર્દ મટાડી મીઠી દુવા આપી શકે.

જ્યારે તમે ખીણાની ધાર ઉપર ઉભા હો,
ત્યારે કુનેહ એ અકળાવનારી તિરાડ પૂરી જાડો છે.
તમે જે કંઈ વિચારો તે બોલી નાંખો,
એના કરતાં જે કંઈ બોલો તે વિચારીને...
...એમાં સમાયેલી છે સાચી કુનેહ!

નાની શ્રી વાત!

“હા, તેં આ કર્યું!”... “ના, મેં હરાળીજ નહીં!”
આમ તકરારની શરૂઆત થઈ,
આવા થોડા કડવા શબ્દોની આપ-લે
અને બે દિલોજાન મિત્રો છૂટા પડ્યા.

“હું દિલગીર ધું?”... “હું પણ!”
આમ તકરાર ત્યાં જ પતી ગઈ,
બે મીઠા પ્રેમાળ બોલ અને
બે હેતાળ હૈયાં જોડાઈ ગયાં.

અર્પણ અને ક્ષમાપન

જીવનને જીવવાજોગ બનાવે છે
આપણાં અર્પણ અને ક્ષમાપન!

સદ્ગુરીનાં નાનાં એવાં કામ,
જે અનેરી પ્રસન્નતા પ્રસરાવી જાય.

અને જળવી કડવાશોને ક્ષમી દેવા
એકાદ્ય યોગ્ય શબ્દ સક્ષમ બને.

કારણ કે આપણને દેખાય છે તે કરતાં
નાની લાગતી ચીજો હોય છે ઘણી મોટી.

જીવનને જીવવાજોગ બનાવે છે
આપણાં અર્પણ અને ક્ષમાપન!

- થોમસ ગ્રાન્ટ સ્પ્રિંગર

આપવા માટેની સૌથી અધરી એવી ચીજ છે સદ્ગુરીનાં...
કારણ કે મોટાભાગે તે આપણને પાછી વળાય છે.

- માર્ક ઓર્ટમેન

હૃદય તૂટકું બચાવો!

જો એક પણ હૈયું તૂટતું હું રોકી શકું,
તો જીવન મારું મિથ્યા નહીં ઠરે.

હું કોઈ જીવનું દુઃખ મટાડી શકું,
કે તેની પીડા શમાવી શકું;
કે કોઈ એકલા અટુલાનો હાથ પકડી
એના જીવનમાં આનંદનો સંચાર કરી શકું.

આટલું જો હું કરી શકું,
તો મારું જીવન સાર્થક થશે.

- એમીલી ડિક્રિન્સન

માનવીય સંબંધોના પારંગત બનો!

સ્ટીલના ધંધામાં કામ કરનારા ચાર્ખ્સ સ્કવોબને વાર્ષિક લાખો ડૉલરોનો પગાર ચુકવાતો હતો, લોકો સાથે વ્યવહાર કરવાની એની વિશિષ્ટ શક્તિને કારણે. કલ્પના તો કરો! વર્ષના દસ લાખ ડૉલર, કારણ કે એ લોકો સાથેના વ્યવહારમાં પારંગત હતો.

એક દિવસ બપોરે ચાર્ખ્સ પોતાના કારખાનામાંથી પસાર થતો હતો ત્યાં ‘અહીં ધૂમપાનની મનાઈ છે’ના પાટિયા નીચે જ બેસીને કેટલાક લોકો સીગરેટ પીતા હતા.

તમે શું એમ માનો છો કે ચાર્ખ્સ પેલું પાટિયું બતાવીને તેમને પૂછ્યું હશે કે, “આ પાટિયું વાંચતા નથી?”

જરા પણ નહીં! માનવીય સંબંધોનો નિષ્ણાત તો આવું કહે નહીં.

એમણે તો એ માણસો સાથે મૈત્રીપૂર્ણ વાતો શરૂ કરી અને ‘ધૂમપાનની મનાઈ’ના પાટિયા નીચે તેઓ ધૂમપાન કરી રહ્યા છે તે વિષે હરફેય ઉચ્ચાર્યો નહીં.

છેવટે છૂટા પડતાં એ લોકોને થોડી સીગરેટ આપતાં, આંખમાં ચમકારા સાથે ચાર્ખ્સ કહ્યું, “આ તમે બહાર જઈને પીશો તો મિત્રો, મને એ ગમશો.”

બસ, એણે આટલું જ કહ્યું. એ લોકોને પણ ભાન થયું કે તેમણે નિયમ તોડ્યો છે એ વાત જાણતા હોવા છતાં ય ચાર્ખ્સ તેમને હલકા ન પાડ્યા. તેણે એવી ખેલદીલી જાળવી કે બદલામાં એમની ખેલદીલી બતાવવાનું પણ એમને મન થયું.

જવનમાં સફળતા મેળવવી હોય તો...
માનવીય સંબંધોમાં તમારે પારંગત બનવું જ રહ્યું!

ટીમમાં આત્મ-વિશ્વાસનું નિર્માણ

ઓડોલ્ફ સેલ્જી, ફિલાડેલ્ફીયા વાહનોના એક શોરૂમમાં વિકેતા હતો. અચાનક એવા સંજોગો ઉભા થયા કે પોતાના નિરાશ અને વેરવિભેર થઈ ગયેલા સાથીગણમાં ઉત્સાહ પ્રેરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ ગઈ.

એણે સેલ્ઝ મીટિંગ બોલાવીને તેના સાથીદારોની પોતાની પાસે શી અપેક્ષા છે તે પૂછ્યું. તેઓ જેમ જેમ કહેતા ગયા તેમ તેમ એ બધું બ્લોકબોર્ડ ઉપર લખતો ગયો. પછી એણે કહ્યું, “તમે જેની મારી પાસે અપેક્ષા રાખો છો, તે બધી જ યોગ્યતા હું પૂરી પાડીશ. પરંતુ હવે મારે તમારી પાસે શી અપેક્ષા રાખવી તે વિષે તમે કાઈ કહો તે ઈચ્છું છું.”

એક પછી એક જવાબો જરૂરિયાત આવવા મંડ્યા -
“વફાદારી, પ્રામાણિકતા, પહેલ, આશાવાદ, સંયોજન,
સમર્પણ...”

મીટિંગ પૂરી થઈ ત્યારે નવી પ્રેરણ અને જુસ્સાની સૌઅં અનુભૂતિ કરી. કેટલાક સાથીદારોએ તો રોજના ચૌદ કલાક કામ કરવાની સ્વેચ્છા દાખવી. ત્યાર પછી શ્રી સેલ્જીનો અહેવાલ પણ બહાર પડ્યો કે તે વર્ષે અદ્ભુત વેચાણ થયું.

સેલ્જે કહ્યું, “જાણો એ બધાએ મારી સાથે નૈતિક સોદાગીરી કરી હતી. જ્યાં સુધી મેં મારી બોલી જાળવી રાખી, ત્યાં સુધી તેઓએ પણ તેમના વચન પાળવાનો નિર્ધાર કર્યો હતો. જરૂર હતી એમની ઈચ્છાઓ અને અપેક્ષાઓ વિષે તેમને વિશ્વાસમાં લેવાની અને એ વાત જ બધું કામ કરી ગઈ.”

તમારી ટીમમાં આત્મવિશ્વાસ જગાવવા માટે
પ્રત્યેક તકનો લાભ ઊઠાવો!


સફુળતાનું રહસ્ય

સફુળતાની વ્યાખ્યા
એ છે કે...

પૈસા જે તાંઈ ખરીદી શકે
તેમાંનું
ઘણું બધું મેળવવું...

અને
પૈસા જે ખરીદી ન શકે
તે બધું જ
પ્રાપ્ત કરવું!





સ્ફુરતાનું રહસ્ય

પાણીને
માત્ર પરખવા માટે...
એમાં શું કામ ઉત્તરવું?

મોજાં ઉછાળવાની
તમજ્જા સાથે...
પાણીમાં જરૂર પ્રવેશો!

વિજયી વિરુદ્ધ પરાજયી

વિજયી કહે છે : “ભલે એ મુશ્કેલ હોય, પણ શક્ય તો છે જ,”
પરાજયી કહે છે : “ભલે એ શક્ય હોય, પણ બહુ મુશ્કેલ છે.”

વિજયી શક્ય બનાવે છે,
પરાજયી જે થાય તે થવા દે છે.

વિજયી જોરદાર દલીલો કરે, પરંતુ સૌભ્ય ભાષામાં,
પરાજયીની દલીલો દમ વગરની, પણ ભાષા ભારે આકરી.

વિજયી કહે છે, “લાવો, તમને હું કરી આપું!”
પરાજયી કહે છે, “આ કાંઈ મારું કામ નથી!”

વિજયી દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે,
પરાજયીને દરેક ઉકેલમાં પણ સમસ્યા દેખાય છે.

વિજયી પાસે હંમેશા કાર્યક્રમ હોય છે,
પરાજયી પાસે માત્ર બહાનાબાળ!

વિજયી સૌ કોઈના માટે જીત ચાહે છે,
પરાજયી માને છે કે તેમણે જીતવા અન્યએ હારવું જરૂરી છે.

વિજયી ટીમના ભાગ બને છે,
પરાજયી રહે છે ટીમથી દૂર.

વિજયી કહે છે, “મારે કાંઈક કરવું જોઈએ!”
પરાજયી કહે છે, “કશુંક થવું જોઈએ!”

વિજયી શું બોલવું તે પસંદ કરે છે,
પરાજયીને પસંદ પડે તે જ બોલે છે.

વિજયી ભૂલ કરે તો કહે છે, “હું ખોટો હતો!”
પરાજયી ભૂલ કરીને કહે છે, “આમાં મારો કાંઈ વાંક ન હતો!”

સીંચી દો સર્વોત્તમ...અને જીત છે તમારી!

ભલેને તાલીમ વર્ષો લે,
પરંતુ સ્પર્ધા પૂર્ણ થાય છે ક્ષણોમાં,
મહેનત અને અશ્વનું મૂલ્ય
એ કેવળ જીત માત્ર માટે નથી.

ગડગડાટ તાજીઓના ભૂલાઈ જશે,
અને પુરસ્કારો પણ ખોવાઈ જશે,
પરંતુ પ્રશિક્ષણના લાંબા-કપરા કલાકો
નહીં ક્યારેય વેડફાશે.

કારણ કે વિજય માટેનો પ્રયાસ કરતાં
તમારું કૌશલ્ય વધે છે,
આટલું તો તમે શીખી જ લો છો કે,
ઈચ્છાશક્તિ પર જીતાય છે!

તમે કેટલી જીત મેળવી એ કાંઈ
તમારા વિકાસનો આંક નથી,
તમે કેટલી શક્તિ રેડી તે પરથી
તમારી પ્રગતિ અંકાય છે.

એટલે કોઈ પણ નવો પડકાર જીલો ત્યારે,
સીંચી દો સર્વોત્તમ...અને જીત છે તમારી!

આ જ છે સાચી સર્વાત્મા!

પ્રભુના સિંહાસન પાસે બિરાજ
એક બિચારાએ માથું જુકાવી એકરાર કર્યો કે, “હું હાર્યો!”
પણ ત્યારે પ્રભુ બોલી ઉઠચા,
“હરગીજ નહીં. તારાથી શક્ય શ્રેષ્ઠ તેં કર્યું...
અને આજ છે સાચી સર્વાત્મા!”

સા સફળતા-નિષ્ફળતા શું છે?

સફળતા... આપણો ન તો એને ટોકીએ, ન રોકીએ, ન એને ખોલીએ. પરંતુ સફળતા અને નિષ્ફળતા છે શું એ તો પહેલા સમજીએ.

સફળતા અને નિષ્ફળતા: એ રમતની હાર-જત કરતાં કાંઈક વિશેષ છે? હા. કારણ કે સફળતા એ એક પ્રક્રિયા છે. રમતના પાઠિયા પર લખાય તે કરતાં એ વધારે છે. રમત પૂરી થાય અને પ્રેક્ષકો ઘેર જાય પછી હાર કે જત અટકતા નથી. આપણે ઘણાય એવા વિજેતા જોયા છે જે રમત જતીને ફૂલાઈને ફાળકો બની જાય છે. એમની જત એમની પડતીનું કારણ બને છે. અને આપણે એવા પણ પરાજ્યાઓ જોયા છે કે જે ઓએ ખેલીદીલી અને સૌજન્યતાપૂર્વક પોતાની હારને માથે ચઢાવી તેને પોતાની અંગત જત બનાવી દીધી હોય.

સફળતા/નિષ્ફળતા: એ શું લક્ષ્યાંકો નક્કી કરી એને મેળવવાની મથામણ છે? હા. પરંતુ છાપામાં જે કાંઈ આવે તે કરતાં એ ઘણું વધારે છે. કારણ કે, સાચી સફળતા એ છે, જેમાં તમે ઈશ્વર-દત્ત અવસરોને સ્વીકારી તમારા ઈશ્વર-પ્રેરિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા, તમારી સર્વોત્તમ શક્તિના સો એ સો ટકા કામે લગાડો. હારી જવાની અંતિમ ક્ષણ સુધી પણ જત તમારાથી સંતાતી રહે. વાંસ પર ઊંચો ફૂદકા લગાવનારો જ્યાં સુધી પોતાના ભાર્ગના ઊંચામાં ઊંચા વિન્ધો દૂર ન કરે ત્યાં સુધી એ મંજિલ સર ન કરી શકે. હારતા હારતા જ તે જતના ઉંબરે પહોંચે છે.

તમારી ક્ષમતાને શોધવી અને વિકસાવવી તેમજ રોજેરોજ તમારી આસપાસ ઊભી થતી નવી તકોને અજમાવવી એમાં જ સફળતા છે.

સફળતા/નિષ્ફળતા: શું એ સમસ્યાઓને ઉકેલવી અને મુશ્કેલીઓને દૂર કરવી એ છે? હા. પરંતુ સફળતાની પ્રક્રિયા કદી અટકવી ન જાઈએ, તે યાદ રાખો. તમારો એક પ્રશ્ન ઉકેલાયો? આ સફળતા બીજી પ્રશ્નો ઊભા કરશે. તમે કોઈ એક મુશ્કેલી પાર કરી? આ સફળતા બીજી ટગલો મુશ્કેલીઓ ઊભી કરશે. એટલે સાચી સફળતાનું માપ તો એમાં જ નીકળે કે આ આખી પરિવર્તનની પ્રક્રિયા દરમ્યાન તમે કેટલા આનંદી, વિનયી, વિધાયક અને ગૌરવશીલ રહ્યા?

સફળતા/નિષ્ફળતા: શું એ કીર્તિ અને પ્રારબ્ધ કમાવા વિષે છે? હા અનો ના! સત્તા અનુસારી સંપત્તિના અનોક મોટા માંધાતા

જગતના સૌથી વિરાટ માનવો તરીકે નામના પામ્યા છે જ્યારે બીજા અનેકને તો ઈતિહાસમાં ધૂળ ચાટતા પણ કરાયા છે. જ્યાં સુધી ક્રીતિ અને ધન-સંપત્તિ બીજાને મદદરૂપ થવાનાં સાધનરૂપ ન બને, ત્યાં સુધી તેને કુદ્ર આકાંક્ષા જ ગણી શકાય.

એટલે સરવાળે સફળતા એટલે શું? શું એ દિવાલ પર ટીંગાડાયેલી ડિચી કે ડિલોમા છે? કે કબાટમાં શોભતી ટ્રોઝી છે? બંકનો પૈસો કે ધેંધાકીય માનપાન? હા, આ બધી સફળતા છે, પરંતુ તેમાં આથી વિશેષ આ પણ છે કે તમે તમારી મનની આરસીમાં તમારી જાતને જૂઓ અને તમે જે કાંઈ સિદ્ધિ હાંસલ કરી છે, તે બદલ ગૌરવ અનુભવો.

શક્ય હતું તે તમામ શ્રેષ્ઠ તમે કર્યું! ઈશ્વરે તમને બક્ષેત્ર જીવન, સ્વતંત્રતા, તકો અને અવસરોના તમે સારા પ્રયોજક બન્યા, તેનું જ્યારે તમને આત્મગૌરવ થાય, તે સૌથી ઉમદા સફળતા છે. તમારા સાથી માનવ બંધુઓનું સન્માન જાળવવાની સાથે, પોતાનું આત્મગૌરવ સ્થાપવામાં સફળતા છે. આ જ કારણસર, જગતમાં સૌથી વધુ પ્રેમ અને સન્માન આવા લોકોને પ્રાપ્ત થયા છે, પછી ભલેને તેમની ભૌતિક સંપત્તિ સાધારણ રહી હોય. આવા લોકો સૌથી વધુ સફળ ગણાયા છે. તેઓ દરિયાવહિલના છે! સાચે જ, તેઓ દિવ્યાત્મા છે! તેઓ સાચે જ, સુંદર જન છે - પછી ભલેને એમની પાસે ફેશન, કારકિર્દી કે વૈભવશાળી જીવનશૈલી ન હોય!

- ડૉ રોબર્ટ શુલર

સફળતાનું રહસ્ય

- “સફળતાનું રહસ્ય શું?” રિફન્ક્સે પૂછ્યું.
- “આગળ ધ્યાવતા રહો”, બટને કહ્યું.
- “ક્યારેય દોરવો નહીં”, પેન્સીલે કહ્યું.
- “પરિશ્રમ કરતા રહો”, બારીએ કહ્યું.
- “હંમેશા મગજ ઠંડુ રાખો”, બરરે કહ્યું.
- “સદા સુસજજ રહો”, પીપે કહ્યું.
- “પ્રકાશિત કરતા રહો”, અજિનએ કહ્યું.
- “બળપૂર્વક કાર્યરત રહો”, હથોડીએ કહ્યું.
- “તમારા તમામ વ્યવહારમાં ધારદાર રહો”, ચાપ્પુએ કહ્યું.
- “સારી વસ્તુ શોધીને અને ચોંટી રહો”, ગુંદરે કહ્યું.

હાર માને તે બીજા!

માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલા પહોંચનારા આરોહક હતા - સર એડમન્ડ હિલેરી. ૧૯૫૭ની રઘુભી મેઅ તેઓ માઉન્ટ એવરેસ્ટ ચઢ્યા. ૨૮,૦૦૦ ફૂટનું સીધું ચઢાણ! માણસની જાગ્રત્તમાં સૌથી ઊંચો પર્વતરાજ! એના પર ચઢાણની અનેરી સિદ્ધિ બદલ એ બિરદાવાયા. આ કારણોસર અમેરીકન એક્સપ્રેસ કાર્ડની જહેરાતોમાં પણ તે ચમક્યા.

પરંતુ જ્યાં સુધી એમનું પુસ્તક ‘ઉન્નત સાહસ’ વાંચીએ નહીં, ત્યાં સુધી એ આવી સફળતાને શી રીતે પામી શક્યા, તે સમજી ન શકીએ.

૧૯૫૨માં એમણે માઉન્ટ એવરેસ્ટ ચઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં ફાવ્યા નહીં. થોડાં અઠવાડિયાં બાદ દુંગલેન્ડના એક સમૂહે એના સત્યો સમક્ષ કશુંક કહેવા એમને બોલાવ્યા. તાણીઓના ગડગડાટ વચ્ચે હિલેરી મંચ સુધી પહોંચ્યા. શ્રોતાગણ એમના આ પ્રયાસને પણ મહાન ગણાવતા હતા, પરંતુ એડમન્ડ હિલેરી પોતાને નિષ્ફળ માનતા હતા.

લાઉડ-સ્પીકરને દૂર હટાવી એ મંચની ધાર સુધી આવ્યા. પોતાની મૂઠી ભીડી એમણે પર્વતરાજના ચિત્ર ભણી ઉગામી. મોટા અવાજે લલકારતા એ બોલ્યા, “માઉન્ટ એવરેસ્ટ, ભલે પહેલા પ્રયાસમાં તે મને હરાવ્યો, પરંતુ બીજા પ્રયાસે તું જોઈ લેજે! કારણ કે તારે તો જેટલા ઊંચા વધવાનું હતું, તે તું વધી ચૂક્યો છું, જ્યારે હું તો હજુ આગળ વધી રહ્યો છું!”

જ્યારે સારા માણસો સાથે

કાંઈક ખોટું ઘટે તો
તેમનું શું થાય?

એ જ... કે તેઓ વધુ સારા માણસો બને!

નિષ્ફળતાના માર્ગની બહાર નીકળો!

સુવિષ્યાત પ્રાધ્યાપકો ગેરી હેમલ અને સી. કે. પ્રહલાદે વાંદરાંના જૂથ સાથે કરાયેલા એક પ્રયોગ વિષે લખ્યું છે.

આર વાંદરાને એક એવા ઓરડામાં પૂરવામાં આવ્યા, જેની વચ્ચોવચ્ચ એક ઊંઘો થાંભલો હતો. એ થાંભલાની ટોચ પર કેળાની લૂમ લટકાવેલી. એક ભૂષ્યા વાંદરાએ કેળું ખાવા થાંભલા પર ચઢવાનું શરૂ કર્યું અને જ્યાં એ પેલી લૂમ પર જાપટ મારે તે પહેલાં જ અના પર હંડા પાણીનો મારો ચલાવાયો. થર થર થર કાંપી ઊઠીને એ તત્કષણ નીચે ઊતરી ગયો અને એણે કેળું ખાવાના પ્રયાસને છોડી દીધો. એકેએક વાંદરાએ ઉપર ચઢી જોયું, પરંતુ એ બધાં પાણીના મારા સાથે નીચે ઊતરી આવ્યાં. આમ અનેક પ્રયત્નો કર્યા બાદ, છેવટે એમણે ઉપર ચઢવાનું જ છોડી દીધું.

પછી પ્રયોગવીરોએ તે ઓરડામાંથી એક વાંદરાને ખસેડી અના સ્થાને એક નવા વાંદરાને મૂક્યો. આ નવાંગતુકે થાંભલા પર ચઢવાનું શરૂ કર્યું કે તરત જ બીજા ત્રણોએ અના પર હુમલો કરી અને નીચે ખેંચીને ભોય પર પટક્યો. તેમ છતાંય એણે વારંવાર પ્રયત્ન ચાલુ રાખ્યો, પરંતુ દરેક વખતે એની એ જ ગતિ થવાને કારણે અંતે એણે પણ થાંભલા પર ચઢવાનું છોડી દીધું.

ધીરેધીરે એકેક કરીને બધાં વાંદરાં બદલાઈ ગયાં અને દરેક વખતે જ્યારે નવો વાંદરો આવતો, ત્યારે એને ખેંચીને નીચે પટકવાની ઘટના દોહરાતી. થોડા જ વખતમાં ઓરડો એવાં વાંદરાંથી ભરાઈ ગયો, જે મણે પાણીનો મારો વેઠચો નહોતો. એમાંનું કોઈ થાંભલા પર ચઢવા જ તૈયાર નહોતું, પણ કોઈ જાણાંનું નહોતું કે શા માટે?

કમભાગ્યે, જે લોકો નિષ્ફળતાથી ટેવાઈ ગયા છે, તેઓમાંના ઘણા આ વાંદરાં જેવા હોઈ શકે. તેઓ વારંવાર એક જ ભૂલ બેવડાવ્યા કરે છે, પરંતુ તેના કારણ વિષે એમને નિશ્ચિત ખબર નથી. પરિણામે તેઓ નિષ્ફળતાને કયારેય અંતિમ તીલાંજલિ આપી નિષ્ફળતાના માર્ગની બહાર નીકળી શકતા નથી.

આ પુરાણી કહેવત સાચી છે કે...
હંમેશા જે કરતાં આવ્યા છો, તે જ કરતાં રહો તો,
સદા જે પામતા રહ્યા છો, તે જ પામતાં રહેશો!

સર્કળતા

કોઈની પ્રશંસાના બે બોલ કહેવા, એ છે સફળતા,

અન્યના કાર્યને પ્રોત્સાહિત કરવામાં

અને કોઈ પણ કાર્ય કે આયોજન

ઉત્તમ પ્રકારે કરી ધૂટવામાં છે સફળતા!

તમારી વાણી કોઈને દૂભવે ત્યારે મૌન સેવવું,

તમારા પાડોશીની તોછડાઈ સામે વિનભ રહેવું,

વહેતી નિદાઓ સામે દુર્લક્ષ અને

બીજાના દુઃખો પ્રત્યે સહાનુભૂતિ, એ છે સફળતા!

કર્તવ્ય પોકારે ત્યારે વજાદારી

આપત્તિ ટાણે હિંમત દાખવવી,

કેમે કર્યો સમય જાય નહીં, ત્યારે ધીરજ,

વિનોદ-હાસ્યમાં અને ગીતમાં જડેલી છે સફળતા.

મને દુનિયા જે આપે છે,

માન-આદર, પ્રશંસા કે સુવર્ણ, એમાં એ નથી,

એ તો છે, જગતને હું જે આપું છું તેમાં

જેથી બીજા કાંઈક બની શકે.

જીવનમાં મારા કૃત્ય દ્વારા

કોઈ જીવમાં પ્રાણ કૂંકી શકું,

તો પ્રશસ્તિ કે સુવર્ણ દ્વારા જે ન થઈ શકે

તે હું સિદ્ધ કરી શકું.

સરળ શબ્દમાં એક સરળ વિચાર

જન્મ આપે એક મહાન,

અને જો એ વિચાર હોય મારા થકી

કૃતાર્થ જીવન હું જીવી શક્યો!

- રીચાર્ડ એન્ફ. વુલ્ફ



મન ભરીને હસવું અને હસવું વારંવાર...

જુતવો બુદ્ધિવાનોનો આદર

અને બાળકોનો પ્રેમ અપાર...

નિખાલસ વિવેચકોની

પ્રશંસા મેળવવી...

અને દગ્ગાબાજ મિત્રોનો

દ્રોહ પચાવવો...

સુન્દરતાની કદર કરવી...

કોઈક સ્વસ્થ બાળ કે લીલા બાગ

કે

કાંઈક સામાજિક સુધારો કરી

દુનિયાને થોડીક પણ બહેતર બનાવી

અલવિદા કહેવું...

તમારા જીવન થકી

કોઈક એકાદ જીવનને પણ

જીવવા યોગ્ય બનાવી શકાયું...

આ બધામાં જ રહેલી છે

જીવનની સાચી સફળતા

- રાખુ વાલો ઇમર્સન

કરચલાથી દૂર રહો!

રોજના હજારો કરચલા પકડવામાં આવે છે કારણ એમની પાસે પણ માણસજાતની કેટલીક લાક્ષણિકતા છે. એમને પકડવા માટે ઉપર કાણવાનું તારનું એક પાંજરું હોય છે. પાંજરામાં કરચલા લલચાવવા કાંઈક ખાવાનું મૂકાય છે અને પછી તે પાણીમાં ઉતારાય છે. એક કરચલો આવીને પાંજરામાં દાખલ થાય છે અને બચ-બચ-બચ ખાવા માંડે છે, ત્યાં બીજો આવે છે અને પછી ત્રીજો...

છેવટે ખાવાનું તો બધું પૂરું થઈ જાય છે અને કરચલા ધારે તો પાંજરાની બાજુ પરથી ઉપર ચઢી કાણામાંથી બહાર જઈ શકે, પરંતુ એવું તેઓ કરતા નથી. એ પાંજરામાં જ રહી પડે છે. ખાવાનું ખલાસ થઈ ગયા પછી પણ બીજા કરચલા પાંજરામાં આવતા રહે છે.

જો કોઈ એકાદા કરચલાને થાય કે હવે આ પાંજરામાં વધારે રહેવાને કાંઈ કારણ નથી અને એ બહાર નીકળવા મથે તો બીજા કરચલા એના પર તૂટી પડી એને રોકે છે. એ બધા એને જેંચીને પાંજરા તરફ રાખે છે. તેમ છતાંય જો એ મથામજા ચાલુ રાખે તો બીજા બધા એના પંજા તોડી નાંખે છે, જેથી એ ઉપર ચઢી ન શકે. હજુ પણ જો એ છટકવાનો પ્રયાસ ન છોડે તો બધા ભેગા મળી એને મારી નાંખે છે.

બહુમતીના જોરે બધા કરચલા પાંજરામાં એક સાથે રહે છે. પછી તો પાંજરું ઉપર જેંચી લેવાય છે અને બધા કરચલાં રંધાઈ જાય છે અને કાંઠા પર કરચલાના ભોજનની મિજબાની થાય છે.

આ કરચલા અને માણસજાતમાં મુખ્ય ફરક એટલો જ છે કે એ પાણીમાં રહે છે અને માણસો જમીન પર. માનવ-કરચલા મોટા ભાગે ભૌતિક શક્તિનો ઉપયોગ નથી કરતા, છતાંય તેનાથી સાવ બાકાત છે તેવું પણ નથી જ. પરંતુ મોટા ભાગે તેમને એવી જરૂર નથી પડતી. એમની પાસે બીજી, વધારે અસરકારક પદ્ધતિઓ છે. જેવી કે, વકોડિત, શંકાકુશંકા, હાયાસ્પદતા, ઉપહાસ, મજાક-મશકરી, વંગ, ઠપકો, કટાક્ષ, કોઈને હલકા પાડવાં, માહું લગાડવું, મહેણાં-ટોણાં મારવા, ચીડવવું, જૂહું બોલવું વગરે. આવી તો બીજી અનેક રીતો છે, જેનો શબ્દકોશમાં પણ સમાવેશ નથી.

જીવનમાં જો સફળતા મેળવવા ચાહતા હો, તો આવા કરચલા અને આવી કરચલાની માનસિકતાથી દૂર રહો!

જબ્યા જીતવા માટે, જીવ્યા ગુમાવવા માટે!

મરધીનાં બચ્યાંના માળામાં ગરુડનું એક હંડુ મૂકી દેવામાં આવ્યું. સેવાઈને હંડુ ફૂટથ્યું અને ગરુડનું નાનકડું બચ્યું પોતાને મરધી સમજ્ઞને જ મોટું થવા લાગ્યું. બીજાં બચ્યાં જેમ કરે તેમ એ પણ કરતું. વધારે ઊંઘું તે ઉડી શકતું નહોતું, કારણ કે મરધીનાં બચ્યાંની ત્રેવડ એટલી જ હોય છે.

એક દિવસ ઓઝો આકાશમાં ગરુડને ભવ્યતાપૂર્વક સડસડાટ ઊચે ઉડતાં જોઈ, મરધીનાં બચ્યાંને પૂછ્યું. “પેલું સુંદર પંખી કયું છે?” ત્યારે જવાબ મળ્યો કે “એ ગરુડ છે. પરંતુ તું એના જેવું ઉડી ન શકે, કારણ કે તું તો મરધીનું બચ્યું જ છે!” ત્યારબાદ ગરુડના બચ્યાને જે કહેવાયું હતું તે તેણે સાચું માની લીધું. પોતાની જાતની સાચી ઓળખ ન થવાને કારણે માત્ર મરધી બનીને એ જીવું અને મર્યાદ. કેવી વ્યર્થતા! એ જન્મયું હતું જીતવા, પણ તેના જીવતરે એને જબરદસ્ત હાર આપી.

આપડામાંના ઘડા ખરા લોકો માટે આ જ વાત સાચી છે. આપડી પોતાની સાચી ઓળખ નહીં હોવાના કારણો આપણે ઉત્તમતા સિદ્ધ નથી કરી શકતા. ગરુડની જેમ ઉડવું હોય તો ગરુડની રીત-રૂસમ જ અપનાવવી પડે!

તમે જીવનમાં સફળતાનાં પગથિયાં ચઢવા માંડો છો, ત્યારે એવા કૃદ્ર લોકો પણ હશે જે તમને તોડવા, તમને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશો. પરંતુ જો તમે એમની અવગાણના કરો તો તમે જતી જશો. બેકાર હલકા લોકો સામે લડવા તમારે એમના સ્તરે નીચે ઉત્તરવું પડે છે! એ લોકો આ જ વાત છાયે છે. કારણ કે તો જ તમે એમનામાંના એક બની જાઓ છો! એટલે નકામા લોકો તમને નીચે ખેંચી જઈ શકે, તેવું ન થવા દેશો.

જો તમે સફળ લોકો સાથે જોડાશો તો તેમનામાંના એક થશો. વિધાયક ચિંતકો સાથે જોડાશો, તો તેમનામાંના એક ગણાશો. જો તમે હલકા લોકો સાથે જોડાશો, તો તેમનામાંના એક ઠરશો.

આટલું ધ્યાનમાં રાખો કે માણસની ઓળખ માત્ર એના સોબતીઓથી જ થાય છે એવું નથી, બલ્કે, જે સોબતથી એ દૂર રહેવા માંગે છે તે પરથી પણ થાય છે.

સ્વ-સંચાલન માટે રચનાત્મક તનાવ!

સર્વસાધારણ રીતે એમ મનાય છે કે માનસિક તનાવ સારો નથી પરંતુ હકીકતે એવું નથી. તાણ વગર તમે કશું ન કરી શકો. શાંતિ અને મૌન છથ્થનીય છે. હકીકતમાં, તો રોજ ધ્યાન માટે સમય કાઢવો એ અત્યંત જરૂરી પણ છે.

પરંતુ વચ્ચે વચ્ચે વિધાયક તાણવાળા થોડા ગાળા આવવા જોઈએ, નહીંતર તમે પ્રમાણી બની શકો. ઘડિયાળના યંત્રમાં તાણ હોય છે તેને કારણે જ ઘડિયાળ ચાલે છે.

કામનો વિધાયક બોજો ઘણાં રૂપ લઈ શકે. કામ પૂરું કરવાની કોઈ એક નિષ્ઠિત તારીખ નક્કી થવી જોઈએ, તમારા કામની પરીક્ષા થશે તેનું ભાન રહેવું જોઈએ, બીજા સાથે હરિફાઈની ભાવના પણ રાખવાની જરૂર છે. પરિસ્થિતિનાં આ બધાં દબાણો, માણસમાં જે શ્રેષ્ઠ છે તે પ્રગટ કરે છે અને સમયનો સર્વોત્તમ સદૃપ્યોગ થાય તે માટે પડકારતા રહે છે.

તમારી નીચે કામ કરનારા લોકો સાથેના સંબંધમાં, ચોક્કસ પ્રમાણમાં રચનાત્મક તાણ અને દબાણ રાખવાં એ સારા વ્યવસ્થાપનનું એક લક્ષ્યણ મનાય છે. કોઈ પરિણામ લાવવા માટે, પોતાના પર પણ થોડો બોજો પડે તેવા ઉપાયો શોધવા એ સારા સંચાલનનું લક્ષ્યણ છે. પહેલેથી એ કામ કરતાં આવ્યા હો, તેમ છતાંય એ કામની જાહેર જવાબદારી લેવી, એ પોતાના પર સાચું દબાણ લાવવાની એક રીત છે.

અલબીત, નકારાત્મક તનાવ યોગ્ય નથી. એનાથી નુકશાનકારક તાણ ઊભી થાય છે. માથાનો દુંખાવો અને તાણ સાથે જોડાયેલા બીજા ઉપદ્રવો એ સમય સંચાલનની ખરાબ પદ્ધતિઓને કારણે પેદા થતી હતાશાની લાગણીનાં પરિણામો છે. અનિર્ણિત મનોદશા, એકાશતાનો અભાવ, મ્યાથમિકતા નક્કી કરી ન શકવી, પૂર્વયોજન ન કરવું, યોગ્ય પ્રતિનિધિત્વ કરાવી શકવામાં નિષ્ફળતા, કોઈની ડખલગીરી ન થાય અને જેમાં તમે સૌથી વધારે મહત્વનાં કામો કરી શકો તેવા શાંત ગાળાના પૂર્વયોજનનો અભાવ, જેવા નકારાત્મક દબાણોને તો કોઈ પણ કિંમતે દૂર કરવા જોઈએ.

- એડવીન સી. બ્લિસ

આગળ વધવા માટેની નિષ્ફળતા!

હાર કાંઈ એટલી ભૂરી નથી, જો તે હદ્ય પર ચઢી ન બેસે તો!

જુન પણ બરાબર છે, જો એ મગજની રાઈ બની ન આય તો!

સફળતાનો અર્થ એ તો નથી ને કે નિષ્ફળતાથી બચતાં રહેવું? હરગીજ નહીં! આપણે સૌ નિષ્ફળ થતાં રહીએ છીએ. પ્રવાસ કરીએ ત્યારે આપણે સૌ ખાડામાં અથડાઈએ છીએ, ખોટા વળાંકો લઈએ છીએ અથવા તો રેડિએટર તપાસવાનું ભૂલી જઈએ છીએ. એ જ માણસ નિષ્ફળતાને સંદર્ભ દૂર રાખી શકે જે પોતાના ઘરની બહાર જ નીકળતો નથી.

એટલે હાર ખાવી તે મૂળ મુદ્દો નથી. મુદ્દો એ છે કે સફળતાપૂર્વક હારવું છે કે નિષ્ફળતા તમને કાયમનો દેશવટો આપી દે તેવું કરવું છે? સફળતાપૂર્વક હારવું એટલે હારમાંથી પણ નહો તારવવો! નેલ્સન બોસવેલ કહે છે તેમ “મહાનતા અને સર્વસાધારણતા વચ્ચે ફરક એમાં જ પડી જાય છે કે માણસ ભૂલોને કેવી રીતે મૂલવે છે.” તમારે જો સફળતાની વાટે આગળ વધવું હોય તો હાર ખાઈને પણ આગળ વધતાં શીખવું જોઈએ. લાંબો કૂદકો મારતાં પહેલાં આપણે બે ડગલાં પાછળ હટતાં નથી?

નિષ્ફળ નીવડેલા માણસો ઘડીવાર હારથી એવા ડરી જાય છે કે તેઓ જીવનભર જોખમોથી દૂર રહે છે અને હાર ખવડાવે તેવા નિર્ઝયો કરતા જ નથી! તેઓ એટલું પણ સમજતાં નથી કે સફળતાનો આધાર તો હાર ખમવાની, અને ફરી-ફરી મથતા રહેવાની શક્તિ પર નિર્ભર છે. જો તમારું વલણ સાચું હોય તો, નિષ્ફળતા કદી ઘાતક કે અંતિમ નથી હોતી. હકીકતે તો એ સફળતા માટેનું લચીલું પાટિયું બની શકે.

સફળ વ્યક્તિઓ નિષ્ફળતાના નકારાત્મક પરિણામો પર અટકી જવાને બદલે, ‘કિન્તુ-પરંતુ’ અને ‘જો-તો’ ના વિચારમાં ખોવાઈ જવાને બદલે સફળતાનાં પરિણામો તરફ ધ્યાન આપે છે. પોતાની ભૂલોમાંથી બોધપાઠ લઈને પોતાની જાતને અને પરિસ્થિતિઓને સુધારવાનું વિચારે છે!

જીવનમાં નિષ્ફળતા તમારો પગ ખેંચીને તમને નીચે પદ્ધાડશે કે તમારી વિજયયાત્રામાં સફળતા અપાવશો, તેનો આધાર તમારા મનોવલણ પર છે.

- જહોન સી. મેક્સવેલ

સફળતા અનુભવતાં

સજાગ પ્રયત્ન દ્વારા, તમે તમારા મનમાં કોઈ ઘટનાને વિગતવાર બનતી સક્રિયપણે કલ્પી શકો છો અને પછી ધીરેધીરે તમારા સ્મૃતિ-ભંડારમાં એ અમીટપણે અંકાઈ જાય છે.

તમારે જેની તાતી જરૂર છે તેવી સફળતા કદાચ તમને રોજેરોજના પ્રત્યક્ષ અનુભવો દ્વારા ન પણ મળે. તમે સફળતાને અનુભવવા માંગો છો, તો કૃતિમ-પરોક્ષ અનુભવ દ્વારા પણ તમે સરળતાથી સફળતા અનુભવી શકો.

વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે કે તમારું મગજ વાસ્તવિક જીવનના પ્રત્યક્ષ અનુભવ અને કાલ્યનિક ક્ષેત્રના ‘કૃતિમ’ કે ‘બનાવટી’ અનુભવ વચ્ચે ભેદ પાડી શકતું નથી. બંને પરિસ્થિતિઓમાં તમારા સ્મૃતિકોશમાં તમે નવી માહિતી ભરો છો. કોમ્પ્યુટરમાં જે રીતે તમી પ્રોગ્રામ ભરાય છે, તેવું જ કાંઈક આમાં થાય છે. સર્જનાત્મક કલ્પના એ પ્રાથમિક સાધન છે, જેનો ઉપયોગ જીવનવિકાસ માટે કરવાનો હોય છે.

‘રીસર્ચ કવોર્ટર્લી’માં નોંધાયેલા એક અહેવાલ મુજબ, બાસ્કેટબોલની રમતમાં માનસિક કલ્પનાશક્તિનો આધાર લઈ સ્કોરનો આંક વધારી શકાયો હતો. ઉચ્ચ વિદ્યાલયના સમકક્ષ કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને ત્રણ જૂથમાં વહેંચી દેવાયા.

1. પહેલું જૂથ : એમને રોજ વીસ મિનિટ માટે, સતત વીસ દિવસ સુધી જિભેશિયમમાં આવી છૂટા દડા નાખવાનો મહાવરો કરવાનું કહેવાયું.
2. બીજું જૂથ : એમને વીસ દિવસ સુધી છૂટા દડા નાંખવાનો અભ્યાસ ન કરવાનું કહેવામાં આવ્યું.
3. ત્રીજું જૂથ : આના સભ્યોને રોજ વીસ મિનિટ માટે, વીસ દિવસ સુધી મનોમન, કલ્પનાશક્તિ દ્વારા છૂટા દડા નાંખવાનું કહેવામાં આવ્યું. તેમણે એવી કલ્પના કરવાની હતી કે દરેક શૉટ સાથે એ ‘પરફેક્ટ બાસ્કેટ’ નાંખી રવા છે.

પહેલા અને છેલ્લા દિવસે લેવાયેલી કસોટીના આધારે, પહેલા જૂથે ૨૪ ટકાનો સુધારો કર્યો, બીજા જૂથે કોઈ સુધારો ના નોંધાવ્યો અને ત્રીજા જૂથે ૨૩ ટકાનો સુધારો દર્શાવ્યો.

હવે તો નવી શોધ પણ થઈ છે કે તમારા અજ્ઞાત મનમાં અમુક ધારણાઓ દૃઢ થઈ ગઈ હોય, તો તેને બદલવા માટે આવા કાલ્યનિક અનુભવોના પ્રયોગો હેતુપૂર્ણ અને અસરકારક બની શકે. જીવનના કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ પ્રવૃત્તિમાં આ તકનીક તમારી રજૂઆતમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે, પછી એ જાહેર વક્તૃત્વ હોય કે ટેનિસ રમવાની વાત હોય!

રમતવીરો, અવકાશયાત્રીઓ અને વિવિધ ક્ષેત્રના તમામ સાહસવીરો હવે તો પોતાની એકાગ્રતા અને પ્રસ્તુતિ સુધારવા માટે પ્રત્યક્ષ રજૂઆત કરતાં અગાઉ પોતપોતાના મનમાં એનો પૂર્વપ્રયોગ કરી લે છે. પછી ઘરાંગણાની રમત હોય કે ચંદ્ર પર ઉત્તરવાની વાત હોય! ભય રજૂઆત પહેલાનો આ એક માનસિક કાલ્યનિક પૂર્વપ્રયોગ છે, જેનાથી આત્મવિશ્વાસ અને સંયોજનકળા વિકસી શકે છે.

અભ્યાસનું તારણ આ પણ છે કે કાલ્યનિક અને વાસ્તવિક કાર્યસિદ્ધ વચ્ચે સીધો ભૌતિક સંબંધ પણ છે. માણસ જ્યારે પોતાની પ્રવૃત્તિના કાલ્યનિક ચિત્રો નિહાળે છે ત્યારે જ્ઞાનતંત્રાંઓની ગતિવિધિને આખા શરીરમાંથી પસાર થતી માપી શકાય છે. બીજા શરીરમાં કહેવું હોય તો, પ્રત્યક્ષ પ્રસ્તુતિકરણ વખતે મગજના જ્ઞાનકોષોનો જે પ્રભાવ આવેખાય છે, તેવો જે આવેખ મનોમનના કાલ્યનિક નિર્દર્શન વખતે પણ અંકિત થતો જોવા મળે છે.

પોતાના ભવિષ્યને આવી સ્પષ્ટતાપૂર્વક સંકિય કલ્યનાશક્તિ દ્વારા જોવાની ક્ષમતા એ મનની મહાન અજ્ઞાયબી છે! તમારા બાળપણના ઘણા અનુભવો આદર્શથી ઉણા ઉત્તરનારા હતા. મુશ્કેલી આ વાતની છે કે તમે જીવનમાં સફળતા કરતાં નિષ્ફળતાનો અનુભવ જ વધારે કર્યો છે, અને હવે આ બનાવો તમને પાછળ જેંચ્યતા રહે છે. પરંતુ આ બધાની કોઈ ફિકર કરવાની જરૂર નથી.

આ નવી તકનીક દ્વારા, તમારા અનુભવને તમે સફળતાની દિશામાં લઈ જઈ શકો. હવે તમારા ભૂતકાળની કોઈ નકારાત્મક અસરો પોતાનો પ્રભાવ કારગર સિદ્ધ નહીં કરી શકે. નકલી અનુભવો દ્વારા તમારા પર અંકુશ સ્વયાપાય છે અને તમે જ્યારે તમારા વિચારોને હવાલે હો છો ત્યારે તમારું વર્તન તમારા અંકુશમાં હોય છે. તમારી વર્તમાન પ્રસ્તુતિ અને તમારી મૂળભૂત ક્ષમતા વચ્ચેના મોટા ખાડા વચ્ચે સેતુ બાંધવામાં એ મદદગાર થાય છે.

- ડૉ. વોલ્ટર સ્ટેપલ્સ

સુખનું જરાણ

કઢી ભૂલશો નહીં

કે

તમારી સંમતિની મછોર ક
લાગો

ત્વાં સુધી

કઢી ઠોર્ઝ તમને
દુઃખી બનાવી ન શકે!





સુખનું ઝરાય়

સુખનું ઘર
યાત્રામાં છે,
મુઠામમાં નહીં!

સુખનું મૂળુર્ત
આજે જ છે,
અબતી હાલે નહીં!

સુખ યાત્રામાં છે... મંજિલમાં નહીં!

ઘણા લોકોને મન સુખ એટલે કોઈ નિર્દિષ્ટ મંજિલ છે! કેમ જાણો હજુ હવે, ભવિષ્યમાં આવનારી એ ચીજ છે. કશુંક જાણો બનવાનું છે. આવા અભાગી લોકો માટે કેમ જાણો મેઘધનુષ્યના છેવાડે સોનાનું પાત્ર રખાયું ન હોય! આ લોકો મેઘધનુષ્યની શોધમાં જીવન આખું ખર્ચી કાઢે છે. માણસ જે રીતે પોતાના પડછાયા પાછળ ભટકતો રહે અને કયારેય કશું હાંસલ ન કરી શકે. કારણ એ જે શોધે છે, તે તો અની ભીતર જ વસે છે.

જેણો પોતાની સાચી ઓળખ મેળવી હોય, તે જ માણસ સુખી છે. એ માણસ સુખી છે, જે પરમાત્માને જાણો છે. સુખી એ છે, જેનામાં ઉન્નત અને ઉમદા આકાંક્ષાઓ છે! જગતમાં જે વધુને વધુ ઊંચે ચઢતો જાય છે, તે જ છે સાચો સુખી. પોતાની આસપાસના લોકોને સુખી બનાવનાર માણસ સુખી છે. જે આ જગતને વધારે રહેવા લાયક બનાવી જાણો છે તે સુખી છે. જેનાં કામ, જેની દિનચર્યા જેની તમામ પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રેમ છે, જે પ્રેમતત્વને ચાહે છે, જિંદગીને ચાહે છે, તે સુખી છે. જે સ્વયં સુખી છે, એ જ સાચો સુખી છે!

સુખ પ્રત્યેક દિનમાં છે. આ કાણમાં એ વસે છે. સુખ મંજિલમાં નહીં, યાત્રામાં રહેલું છે!

સુખ એ મનની એક સ્થિતિ છે. આપણી આસપાસના ભौતિક પદાર્થોમાં એ શોધ્યું નહીં જડે. સંપત્તિ-પ્રતિષ્ઠા કે પદમાં સુખ છે જ નહીં. જે લોકો જરૂર કરતાં વધારે ધન ભેગું કરવા આખી જિંદગી કાઢી નાખે છે, તેઓ ભ્રમિત અને હતાશ માણસો છે. એમને જ્યારે સમજાય છે કે જીવનમાં પૈસો સુખનું કણ પણ ખરીદી નહીં શકે, ત્યારે તો ઘણું મોદું થઈ ગયું હોય છે!

અત્યારે આપણી પાસે જે કાંઈ છે તેના વિષે સંતોષ અને કદરદાનીનો ઉદ્ગાર એ જ સુખ છે. સુખ વર્તમાનમાં છે. સુખ પ્રત્યક્ષ ક્ષણમાં છે. પ્રત્યેક નવું પરોઠ નવા ઉજ્જવળ દિવસની જાહેરાત કરે છે, જેમાં આપણે પ્રેમ, સંતોષ, ઉલ્લાસ અને નિઃસ્વાર્થ સેવાની આપ-લે કરી શકીએ!

- અધ્યાત્મ લિંકન

સુખી ભવ!

આપણી ભાષામાં આ બે શબ્દો સૌથી વધુ શક્તિશાળી છે.

નિરાશાથી એવી માનસિકતા નિર્માણ થાય છે, જે રચનાત્મક વિચારના પ્રવાહને રૂંધી મૂકે છે. તમે જ્યારે નિરાશા અને શોકના સાગરમાં દૂબી ગયા હતા તે ગાળાને યાદ કરો. ત્યારે કશુંક મહાન કરવાની પ્રેરણા હતી? તમારી સમૃદ્ધિમાં વધારો કરી શકે એવો કોઈ નવો વિચાર ત્યારે તમને સૂજયો હતો? નવી કેડીઓ પાડવાની મહત્વાકાંક્ષા જાગી હતી? આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે - જ નહીં!

એ દિવસો યાદ કરો જ્યારે પ્રચંડ શક્તિ ઉભરાતી હતી અને તમારી હસ્તીનું પ્રત્યેક કણ આનંદ-ઉલ્લાસથી થનગનતું હતું. ત્યારે વિવિધ સ્થળો જઈ અને કાંઈક અવનવું કરવાની ઉત્કંઠા અંદરથી નહોતી આવતી? એ ઘડીએ સામાન્યતઃ જે યોજનાઓ પાર પાડવી ભગીરથ લાગે ત્યારે એની જાણો કશી વિસાત જ નહોતી!

સુખી થાઓ! તમારે કાંઈ સમયાઓ હોય (અને કોને એ નથી હોતી?) તો ય સુખ અનુભવો કે તમને મળેલા જ્ઞાન વડે તમે એને ઉકેલી લેશો. એ પ્રશ્નોને તમારા માથા પર ચઢી જવા નહીં દો.

ધર્શીવાર આપણને સાંભળવા મળે છે કે - ‘બાપ રે! આટઆટલી ઉપાધિઓમાં હું સુખી કેવી રીતે રહી શકું?’ નિરાશા અને ઉદ્બેગ તો તમારી મુક્તિનો રસ્તો જ બંધ કરી દેશે. એના કરતાં સુખ મેળવવાના ઉપાયો શોધવામાં શક્તિ લગાડવી બહેતર નથી?

છાંપું વાંચો એમાં તમારી આસપાસના લોકોની અસંખ્ય કહાણીઓ મળશો, જે મણે તમારી પરિસ્થિતિમાં સુખ પ્રાપ્ત કર્યું છે. એ વાંચીને તમને થશો કે તમારી સ્થિતિ તો ધંધી સારી છે! પછી તમને સુખનો પ્રકાશ ફેલાવવાનું અધરું નહીં લાગે, જેથી વિકટ પ્રશ્નો તમારો વિકાસ રૂંધી શકે તે પહેલાં જ તમે તેના પરનો અંકુશ મેળવી શકો!

હેરોલ્ડ એબોટની આ કઢીઓ યાદ રાખવા જેવી છે...

“પગમાં જૂતાં નહોતાં, તેથી હું ખુબ દુઃખી હતો,

જ્યાં સુધી શેરીમાં, કોઈ અપંગને મેં જોયો નહોતો!

- બેન સ્વીટલેન્ડ

સ્રિમત જાય સર્વત્ર!

સ્રિમત ચીજ છે એવી ચિત્ર-વિચિત્ર,
તમારા ચહેરા પર લઈ આવે કરચલી....
અને સંતાવાની અની ભાગ ન મળે,
એમ ગુપ્ત-ચુપ્ત જાય એ ચાલી!

પણ આથીય વધુ અદ્ભૂત તો એ છે,
સ્રિમત શું શું એવું કરી શકે...
કોઈ સામે સ્રિમત રેલાવો, સામું એ પણ રેલાવે,
આમ એક સ્રિમત, બે સ્રિમત સર્જી શકે!

તમારા સ્રિમતથી પ્રેરાઈ, એ અન્યને પણ આપે સ્રિમત,
અને પછી પેલો પણ સ્રિમત સામું પાછું વાળે....
અને પછી તો હિસાબ માંડી ન શકાય,
તેટલા સ્રિમતોનો ગુણાકાર થાય ભારે!

કરે ચિંતાગ્રસ્તોના હૃદય ઉલ્લાસિત,
છે સ્રિમતનાં એવાં સુંદર કામ....
તો ચાલો સ્રિમતને રેલાવતાં રહીએ,
સ્રિમત જાય સર્વત્ર, ન ભૂલીએ એનું નામ!

- ડાલાસ મેલોક

હાસ્ય તો જિંદગીની રોટી પરનો મુરબ્બો છે.
એ ઉમેરે છે એવો વિશિષ્ટ સ્વાદ,
રોટીને શુષ્ફ થતી અટકાવે છે, અને
ગાળે ઉત્તારવામાં તેને સહજ બનાવે છે!

- ડાયન જહોન્સન

આપણો કેટલા ગરીબ છીએ!

એક દિવસ એક ઘનવાન પિતા પોતાના પુત્રને ગામડાના પ્રવાસે લઈ ગયો. ગરીબી કોને કહેવાય એ તેના છોકરાને દેખાડવાનો અનો ઈરાદો હતો.

ગામડામાં એક અત્યંત ગરીબ કુટુંબના ખેતરમાં એમણે દિવસ અને રાત ગાળ્યા. પ્રવાસેથી પાછા ફર્યા તારે બાપે દીકરાને પૂછ્યું, ‘બેટા, પ્રવાસ કેવો રહ્યો?’

“બહુ સરસ, પણ્ણા” છોકરાએ જવાબ વાળ્યો.

“તો જોયું ને કે લોકો કેટલા ગરીબ હોય છે?”

“હા, પણ્ણા!”

“તો તું શું શીખ્યો?” પિતાએ પૂછ્યું.

દીકરો બોલ્યો, “મેં જોયું કે આપણા ઘરે એક કૂતરો છે, અને તેમની પાસે ચાર. આપણો સ્વિમિંગ પૂલ સો મીટર લાંબો છે, જ્યારે તેમના ઝરણાને તો કોઈ અંત જ નથી. આપણા બજીચામાં પચાસ ઈભોર્ટડ લેમ્પ છે, ત્યારે એમની પાસે તો અગણિત ચમકતા સિતારા છે. આપણી અગાશી આગળના આંગણા સુધી પહોંચે છે, જ્યારે એમની પાસે તો સમસ્ત ક્ષિતિજ છે!”

છોકરાએ પૂરું કર્યું ત્યારે એના પિતા અવાકુ બની ગયા.

એના દીકરાએ વાત સમેટી, “પણ્ણા, તમારો હાર્દિક આભાર! આપણો કેટલા ગરીબ છીએ તે દેખાડવા બદલ!”

પૈસો ભોજન ખરીદી શકે... પણ ભૂખ નહીં!

દવા... પણ સ્વાસ્થ્ય નહીં!

પથારી... પણ નિત્રા નહીં!

ઓળખાણો... પણ મિત્રો નહીં!

નોકરો... પણ વર્ણાદારી નહીં!

મોજમજા... પણ શાંતિ કે સુખ નહીં!

લોભ ન જાણો ઓભ!

એક માલદાર ખેડૂતની વાત છે, જેની સમક્ષ દરખાસ્ત મૂકાઈ કે આજા દિવસમાં એ જેટલી જમીન પર ચાલી શકે, તે બધી જમીન એની! પણ શરત એટલી કે સાંચે સૂરજ દૂબે ત્યારે પોતાના પ્રારંભિક સ્થળે એ પાછો પહોંચ્યો ગયો હોવો જોઈએ. બીજી સવારે વહેલા નીકળી ખેડૂતે ઝડપભેર ચાલવાનું શરૂ કરી દીધું, કારણ કે એ વધારેમાં વધારે જમીન મેળવવા ઈચ્છા હતો. થાકીને લોથપોથ થઈ ગયો હોવા છતાં આખી બપોર ઓણે ચાલવાનું ચાલુ રાખ્યું, કારણ કે મબલખ ધન બેગું કરવા મળેલી જીવનની આ એક અનેરી તક એ ગુમાવવા માંગતો નહોતો!

મોડી બપોર પછી એને ભાન થયું કે સૂરજ આથમે તે પહેલાં પ્રારંભના સ્થાને પહોંચ્યો જવાની શરત રાખવામાં આવી હતી, પરંતુ એની લોભવૃત્તિ એને ખૂબ દૂર લઈ ગઈ હતી. ઓણે ઝડપભેર વળતી યાત્રા શરૂ કરી. એની નજર સતત સૂરજ ભણી હતી. જેમ જેમ સૂરજ ક્ષિતિજમાં દૂબતો ચાલ્યો, ગાંડોતૂર બનીને હાંફતો હાંફતો એ દોડવા લાગ્યો. હાંફ ચરી જવાને કારણે એ ઢગલો થઈ ગયો અને પછી તો સહનશક્તિની માજા ઓંણગી ગયો. શરૂઆતના સ્થળે પહોંચ્યો એ ઢગલો થઈને નીચે પટકાયો અને અતિશ્રમને કારણે અવસાન પામ્યો. સૂરજ દૂબે તે પહેલાં એ પાછો તો આવી ગયો, પરંતુ એનો કાઈ અર્થ ન રહ્યો. પછી એની દફનવિધિ થઈ અને એ માટે એને જમીનના માત્ર નાનકડા ટૂકડાની જરૂર પડી!

આ કથા એ પાઠ શીખવે છે કે જીવનમાં વધારે પડતો લોભ આપણાને ક્યાં પહોંચાડી દે છે! પેસા પાછળ ગાંડાતૂર થઈને તમે પડવા હશો, તો અને તમે ક્યારેય માણી નહીં શકો!

દુનિયામાં એટલું બધું પડ્યું છે આપણા માટે,

માત્ર એને પરખવાની નજર જોઈએ...

ચાહવા માટે હદ્ય જોઈએ...

અને આતે પ્રાપ્ત કરવા માટે બે હાથ જોઈએ!

- વ્યૂસી માંડ મોન્ટગોમેરી

મનની શાંતિ તાજે...

માણસોની હોજરીમાં ચાંદા પડે છે...
એમણે જે ખાંધું તેના કારણો નહીં,
પરંતુ, જે એમને ખાતું રહ્યું... તેના કારણો!

માણસ પાસે ઘર, ધનવૈભવ, પ્રસન્ન પરિવાર હોય, તેમ છતાં આ બધી ચીજો એને ફિક્કી લાગે, કારણ કે જીવનની દોડમાં એના અન્ય સ્પર્ધાઓએ એને વિજયરેખાથી દૂર રાખ્યો હોય. એની જરૂરિયાત પૂરી થાય તે માટે એની પાસે બધું હોવા છતાં બીજા લોકો પાસે તેથી પણ વધુ છે તે એને સંતાપે છે, એનું પોતાનું સત્ત્વ હણે છે અને એની સાચી સિદ્ધિઓનું અવમૂલ્યન કરે છે. આ કેન્સર જ એના ચિત્તની શાંતિને ખાતું રહે છે!

હવે એવો સમય પાકી ગયો છે, જ્યારે માણસે પોતાની જાતને કહી દેવું જોઈએ કે, “બીજા લોકો પાસે કેટલી સત્તા-સંપત્તિ છે, તે હું નથી જોવાનો. બસ, મને તો મારા પરિવાર અને મારી સુરક્ષિતતા અને આભાગોરવ માટે પર્યાપ્ત મળી રહે તે ઘણું છે. મારે હવે આ વિષયકમાંથી બહાર નીકળવું છે, જે હંમેશાં તુલનાત્મક ભાષામાં જ પ્રશ્ન પૂછ્યા કરે કે - ‘મોટું કોણ? કોણ વધુ પૈસાદાર? કોણી પાસે વધારે છે?’ હવે તો બીજા પાસે ઉછીનાં લેવાને બદલે, હું જ મારાં લક્ષ્યાંક નક્કી કરીશ. હવે સફળતા અંગેની પુખ્ત સમજ કેળવવા હું મથીશ, જે સાચા વિકાસ અને સાચી સિદ્ધિ ભણી મને લઈ જાય તેમજ મિથ્યા, બનાવટી, વર્થ શાશ્વતારેલી અને ગર્વાન્ભત કરનારી પ્રાપ્તિની વાસનાથી મને દૂર રાખે.”

આવો જ માણસ આપણા યુગના ઉન્માર્દી ભौતિકતાવાદથી દૂર રહી શકે.

પાંચ-પચીસ મકાનો અને ઢગલાબંધ જર-જવેરાત, ગાડી-મોટર અને રેફીજરેટર, બોંડ અને શોર એકઠા કર્યે જવાની સ્પર્ધામાંથી બહાર નીકળી આવી, માણસે હવે પોતાની સાચી સંપદા તરફ ધ્યાન આપવું જોઈએ અને એ મૌલિક સમૃદ્ધિ દ્વારા જે કાંઈ સંસિદ્ધ થાય તેનાથી પરિતૃપ્ત થતાં શીખવું જોઈએ. આવું થાય, તો જ સ્વસ્થતા સિદ્ધ થઈ શકે!

- જોશુઆ લોથ લીલ્યેન

સુખમાં શ્રદ્ધા

તમારે સુખમાં શ્રદ્ધા રાખવી જ રહી,
નહીંતર સુખ કદીય નહીં મળે!
પંખીને રોટીનું નાનું બટકું મળે,
તોય એ આનંદથી કેવું ચી...ચી... કરી ઉઠે છે!

શ્રદ્ધા તમારે રાખવી જ રહી કે કળી કાલે ખીલશે,
હિમ પડે ત્યારે ધાસની હાલતમાં શ્રદ્ધા રાખવી!
અરે, એટલે સ્તો, તેના અંધકારમય દિવસોમાં પણ
પંખી ગાઈ શકે છે, વસંતમાં એના વિશ્વાસથી!

તમારે સુખમાં શ્રદ્ધા રાખવી જ રહી,
એ કાંઈ બાધ ચીજ નથી!
વસંત ક્યારેય કોઈ ગીત નથી બનાવતી,
એ તો મધુરાં કલરવ જ વસંત સર્જે છે!

અરે, રસ્તે પસાર થતાં ઉછળતાં આનંદ-કિલ્લોલ જોઈને,
કેટ કેટલાં હૈયાં પરિતૃપ્ત થઈ શકે!
જ્યારે હદ્ય સંતપ્ત હોય, આગળ તો આનંદ છે,
બસ જરૂર છે તમારે સુખમાં શ્રદ્ધા રાખવાની!

- ડગલાસ મેલોક

૭૮

જો તમે તમારો પડછાયો ઓઈ શકતા હો તો,
જરા મારી આટલી વાત યાદ રાખશો...
સૂરજ તો જળહળી રહ્યો છે,
માત્ર તમે છો હજુ માર્ગમાં!
ચિંતાઓ ઓસરશે, કાર્ય સિક્ષ થઈને રહેશે...
જે સૂર્યની સામે રહે, તેને કોઈ પડછાયો નહે નહીં!

- રોબર્ટ ફારલે



સુખનું એક ઝાર
બંધ થતાં જ
બીજું ઝાર ખૂલે છે...

પરંતુ ઘણીવાર, આપણે
બંધ બારણા સામું જ
એટલું લાંબું

અને

ખેદપૂર્વક
તાકયા કરીએ છીએ..

કે આપણા માટે
ખોલાયેલું નવું ઝાર
આપણે
જોતાં જ નથી!

- હેલન કેલર

તમારો મિજાજ

એક ગરમ મિજાજનો છોકરો હતો. એના પિતાએ એને થેલો ભરીને ખીલા આપ્યા અને કહ્યું કે જ્યારે જ્યારે એને ગુસ્સો ચડે ત્યારે પાછળની વાડમાં ઓણે એક ખીલો ઠોકી દેવો. પહેલા જ દિવસે, છોકરાએ ઉજ ખીલા ઠોકી બેસાડ્યા. પછી ધીરેધીરે એ ઓદ્ધા થતા ગયા. એને સમજાયું કે વાડમાં ખીલા ઠોકવા, તે કરતાં તો તેના મિજાજને કાબૂમાં રાખવાનું વધુ સહેલું છે.

અંતે એક દિવસ એવો ઉગ્યો જ્યારે એ છોકરાએ એકવાર પણ ગુસ્સો ન કર્યો. ઓણે પોતાના પિતાને આ વાત કરી, ત્યારે પિતાએ પેલી વાડમાંથી રોજ એક ખીલો બહાર કાઢી લેવાનું સૂચયું. એ મિજાજ જાળવી શકે છે એના પ્રતીકરૂપ આ કસરત હતી. દિવસો વીતતા ગયા અને છેલ્લે એવો દિવસ આવ્યો, જ્યારે દીકરાએ બાપને કહ્યું કે હવે બધા ખીલા બહાર નીકળી ગયા છે.

પિતાએ દીકરાને વાડ ભણી દોરી જતાં કહ્યું, “બેટા, તેં સરસ કામ કર્યું. પરંતુ વાડમાં પડેલાં કાણાં તને દેખાય છે? હવે આ વાડ અગાઉ જેવી કયારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં કશુંક કહી નાંખો છો, ત્યારે આ જ રીતે અંતરમાં ચીરા પડી જાય છે. માણસની અંદર તમે છરી મૂકીને, પાછી બહાર કાઢી શકો. પરંતુ તેમ છતાંય ઓણે પાડેલા ઘાનાં નિશાન તો રહી જ જશે, પછી ભલેને તમે લાખવાર દિલસોજી કેમ ન દેખાડો! અને છરીના ઘા કરતા શબ્દોના ઘા વેઠવા વધુ આકરા હોય છે.”

—૭૮—

તમે જ્યારે કોધે ભરાઓ છો... ત્યારે

તમે માત્ર મિજાજ નથી ગુમાવતા!

સદા યાદ રાખો...

ગુસ્સો (Anger)... ભય (Danger) થી કેટલો સમીપ છે!

પ્રસંગચિત માનવ

પ્રસંગતા એ મનનું કાયમી સ્નેહન-તત્ત્વ છે.
જુશીની એ એવી સિનગ્ધતા છે, જે વર્ષણ, ચિંતા, ઉપાધિઓ અને
પ્રતિકૂળ સંઝોગોની તીવ્રતા હળવી કરે છે.

આનંદી માણસ પાસે એવી સર્જનાત્મક શક્તિ હોય છે, જે રોતલ માણસ પાસે નથી હોતી. જીવનમાં આટલી બધી મીઠાશ,
બીજી કોઈ ચીજથી આવી ન શકે. પ્રસંગતા બધી કડવાશને પી
જાય છે. પ્રવાસમાં માર્ગ પર લાગેલા તમામ જટકા-આંચકાને એ
આરામથી મટાડી દે છે. આનંદી ચિંતક પાસે, નિરાશ કે બિન ચિંતક
કરતાં અનંતગણું વધારે સામર્થ્ય હોય છે.

આરોગ્ય જીળવવા અને રોગ-દુરસ્તી માટે પણ પ્રસંગતાનું
અનેરું મહત્વ છે. શરીરના કોષોને દ્વાની જેમ એ કૃત્રિમ રાહત
પહોંચાડું નથી. કેટલીક દ્વાઓમાં તો પાછળથી વધારે ખરાબ
પ્રતિક્રિયાઓ પણ થાય છે. પરંતુ, પ્રસમતાનું આવું નથી. પ્રસંગતાનો
પ્રભાવ તો પ્રત્યક્ષ જીવનદાયક પ્રભાવ છે, જેનું પરિણામ શરીરની
આખી સંરચના અને અંગપ્રત્યંગ પર પડે છે. આંખોમાં તેજ પૂરાય
છે, ચહેરા પર સુરખી છવાય છે, પગમાં લચીલાપણું અનુભવાય
છે અને અંદરથી અપાર જોમ અનુભવાય છે, જેના આધારે જીવન
ટકે છે. રક્તાભિસરણ મોકળાશથી થાય છે, કોષોમાં પ્રાણવાયુ સંચરે
છે, આરોગ્ય સુધરે છે અને રોગ છૂભંતર થઈ જાય છે.

ઘણા લોકો ‘હાસ્ય-ચિકિત્સા’ દ્વારા સાજા થઈ નિરામય થયા
છે અને ચિંતા ફરિયાદ અને તુમાખીને સ્થાને આનંદ પ્રસ્થાપિત
કરીને રોગને હટાવ્યો છે. જ્યારે પણ કોઈ માણસ ફરિયાદ કરે કે
કોઈના દોષ જૂબે ત્યારે એ પોતાના વેરીઓની શક્તિને જ પ્રમાણે
છે, જે એને પોતાને જકડી રાખે છે, એના જીવનને અસ્વસ્થ અને
પ્રતિકૂળ બનાવે છે. સુખના આ દુશ્મનોથી મુક્ત થવાનો એક જ
ઉપાય છે. એમના અસ્તિત્વનો ઈન્કાર! મનમાંથી એમનો સંદર્ભ
દેશનિકાલ! કારણ કે એ નરી ભ્રમણા જ છે! સુસંવાદ, આરોગ્ય,
સૌન્દર્ય, સફળતા... આ જ બધી યથાર્થતા છે, વાસ્તવિકતા છે!

- ઓરિસન સ્વેટ માર્ડિન

આફુતોને ટીંગાડો ઝાડ પર!

તમારા રોજેરોજના જીવનમાં ઉભી થતી મુશકેલીઓ સામે અસરકારક પગલાં કેવાં લઈ શકાય તેની વાત નીચેની આ કહાણીમાં છે.

એક સજજન ભારે મોટા વ્યવસાયમાં લાગેલા હતા, જેમાં અનેક પડકારો જીલવા પડતા. પરંતુ એ પડકારો ગમે તેટલા મોટા કેમ ન હોય, એ જ્યારે ઘેર પાછા ફરે ત્યારે હુંમેશાં પ્રસન્ન ચિત્ત હોય. જ્યારે આનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે એમણે કહ્યું, “મારા આંગણાના મુખ્ય દરવાજા પાસે કોપર બીચનું એક ઝાડ છે, એને હું મારી ‘અંગત આફનોનું વૃક્ષ’ કહું છું. રોજ રાતે જ્યારે હું ઘેર આવું છું ત્યારે મારા આખા દિવસની મુસીબતોને હું એ ઝાડ પર લટકાડી દઉં છું એને એમને કહું છું, ‘રાતભર અહીં જ ટીંગાયેલા રહો. સવારે કામ પર જઈશ ત્યારે તમને સાથે લઈ જઈશ.’”

“મજાની વાત તો એ છે કે બીજી સવારે જ્યારે હું ઘર છોડું છું ત્યારે ઝાડ પર જોઉં છું કે મેં જેટલી મુશકેલીઓ ગઈ સાંજે ઝાડ પર લટકાવી હતી, તેમાંથી મોટા ભાગની તો રાતે જ હવામાં ધૂમંતર થઈ ગઈ હતી. ઝાડ પર જે બાકી રહી ગયેલી તકલીફો હોય છે, તે દેખાય તેટલી મુશકેલ કે ચિત્તપ્રદ નથી હોતી, જેટલી ગઈ સાંજે ઘેર આવ્યો ત્યારે દેખાતી હતી.”

મનોવિજ્ઞાન કહે છે કે મોટા ભાગની સમસ્યાઓ તો આપણા મનની જ ભૂતાવળ હોય છે એને વાતનવમાં આપકા જીવનમાં તે ક્યારેય ઉભી થતી નથી!

છે બધું તમારા હાથમાં!

તમારા પંથે જતાં જતાં, થોડુંક હસો એને ગાઓ!
થોડુંક કામ કરો, થોડુંક રમો! રોજેરોજ આ કરો!

થોડુંક આપો, થોડુંક લો,
મીઠું રિમત વેરીને સૌ કોઈને આવકારો!

થોડુંક હસો, થોડુંક ચાહો, ગગન સદા નીલું છે!
પ્રત્યેક વાદળને રૂપેરી કોર છે, પણ
બધું તમારા હાથમાં છે!

સુખ છે એક મનોવિદ્યા!

તમે જે છો એનાથી સુખી ન હો તો...
તમારી પાસે શું છે તેના કારણો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો!

ધણા લોકો માને છે કે એમનું ધરનું ધર બંધાય, ત્યારે જ તે સુખી થાય. પરંતુ એમ થતું નથી. પછી કહેશે કે હવે તો ધરનું દેવું ચૂકવાય. પછી હવાઈની સફરે જઈ શકાય. આ બધું થાય તો જ મહાસુખ મળે, એવું તેઓ માને છે. પણ આવું બનતું નથી. સુખ દૂરનું દૂર જ રહી જાય છે, કારણ કે જ્યાં પહોંચો છો ત્યાં, તમે તો તેના તે જ રહી જાઓ છો! તમને ગમે તેટલું મળે, પરંતુ વધુને વધુ પામવાની તમારી ઈચ્છાઓનો અંત જ આવતો નથી!

દેનોસ પ્રેગરે મોજમજા અને સુખ વચ્ચે ભેદરેખા આંકતા કર્યું છે કે...

ભોગવો ત્યારે જ જે માણી શકો તે છે મોજ અને મજા.
જ્યારે સુખ તો ભોગવી લીધા બાદ પણ અનુભવી શકાય છે.

લાગણીઓ સાથે જોડાયેલો જિડેરો ભાવ છે એ!

કોઈ બગીચામાં જવું કે રમત રમવી, અથવા તો ફિલમ જોવી કે ટી.વી. જોવું... આ બધી મોજમજાની પ્રવૃત્તિઓ છે. એ કરવાથી આપણે થોડી હળવાશ અનુભવી શકીએ, થોડોક હાસ્ય-વિનોદ કરી શકીએ, પરંતુ આ બધું આપણને સુખ ન આપી શકે, કારણ કે એનો આનંદ તો જ્યાં સુધી તમે એ માણતા રહો ત્યાં સુધી જ ટકતો હોય છે.

વળી, જ્યાં સુધી આપણો આપણી જાત સાથે સુખી નથી હોતા, ત્યાં સુધી સુખ અનુભવવું મુશ્કેલ છે. સુખ એ તો મનોવલણ છે. વિલ રોજર્સ સાચું જ કર્યું છે કે - “મોટા ભાગના લોકો પોતે જેટલું ધારે તેટલું જ સુખ પામી શકે છે!”

મોજમજા ભરેલી, બેફિકરી જિંદગી જ સાચું સુખ છે એવી માન્યતાને વળગેલા માથસો, જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કરવાના અવસરો પણ ઘટાડતા જાય છે. જો આનંદ-મોજ એ જ સુખ હોય, તો તો પછી પીડાને દુઃખ સાથે જ સરખાવવી જોઈએ. પરંતુ હકીકતે તો, આથી વિરોધી બાબત જ સાચી છે. ઘણીવાર જીવનમાં સુખ પામવાના રસ્તે પીડા જ ભોગવવાની છે. એટલે આ સનાતન સત્ય છે કે મોજમજા એ કાંઈ સુખ નથી.

- જીગ જીગલર

આપણી નજરવિહોણી આંખો!

જીવનનું સૌન્દર્ય સર્વત્ર ફેલાયેલું છે આ હડીકતની આપણને કદર હોવી જોઈએ. તમારા મિત્રો અને પ્રિયજનોના ચહેરા પર, બાળકોના બિલબિલાટ હાસ્યોમાં, સાગરનાં મોજામાં અને ગગનના વાદળમાં એ જરી શકે. એ બગીચાના ઘાસમાં, ફૂલ-જાડમાં પણ પથરાયેલું છે. તમારી ચોમેર એ છવાયેલું છે! બસ, એને પામવા ‘દૃષ્ટિ’ જોઈએ!

કેઝીયર હંટે ‘આપણી દૃષ્ટિવિહીન આંખો’ નામે એક લેખ લખ્યો હતો, જેમાં હેલન કેલર સાથેનો એનો એક હૃદયંગમ અનુભવ વર્ણવાયો હતો.

“જુલાઈની એક સાંજે, કેનેડાના પહાડી પ્રદેશમાં હેલન કેલરના ઘર ભણી મારી ગાડી હંકારી ગઈ. જે સ્ત્રી પોતાની કાજળકાળી, નિરવ ખોલીમાં જીવનભર કેદ હતી તે સ્ત્રીને જંગલની કેરી પર ચાલી આવતી જોઈને તો હું સત્ય થઈ ગઈ. મારી નજર સામે જ જંગલ વટાવીને એ ખૂલ્લા મેદાનમાં પહોંચી ગઈ અને સરૂની લાંબી ડાળીઓના ઝૂંડને કારણે અટકી ગઈ. પોતાના હાથમાં એ ડાળીઓને પકડી પોતાના ઊંડા શાસમાં એની સુગંધ ભરી, એની નજરવિહોણી આંખો દ્વારા, ઉપર સૂરજ સામું જોઈ રહી અને એના હોઠ પરથી માત્ર એક શબ્દ સરી પડ્યો. ‘સુંદર!’ અને પઢ્યો, હસતી-હસતી એ મારી પાસેથી ગુજરી ગઈ.

મેં મારી અપાત્ર આંખોમાંથી આંસુ લૂછ્યાં. મને તો આ પહાડો ક્યારેય આટલા સુંદર નહોતા દેખાયા. જંગલનું, આકાશનું અને પહાડોનું અખૂટ સૌન્દર્ય જોઈ શકવાની આંખો મારી પાસે હતી, ખળખળ વહેતા જરણાનો નિનાદ અને વૃક્ષની ટોચ પરથી વહી જતી હવાનું સંગીત સાંભળવાના કાન મારી પાસે હતા. પરંતુ આ બધામાં સૌન્દર્ય મને દેખાડ્યું એ અસાધારણ સ્ત્રીની દૃષ્ટિવિહોણી આંખોએ અને શ્રવણહીન કાનોએ!”

તમારા વિચારો અને લાગડીઓ પર કાબૂ મેળવવાની તમારી શક્તિ અજમાવવા નીચેનો સાદો પ્રયોગ કરી જૂઓ. ઘડીભર તમારી આંખો બંધ કરી દો, થોડા ધીમા-ઊંડા શાસ લો અને પ્રસન્નતા અનુભવવા પ્રયત્ન કરો.

સાથોસાથ, ભૂતકાળના કોઈ સુખદ્દ સ્મરણને યાદ કરો, અથવા તો તમારા જીવનની ધ્યેયસિદ્ધિના આનંદની મનોમન કલ્પના કરો. તમારા ચહેરા પર ચમકતું સ્મિત રેલાવા દો. થોડીવાર થોભી જાઓ અને અંતરમાં કેવી વિધાયક લાગણીઓ અનુભવાય છે તે જૂઓ! અને હવે પરિસ્થિતિ બદલો. મનોમન ઉદાસી અનુભવો. ભૂતકાળના કોઈ નિરાશાભર્યા બનાવને વાગોળો અથવા તો ભવિષ્યમાં કોઈ નિષ્ફળતાને કારણે પેદા થઈ શકે તેવી પીડાની કલ્પના કરો! તમારા ચહેરા પર શોકનું વાદળ છવાઈ જવા દો! ઘડીલભર થોભો, અને અંતરમાં કેવી નકારાત્મક લાગણીઓ અનુભવાય છે, તે તપાસો!

નોંધો કે બાબ્ય પરિસ્થિતિમાં કશો ફેરફાર નથી થયો અને છતાંય તમે લિન્ન પ્રકારની લાગણીઓ અને સંવેદના અનુભવો છો. માત્ર તમારા અંતર સાથે સંવાદ સાધવાની રીતમાં જ ફેર કરાયો છે. તમારા અંતર્જગતને જોવા-તપાસવાની પ્રક્રિયામાં જ ફેર કરાયો છે!

- ડૉ. વોલ્ટર સ્ટેપલ્સ

સાચો આશાવાદ સમસ્યાઓને જાડો છે... પણ

એના નિવારણને પણ પીછાણો છે!
આડે આવતા અંતરાયોની એને જાણ છે...
પણ એને શ્રદ્ધા છે કે એ પાર પાડી શકાશો!
નકારાત્મકતા જૂએ છે... પણ ઉચ્ચારણ કરે છે હકારાત્મક!
અધમનું દર્શન, પણ અપેક્ષા છે સર્વોત્તમની...
ફરિયાદનાં પૂરતાં કારણ છે...
પણ પસંદગી ઢળે છે સ્મિત પર!

- વિલિયમ આર્થર વોર્ડ

સમયનો ઘજાનો

ગઈકાલ તો છે સ્વાન માત્ર
અને
આવતીકાલ માત્ર કલ્પના!

પરંતુ આજનો દિવસ
જો સુંદર જીવાય...

તો
પ્રત્યેક ગઈકાલને
સુખનું અનેસું સ્વાન
અને

પ્રત્યેક આવતીકાલને
આશાનું દર્શન બનાવી શકાય!





સમયનો ઘજાનો

ગઈ છાલ તો છે
રદ થયેલો યેક...

અને

આવતી છાલ,
એક પ્રોમિસરી નોટ!

આજનો દિવસ જ છે
તૈયાર રોકડ...

તેનો પૂર્ણ ઉપયોગ કરો!

એક સાથે એક દિવસ!

એક સાથે એક દિવસ, ભય અને નિષ્ફળતાના શત્રુ,
એના આધાતો અને ભૂલો, નબળાઈઓ અને અશ્વ...
એની પીડાનો ભાગ અને ચિંતાનો ભાર,
એક સાથે એક દિવસનો આપણો કરીએ સ્વીકાર!

એક સાથે એક દિવસ શીખવે ધૈર્ય અને દૃઢતા,
કસોટી સમયે શાંતિ અને અનિષ્ટ સામે મધુરતા...
આમ કરવાથી દૂર થાય થાક અને પીડા પણ શમતી,
અંધકાર સાથે એનો અંત અને રાત્રિ લાવે નીરવ શાંતિ!

એક સાથે એક દિવસ, પરંતુ લાંબો એનો વખત,
નથી હૈન્યું એટંબું સાખૂત અને જીવ એટલો સશક્ત...
હું દ્યાળું પરમાત્મા, તું રહે સમીપને કરીએ હિન પસાર,
તું આપે દિવસભરની હિંમત, ધૈર્ય અને શક્તિ અપાર!

નહીં કોઈ ડર કે અનિષ્ટયતા આવનારા કાલના,
નહીં બોજો કે ભાર વહન કરવા વીતેલા કાલના...
શા માટે આગળની આશ અને પાછળના વિશ્વાસ,
મળી રહેશે કૃપા તારી આજમાં, અમે રાખીએ વિશ્વાસ!

એક સાથે એક કરીએ તો બને હર હિન પ્રભુનો,
કરીએ ઉતાવળ કે ઢીલ, પરંતુ સમય તો છે ગણતરીનો...
નથી આપણો એકલા, છે પ્રભુની કૃપા પણ સંગ,
જેમ આપે દિવસ સૌને એમ આપે અનેરો શક્તિરંગ!

- નિક્સન વોટરમેન

૭૮

ગઈકાલનાં બારણાંને કરી બંધ,
ફેરી દીધી છે મેં એની ચાવી...
નથી કોઈ ભય મને આવતીકાલનો
કારણ આજ છે મને મળી આવી!

૭૯

કરો અત્યારે જ!

તમારે સખત મહેનત કરવાની હોય તો,
કરો અત્યારે જ!
આજે આકાશ ખૂલ્યું અને નીલું પણ છે,
કાંચે પાછાં વાદળ ધેરાઈ શકે.
તમારા માટે ગઈકાલ તો હવે છે નહીં;
માટે, જે કાંઈ કરો તે કરો અત્યારે જ!

તમારે જો ગીત ગાવાનું હોય,
તો વાર શેની?
આનંદના સૂરને વહેવા દો,
પંખીના વસંતગાન સમા.
જો રોજેરોજ સંગીત પ્રગટાવવું હોય તો,
ગીત ગાઓ અત્યારે જ!

તમારી પાસે બે મીઠા બોલ હોય તો,
હમણાં જ કહી દો!
આવતી કાલને એની અડફટે ન ચડાવો,
કરી શકો તેમ હો ત્યારે ભલાઈ કરો.
પ્રિયજનો ગમે ત્યારે વિદ્યાય લે,
માટે મીઠાં બોલ બોલો અત્યારે જ!

વેરવા માટે તમારી પાસે સ્થિત હોય,
તો રેલાવો આ જ કણો!
હૈયાંને ઠારો, ગુલાબોને ખીલવા દો,
મિત્રોને પ્રતીતિ થવા દો,
તમારા પ્રેમને, એમની વિદ્યાય પહેલાં,
પ્રગટ કરો અત્યારે જ!

- એડગર ગેસ્ટ

ભીષણમાં ભીષણ આગ
ઓલવાઈ શકી હોત...
...જો રેડાયો હોત
પાણીનો એક ખાલો સમયસર!

સમયનું મૂલ્ય સમજો!

એક વર્ષ એટલે શું, જાણવું છે અનું મૂલ્ય?

તો પૂછો એ વિદ્યાર્થીને....

જે અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થયો!

એક મહિનાનું મૂલ્ય સમજવા,
આઠમા માસે પ્રસવેલા શિશુની માને પૂછો!

એક સપ્તાહનું મૂલ્ય જાણવા,
કોઈ સાપ્તાહિકના તંત્રીને પૂછો!

એક કલાકની ઘડી કેટલી,
પૂછો મળવા તત્પર પ્રેમીઓને!

એક મિનિટની કિંમત સમજવા,
બસ, ગાડી કે વિમાન ચૂકી ગયેલાને પૂછો!

એક સેકન્ડના મહત્વને સમજવા,
અક્ષમાતમાં બચી ગયેલા માણસને પૂછો!

એક મીલિસેકન્ડનું મૂલ્ય સમજવા,
પૂછો ઓલિમ્પિકમાં રજતચંદ્રક જીતનારને!

જીવનનું ઘડિયાળ

જીવનના ઘડિયાળની ચાચી એક જ વાર અપાય છે,

કોઈ એ ભાખી ન શકે કે

એના કાંટા ક્યારે ચાલતાં થોભી જશે...

મોડી રાત્રે કે વહેલી સવારે.

તમારી પાસે તો, માત્ર વર્તમાન છે,

જીવો, ચાહો, ફાવે તેમ કામ કરો.

આવતીકાલના ભરોસે ન રહેશો...

કારણ કે

ઘડિયાળ ગમે ત્યારે બંધ થઈ જઈ શકે!

રોજના રૂપિયા ૮૬,૪૦૦!

માની લો કે કોઈ એવી બંક છે, જે રોજ સવારે તમારો હિસાબ ૮૬,૪૦૦ રૂપિયાથી માંડે છે.

આજની બચત એ કાલ પર રાખતી નથી. રોજ સાંજે દિવસ દરમ્યાન ન વપરાયેલી રકમને એ રદ કરી નાખે છે! અને તમારો એના પર કોઈ હક્ક-દાવો નથી રહેતો!

આવી બંક સાથે કેવો વ્યવહાર રાખશો?

ચોક્કસ વળી! એમાંથી એકે એક પૈસો હાથવગો કરી લેવાનો. દરેક પાસે આવી એક બંક છે, જેનું નામ છે - સમય!

રોજ સવારે એ તમને ૮૬,૪૦૦ સેકન્ડ આપે છે. આખા દિવસનું સરવૈયું રોજ રાતે નીકળી જાય. દિવસમાં વાપરવાનું જે કંઈ બાકી રહી ગયું, તેની ખોટ તમારી! એમાં ન પાછળ જઈ બચત માંગી શકાય, ન આવતી કાલ પાસેથી ઉધાર લઈ શકાય.

આજનો હિસાબ આજ ચૂકતે! એટલે એને એ રીતે કામે લગાડો જેથી તમારા આરોગ્ય, સુખ અને સફણતા ઉત્તમ રીતે જળવાઈ શકે.

વારિયાળ તો ચાલતું રહે છે! એનો ફાયદો આજે જ બેઠાવો!

સમયની આ હિવાલો પર કામ કરતાં

સૌ કોઈ છે ભાવિના શિલ્પી.

આપણો જે કંઈ ઈમારત રચીએ

સમયની સાધનસામગ્રી પણ એમાં પૂરાશે.

આપણી આજ અને ગઈકાલ

પત્થર છે, જેનાથી મકાન રચાશે.

એટલે એને આજે જ બાંધો, મજબૂત અને પાકું

દૃઢ અને વિશ્વાળ પાયા પર.

ઉપર જતી રચો એવી સલામત

જે ઈમારતમાં વસે આવતીકાલ!

- હેનરી ડબલ્યુ લાંગફેલો

મૂલ્ય-નિષ્ઠ જીવનશૈલી... સમય ડોશાદ્યની છપા!

જો તમે કોઈ હેતુપર્ણ જીવન ન જીવી રહ્યા હો, જેમાં તમારા સમયનું હેતુલક્ષી સંયોજન કરાયું ન હોય, તો સંભવ છે કે તમારી આંતરિક સંભાવનાઓને સાકાર કરવા તમારી તમામ શક્તિનો તમે પૂર્ણ ઉપયોગ ન કરી શકો.

એક વાર જો તમે મૂલ્ય-નિષ્ઠ જીવનશૈલી જીવવાનું નક્કી કરો, તો તમારા જીવનના એવા સુંદર ઘાટ ઘડાતા જશે કે અલ્યસંતોષ, પ્રમાદ કે બહાનાબાળ્યને કોઈ અવકાશ જ નહીં રહે. પછી તમે આગળ જ વધશો, પાછળ નહીં. જીવનમાં સામનો પડકારોનો થશે, સમસ્યાઓનો નહીં. રસ્તા પરના પથર તમારા માર્ગના અંતરાય નહીં બનતાં, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેના પગથિયાં બનશે. જ્યારે તમે ઉત્તમ જીવન જીવવા માંડો છો ત્યારે બધા નિયમો બદલાઈ જાય છે, કારણ કે તમારાં મૂલ્ય તમારા ચિંતનને શુદ્ધ કરતાં રહે છે.

જીવન ફલદાયક વ્યવહાર તમારા જીવનને સંગઠિત અને ચરિતાર્થ કરી શકે તેવી ભૂમિકા તૈયાર કરે છે. તમે જ્યારે તમારા સમયને સંયોજો છો, ત્યારે તમારાં મૂલ્યોને પણ સંયોજો છો. જ્યારે તમારાં મૂલ્યોનું સંયોજન થાય છે ત્યારે તમને આંતરિક શાંતિનો અનુભવ થવા માંડે છે, કારણ કે તમારું અને તમારા જીવનનું સંઘાદમય બની જાય છે. પછી સંઘર્ષ નથી રહેતો. જ્યારે તમારાં મૂલ્યો વિષે તમે સ્પષ્ટ હો, ત્યારે સમયને ક્યાં કેવી રીતે વાપરવો તે વિષે દ્વિધા રહેતી નથી. તમારે તો બસ, તમારી પ્રવૃત્તિઓને તમારાં મૂલ્યો સાથે જોડીને ચાલુ રાખવાની રહે છે.

જે લોકો પોતાના વિષે સંતોષ અનુભવે છે, તેઓ સારાં પરિણામો લાવે છે. વ્યવસ્થાતંત્રમાં, આત્મ-સન્માન અને સ્વવિકાસ અંગેની આપણી સમજ સાથેનો સીધો સંબંધ જળવાય, તે જાણીતો સિદ્ધાંત છે. વ્યક્તિમાં ઘણી બધી વ્યવહાર કાર્યકુશળતા હોય, અને એનો સરસ ઉપયોગ કરવાનું પણ એ જાણતો હોય, તેમ છતાંય પોતાના વિષેનું અનું આત્મ-સન્માન ઓછું હોય, એવું બની શકે. આવો માણસ કશું નવું શીખવાની વાત આવે ત્યારે, અથવા તો એની આસપાસના વાતાવરણમાં પરિવર્તન કરવાનું આવે ત્યારે એકદમ વિહૂવળ બની જાય છે.

બીજો માણસ, જેનામાં આત્મગौરવ પૂરતા પ્રમાણમાં હોય પણ વ્યવહાર દક્ષતા ઓછી હોય, તેને નવું કશું શીખવામાં કે નવા વાતાવરણને અનુકૂળ થઈ જવામાં કોઈ ડર લાગતો નથી.

ધ્યેયુક્ત જીવન જીવવા માટે, તમારે તમારા આત્મવિશ્વાસને પાકો કરી સંયમશીલ બનવું જોઈએ. તમે કાંઈ કરો ત્યારે સન્માન વધે છે, જ્યારે કરવાની ના પાડો છો, ત્યારે તે ઘટે છે. તમારા જીવનની ઘટનાઓ પર તમારો અંકુશ નહીં હોય, તો એ ઘટનાઓ તમને ગુંગળાવશે. તમારો કાબૂ હોય ત્યારે તમારી ઉત્પાદકતા વધે છે અને જ્યારે તમે કાબૂ બહાર હો ત્યારે ઉત્પાદકતા ઘટે છે. આવી નબળી સ્થિતિમાં, તમે ખોટા નિર્ણયો લેતા થશો અને તમારો પ્રત્યેક ખોટો નિર્ણય તમારી ઉત્પાદકતા પર સીધી અસર કરશે.

સ્વસ્થ જીવન જીવવા માટે, તમારે જરૂર છે -

- * તમારા મૂલ્ય-વિષયક ક્ષેત્રોની પૂર્ણ જાણકારી
- * આ ક્ષેત્રોમાં તમે શું સિદ્ધ કરવા માંગો છો તેનો સ્પષ્ટ સંકલ્પ.
- * જરૂર લાગે તો આ ક્ષેત્રોમાં વધુ અસરકારક બનવા માટેની નવી આવડતોનું જ્ઞાન.
- * એવી પ્રવૃત્તિઓનું આયોજન જે આ ક્ષેત્રોમાં પરિપૂર્ણતા મેળવ્યાનો સંતોષ આપે.
- * તમારા વ્યવહારમાં સાતત્ય જાળવી, તમારા કાર્યોને તમારા મૂલ્યો સાથે સુસંગત કરવા.

નિર્ણય શક્તિને સમય કે પૈસા સાથે સંબંધ નથી, એ તો મૂલ્યો સાથે ઓડાયેલી બાબત છે.

આના પર ગણિત માંડો. અત્યાર સુધી જીવનમાં જે ન કરી શક્યા હો તે કરવા રોજ એક કલાક વહેલા ઊઠો અને રોજ એક કલાક મોડો સુઈ જાઓ. આને પરિણામે, દર વર્ષ તમને ૭૩૦ કલાક વધારાના મળશે, જેમાં તમે તમારાં ઉપયોગી કામ કરી શકશો. એમાં પાઈનું ય ખર્ચ નહીં થાય, પરંતુ આ માટે શિસ્તભર્યું જીવન જીવવાની પૂરી તૈયારી જોઈશે.

મનપસંદ જીવન જીવવા, સુગંઠિત આયોજન, જવાબદારીની વહેંચણી તેમજ સમયપાલનની કળામાં તમારે નિષ્ણાત બનવું પડે. પછી તમારા અંતિમ ધ્યેયને સિદ્ધ કરવા તમારા એકમાત્ર પ્રેરકબળ તરીકે તમારાં મૂલ્યોને જ રાખવાના રહે!

- ટૉડ ઝન

સમય કાઢો

હસવા માટે સમય કાઢો,
એ તો આત્માનું સંગીત છે.

રમવા માટે સમય રાખો,
અખંડ યૌવનનું એ રહસ્ય છે.

સપનાં જોવાં સમય ફાળવો,
તારલા પાસે એ પહોંચાડશે.

વિચારવાનો સમય કાઢો,
શક્તિનો એ સોત છે.

વાંચવા માટે સમય રાખો,
શાષ્ણપણનો એ જરો છે.

મૈત્રી માટે સમય કાઢો,
સુખ-મુકામે એ પહોંચાડશે.

આપવા માટે પણ સમય આપો,
સ્વાર્થી થવાનું પાલવે નહીં.

પ્રેમ કરવા-મેળવવા રહો તત્પર,
એ ઈશ્વર-દત્ત અધિકાર છે.

કામ માટેનો સમય આપો,
સફળતાનું એ મૂલ્ય છે.

પ્રાર્થના માટેનો પણ સમય કાઢો,
એ તો પૃથ્વી પરનું મહાસામર્થ છે!

- એક પુરાણી અંગ્રેજ પ્રાર્થના



“આ પણ પસાર થઈ જશો!”

અદ્ભુત છે આ કથન
જીવનમાં ડગાલેને પગાલે
ગાંઠે વાળી રાખવા જેવું!

જ્યારે ચોમેર બધું ચોકાવનારં હોય
કે ભયંકર રીતે ભડકાવનારં
અથવા તો બધું જ સરસ અને ભવ્ય,
આનંદમય અને પ્રસંજ હોય...
ત્યારે પણ આ પાંચ શાણ્દો કહેતા રહો
તમારી જાતને.

આ શાણ્દો તમને અનોખી જીવનદંડિટ આપશો
અને સારપના શ્રેષ્ઠત્વને સર્જવામાં
મદદરૂપ થશો
તેમજ જે કાંઈ ખરાબ હશો,
તેમાં પણ શાંત અને સ્વસ્થ રહેવામાં
સહાયભૂત થશો!

- કલેર રેનર

તમામ સંપત્તિમાં સૌથી મૂલ્યવાન!

સવારે તમારી આંખ ખૂલે છે, અને વાહ!

તમારા થેલામાં આણો આદુથી ભરયા છે...

તમામ સંપત્તિમાં સૌથી મૂલ્યવાન એવા ચોવીસ કલાક!

સમય એ સઘળી બાબતોનો મૂળભૂત પદાર્થ છે. એ છે, તો બધું શક્ય છે. એ નથી તો કશું જ નથી. સમયનો આ પુરવઠો, એ સાચે જ રોજેરોજ નિર્માણ થતો અદ્ભુત ચમત્કાર છે!

સમય તમારા તમામ વૈભવોમાં સૌથી વધુ કિંમતી છે. કોઈ પણ તમારી પાસેથી એ છીનવી ન શકે, ન કોઈ ચોરી શકે. વળી તમે જે સમય મેળવો છો તેનાથી ઓછો કે વધારે બીજા કોઈને પણ મળતો નથી.

સમયના સાંઘાર્યમાં સંપત્તિ કે બુદ્ધિની અમીરાઈ મહત્વની નથી. પ્રતિભાસંપન્ન વ્યક્તિને પણ દિવસમાં એક કલાક વધારાનો અપાતો નથી. અને અહીં કોઈ સજ્ઞાનશિક્ષા પણ નથી. આ અત્યંત મૂલ્યવાન સાધનનો મનફાવે વેડફાટ કરો, તો પણ તમને પહોંચાડતો સમયનો પુરવઠો કોઈ કાપી નહીં લે. વળી, તમે કશું ભવિષ્ય માટે બચાવીને પણ રાખી ન શકો. ઉધાર-ઉધીનું કશું ન મળો! વહી જતી ક્ષણને તમે વેડફી શકો, પરંતુ આવતીકાલને તમે આજે વાપરીને વેડફી ન શકો. એ તમારા માટે સુરક્ષિત છે.

તમારે રોજના આ ચોવીસ કલાક પર જીવવાનું છે. એમાં જ તમારા આરોગ્ય, સુખ, પૈસા, સંતોષ, માન-સન્માન અને તમારા અમર આત્માની ઉન્નતિ અંગે જે કાંઈ કરવાનું હોય તે માટે મથવાનું છે. એનો યથાર્થ અને સૌથી અસરકારક ઉપયોગ થાય તે જોવાનું ખાસ મહત્વનું છે અને આ એક અત્યંત રોમાંચક વાસ્તવિકતા પણ છે. જીવનનું સર્વસ્વ એના ઉપયોગ પર નિર્ભર છે. પ્રપંચી એવા સુખ, જેની તમને સદાની ખેવના છે, તેનો આધાર પણ આના ઉપર જ રહેલો છે!

પોતાને મળેલા ચોવીસ કલાકનું સુવ્યવસ્થિત આયોજન કોઈ ન કરી શકે તો એનું આખું જીવન અનિષ્ટિત કાળ માટે ખોરવાઈ જવાનો સંભવ છે.

- આર્નોલ્ડ બેનેટ

આજ છે

ગઈકાલની આવતીકાલ!

...અને આવતીકાલની ગઈકાલ પણ!

આજ એ ગઈકાલનું ફળ છે. તમે જો ગઈકાલે બરાબર આયોજન કર્યું હોય, એના એકેએક કલાકનો સરસ ઉપયોગ કર્યો હોય તો એનાં સારાં પરિણામો, પ્રાપ્તિ અને સિદ્ધિઓની સંભાવના આજે સાકાર થઈ શકે. ગઈકાલના એ કિંમતી સમયને તમે જો નાહક વેડફી નાંખ્યો હશો, તો આજે એનાં પરિણામો પણ એવા જ નિરાશાજનક આવશે. ‘ગઈકાલ’ના પ્રયાસોનો પ્રભાવ જે રીતે આજ પર પડે છે, એ જ રીતે ‘આજ’ માં ‘આવતીકાલ’ની સંભાવનાનાં બીજ પણ પડ્યાં જ હોય છે.

તમારે આવતીકાલ જેવી ઘડવી હોય તેવી ઘડવાની તક આજે મળી શકે તેમ છે. પ્રત્યેક દિન એ તમારા અગાઉના પ્રયાસોનાં પરિણામ અને સાબિતી સ્વરૂપ છે, તદ્વપરાંત ભાવિ પરિવર્તન માટેની અમૂલ્ય તક પણ! આજે જે કાંઈ પુરુષાર્થ આચરાશે, તે આવતીકાલે હકીકત બનીને પ્રગટ થશે. આવતીકાલે તમે ક્યાં હશો એનો આધાર તમે આજે મળેલા સમયનો ઉપયોગ કરવામાં કેટલું શાશપણ દાખલ્યું તેના ઉપર છે!

એટલે પ્રત્યેક દિવસને રચનાત્મક વલણથી આરંભો. તમારા જીવનઅદર્શો પર બધું ધ્યાન કેન્દ્રિત કરો. કાળજીપૂર્વક આયોજન કરો. એ બધું જોઈએ તો, વિગતે લખી નાંખો. તમારા ધ્યેયને પહોંચી વળવા રોજેરોજ કરી લેવાની બાબતોની યાદી બનાવો. તમારા આયોજનને સફળ બનાવવાની દિશામાં રોજનો પ્રત્યેક કલાક વાપરો.

ચોજ દિવસ પૂરો થાય ત્યારે તમારી આતને પૂછો:
મારી ઈચ્છા મુજબની આવતી કાલ ઘડવા
આજે શક્ય હતું તે તમામ મેં કર્યું?

જ્યારે તમે આ રોજિંદા પ્રશ્નનો જવાબ પૂરેપૂરી ‘હા’ માં આપી શકો, ત્યારે તમે જે સફળતા અને સિદ્ધિ ઈચ્છો છો, અને જે પ્રાપ્ત કરવાની તમારામાં યોગ્યતા પણ છે, તે હંસલ કરવાની દિશામાં તમે મક્કમપણે આગળ વધી શકશો!

- હર્બર્ટ હોરિસ

સમય સર્વોત્તમ સદાભાગબો!

ઘણા લોકો પોતાની ઉમરના અનુસંધાને મને પત્રો લખે છે. એક ભાઈ લખે છે... “હું ૫૧ વર્ષનો હું. મારો પોતાનો ધંધો શરૂ કરવા માટે શું બહુ મોંડું થઈ ગયું ગણાય?” જ્યારે બીજો એક યુવાન લખે છે... “મને ૧૮ વર્ષ થયાં. રસ્તા પર સેલ્સમેન બનીને જવા માટે શું હું ખૂબ નાનો ગણાઉં?”

પારણામાં જૂલતું બાળક સૌના આકર્ષણનું કેન્દ્ર છે. અને જો વ્યક્તિ સો વર્ષની થાય, તો ફરી એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને.

માણસના જીવનના પ્રત્યેક વર્ષમાં કાંઈકને કાંઈક વિશિષ્ટતા હોય છે. કેટલાક ગુણો બાળપણમાં જ જોવા મળે છે. પછી માણસ ૨૦નો થાય ત્યારે એ ગુણો જતાં રહે અને કેટલાક નવા ગુણો દેખાય. આજ રીતે, ૪૦, ૬૦ અને ૮૦માં વર્ષો પણ નવી નવી ખાસિયતો દેખા દે છે. કશુંક જાય અને કશુંક નવું આવે. માનસિક રીતે વ્યક્તિ જો સ્વસ્થ રહે, તો આવું સ્વાભાવિક રીતે બનતું રહે.

માણસની ઉમર કેટલી છે, તે મહત્વનું નથી. કોઈ પણ ઉમરે એ સર્જનશીલ અને પ્રભાવશાળી રહી શકે.

મોઝાર્ટ દું વર્ષની ઉમરે સંગીતના જલસા શરૂ કરી દીધા હતા, તો માઈકલ અન્જલોએ ૮૭મા વર્ષે એની સર્વાધિક વિખ્યાત કૃતિ બનાવી હતી. પિછુ ૨૪મા વર્ષે વડા પ્રધાન બન્યા, જ્યારે જ્વેડસ્ટોન ૮૮મા વર્ષે. કોલરિજે રૂપમા વર્ષે એની જગવિખ્યાત કવિતા ‘ધ ઓન્શિયન્ટ મેરીનર’ રચી, અને લીઅનાર્ડો દ વિન્ચી ૭૭ના હતા, ત્યારે એમણે પ્રખ્યાત ‘ધ લાસ્ટ સપર’ ચિત્ર બનાવ્યું.

તો પછી ઉમરનું આ ભૂત શું છે? શું આ નરી ભ્રમણા નથી કે કોઈ ઉપયોગી કામ કરવા માટે માણસ ખૂબ નાનો પડે છે અથવા તો ઘરડો પડે છે? માણસની સર્જનશીલ જિંદગીનો આરંભ ૮૮ે અથવા ૮૦મે વર્ષે પણ શરૂ થઈ શકે. મહાન માણસોનાં જીવનચરિત્ર વાંચીએ ત્યારે આ તથયનું આપણાને ભાન થાય છે.

ઉમરમાં તમે કેટલા નાના છો કે કેટલા મોટા,

તેનો કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં!

ઉમર તમારા માટે ક્યારેય બાધ્યરૂપ બની શકે નહીં!

- હર્બર્ટ કેસન

મનથી સદા યુવા!

મનથી સદા યુવા રહીને
ઉંમરે મોટા થતાં રહેવાનું ભવ્યાતિભવ્ય છે!

તમારું આંતર્મન કદી ઘરકું થતું નથી. એ તો સમય, ઉંમર અને અંતથી સદા પર છે. એ તો ઈશ્વરી ચેતનાનો એક અંશ છે, જે કદી જન્મતો નથી કે મરતો નથી.

શાંતિ, પ્રેમ, આનંદ, સુન્દરતા, શાશપણ, સદ્ગ્રાવના, સુભેળ અને સમજણ એ એવા ગુણ છે, જે કદી વૃદ્ધ થતા નથી કે નથી મરતા. જીવનમાં જો તમે આ સદ્ગુણોનો વિકાસ કરો તો મનથી તમે હંમેશાં ચિરયુવા રહેશો. તમારું શીલ, તમારા મનના સદ્ગુણો, તમારી શ્રદ્ધા અને નિષ્ઠા આ બધાં તો અવિનાશી તત્ત્વ છે.

આપણો જેને વૃદ્ધત્વ કહીએ છીએ, તેને આપણો આદરપૂર્વક સ્વીકારવું જોઈએ. વયસ્કતાને પોતાના ગૌરવ, સૌન્દર્ય અને ડહાપણ હોય છે.

રાલ્ફ વાલ્ડો ઈમર્સન કહે છે તેમ -

જ્યાં સુધી માણસ પાસે ગણનાપાત્ર બીજું કશું નથી હોતું
ત્યાં સુધી આપણો કદી માણસની ઉંમર ગણતા નથી.

ઉંમર તો એક માનસિકતા છે.

જો તમારી નજર ભાવિનું સ્વભાવ જોઈ ન શકતી હોય,

જો તમારી મહેચણાઓ ઠંડીગાર થઈ ગઈ હોય...

તો સાચે જ, તમે વૃદ્ધ છો!

પરંતુ, જો તમે હજુ પડા જીવનનું સર્વોત્તમ દોહી શકો,

જો જીવનમાં હોંશ ભર્યો ઉત્સાહ દાખવી શકો,

પ્રેમ વડે રહો હર્યાભર્યા...

તો વર્ષાં ભલેને વીતી જાય,

વર્ષગાંઠો આવે ને ઉરી જાય...

તમે કયારેય વૃદ્ધ નથી!

સદ્ગુરીય કે દુર્ભાગ્ય

ચીનની આ પ્રાચીન લોકકુથા સૂચવે છે કે
જીવનની જીવનતાને નસીબ સાથે કશી લેવાદેવા નથી.

એક વૃદ્ધ માણસ પાસે બધું હતું. વહાલો દીકરો હતો, રેસમાં જીતેલો ઘોડો હતો અને મોટાભાગના લોકો ઈચ્છે તે તમામ ભૌતિક સંપત્તિ એની પાસે હતી. પરંતુ એક દિવસે એની માંબેરી મિરાત સમો ઘોડો તબેલામાંથી ભાગી છૂટીને નજીકના પહોડોમાં જતો રહ્યો. એક જ પળમાં, એઝો પોતાની આ કિંમતી સંપર્ક ગુમાવી.

આવી પડેલી આપત્તિ વિષે સાંભળતાં એના પાડોશી સહાનુભૂતિ દાખવવા મળવા આવ્યા. એમણે કહ્યું, “તમારો ઘોડો જતો રહ્યો! કંવું દુર્ભાગ્ય!” ત્યારે વૃદ્ધ સામું પૂછ્યું કે - “આ દુર્ભાગ્ય છે એવું તમે શી રીતે તારવ્યું?”

અને સાચેજ, થોડા દિવસોમાં ઘોડો ઘેર પણો ફર્યો. એ પોતાની સાથે સરસ મજાના બાર જંગલી ઘોડા પણ લઈ આવ્યો હતો. ગામના લોકોએ જ્યારે આ વાત જાણી, ત્યારે આવીને કહેવા લાગ્યા... “વાહ! કેવું સદ્ગુરીય! તેર તેર ઘોડાનો ધણી!” ત્યારે પણ પેલા શાણા વૃદ્ધ આટલું જ કહ્યું કે - “આ સદ્ગુરીય છે એવું તમે શી રીતે જાણ્યું?”

બીજા દિવસે એના એકના એક દીકરાએ એક જંગલી ઘોડા પર સવાર થવાનો પ્રયત્ન કર્યો. એ ફંકાઈ ગયો અને એનો પગ ભાંગી ગયો તેમજ કાયમ માટે એ લૂલો પણ થઈ ગયો. અકરમાતનું સાંભળીને ફરીવાર એ લોકો આવીને બોલ્યા, “તમારો દીકરો કાયમ માટે અપંગ થઈ ગયો! ભારે ખોટું થયું! કેવાં કમનસીબ!” ત્યારે પણ પેલા શાણા માણસે આ જ પૂછ્યું કે, “તમે કેમ માનો છો કે આ કમભાગ્ય છે?”

અને બરાબર, એકાદ વર્ષ પછી યુદ્ધનો એક સેનાપતિ નગરમાં આવ્યો અને તમામ તગડા જીવાનિયાઓ વીણીવીણીને યુદ્ધ માટે લઈ ગયો. લડાઈમાં હાર થઈ અને બધા લડવૈયા મરી પરવાર્યા. ગામમાં માત્ર એક જ યુવાન બચ્યો હતો, અને તે હતો આ વૃદ્ધનો અપંગ દીકરો, કારણ કે અપંગતાને કારણે યુદ્ધમાં એની ભરતી નહોતી થઈ!

કોઈ ઘટના તમારા માટે સદ્ગુરીય કે દુર્ભાગ્ય લાવી છે. એ તમે જાણી નથી શકતા! એ તો સમય આવે જ ખબર પડે! એટલે તમારા ધ્યેયને પામવા માટે નસીબના ભરોસે રહેશો નહીં!

આવેગોને શમાવ... હે નાથ!

મારા આવેગોને શમાવ, મારા નાથ!

મારા હદ્ય-ધબકારને ધીમા પાડ,
મારા મનને શાંત કરીને.

સમયની શાશ્વતીના દર્શનપૂર્વક
મારી હરણિયા ફાળને થોભાવ!

દિવસભરની અનેક ગુંચવણો વચ્ચે,
અડગ પહાડોની રિસ્થરતા તું આપ!

મારી સ્મૃતિમાં સળવળતાં સરોવરનાં ગાનનાં શાંત સંગીત થકી
મારી નસેનસ અને સ્નાયુનાં દબાણોને શમાવ!

કોઈ ફૂલ સામે પળભર જોવા માટે,
થોડુંક થોભી જવાની કળા મને શીખવ!

મિત્રો સાથે ગપ્પા મારવાનું, કે કૂતરાને પંપાળવાનું,
બાળ સામે હસી લેવાનું કે
કોઈ સારા પુસ્તકની થોડી પંક્તિઓ વાંચી લેવાનું,
તું મને શીખવ, મારા પ્રભુ!

હંમેશાં મને યાદ અપાવતો રહે કે,
જીવનમાં હંમેશાં દોડની જ સ્પર્ધા નથી હોતી!
વેગ-આવેગ વધારવા કરતાં
જીવનમાં બીજું ઘણું બધું હોય છે!

ઉંચા આ વૃક્ષો સામું મને જોવા દે,
અને મને એ જાણવા પણ દે કે
એ આટલા ઉંચા અને મજબૂત બની શક્યાં
કારણ કે
તેઓ ધીરે ધીરે અને સુદૃઢ પણો ઉગતાં રહ્યાં!

- વિલ્ફેડ એ. પીટરસન

જીવનની દર્શિ

એક દિવસ

આપણા સૌનું મૂલ્યાંત્રન થશે...

આપણી જિંદગીના ગુણાદ્વારાથી...

નહીં કે

આપણા જીવનધોરણાથી!

આપણો કેટલું આખ્યું...

નહીં કે

આપણી સંપત્તિના પ્રમાણાથી!

આપણી સહજ ભરાઈથી...

નહીં કે

આપણી મોટાઈના દેખાવથી!





જીવનની દર્શિ

પતંગિયા સામે
બંદૂક તાણશો નહીં!

નજીબી બાબતોને
હસી હાઢશો...

એને દુઃખ ઘટનાઓ
અનાવશો નહીં!

જીવન એક દર્પણ

જગત ભર્યું છે ઉમદા દિલોથી, વીર જીવોથી,
નિર્મળ અને સંનિષ્ઠ આત્માઓ વસે છે આ જગમાં!
એટલે તમારામાંના સર્વોત્તમને બક્ષો જગને,
અને જગતનું શ્રેષ્ઠતમ પાછું આવી મળશે તમને!

પ્રેમ વરસાવો, અને તમ જીવનમાં વહીને આવશે એવો પ્રેમ,
જે શક્તિ સમાન સિદ્ધ થશે હર સંકટમાં!
શ્રદ્ધા સેવો, અને સેંકડો દિલોના શ્રદ્ધા-વિશ્વાસ
તમારા શબ્દો અને કૃત્યોમાં છલકાશે!

સત્ય આચરો, અને સવાઈ ભેટ તમને આવી મળશે,
આદર સામે તમે પ્રતિ આદર પામશો!
અને મધુ-મીઠું સ્મિત આપી તમે પામશો,
નિશ્ચિયત એટલું જ સુમધુર સ્મિત!

શોકમાં દૂબેલાને આપો દિલાસો-સહાનુભૂતિ!
વીળી શક્ષો ફૂલો તમે...
જર્જરિત વિચારોના વીખરાયેલાં બીજનું
ભલે વ્યર્થ એવું થયું હોય વાવેતર તો પણ!

કારણ, જીવન તો છે દર્પણ રાજ અને ગુલામનું,
આપણે જે છીએ અને કરીએ તેનું પ્રતિબિંબ!
એટલે તમારામાંના સર્વોત્તમને બક્ષો જગને,
અને જગતનું શ્રેષ્ઠતમ પાછું આવી મળશે તમને!

- મેરી ઔંગ દ વેર

—૭૮—

લોકો તમને જેવા ધારે છે, તે છે તમારી પ્રતિષ્ઠા...
તમે જેવા દેખાઓ છો, તે છે તમારું બઝિતવ્ય...
પણ વાસ્તવમાં તમે જે છો, એ છે તમારું ચારિય!

માનપાત્ર માનવ!

ખુશ રહેવું તો છે સાવ સરળ,
જ્યારે ગીત બનીને જીવન વહેતું સરસર!
પણ જ્યારે સધળાં પાસાં અવળાં પડે,
ત્યારે સાચો ભરજીવો તો દિલથી હસી જાણો!

કારણ, જીગરની ખરી કસોટી છે આફત,
અને વર્ષો વીતવાં સાથે એ ઉતરી જ આવે!
અને પૃથ્વીની પ્રશસ્તિને પાત્ર છે એવું સ્મિત,
જે ટપકતા આંસૂઓ વચ્ચે પણ ચમકતું રહે સ્મિત!

જીવનમાં કશું લોભામણું ભ્રમિત કરનાર ન હોય,
ત્યારે વિચાર-વિવેક દાખવવો છે સહેલો!
જ્યારે આત્માને આમ-તેમ ભટકાવવા
પાપનો કોઈ પોકાર ન હોય!

પરંતુ, કસોટીની એરણો ન ચઢે,
ત્યાં સુધી એ છે માત્ર નકારાત્મક ગુણ!
વિશ્વમાં સાચા સન્માનને તો છે લાયક,
એ જીવન જે વાસના સામે ટક્કર જીલી શકે!

આજે તો જગતના રાજમાર્ગ ઉપર ઉભરાય છે,
વક્ઠદર્શી, હતાશ અને ગમગીન!
ઝૂમવાનું કશું કૌવત દેખાડી ન શકતા
એવાજ લોકો બનાવે છે જીવનના સરવાળા!

પરંતુ લાલસા ઉપર વિજય પામતી નીતિમત્તા,
અને વેદનાને ઘૂપાવતું સ્મિત!
વિશ્વધરા પર વંદનીય છે આ સદ્ગુણા,
કારણ દર્શન એના છે ખરેખર દુલભ!

- ઈલા વીલર વિલકૉક્સ

સુવર્ણની શોધ

યુવાન સ્કૉટિશ અંડુ કાર્નેગી અમેરિકા આવ્યા અને ત્યાં નાના એવા કામ-ધ્યાનો આરંભ કર્યો. અંતે આખા અમેરિકામાં લોખંડના ક્ષેત્રે એ સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે પંકાયા. એક સમયે એમની પાસે ૪૩ લાખોપતિ કર્મચારીઓ હતા. એ જમાનામાં લાખો ડોલર હોવા ભારે મોટી બાબત હતી!

કોઈકે કાર્નેગીને માણસો સાથેના એમના વ્યવહાર અંગે પૂછ્યું તો કહે, “લોકો સાથેની આપણી વર્તણુંક એ સોનું ખોદવા જેવું છે. સોનાની ખાણમાં તમે ટનબંધી માટી ખોદો, ત્યારે કણાભર સોનું મળો! પરંતુ જ્યારે તમે ખોદવાનું શરૂ કરો છો ત્યારે તમે માટી માટે ખોદતા નથી! તમારી ખોજ સોનું છે!”

તમારું કેન્દ્રબિન્દુ શું છે? સુવર્ણના ખાણિયા બનો. લોકોમાં તમે દોષો જ જોવા લાગશો તો, એ તો ઠગલાબંધ મળશો! તમારે જોઈએ છે શું? અંડુ કાર્નેગીના જવાબમાં મહત્વનો સંદેશ ધૂપાયલો છે.

પ્રત્યેક વ્યક્તિમાં અને પ્રત્યેક પરિસ્થિતિમાં, કાંઈકને કાંઈક વિધાયક હોય જ છે! ક્યારેક કશું વિધાયક પામવા આપણો ઊર્દેશી સુધી ખોદવું પડે છે, કારણ કે નરી નજરે એ ન પણ દેખાય! વળી, આપણે લોકોની નબળી બાબતો જ જોવા એટલા બધા ટેવાઈ ગયેલા હોઈએ છીએ કે, સારી ચીજ આપણા ધ્યાનમાં જ આવતી નથી. કોઈકે સાચું કહ્યું છે કે ખોટકાઈ ગયેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર તો સાચી હોય જ છે!

એટલે યાદ રાખો કે સુવર્ણની શોધ હોય ત્યારે કણાભર સોનું મેળવવા મળાબંધ માટી ખોદવી જ પડે! તેમ છતાંય, તમારી શોધ માટીની નથી, તમારી શોધ તો છે સુવર્ણકણાની છે!

મકાન અને તેનો ઘડવૈયો

ઈમારતો બાંધનાર એક ઉમરલાયક બિલ્ડરને નિવૃત્તિ લેવાનું મન થયું. એણે પોતાના ઠેકેદારને બોલાવીને ધંધામાંથી મુક્ત થઈને કુંભ સાથે આરામથી જીવવાની પોતાની ઈચ્છા વિષે વાત કરી.

ઠેકેદારને તો પોતાનો એક સાથી કાર્યકર વિદ્યા લે તે કેમ ગમે? એણે કેવળ એક ઘર વધારે બાંધી આપવા માટે વિનાંતિ કરી.

બિલ્ડરે હા તો પાડી, પણ એનું દિલ કામમાં લાગતું નહોતું. એણે આજાઘડ કારીગરોને રોક્યા અને માલ પણ બધો નબળો વાપર્યો. આવી ખરાબ રીતે પોતાની કારકિર્દીનો અંત લાવવો, તે કમભાગી તો હતું જ.

જ્યારે એણે કામ પૂરું કર્યું, ત્યારે પેલા ઠેકેદારે ઘરની ચાવી એને જ સોંપતા કહ્યું, “આ તમારું મકાન છે! મારા તરફથી તમને ભેટ!”

બાપ રે! કેવો આધાત? અને કેવી શરમ? જો એ જાણતો હોત કે એ પોતાનું ઘર બાંધી રહ્યો છે, તો બધું જ એણે સાવ જુદી રીતે ન કર્યું હોત! હવે તો એને સાવ બંગાર ઘરમાં જ રહેવાનું થયું!

આપણું પણ આવું જ છે! આપણે પણ આપણા જીવન પર ધ્યાન આપતાં નથી! એમાં સક્રિયતા કરતાં પ્રતિક્રિયાત્મકતા જ વધારે હોય છે, આપણું સર્વોત્તમ રેડતાં નથી. જ્યાં વધુ કાળજી દાખવવી જોઈએ ત્યાં આપણે બેધ્યાન રહીએ છીએ. સામે જે પરિણામ આવે છે, તે જોઈ આધાત પામીએ છીએ અને પછી પેટ ભરીને પસ્તાઈએ છીએ!

મકાનના ઘડવૈયાના સ્થાને તમારી જાતને મૂકો. મકાનને સ્થાને તમારા જીવન ઘડતરને મૂકો. રોજ તમે જે ખીલી ઠોકો, પાટિયું મૂકો કે દિવાલ ચણો! જે કાંઈ રચો, તે સરસ રચો! રચવા માટે આપણને એક જ જીવન મળે છે!

એક દિવસ પણ વધુ જીવવા મળે, તો એ દિવસ સરસ રીતે, ગરિમાપૂર્વક જીવવો જોઈએ. દિવાલ પરનું લખાણ કહે છે : “જિંદગી ઘડવાની યોજના એ સંપૂર્ણતાઃ તમારા હાથમાં છે!”

તમારું વર્તમાન જીવન એ તમારા ભૂતકાળના વલણો અને પસંદગીઓના પરિણામરૂપે છે. આજે તમે જે વલણો દાખવશો અને જે પસંદગીઓ ચૂંટશો, એના પર તમારી આવતી કાલનું જીવન નિર્ભર છે!

માંગો તેટલું જીવન આપે!

મેં જિંદગી સાથે સોઢો કર્યો એક પૈસાનો,
અને જીવને એક પાઈ પણ વધુ ન આપી.
સાંજે, જ્યારે મેં મારો ખાલી ખજાનો જોયો,
વધુ માટે ઘણું કરગયો તો પણ!

કારણ, જીવન એ તો છે માત્ર માલિક,
માંગો તેટલું જ એ આપે.
પરંતુ એક વાર વેતન નક્કી કર્યાને,
પછી તો, મળ્યું એ સ્વીકારવું જ પડે!

મેં બાંધી હતી એક ચાકરની રોશ,
પણ ગ્રાસકો પડ્યો મેં જાણ્યું ત્યારે.
જે કાંઈ વેતન મેં માંગ્યું હોત,
જીવન મને તે ખુશીથી આપત!

- જેસી રીટનહાઉસ

આંખોની દંડિ હોય, પરંતુ જીવનદંડિ ન હોય...
તેના કરતાં તો જીલટી પરિસ્થિતિ વધુ સારી!

- હેલન કેલર

યથાર્થ જીવનનું વ્યાકરણ

તમારા વ્યાકરણને બરાબર સમજી લો! હંમેશાં ‘સક્રિય કર્તૃવાચ્ય’ માં રહો, ‘નિષ્ક્રિય કર્મવાચ્ય’ માં નહીં. તમારી સાથે જે બને તે કરતાં તમે પોતે જે કરો છો, તે પર વિશેષ ધ્યાન આપો. ભૂતકાળ માટે પસ્તાવો કર્યા વગર અથવા તો ભવિષ્યકાળ વિષે ચિંતા કરવાને બદલે, હંમેશાં ‘વર્તમાનકાળ’ માં જોવો.

હંમેશાં ‘પ્રથમ પુરુષ’ બની રહો. બીજાના દોષો જોયા કરવા કરતાં પોતાને તપાસતાં રહેવું સારું છે. ‘એકવચન’ માં જીવો, ટોળાની વાહ-વાહ મેળવવા કરતાં તમારા પોતાના અંતરાત્માના સ્વીકારનું વધુ મહત્વ છે.

સારો માર્ગદર્શકના સાથમાં...

આપણાં સપનાં પાર પાડવા આપણી પાસે ઘણા ઉપાયો હોય છે. પુસ્તકો વાંચવા, ટેપો સાંભળવી, પરિસંવાદોમાં જવું અને જુદા જુદા પ્રશિક્ષણ વર્ગોમાં જવું. આ બધું તો સારું, સાચું અને મહત્વનું છે. પરંતુ આપણા કામમાં અને જીવનમાં સાચા નિર્ણયો પર પહોંચીએ તે માટેનો સૌથી વેગીલો રસ્તો છે - સારો માર્ગદર્શક રાખવો. હજારો વર્ષોથી, લોકોના જીવન પર ભારે મોટો ગ્રભાવ આવા સલાહકારો દ્વારા પડી રહ્યો છે.

સારો માર્ગદર્શક તમારા વિકાસ અને ઉત્થાનને ઝડપી બનાવશે અને અનુસરવા માટેનો એક સારો નમૂનો પણ રજુ કરશે. તમારા ધ્યેયને હાંસલ કરવા જે કાંઈ જરૂરી પગલાં ભરવાં જોઈએ, તે ભરવામાં એ સાથે રહેશે. તમારો માર્ગદર્શક લીધેલા પગલાંનાં કોઈ બીજાં વિકલ્પો હશે તો તે સૂજાડશે, આગળ પર ક્યાં ખાડા-ટેકરા આવી શકે તે વિષે તમને ચેતવતો રહેશે અને જો જરૂરી હશે તો પરિવર્તન માટેની પદ્ધતિ અને ગ્રોત્સાહન બંને પૂરા પાડશે.

માર્ગદર્શક હશે તો તમે તમારા હેતુને વધુ ઝડપથી, વધારે કુશળતાપૂર્વક અને ઓછા પ્રત્યાઘાતો સાથે સિદ્ધ કરી શકશો. પ્રવાસમાં તમને એવો એક સાથીદાર મળશે જેની સાથે પ્રવાસનો આનંદ તો આવશે જ, તફુપરાંત તે તમને કદ્દી નુકશાન વેઠવા નહીં હે, અને તેના હૈયે તમારા તમામ હિતો વરસ્યા હશે.

તમારા માર્ગદર્શક નક્કી કરવામાં તમારા વિકલ્પોને મર્યાદિત ન કરશો. એકી સાથે, એક કરતાં વધારે માર્ગદર્શક હોય, તો તે તમારા માટે ઉત્તમ છે, એવો તમને અનુભવ થશે. તમે આર્થિક ક્ષેત્ર, આરોગ્ય અંગો, આધ્યાત્મિકતા માટે અને વેપાર-વ્યવસાય માટે જુદા જુદા માર્ગદર્શકો રાખી શકો.

તમે જેને માર્ગદર્શક બનાવવા માંગો, તેને અન્ય કોઈએ માર્ગદર્શન આપ્યું હશે. એવી જ રીતે તમારું માર્ગદર્શન મેળવવા પણ કોઈ પ્રતીક્ષા કરતું હશે. તમને કશુંક મૂલ્યવાન શીખવા મળ્યું હોય, તો તે બીજાને આપવાની તમારી જવાબદારી છે. આમ અંતે આ ‘અરસ-પરસની જીત’નો સંબંધ છે!

- ટોડ ડિકન

જીવન તો જેવું બનાવીએ તે!

ઉમદા કાર્યોની ચાલો વાત કરીએ
ન કરીએ વાત કોઈ ખોટા કામોની,
અને ગીત ગુનગુનાવીએ સુખી ટિવસોના
ન ગાઈએ આપણા દુઃખના ગાણા.

નથી સર્જયા આપણે ચીડાવા કે નિસાસા નાખવા
અને સૂતેલા વિધાદ-વ્યથાને જગાડવા.
ઉજ્જવળ આનંદ છે ઉભો આપણી પડખે,
જીવન તો જેવું બનાવીએ તે!

ચાલો શોધીએ માનવોનાં ઉજળાં પાસાં
અને રાખીએ એમાં પૂર્ણ વિશ્વાસ.
છે દરેક જીવમાં કાંઈક એવો પ્રકાશ,
જે કષ્ટ ઉઠાવે છે એની જીત માટે.

અરે! પડી હોય છે સૌ કોઈમાં સુષુપ્ત ભલાઈ
અને જો તક ઉઠાવીએ અને જગાડવાની.
આપણા હાથમાં જ છે છડી જાહુઈ,
જીવન તો જેવું બનાવીએ તે!

વળી અહીં એવાં પ્રેમાળ હૃદય પણ
જે પ્રકાશ અને આનંદ પ્રસરાવે.
ધન્યવાદ છે એમને, જેમના વગર
ન જાણી શક્યા હોત અગણિત રત્નો.

આ બધાંની સાથે જોડાય છે
બને તેમની દુનિયા ધન્ય અને સુખી.
જો ન થઈ શકે એમ, તો ભૂલ છે આપણી જ
જીવન તો જેવું બનાવીએ તે!

- જ્યોર્જ ઈલિયટ



ઓછાં સાધનો સાથે પણ સંતુષ્ટ રહી જીવં...
વૈભવ-વિલાસ કરતાં સૌજન્યશીલ લાલિત્ય શોધવું...
અને ફેશન કરતાં સુલચિપૂર્ણ સૌંદર્યની ખોજ...
માનનીય નહીં પણ આદરને પાત્ર બનવું...
અને બનવું સમૃદ્ધ, નહીં ધનવાન!

સધન વિદ્યાપ્રાપ્તિ માટે, વિચારવું શાંત ચિત્તે...
સૌમ્ય સંવાદ, કાર્ય નિખાલસ...
તારલા અને પંખીડાને, બાળક અને મહાત્માને...
સાંભળવા ખુલ્લા દિલે અને મોકળા મને...

સૌને આનંદપૂર્વક સહી લેવા...
અને કરવું સધજું કામ વીરતાપૂર્વક...

આ છે મારું જીવન દર્શન!

– વિલિયમ ચેનિંગ

દુનિયા બદલવા જતાં...

જ્યારે હું નવલોહિયો યુવાન હતો,
દુનિયાને મારે બદલવી હતી.
પણ મને દુનિયા બદલવાનું અધરં લાગ્યું,
એટલે મેં મારા દેશને બદલવાનું નક્કી કર્યું.

પરંતુ મેં જોયું કે દેશ પણ હું બદલી શક્યો નહીં,
એટલે મેં ધ્યાન આપ્યું મારા શહેર ઉપર.
મારા શહેરને પણ ન બદલી શક્યો અને ઊમર થતાં
મેં મારા કુટુંબને બદલવાનો પ્રયાસ શરૂ કર્યો.

હવે એક વૃદ્ધ તરીકે, મને સમજાયું છે કે
બદલી શકું તો હું કેવળ જાતને.
અને અચાનક એ પણ સમજાયું, કે જો વર્ષો પહેલાં
મેં મારી જાતને બદલી હોત તો
પાડી શક્યો હોત તેનો પ્રભાવ મારા કુટુંબ પર.

મારો પરિવાર અને હું બને મળીને
અમારા નગર ઉપર પણ પ્રભાવ પાડી શક્યા હોત.
એની અસરથી બદલાયો હોત મારો દેશ
અને આમ, સાચે જ, હું દુનિયાને પલટી શક્યો હોત!

બહેતર ‘તું’ શી સારંભ ઊર!

“તારે બહેતર દુનિયા બનાવવી જોઈએ!” પ્રભુએ કહ્યું.

એણે પૂછ્યું, “શી રીતે?
જગત તો કેવું અદ્ભુત સ્થાન છે
અને સાથે કેવું ગૂચવાયેલું!
અને હું તો સાવ નાનકો, વળી નકામો.
હું શું કરી શકું, નાથ?”

પરંતુ સર્વજ્ઞ અને કૃપાળુ પ્રભુએ જવાબ વાળ્યો,
“પહેલા બહેતર ‘તું’ નું સર્જન કર!”

- એલેક્ઝાંડર પોપ

પ્રભુ, આપ સાવા માનવ!

પ્રભુ, અમને એવા માણસ આપ! આજના સમયને લાયક,
મજબૂત મનના, દરિયાવ દિલના,
હોય જેમની સાચી શ્રદ્ધા અને તત્પર હાથો.

એવા માણસો, જેમને અધિકારનો મોહ મારી ન શકે,
જેમને હોદાની બદીઓ ખરીદી ન શકે,
એવા માણસો જેમને પોતાના અભિગ્રાય અને મનોબળ હોય
જેમને સ્વાભિમાન હોય, જે અસત્ય ન બોલે.

એવા માણસો જે લોકલાગણી ઉશ્કેરનારનો સામનો કરી
અને તેમની વિશ્વાસઘાતી પ્રશંસાનો મક્કમ પ્રતિકાર કરે!
મૂઠી ઊંચેરા માનવી, સૂર્ય-તાજ વિભૂષિત, ધુમ્મસથી રહેતા અલિપ્ત,
જાહેર સેવામાં તેમજ ખાનગી ચિંતનથી.

જ્યાં તોફાની ટોળાની અંગૂઠાછાપ માન્યતાઓ,
મોટા એમના દાવાઓ અને શૂન્યસમા કામો,
સ્વાર્થના સંઘર્ષમાં સદા અટવાયેલા...
જુઓ કેવી રડી રહી છે સ્વાતંત્ર્યની દેવી,
બદી રાજ કરે છે પૃથ્વી પર...
અને વિવંબિત ન્યાય ઉંઘે છે!

- જોસીયાહ ગિલબર્ટ હોલેન્ડ

માનવ નિર્માણ

અંધ છીએ આપણો સૌ જ્યાં સુધી ન નિહાળીએ...
શું છે માનવ આયોજન?
નથી કોઈ રચનાનો અર્થ...
માનવ નિર્માણ જો તે ન કરી શકે!

શાં માટે બાંધવાં આ જળહળતાં નગર...
જો માનવનું સર્જન ન થઈ શકે?
બાંધકામ આપણું વ્યર્થ બની શકે...
જો બાંધનારનું પણ ન થાય નિર્માણ!

- એડ્રિન માર્કહેમ

તમે ફરત પાડી શકો!

દરિયાકંઠે દાદા સાથે ટહેલતા પૌત્રની આ વાત છે. દાદાજી વારંવાર પાણીમાં જઈ, કાંઠાના ‘સેન્ડ-ડૉલર’ને પકડી પાછા દરિયામાં નાંખતા રહેતા હતા. આ બધું થોડો વખત જોતાં રહી, પૌત્રે અંતે પૂછ્યું, “દાદાજી, તમે આ શું કરો છો?”

તો હસીને દાદા બોલ્યો, “બેટા, વાત એમ છે કે આ ‘સેન્ડ ડૉલર’ જીવિત જળ-તત્ત્વો છે. એમને જો હું પાછા દરિયામાં ન નાંખી દઉં તો સૂરજના તાપમાં એ મરી જાય.”

ત્યારે પૌત્ર બોલ્યો, “પણ દાદાજી, આવાં તો હજારો જીવડાં કાંઠા પર પડ્યાં છે! તમે આટલું કરો, એથી શો ફરક પડે?”

દાદાજીએ એ જ ક્ષણો, નીચા વળીને એક જીવડાને હાથમાં લઈ દરિયામાં નાંખ્યું અને કહ્યું, “આ એક જીવડાને તો ભારે મોટો ફરક પડ્યો. કેમ ખરું ને??”

તમે જગત આખાને બદલી ન શકો, પરંતુ જ્યારે તમે તમારી પોતાની દુનિયા બદલી નાંખો ત્યારે બીજાની દુનિયા બદલવા તરફનું એક ભારે મોટું કદમ તમે ઊઠાવો છો! એ બીજા લોકો એવા હશે, જેમાંના ઘણાને તમે કદી જાણશો પણ નહીં, પરંતુ તમારા શર્બદો કે પ્રત્યક્ષ કૃત્યો દ્વારા એમના જીવનમાં પરિવર્તન આવી શકે. ડૉક્ટર જહોન મેક્સિવેલ કહે છે કે સરેરાશ મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન દસેક હજારથી વધુ લોકો પર પોતાનો પ્રભાવ પાડી શકે છે. આ સાવ નગણ્ય તો નથી જ!

કોઈકે ક્યાંક કહ્યું છે કે વરસાદનું કોઈ એક ટીપું પૂરની જવાબદારી લેતું નથી, પણ હકીકત એ છે કે દરેક ટીપું પોતાનો ભાગ ભજવે છું. કમનસીબે, મોટા ભાગના લોકો પોતાના હાથ ઊંચા કરી કહી દે છે કે - “એમાં હું શું કરી શકું?”

બીજું કાંઈ નહીં તો તમે કાંઠા પરનાં દરિયાઈ જીવડાને પાછા દરિયામાં તો ફેંકી શકો, જેથી એ જીવી શકે. તમે મદદ જંખતા લોકો પાસે પહોંચ્યો થોડા સહાયભૂત તો થઈ જ શકો. તમારી આસપાસના જ નહીં, પણ તેમના દ્વારા બીજા ઘણા બધા સાથે વાત કરીને તમે પ્રોત્સાહન આપી શકો. બીજું કશ્યું નહીં, તો તમારું જીવન સ્વયં, એક સુવાક્ય બની શકે!

- જીગ જીગલર

તડવાળો ઘડો

ભારતમાં એક પનિહારા પાસે બે મોટા ઘડા હતા, જે વાંસની કાવડના બંને છેડે લટકેલા હતા. પોતાની ગરદન પર પાણીની આ કાવડ એ ગોઠવતો. એક ઘડો તડવાળો હતો, બીજો સાજોસમો હતો. સાજો ઘડો કેઠ નદીથી તે માલિકના ઘર સુધી બધું પાણી યથાવત્ ઘેર પહોંચાડતો હતો, જ્યારે તડવાળો ઘડો ઘેર પહોંચતો ત્યારે અડવો થઈ જતો!

બે વર્ષ સુધી આમ ચાલ્યું. અંતે એક દિવસ પેલા તડવાળા ઘડાએ પનિહારાને કહ્યું, “મને મારી શરમ લાગે છે અને હું તમારી માફી માંગુ છું.” ત્યારે પનિહારાએ પૂછ્યું, “કેમ, શેની શરમ લાગે છે?”

ત્યારે ઘડો કહે, “છેલ્લાં બે વર્ષથી હું અડવું જ પાણી ભરી શકું છું. કારણ કે તડને કારણો અડવું પાણી તો અમથું જ રસ્તા પર વેડફાઈ જાય છે. તમારે કામ તો પૂરેપૂરું કરવું પડે છે, પણ તેની પૂરી કિંમત તો તમને મળતી નથી!”

પેલા પનિહારાને જૂના તડવાળા માટલા માટે દિલગીરી થઈ પણ સહાનુભૂતિભર્યા અવાજે એ બોલ્યો, “આપણે આપણા માલિકને ઘેર પાછા જઈએ ત્યારે રસ્તા પરનાં સુંદર ફૂલો જોવા મારી તને વિનંતિ છે!” અને સાચે જ, જ્યારે તેઓ ટેકરી પર ચઢ્યા, પેલા તડવાળા માટલાએ જોયું કે રસ્તાની બાજુ પર ખીલેલાં સુંદર વન્ય ફૂલો પર હુંઝાળો સૂરજ ચમકતો હતો!

પનિહારાએ માટલાને કહ્યું, “તે જોયું કે આ ફૂલ માત્ર તારા તરફના રસ્તાની બાજુ પર છે અને બીજી તરફ નથી? એનું કારણ આ છે કે, જ્યારથી તારી તડમાંથી પાણી વહી જવાની મને ખબર પડી ત્યારથી મેં અનો ફાયદો ઉઠાવ્યો. મેં રસ્તાની તારી બાજુ પર ફૂલોનાં બી વાવ્યાં અને રોજ જ્યારે આપણે ઘેર પાછા ફરતાં ત્યારે તું એમને પાણી પાતો. છેલ્લાં બે વર્ષથી, આ સુંદર ફૂલો ચુંટીને હું મારા માલિકના મેજને શાશગારું છું. તું જેવો છું તેવો ન હોત તો, એમને એમના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા આ સુંદર ફૂલો ન મળ્યાં હોત!”

આપણા સૌમાં કોઈ તુટિ રહેલી છે. આપણો જો પેલા તડવાળા ઘડા જેવા છીએ. પરંતુ આ આપણો આપણામાં રહેલી તડ અને તુટિઓનો કલ્પનાસમબર ઉપયોગ કરીએ, તો આપણા જીવન સાચે જ લાભદાયી બની રહે!

પાડ માનો!

પાડ માનો કે, તમે માંગો તે બધું તમારી પાસે નથી,
જો એ બધું મળ્યું હોત, તો શેની અપેક્ષા રહેત?

પાડ માનો કે તમે સર્વજ્ઞ નથી,
જેથી કશુંક શીખવાની તમને તક મળે છે!

પાડ માનો, સંકટ સમયનો,
તે દરમ્યાન જ, તમે વિકસી શક્યાં!

પાડ માનો, તમારી ભર્યાદાઓનો,
કારણ કે એથી સ્તો તમને સુધરવાની તક રહે છે!

પાડ માનો, પ્રત્યેક નવા પડકારનો,
કારણ કે એ જ રચશે તમારાં જોમ અને શીલ!

પાડ માનો, તમારી ભૂલોનો,
એ જ શીખવશે તમને મૂલ્યવાન જીવનપાઠ!

પાડ માનો, જ્યારે થાક અને શ્રમ અનુભવો,
એથી તો સિદ્ધ થાય છે તમારા પ્રયાસ!

જીવનમાં સારી બાબતો માટે તો સૌ કોઈ આભાર માને!
પરંતુ જીવનની સમૃદ્ધ કૃતાર્થતા ત્યારે પ્રગટ થાય છે,
જ્યારે માણસ પોતાની પડતી માટે પણ કૃતજ્ઞ બને છે!

મિત્રોની સોગાદ!

આ શ્રમિત પૃથ્વીનાં તમામ દુઃખો, માનવોની પીડા અને ઉદ્ઘાગો,
બધાં એકસામટાં ભેગાં કરાઈને અપાયાં હોત જો મને,
તો પણ મારી પાસે મારી કિંમતી દોલતનો ભાગ શેષ બચત!

ધન્યવાદ પ્રભુનો મિત્રો માટે, કે વર્ષો વધતાં મિત્રો પણ વધે છે,
જ્યારે ધન-વૈભવ, આશા-અરમાનનું કરે છે ખંડન,
ત્યારે જમીન-સોના કરતાં પણ કિંમતી, ભવ્ય વરદાન સિદ્ધ થાય છે,
પછી ભવેને બધું લૂંટાઈ જાય, સાચી મૂડી તો છે મુજ મિત્રો!

હે જીવન નાથ! કૃપા વરસાવો અને બક્ષો મને...
જીવનપથના સાચા સાથી એવા મિત્રોની સોગાદ!

તમે ટોચ ઉપર છો, જ્યારે...

૧. તમે બરાબર સમજો છો કે, નિષ્ફળતા એ ઘટના છે, વ્યક્તિ નથી! વળી એ કે, ગઈ રાતે ગઈ કાલ તો પૂરી થઈ ગઈ અને હવે ‘આજ’ એ તો સાવ નવોનકોર દિવસ છે!
૨. ભૂતકાળ સાથે દોસ્તી બાંધી, તમે હવે વર્તમાન પર કેન્દ્રિત થયા છો અને તમારા ભવિષ્ય અંગે આશાવાદી છો!
૩. તમે જાણો છો કે સફળતા તમને બનાવતી નથી અને નિષ્ફળતા તમને તોડતી નથી.
૪. તમે શ્રદ્ધા, આશા અને પ્રેમ વડે સભર છો અને કોધ, લોભ, અપરાધભાવના કે ઈઞ્ચા-વેરજેર વગર જીવો છો.
૫. તમારા વિરોધીઓને તમે તમારા મિત્ર બનાવ્યા છે અને જેઓ તમને સૌથી વધારે જાણે છે, તેમના પ્રેમ અને આદર તમે મ્રાપ્ત કર્યા છે.
૬. તમે સમજો છો કે બીજા તમને સુખ આપી શકશો, પરંતુ સાચો આનંદ તો ત્યારે જ અનુભવાય છે, જ્યારે આપણો બીજા માટે કશુંક કરી છૂટીએ છીએ.
૭. તમે કઠોર લોકો પ્રત્યે આનંદી, અસભ્યો પ્રત્યે મળતાવડા અને જરૂરતમંદો પ્રત્યે ઉદાર બનો છો.
૮. ચાહવા મુશ્કેલ તેવા પર પણ તમે પ્રેમ ઢોળી શકો છો, નિરાશામાં દૂબેલાને આશા, મિત્રવિહોણાને મૈત્રી અને હતાશ થયેલાઓને તમે પ્રોત્સાહન આપો છો.
૯. ક્ષમા આપવામાં પાછળ, આશા સેવવામાં આગળ, કરુણામાં નીચે અને આભારવશતામાં તમે ઉપર જોઈ શકો છો!
૧૦. તમે પારખી શકો છો, કબૂલ કરી શકો છો, વિકાસ કરી શકો છો અને તમારી ઈશ્વરદત્ત શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને ઈશ્વરની કીર્તિ સ્થાપવામાં અને માનવજીતિના લાભ માટે વાપરી શકો છો.
૧૧. વિશ્વના સર્જનહાર સમક્ષા તમે ખડા રહો છો અને એ તમને બિરદાવે કે - “શાબાશ બેટા, મારા ભલા અને વજાદાર સેવક! તેં સરસ કામ કર્યું!”

- જીવા જીગલર

ઠહાપણાનો ભંડાર

હવે પછી શું ઊરવું
એ જાણવું...
તે છે ઠહાપણા!

તે કેવી રીતે ઊરવું
એ જાણવું...
તે છે કાર્યકુશળતા!

અને જાણ્યા પછી
તેબું ખાચરણ ઊરવું
એ જ છે સાચો સદ્ગુણા!





ଡଣାପଣାନୋ ଭଂଡାର

ପବନନୀ ଦିଶା
ଆପଣେ ଭଲେ ନ ବଢ଼ି ଶାଙ୍କିଏ...

ପରଂକୁ
ସାବୁକୁଣ୍ଡ ସଠ
ତୋ ଜରୁର ତାଣୀ ଶାଙ୍କିଏ!

ତମାରୁ ବଣାଏ
ତମାରା ସୁଧି ପଛିଏ...
ତେବୀ ରାଣ ନ ଜୁଖୋ...

ତ୍ୟାଂ ସୁଧି ତରୀ ଜବାନୀ
ତୈୟାରୀ ରାଖୋ!

સંઘ-ભાવના

સંઘ ભાવનાના પ્રેરક પાઈ શીખવા માટે, આકાશમાં ઊડતા કલહંસો (Geese)ની હારની રસપ્રદ રીતને ધ્યાનપૂર્વક જોઈએ.

હંસોની એ હાર હંમેશા V આકારમાં જ કેમ ઊડે છે? એનો વૈજ્ઞાનિક ખુલાસો એ છે કે જ્યારે દરેક પક્ષી પોતાની પાંખો હવામાં વીજે છે ત્યારે એને અનુસરતા પંખીને તે ઉત્તત કરે છે.

જ લોકો કોઈ એક સમૃહના ભાગરૂપ હોય અને એક જ દિશામાં ગતિ કરે, તો તેઓ પોતાની મંજિલે વધારે ઝડપભેર અને સુગમતાથી પહોંચે શકે છે, કારણ કે તેઓ પરસ્પરના વિશ્વાસે ચાલે છે.

વચ્ચે ક્યાંક કોઈ હંસ V આકારમાંથી આડોઅવળો થવા માંડે તો તરત જ એ એકલા ઊડવાની દિશામાંથી વિરોધી ખેંચાડું અનુભવે છે અને એ પાછો V આકારમાં આખા સમૃહની શક્તિનો લાભ લેવા પહોંચી જાય છે.

આપણામાં જો હંસ જેટલી વિવેકબુદ્ધિ હોય, તો આપણી જ દિશામાં આગળ જતાં લોકો પાસેથી માહિતીની આપ-લેનો લાભ મેળવવો જોઈએ.

જ્યારે આગળનો હંસ થાકે ત્યારે એ પાછળ સરકી જઈ બીજાને પોતાનું સ્થાન આપે છે.

નેતૃત્વ લેવામાં વારાફરતી ભાગીદારી નોંધાવીને અધરા કાર્યો પાર પાડી શકાય.

પાછળના હંસો આગળના હંસોની ગતિ વધારવા કાંઈક ને કાંઈક અવાજ કરતા રહે છે.

આપણી આગલી હરોળમાં જે હોય, તેમને ટેકો અને પ્રેરણા આપે તેવા પોકારો કરતા રહેવાથી તેમનો થાક અને બોજો ઓછો થાય છે.

સમૃહમાંનું કોઈ એક પંખી માંદું પડે કે કોઈ પિસ્તોલની ગોળીથી નીચે પડી જાય તો બીજા બે પંખી પણ બહાર નીકળી જઈ ધાયલ હંસ પાસે પહોંચી જાય છે અને એને મદદ કરી સાચવે છે.

કપર સંજોગો આવી જાય ત્યારે આપણો એકમેકને સહાયત્વત થતું!

એટલે ફરીવાર જ્યારે તમે હંસોની હાર જૂઓ ત્યારે યાદ રાખજો કે કોઈ જૂથ કે ટોળકીના સભ્ય બનીને પોતાનો ભાગ ભજવવો એ સુંદર પડકાર, અધિકાર અને પુરસ્કાર છે!

ગુણવત્તાની ચાવી

એક વ્યવસ્થાપક પોતાના એકેએક કર્મચારીઓ કેટલા મહત્વના છે તે દર્શાવવા નીચે મુજબનું લખાણ કરતો. કોઈ પણ જૂથ કે સંસ્થાનો એકેએક માણસ પોતાની કિંમતી ભૂમિકા કેવી રીતે ભજવે છે તે આ લખાણમાં સરસ રીતે દર્શાવાયું છે. તદ્દુપરાંત, આખું જૂથ સાથે મળીને કામ કરે અને એક એકમ તરીકે જ સફળતાને વરે તે જોવાનું કામ જે-તે વિજિતનું છે, આ વાત પણ સ્પષ્ટ કહેવાઈ છે.

કોઈ એકાદો માણસ પણ (આ હણાંતમાં ‘ક’) જો બરાબર કામ ન કરે તો ઉત્પાદનની ગુણવત્તા પર કેવી અવળી અસર પડે છે તે તપાસો! નીચેના ટાઈપોમાં ‘ક’નું બટન ખોટકાઈ ગયું છે એટલે ‘ક’ ને સ્થાને X કરવું પડ્યું છે.

દરેX માણસ મહત્વનો છે.

મારું ટાઈપ રાઈટર જૂનું થઈ ગયું છે તો ય એ સારું Xમ આપે છે. માત્ર એXજ બટન તેમાં બગડ્યું છે, એ બટન છે Xનું. તમને થશે કે બીજા બધાં બટનો બરાબર Xમ આપતાં હોય તો એX બગડેલા બટનથી ખાસ ફરીX ન પડે, પરંતુ એX બટન પણ સરખું ન ચાલે તો Xમની બધી મજા બગડી જાય છે!

તમે તમારી જાતને Xહી શકો. અરે, હું એXલો માણસ સારું Xમ નહીં કરું તો Xોઈનું ધ્યાન નહીં જાય, પરંતુ એથી ચોXXXસ ફરીX પડે છે, Xારણ ખે સંગઠનમાં Xાંઈ પણ પરિણામ લાવવું હોય તો પ્રત્યેX વિઝિતની ઉત્તમોત્તમ શાખિત પ્રગટ થાય તેની સખ્ખિય ભાગીદારી નોંધાવી જોઈએ.

એટલે ફરીવાર જ્યારે વિચારો X તમારું Xોઈ મહત્વ નથી, ત્યારે મારું આ જૂનું ટાઈપરાઈટર યાદ Xરજો. તમે ‘Xી’ પર્સન છો, ચાવીરૂપ છો!

બાળક શીખે આ રીતે!

બાળક જો નિંદાકુથલી વચ્ચે જીવે તો એ અવગણતાં શીખે.

જો એ પ્રશંસા વચ્ચે જીવે તો એ કદર કરતાં શીખે.

બાળક જો વેરઝેરમાં ઉછરે તો એ જઘડાખોર બની જાય.

પણ જો એ સહિષ્ણુતા સાથે જીવે તો અનામાં ધીરજ વિકસે.

બાળકની જો મશકરી થતી રહે તો એ શરમાળ બને.

અને જો અને શાબાશી મળતી રહે તો અનામાં આત્મવિશ્વાસ પ્રગટે.

જો બાળકને હરવડી શરમાવું પડે તો અનામાં અપરાધભાવના જાગે.

પણ જો અને અનુમોદન મળતું રહે તો અનામાં આત્મગૌરવ ઉભરે.

બાળક સાથે જો સદ્વ્યવહાર થાય, તો એ ન્યાયભાવના કેળવે.

જો એની સરસ સંભાળ લેવાય, તો શ્રદ્ધા રાખતાં શીખે.

બાળકના સહજ સ્વીકાર સાથે જો મૈત્રી કેળવાય

તો જગતમાં એ પ્રેમ પામતાં શીખે.

જવાબદાર તોણા?

એક ન્યાયાધીશે ગુનેગારને લુંટ ચલાવવા માટે સજા ફરમાવીને પૂછ્યું, “તારે કાઈ કહેવાનું છે?”

ત્યારે પેલા ગુનેગારે કહ્યું, “હા, નામદાર સાહેબ, મારા મા-બાપને પણ જેલની સજા ફટકારો!”

ન્યાયાધીશે એનું કારણ પૂછ્યું.

ત્યારે એડો જવાબ આપ્યો, “હું જ્યારે નાનો હતો ત્યારે શાળામાંથી એક પેન્સીલ ચોરી આવ્યો. મારા મા-બાપને એની ખબર હતી પણ તેઓ એક શર્બદ પણ ન બોલ્યા. પછી તો નિશાળમાંથી અને અડોસપડોસમાંથી હું ઘણું બધું ચોરતો થઈ ગયો અને ધીરે ધીરે મારા માટે ચોરી એ વળગણ થઈ પડ્યું. મા-બાપ આ બધું જાણતા હતાં, પણ આંખ આડા કાન કરતા રહ્યા. એટલે જેલમાં મારી સાથે કોઈ હોવા જોઈએ તો તે મારાં મા-બાપ છે.”

ખોટું કરવા બદલ સંતાન તેની જવાબદારીમાંથી મુક્ત થતું નથી, તેમ છતાં પોતાની જવાબદારીઓ અદા કરવામાં કસ્તૂરવાર મા-બાપ પણ એટલા જ ઢોળી છે.

નાનકડી આંખો જૂણે છે તમને!

બે નાનકડી આંખો, સતત રાત અને દિવસ
ટીકી-ટીકીને જોઈ રહી છે તમને.

એવા જ નાના બે કાન, ઝડપભેર જીલી રહ્યા છે
તમારા એક-એક બોલને.

બે નાનકડા હાથ છે, તમે જે કાંઈ કરો
તે કરવા આતુર.

અને સપનાં જોતું એ નાનું બાળક
મોટું થઈને થવા માંગતું તમારી માફક.

એ નાનકડા બાળના તમે છો દેવાધિદેવ,
એને મન છો તમે શાશપણના રાજા.

એના નાનકડા મનમાં તમારા વિશે
ક્યારેય કોઈ પ્રકારની શંકા ન ઉદ્ભબે.

ભક્તિભાવભરી શ્રદ્ધા સાથે, તમે જે કાંઈ કહો કે કરો,
તને એ સહૈવ માથે ચડાવે.

તમારા જેવો મોટો થશે જ્યારે એ
ત્યારે એ પણ બોલશે-ચાલશે તમારા પગલે.

વિસ્મયી નયનો ધરાવતો એ બાળ
તમે જ સદા સાચા એવી અતૂટ એની શ્રદ્ધા.

એની આંખો સતત ટીકી રહે છે
દિવસ-રાત જોતો એ તમને અને તમને જ.

રોજ જે કાંઈ કરો છો તમે, તે દ્વારા
બેસાડો છો એક દાખલો એના મનમાં,

પેલા નાનકડા બાળ માટે, જે જંખે છે
મોટા થઈને બનવું એને તમારા જ જવું!

પુસ્તકોની દુનિયા

પુસ્તકોનું આ વિશ્વ એ તો છે માનવનું આગવું સર્જન!

બીજું જે કાંઈ એ રચે, તે ટકી ન શકે સદાકાળ.
સ્મારકો પડી ભાંગે, રાષ્ટ્રો નાશ પામે,
સત્યતાઓ પુરાણી થઈ મરી પરવારે.

અને અંધકારના લાંબા યુગ બાદ, નવા લોકો નવસર્જન કરે!

જ્યારે પુસ્તકોની દુનિયામાં તો એવા ખંડોને ખંડો છે,
જેઓ સાક્ષીરૂપ છે આવી ઘટનાઓનાં પુનરાવર્તનના.

હજુય એ જીવે જ જાય છે, નિત્ય નવાં બનીને.
લખાયાં ત્યારે હતાં, તેવાં જ સ્વૃતિદાયક અને પ્રેરણાશીલ
સેકાઓ અગાઉ મૃત્યુને વરી ચૂકેલા
લોકોના દિલની વાત હજુ આજ પણ
કરી રહ્યાં છે, આ નિત્ય નૂતન ગ્રંથ!

સદ્ગ્રંથોનો સ્વાધ્યાય તરો!

સદ્ગ્રંથ એવી અજબ ચીજ છે, જે જીવાત્માને મ્રવાસ કરાવે છે.

અવનવી રોમાંચક રાહો ખેડી,
સ્વખ્નેય ન કલ્પેલાં નવાં દ્વાર ખોલવાની.

ચક્ષુ સમક્ષ ખોલે એ ભાવિની ઝાંખી,
જ્યાં પાર કરવાના દૂરસ્થિત સુખદ અંતર.
બહાર નીકળીને કોઈ પંથ પકડે ત્યારે,
રોજ-બરોજની ચિંતાઓ એ ઉપાડી લે.

અરે, સાચેજ, સારું પુસ્તક લઈને,
ઘેર રહીને પણ, હૈયું કરી શકે જગની સેર.
બસ જોઈએ, એક મેજ, દીવો અને ખુરશી,
અને દૂબી જઈએ આપણે કોઈ કાલ્ય કે રહસ્ય કથામાં.

મશાગુલ થઈને એક પૃષ્ઠના શબ્દોમાં
ઓ પ્રશ્નાર્થી યુવા, ઓ ખોળતી અવસ્થા.
વાંચો પુસ્તકોને, સદ્ગ્રંથોનો સ્વાધ્યાય કરો
અને તમે મેળવશો સાહસસભર નૂતન વિશ્વની રૂપરેખા!

વસાવો ઘરબું પુસ્તકાલય!

મને બતાવો માણસના ઘરનું પુસ્તકાલય...

કેવાં પ્રકારનાં પુસ્તકોનું વાંચન કરે છે એ...

અને એ માનવીનું ચારિશ્ય હું વધુ સારી રીતે આહી શકીશ.

સાથોસાથ સારી એવી ચોકસાઈથી,

હું તેનું ભાવિ પણ ભાખી શકીશ!

જીવનમાં ઉદાત્ત આદર્શો અને ઉમદા હેતુઓ સર કરવા માટે આત્મ-પુરુષાર્થ લક્ષી અને પ્રેરણાદાયી પુસ્તકો, એ માનવીના પ્રયત્નોમાં સૌથી મૂલ્યવાન એવું સાધન છે. પ્રયેક ઘરમાં ચોપડીઓ માટેની અભરાઈ તો જોઈએ જ, જેમાં આધ્યાત્મિક, માનસિક અને ભૌતિક સિદ્ધિઓ માટેનું દિશાસૂચન સંઘરાયેલું હોય.

વાંચનનો મુખ્ય ઉદેશ છે તમને મનનું વિશાળ જ્ઞાન તેમજ માહિતીનો એવો ભંડાર આપવાનું, જેનો વ્યવહારું ઉપયોગ તમે રોજંદા જીવનમાં કરી શકો. વાચકના ચારિશ્યને દઢ કરી શકે, તેમજ સુધારીને ઉજ્જવળ કરી શકે તે આ સ્વાધ્યાયનું પ્રયોજન છે.

આધ્યાત્મિક પુસ્તકો, શબ્દકોશ, વિશ્વકોશ અને સ્વયંશિક્ષણ કરાવતા ગ્રંથો વગરનું ઘર, એ બારી વગરના મકાન જેવું છે, જેમાંથી અજવાણું આવી ન શકે.

નાના, કુમળાં મન જ્યાં ઘડાય અને જીવન માટે કંડારાય છે તે સ્થાન વિશ્વવિદ્યાલય નથી, પરંતુ એ છે - ઘર!

- બટ્રોન્ડ રસેલ

પુસ્તકો

કદીય દળો ન દેનારા, મિત્રો છે એ મારા...

જેમની સાથે કરું ગોછિ, હું તો રોજ-બરોજની!

- રોબર્ટ સથી

૭૮

અહુંકાર

જ્યારે ઉન્મતતા અને બળુકાઈ અનુભવો
 અને તમારો અહું છાપરે ચઢે;
 જ્યારે તમે સ્વર્ગના રાજા થઈને મહાલો, પોતાને
 સૌના સ્વખનાં રાજકુમાર માનો.

ત્યારે થોડું થોભી જાઓ, અને તપાસી લ્યો કે
 તમે કાંઈ જગત માટે અનન્ય નથી;
 ત્રિપંખી લવિંગ સમા તમે વિરલ પણ નથી,
 ડગલા કરતાં વધારે તમારો કશો ઉપયોગ નથી!

એક બાલ્ટી લો, એમાં વરસાદનું પાણી ભરો,
 કોણી સુધીના હાથ તેમાં દૂબાડો
 પાછા ખેંચી લો એ હાથ અને તપાસો એ ખાડો
 તમારી ખોટ કેવી પૂરાઈ જય છે તે માપો.

જગતે જ્યારે આવ્યા, ચીસો પાડીપાડીને રક્યા.
 ચોમેર, બસ શોરબકોર!

પરંતુ જ્યારે જગેથી વિદ્યાય થશો, જાણીને અચરજ થશે કે,
 જગત તો એવું જ છે, જેવું અગાઉ હતું.

એટલે તારણ સ્વયંસ્પષ્ટ છે,
 થાય તે કાંઈ કરી છૂટો;
 નમ અને ન્યાયી બનો, એકાદું આંસુ લૂધ્યો
 કદી ન માનો કે તમે અનિવાર્ય છો!

- ડિગોન્ડાસ



જે કાંઈ જાણતો નથી,
અને એટલું પણ જાણતો નથી
કે તે જાણતો નથી...
તે મૂર્ખ છે... છોડો એને!

જે કાંઈ જાણતો નથી,
અને જાણો છે
કે તે જાણતો નથી...
તે સરળ છે... શીખવો એને!

જે જાણો છે
પરંતુ જાણતો નથી
કે તે જાણો છે...
તે ઉંઘતો છે... જગાડો એને!

જે જાણો છે
અને એ પણ જાણો છે
કે તે જાણો છે...
તે જ્ઞાની છે... અનુસરો એને!

- સ્વામી વિવેકાનંદ

નિંદ્રા તો સુવર્ણમુદ્રા!

તમારું અજ્ઞાત મન તો હમેશાં સક્રિય જ હોય છે. એ કદ્દી સૂતું કે જંપતું નથી. તમે ઊંઘો છો ત્યારે એ વધુ જડપભેર કામ કરે છે, કારણ કે તમારા જ્ઞાત મન તરફથી કશી ઉખલગીરી અને થતી નથી. તમે જ્યારે ઊંઘો છો ત્યારે અજ્ઞાત મન પાસેથી તમને મહત્ત્વના પ્રત્યુત્તરો મળે છે! તમારી નિંદ્રામાંથી તમે સર્વોત્તમ મેળવી શકો, તે માટેનાં આ વ્યવહાર સૂચનો યાદ રાખો:

- મનની શાંતિ અને શરીરની તંહુરસ્તી માટે ઊંઘ જરૂરી છે. ઊંઘની કમી ચીડ, ગ્લાનિ, ઉદ્બેગ અને માનસિક અભ્યવસ્થા ઉપજાવી શકે. નિંદ્રા દરમ્યાન આધ્યાત્મિક રીતે તમારામાં વિદ્યુતસંચાર થાય છે. પ્રસન્નતા અને શક્તિ-સંચય માટે પર્યાપ્ત ઊંઘ જરૂરી છે.
- તમે સમયસર જગી નહીં શકો તેવો ડર હોય તો, સૂતાં પહેલાં તમારા અજ્ઞાત મનને સૂચવો કે તમે ક્યારે ઊઠી જવા માંગો છો! તો તે તમને જગાઈ દેશે. એને ઘણિયાળની જરૂર નથી.
- તમે કોઈ પૂસ્તક લખતાં હો, અથવા તો સંશોધનનું કોઈ કાર્ય કરતાં હો તો રાતે તમારા અજ્ઞાત મનને કહો કે અની શક્તિ, જ્ઞાન અને અની બુદ્ધિ થકી જ સુંદર પૂસ્તક લખી શકશો, અથવા તો પૂર્ણ સંશોધન કરી શકશો. તમને આનાં આશ્ર્યર્થજનક પરિણામ જોવાં મળશે!
- તમારી જાતને અને બીજા સૌ કોઈને, સૂતાં પહેલાં માફ કરી દો અને જડપભેર રૂઝાયેલા ધાના ઉપચાર સાથે સવારે તો તમે પુનર્જન્મ પામ્યા હો, તેવા સ્કુર્ટિસભર બનીને જાગો છો!
- નિંદ્રા તમારી સાથે પરામર્શ કરે છે. ઊંઘતા પહેલા, પાંકું કરો કે તમારા અજ્ઞાત મનની અગાધ શક્તિ તમને દોરવાની છે. સર્વોત્તમની અપેક્ષા સેવો અને તમે જોશો કે સર્વોત્તમ જ અચૂકપણે તમારી પાસે ખંડું થશે.
- તમારા અજ્ઞાત મન પર અખૂટ વિશ્વાસ રાખો. ઘડીવાર તમારો અંતરાત્મા અયંત સ્પષ્ટ સ્વખ દ્વારા કે જાંખી દ્વારા પ્રત્યુત્તર વાળે છે. એ જ રીતે, સ્વખમાં તમને ચેતવણીના પૂર્વસંકેત પણ મળે છે!
- જ્યારે ટિવસ આખાનાં કષ્ટો અને સંધર્થોથી ત્રાસ પામો ત્યારે તમારા જ્ઞાત મનના ચક્કને શાંત પાડી દો અને તમારા અજ્ઞાત મનના શાણપણ અને પ્રજ્ઞાને વાગોળો, જે તમને ટેકો કરવા તત્પર છે. આથી તમને શાંતિ, શક્તિ અને વિશ્વાસ સાંપડશે.

માનસપટનો નકશો

તમારા ફુટંબ માટે જો તમે નવું મકાન બંધાવતા હોત તો તમને તમારા ઘરનો નકશો બનાવડાવવામાં કેટલો ઊંડો રસ પડ્યો હોત તે તમે જાણો છો. પહેલાં તો તમે એ જોશો કે ઠેકેદારે નકશાને બરાબર સમજી લીધો છે. તમે બધી માલસામગ્રી તપાસી લેશો અને સારામાં સારું લાકડું અને લોખંડ તથા બીજી તમામ વસ્તુઓ ઉત્તમ જ ખરીદશો.

પરંતુ તમારા અંતર્ગૃહ તથા પ્રેમ અને સમૃદ્ધિના આંતરિક નકશાનું શું? તમારા જીવનના તમામ અનુભવો અને જીવનમાં જે કંઈ આવે તે બધાનો આધાર તમે તમારું અંતર ઘડવામાં કેવી સામગ્રી વાપરો છો, તે પર નિર્ભર છે.

તમારા માનસિક નકશામાં જો ચિંતા, ભય અને ઉપાધિની ભાતો ઉપસી હશે, અને જો તમે નિરાશ, શંકાશીલ કે વકદરી હશો તો તમારા મનમાં જે કંઈ તાણાવાણા વણાશે તેમાંથી ચિંતા, તનાવ, ઉપાધિ અને મર્યાદાઓ જ બહાર આવશે.

તમે બધો વખત તમારા માનસિક ઘરના અંતર્ગૃહને ઘડતા હો છો. તમારા વિચારો અને કલ્યાણાઓ દ્વારા એનો નકશો બને છે. તમારા વિચારો દ્વારા તમે આરોગ્ય, સફળતા અને સુખ ગ્રાપ્ત કરી શકો. તમારી માન્યતાઓ અને અંતરપટ પર જીલાતી છબીઓનો પણ પ્રભાવ પડે છે. અંતરની આવી ઈમારતની રચના પર તમારું વ્યક્તિત્વ ઘડાય છે, લોકોમાં તમારી ઓળખ સર્જય છે અને પૃથ્વી પરનું તમારું સમગ્ર જીવન નિર્ભર છે.

એટલે તમારા માનસપટનો નકશો બરાબર દોરો! વર્તમાન ક્ષણમાં શાંતિ, સંવાદિતા, આનંદ અને મંગળભાવના સેવીને એનું ચુપચાપ નિર્માણ કરો. આ બધા સદ્ગુણો પર સ્થિર થશો અને એમને આત્મસાત્ત કરશો તો તમારું અજ્ઞાત મન તમારા નકશાને સ્વીકારી અને સાકાર કરી આપશો.

- ડૉ. જોસેફ મર્ફી

શબ્દોની અદ્ભુત શક્તિ!

હાલરડાનાં મધુર શબ્દો બાળકને ઊંઘારી શકે...

ઉતેજક વાણી ટોળાને હિંસક બનાવી શકે...

પ્રખર વક્તવ્ય લશ્કરને ફૂચ કરીને મૃત્યુના માં

ભાડી ધસવા પ્રેરશે...

પ્રોત્સાહક ઉદ્ગારો પ્રતિભાની જવાણાને ફૂંકી શકે

રેખ્ખાન્ટ અથવા તો લિંકન સમી...

શક્તિશાળી શબ્દો લોકમાનસને ઘાટ આપી શકે,

જે રીતે શિલ્પકાર સર્જ છે માટીમાંથી મૂર્તિ...

શબ્દો છે ગતિશીલ પરિબળ!

શબ્દોમાં આણુભોભની વિસ્ફોટક શક્તિ પણ છે અને ઘર્ષણ પર સ્નેહન કરવાની તૈલી શક્તિ પણ છે. એ યુદ્ધની હાકલ પણ કરાવી શકે, અથવા શાંતિની ઘોખણા પણ કરી શકે.

બીજા લોકોના આપણા વિષેના પ્રત્યાઘાત કેવા હશે, તેનો મોટો આધાર તેમની સાથેની આપણી વાતચીત પર છે. જીવન એ એક એવી વિશાળ ગોલરી છે, જેમાં આપણા શબ્દો પ્રયંડપણે પડધાય છે.

કેટલાય શબ્દો સાથે આપણા વિચારોની રૂઢિગ્રસ્તતાને કારણે એક એવો માનસિક સંદર્ભ રચાયેલો હોય છે કે, એ શબ્દો વાપર્યા વગર આપણા માટે વિચારવું અશક્ય થઈ પડે છે.

એટલે આપણે શબ્દોની પસંદગીમાં ખૂબ જીણવટથી ધ્યાન આપવું જોઈએ. માત્ર સારી અભિવ્યક્તિ માટે જ નહીં, બલ્કે સ્પષ્ટ ચિંતન રજુ કરવા માટે પણ ઉત્તમ શબ્દોની પસંદગી થવી જોઈએ.

અસરકારક શબ્દોની પસંદગી કરવા અને એનો ઉત્તમોત્તમ ઉપયોગ કરવા માટે, સર્વપ્રથમ તો તમારી પાસે વિશાળ શબ્દભંડોળ જોઈએ. આવો વિશાળ શબ્દભંડાર ધરાવનાર પોતાની વાતને સ્પષ્ટ અને પ્રભાવકારી રીતે કહી શકશો.

આજના દિવસ માટે આટલું નક્કી કરવું ફાયદાકારક અને આનંદદાયી નીવડશે કે તમારા શબ્દભંડોળને સમૃદ્ધ કરવા તમે રોજ એક નવો શબ્દ જાણો. બાર મહિનાના અંતે ઉદ્યે નવા શબ્દો ઉમેરી તમારા શબ્દકોષને તમે સમૃદ્ધ કરી લીધો હશે.

સ્વાધ્યાયની કથા

અભ્યાસ માટેનો લગાવ એ જિંદગીનો સૌથી સુંદર આનંદ છે. અભ્યાસ એટલે જે ના વિષે જાણવું હોય, તે વિષય પર આપણા મનને એકાગ્ર કરવું. શૈક્ષણિક પ્રક્રિયાનો આ એક ભાગ છે અને વાચન, નિરીક્ષણ, પ્રશ્નોત્તરી દ્વારા એની પરિપૂર્તિ થાય છે.

સફળ અભ્યાસ એ વાચન કરતાં ધણું બધું વધારે છે. સફળતાપૂર્વક અભ્યાસ કરવા માટે, મનને આંતરશિસ્ત વડે કેળવી વાંચવામાં લગાડવું જોઈએ. આપણા અભ્યાસ દ્વારા આપણને જે જ્ઞાન મળ્યું હોય તેને અમલમાં મૂકી એનો પરિણામદાયી ઉપયોગ કરવાની શક્તિ ગ્રાપ્ત કરવી એ સ્વાધ્યાયનું અંતિમ લક્ષ્ય છે.

કશું સમજ્યા વિચાર્યા વગર ઉતાવળે વાંચ્યે જવું, અથવા તો મન આમતેમ ભટકતું હોય અને આંખો અક્ષરો પર ફરતી હોય, તો આવા નિષ્ઠિય વાચનથી કશું નીપજતું નથી. આનાથી વિચારને કશો અભિક્રમ મળતો નથી કે નથી કોઈ માહિતી સંધરાતી. વાચનને અભ્યાસ કે સ્વાધ્યાયમાં ત્યાં સુધી નહીં ગણાય, જ્યાં સુધી વાચક પોતે જે કાંઈ વાંચ્યે તેને વાગોળી પ્રત્યક્ષ જીવનમાં આચરણમાં મૂકવાનો નિર્ણય ન કરે.

પુસ્તકોમાંથી સર્વોત્તમ ચીજ સારવવી હોય તો પંદરેક મિનિટ વાંચો અને પિસ્તાલિસ મિનિટ સુધી જે કાંઈ વાંચ્યું તે પર ચિંતન-મનન કરો.

અનુકૂળ બેઠક પર સીધા બેસી સામે મેજ પર પુસ્તક રખાય તો સારો અભ્યાસ થઈ શકે છે. વાંચવાના સ્થળ પર ઓછામાં ઓછી ડખલગીરી જોઈએ. આંખો ખેંચાય નહીં તે માટે પૂરતો પ્રકાશ જોઈએ. ઓરડાનું તાપમાન મધ્યમસરનું હોવું જોઈએ, જેથી એકાગ્રતા સાધી શકાય.

તમારા અભ્યાસ દરમ્યાન, અગત્યના ભાગ પર ચિંતન કરવા નીચે લીટી દોરો. હાંસિયામાં પણ નાની નાની નોંધો કરી લેવાય અને સારરૂપે થોડોક સારાંશ અંકિત કરી લેવાય, તો વાંચેલું પચાવવામાં સરળતા થશે.

- ઇમર્સન

શાળાના આચાર્યને અષાહમ લિંકનનો પત્ર

ઉમદા વિચારો અને આદર્શોવાળા અમેરિકાના સોળમા પ્રમુખ અભ્રાહમ લિંકનની, દુનિયામાં આજ સુધી થઈ ગયેલા નામાંકિત રાજદ્વારી વિચારકોમાં આગવી ગણતરી થાય છે.

લિંકનનો પુત્ર શાળામાં ભણતો હતો, ત્યારે તેના આચાર્યશ્રીને અનોખી શૈલીમાં બહુ જ સમજપૂર્વકનો તેમણે પત્ર લખ્યો હતો. શાળામાં શું શીખવવું જોઈએ તે અંગે આ પત્ર ઘણા જ ઉમદા વિચારો દર્શાવે છે. આ પત્ર શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમજ તેમના વાલીઓ માટે પ્રેરણાદ્યક અને હદ્યસ્પર્શી બની જશે.

“હું જાણું છું કે તેણે શીખવું પડશે કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી અને બધા માણસો સાચા હોતા નથી. પણ તેને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્યા માણસો હોય છે તેમ સારા માણસો પણ હોય છે જ, અને સ્વાર્થી રાજદ્વારી માણસો હોય છે તેવી જ રીતે સર્મર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે જ. અને એ પણ શીખવજો કે દુશ્મનો હોય છે તો સાથે સાથે મિત્રો પણ હોય છે. બની શકે તો અને શીખવજો કે સાચી રીતે કમાયેલો ડૉલર મફતમાં મળેલા પાંચ ડૉલર કરતાં અનેકગણો કિંમતી છે. અને ખેલદિલીથી હારતાં શીખવજો અને જીતવાનો આનંદ માણવાનું પણ શીખવજો. તમારાથી બની શકે તો તેને પુસ્તકની અજાયબ દુનિયાની સમજ આપજો. અને થોડોક નિરાંતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકસો બેસીને આકાશમાં ઊંચે ઊડતાં પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઊગેલાં અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ મારી શકે.

“શાળામાં અને એટલું તો જરૂર સમજવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું તેના કરતાં નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તોપણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રદ્ધા રાખતાં અને શીખવજો. એણે સારા માણસો સાથે સલુકાઈથી વર્તવાનું અને આકરા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ રોપજો કે બધાં જ જ્યારે પવન પ્રમાણે પીઠ

બદલતાં હોય, ત્યારે ટોળાને અનુસરવાને બદલે તે એકલવીર બની શકે. એને બધાની જ વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જે સારું હોય એ જ ગ્રહણ કરે.

“તમારાથી બને તો તેને દુઃખમાં પડા હસ્તાં શીખવજો અને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક દૃષ્ટિવાળા માણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતતા રહેવાનું પણ શીખવજો. એને પોતાની બુદ્ધિ અને શક્તિની વધારેમાં વધારે હિંમત ઉપજવતાં શિખવાડજો પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બૂમોથી ઝૂકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઊભો રહી લડત આપે તેવું શિખવાડજો.

“એને મૃદુતાથી સંભાળજો પણ વધુ પડતાં લાડ લડાવી બગાડશો નહીં, કારણ કે અનિમાં તપીને જ લોખંડ પોલાદ બની શકે છે. એને અસહિષ્ણુ બનવાની હિંમત આપજો અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જાતમાં અડગ વિશ્વાસ રાખતાં પણ શિખવાડજો, કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે.

“હું જાણું છું કે આ બધું જ શીખવનું અતિશય મુશ્કેલ છે પણ તમારાથી જે કાંઈ કરી શકાય તે જરૂર કરજો. કારણ કે મારો પુત્ર એક મજાનો માણસ છે.”

અમર આત્માની તપ્તી પર...

આરસના પથ્યરને કંડારો, વહેલો-મોડો એ નાશ પામશે,

તાંબા પર શિલ્પકામ કરો, તો એના પર પણ કાળનો પ્રભાવ પડશે,
મંદિરો ઊભાં કરીશું, તો એ પણ જમીનદોસ્ત થશે.

પરંતુ જો આપજો માનવના અમર આત્મા પર કામ કરીએ...

ઉન્નત વિચારોથી એને ભરી દઈએ.

ઇશ્વરના ન્યાયી ભયથી અને બાંધવોના પ્રેમથી... ભરી દઈએ.
આત્માની આ તપ્તી પર, એવા અક્ષર કોરીએ, જેને કાળ ભૂંસી ન શકે,
અને ઉત્તરોત્તર એ વધુને વધુ જગારા મારે અનંતકાળ સુધી!

- ડેનિયલ વેઝ્સ્ટર

કૃપા પરમાત્માની



હે પ્રભુ!

આટખું યાદ રાખવામાં
તું મને મદદ તર...

... કે આજે
એવું ઊંઠથી નથી બનવાનું...

જે, તું અને હું
સાથે મળીને
પાર પાડી ન શકીએ!







કૃપા પરમાત્માની

પ્રભુ!

જેને હું બદલી ન શકું
તે સ્વીકારવાની
મને સ્વર્ણતા આપજો!

જેને હું બદલી શકું,
તેને બદલવાની
મને હિંમત આપજો!

... એને
આ બન્ધેની ભેદરેખા
સમજવાનું
શાણપણ મને આપજો!

વાત છે તમારી અને પરમાત્મા વચ્ચે!

લોકો ઘણીવાર વિવેકહીન, અવ્યવહાર

અને સ્વકેન્દ્રી બની જાય છે...

આવા લોકોને ગમે તે રીતે જીમા કરી રહો!

તમે ભલા હો તો પણ,

લોકો તમને સ્વાધી અને ડિતવાંધુ કહે...

તેમ છતાંય ભલા બની રહો!

જો તમે સફળ હશો તો,

કેટલાક વિશ્વાસધાતી મિત્રો મળશે

અને કેટલાક કણ્ણર દુષ્મન પણ...

તેમ છતાંય સફળ થતાં રહો!

તમે પ્રામાણિક અને નિષ્ઠાવાન હશો,

તો લોકો તમને છેતરશે...

છતાંય પ્રામાણિક અને સંનિષ્ઠ બન્યા રહો!

જે નિર્માણ કરવામાં તમને વર્ષો લાગ્યાં,

બીજાઓએ રાતોરાત એનો નાશ કર્યો....

તો પણ સર્જન કરતા રહો!

જો તમે શાશ્વત અને સુખી હશો,

તો કેટલાક ઇર્ધ્યા પણ કરશે...

છતાંય સુખી બન્યા રહો!

તમારાં સત્કાર્યો

મોટા ભાગે ભૂલાઈ જવાનાં...

છતાંય એ કર્યો કરો!

તમારું સર્વોત્તમ આપતાં રહો,

અને ક્યારેય એ પર્યાપ્ત ન પણ બની રહે...

છતાંય ઉત્તમને પીરસ્યા કરો!

અંતે તો ખરી વાત છે તમારી અને પરમાત્મા વચ્ચેની!

તમારી અને એ લોકો વચ્ચેની વાતનાં કોઈ સવાલ જ નથી!

પ્રેરણામૂર્તિ ગણેશ



ગણેશજનું મોટું મસ્તક પ્રેરે છે આપણને,
આપક અને નફાકારક ચિંતન કરવાનું...

એમના વિશાળ કર્ણ પોકારે છે કે,
આપણે ધ્યાનપૂર્વક કાન માંડીએ
નવા વિચારો, નવા સંકેતો ભડી....

એમની જીણી જીણી આંખો ઉતેજે છે આપણને,
આપણાં કામો સફળતાથી પૂર્ણ કરવા
લક્ષ્યવેધી એકાગ્રતાથી....

એમનું લાબું નાક પ્રેરે,
સૂંઘતા રહીએ જ્ઞાસાથી
જ્ઞાનભંડાર મેળવવાને....

એમનું નાનું મોહું સૂચવે,
બોલો ઓછું અને સાંભળો વધુ...

એમનું વિશાળ પેટ યાદ કરાવે,
જે કાઈ સાંભળીએ તે સમાવી રાખીએ આપણા પેટમાં...

એમના હાથમાં લાડુ પ્રેરે,
સૌની સાથે વહેંચીએ મીઠાશ....

રિદ્ધિ અને સિદ્ધિ, એમની બે જીવન સંગ્રિની,
શીખ આપે આપણને,
કે જીવનમાં મહત્વનાં છે વિદ્યા તેમજ સંપત્તિ!

જગાડ મારા દેશને, હે તાત!

ચિત્ત જ્યાં હોય ભયશૂન્ય
અને મસ્તક જ્યાં ઉમત,
જ્યાં જ્ઞાન હોય બંધનમુક્તાં...

જ્યાં સાંકડી ઘરેલું દિવાલોથી
વિશ્વને ટુકડાઓમાં ખંડિત ન કરાયું હોય...

શબ્દો જરે જ્યાં સત્યના ઊંડાણોથી...

જ્યાં કર્મનો અથાક પ્રવાહ
પૂર્ણતા તરફ ફેલાવે હાથ...

જ્યાં બુદ્ધિનું નિર્મળ જરણું
રગશિયા જીવનની સૂકી રણ-રેતમાં વિલોપાયું ન હોય...

જ્યાં સદા વિસ્તરતા વિચાર-આચાર પ્રતિ
મનને આગળ ધ્યાવતા તમે સારથી બની...
આવા અનોખા સ્વાતંત્ર્યના સ્વર્ગો, હે તાત...
જગાડ મારા દેશને!

- રવીન્દ્રનાથ ટાગોર

વૈશ્વિક પ્રાર્થના

હે પ્રભુ! તારી શાંતિનું વાધ બનાવ મને!

જ્યાં તિરસ્કાર છે ત્યાં વરસાવું હેત...
જ્યાં કરાય હુમલો ત્યાં બંધું ક્ષમા હું...
હોય જ્યાં સંશય ત્યાં વિશ્વાસ રોણું...
નિરાશા જ્યાં વસે ત્યાં પ્રગટાવું આશા...
જ્યાં રહે વિધાદ ત્યાં આનંદ વસાવું...

હે પરમાત્મા! મને સાંત્વન, સમજદારી અને પ્રેમની
ઝંખના ન કરતાં... આ સદ્ગુણો હું કેળવું તે શીખવાડજે...

કારણ, આપવાથી જ આપણને મળી શકે છે!

- સેન્ટ ફાન્સિસ ઓફ અસીસી

ભીતરમાં ડોફિયું

હિંદુ દંતકથા મુજબ, પૃથ્વી પર એવો યુગ હતો જ્યારે લોકોમાં પ્રભુનું જ્ઞાન અને ગુણ હતાં. પરંતુ ભૌતિક સુખસગવડનો અંતરપટ, માણસજાતને આ વારસાથી દૂર કરતા ગયા.

બ્રહ્માને થયું કે આવા મૂલ્યવાન ખજાનાને તરંગી માણસોના હવાલે રાખવો યોગ્ય નથી. એટલે એમણે માત્ર કોઈ વીરલો જ શોધી શકે તેવી સલામત જગ્યાએ એને સંતાડવાનું નક્કી કર્યું.

“ચાલો આપણો એને પૃથ્વીના પેટાળમાં ઉંડે દાટી દઈએ,” એક દેવે સૂચન કર્યું.

“નહીં! લોકો પૃથ્વીને ખોદીને પણ એ શોધી કાઢશો,” બ્રહ્માએ જવાબ આપ્યો.

“તો પછી ચાલો એને આપણો સાગરને તળિયે સંતાડી દઈએ,” બીજાએ કહ્યું.

બ્રહ્માએ એ વિચારને પણ ન સ્વીકાર્યો. એમણે કહ્યું, “લોકો ઉંડી રૂબકી મારીને ક્યારેક ત્યાંથી પણ એને શોધી શકશો.”

ત્રીજા દેવે પૂછ્યું “તો પછી આપણો એને સૌથી ઉંચા પર્વતની ટોચ ઉપર કેમ ન સંતાડીએ?”

ત્યારે બ્રહ્માએ કહ્યું, “બિલકુલ નહીં, લોકો તો ઉંચામાં ઉંચા પર્વત પર પણ આરોહણ કરી જાણે છે! પણ મારી પાસે એક બહેતર સ્થાન છે. ચાલો, આપણો એને માણસમાં જ ઉંડે સંતાડી દઈએ. ત્યાં શોધવાનું કદી કોઈને સુઝશે જ નહીં!”

અને આમ, યુગયુગાંતરથી માણસ અહીં-તહીં ફંકા મારતો નિરર્થક ભટક્યા કરે છે. એને જરીકે ભાન નથી કે સાચું જ્ઞાન અને પરમ આનંદ તો એની પોતાની અંદર જ છૂપાયેલાં છે.

માત્ર કેટલાક સદ્ગ્રામી આત્મા, જેમને ‘આત્મસાક્ષાત્કાર’ થયો છે, તેમણે જીવનનું આ પરમ ધ્યેય પ્રાપ્ત કર્યું છે!

અનેંત શક્તિંદ્રિય... ... અનેંત સાથે એકત્ર થકી!

આપણો અનંત શક્તિના છીએ આત્મસ્વરૂપ,
જેટલા પ્રમાણમાં આપણી અભિમુખતા હોય
તેટલા અંશે પરમશક્તિ પ્રગટે આપણી ભીતર
પ્રભુ સાથે અનુસંધાન કેળવાય, તો બધું જ શક્ય છે જીવનમાં!

આપણી અંદરની શક્તિનું સાચું રહસ્ય પરમતત્વ સાથે
અનુસંધાન કેળવામાં છે. જેટલા પ્રમાણમાં આ અનુસંધાન
જળવાઈ રહેશે, તેટલા પ્રમાણમાં આપણો આપણી પ્રત્યેક સંભવિત
મર્યાદાઓને ઓળંગી જઈ શકીશું.

તો પછી, શક્તિ મેળવવા માટે આમતેમ ભટક્યા કરવાની
શી જરૂર છે? કેડીઓમાં, ખીણોમાં અને અન્ય ઢોળાવોમાં રખડ્યા
કરવાને બદલે સીધા પર્વતના શિખરે જ શા માટે ન પહોંચી
જવું? વિશ્વના તમામ ગ્રંથોમાં આ વાત કહેવાઈ છે કે શરીરે
બળવાન માણસમાં નહીં, પણ આધ્યાત્મિક મનુષ્યમાં જ સર્વોપરી
શક્તિ ધૂપાયેલી છે. દાખલા તરીકે, મનુષ કરતાં ઘણાંય વિશાળ
અને શક્તિશાળી જાનવરો હોય છે, પરંતુ માણસ આ લોકો પર
પણ પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે છે એ માટે એને ફુદરત તરફથી
મળેલી માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ
કરવો પડે છે, જે સૌથી મહાન શક્તિ છે.

ભૌતિક રીતે જે સાધી ન શકાય, તે આધ્યાત્મિક રીતે
સાધી શકાય છે. જેટલા પ્રમાણમાં માણસને એની આ આત્મશક્તિનું
ભાન થાય છે અને તદનુસાર પોતાનું જીવન ગોઠવી જાણે છે,
તેટલા પ્રમાણમાં એની આ શક્તિનો સ્કોટ થાય છે. જગતના
તમામ સદ્ગ્રંથો આપણો જેને ચ્યામ્પટકાર કહીએ છીએ, તેવા
દાખલાઓથી ભર્યા પડ્યા છે. આ કોઈ લોકોત્તર માણસો નહોતા.
એ તો બસ, ઈશ્વર સાથેની પોતાની અભિનન્તતા પામી જઈ, પ્રભુના
માણસ બન્યા હતા, જેથી અપાર્થિવ પરિબળો તેમના દ્વારા કામ
કરી શકે.

તો ચમત્કાર એટલે શું? શું એ કોઈ અલૌકિક ઘટના છે ? સામાન્ય માણસો સામાન્ય સંજોગોમાં જે કામ કરી શકે તેના કરતાં કશુંક ઊંચા પ્રકારનું બને તેને ચમત્કાર કહી શકાય. ચમત્કારનો અર્થ આના સિવાય બીજો હોઈ ન શકે. જે માણસને પોતાના સ્વરૂપનું સાચું ભાન થઈ ગયું છે અને સર્વવ્યાપી, સર્વજ્ઞતા, સર્વશક્તિમાન પરમ સત્તા સાથે જેણે તાદાત્મ્ય સિદ્ધ કરી લીધું હોય, તે માણસ ઈશ્વરી નિયમો અને શક્તિઓનો જ્ઞાનપૂર્વક સદ્ગુર્યોગ કરી જાણે છે.

હા, આવા પ્રભુના માણસ અલૌકિક શક્તિઓને આત્મસાત્ત્ર કરી મોટા ભાગના લોકો કરતાં મૂઢી ઊંચેરા બની જાય છે. પરંતુ જે વાત એક માણસ માટે શક્ય છે, તે તમામ માટે શક્ય છે. જીવનમાત્ર માટે એક જ કાનૂન લાગુ પડે છે. આપણે પણ વીર્યવાન અથવા નયુસસ્ક બંને બની શકીએ. જે ક્ષણે માનવને ભાન થાય કે એ ઊંચો ચરી શકે છે, તે ક્ષણે એની તમામ મર્યાદાઓ તૂટી પડે છે અને એ ઊંચો ચરી જાય છે. પછી તો એ પોતે બાંધે તે સિવાયની કોઈ મર્યાદાઓ રહી શકતી નથી. મહિમાં નવનીત ઉપર તરી જ આવે, કારણ કે નોખા તરી આવવું એ માખણનો ગુણધર્મ છે.

વિશ્વમાં શક્તિનો એક જ સ્લોત છે. તમે ચિત્રકાર, વક્તા, સંગીતકાર, લેખક, ગુરુ કે ગમે તે હો, તમારે સમજી લેવું જોઈએ કે શક્તિનું રહણ્ય જાણવું એટલે પરમ શક્તિ સાથે જોડાવું! જેથી એ સતત કામ કરી શકે અને તમારા દ્વારા પ્રગટ થઈ શકે.

તમે તમારી જાત માટે ગમે તેટલો ઊંચો આંક ધરાવતાં હો, પરંતુ જ્યાં સુધી તમે માત્ર ભૌતિક, શારીરિક, બૌધ્ધિક સ્તર પર જીવ્યા કરશો, ત્યાં સુધી તમે તમારી જાતને મર્યાદાઓથી બાંધી રાખશો.

તેમ છતાં, જ્યારે તમે અનંતજીવન અને પરમશક્તિ સાથે તમારા વ્યક્તિત્વને એકાત્મ થયેલું અનુભવો અને તમારા દ્વારા એ પરમ શક્તિ ને કાર્યરત થતી અનુભવો ત્યારે તમે જીવનના એક નવા જ તબક્કામાં પ્રવેશ કરશો જ્યાં ઉદ્વર્ગામી શક્તિઓ માત્ર તમારી જ હશે!

- રાલ્ફ વાલ્ડો ટ્રાઈન

પાદચિહ્ન!

એક રાતે,
મને સપનું આવ્યું
કે
સાંગરકાંઠે હું પ્રભુ સાથે ટહેલતો હતો.
દૂર આકાશમાં
મારા જીવનની અનેક ઘટના
દર્શાવાઈ રહી હતી.

ક્યારેક એમાં બે પગલાંનાં ચિહ્ન દેખાતાં
તો ક્યારેક ચાર!

આથી મને મૂંજવણ થઈ, કારણ મેં નોંધ્યું કે
મારા જીવનના કપરા કાળમાં,
જ્યારે દુઃખ, પીડા અને પરાભવથી
હું દુઃખી દુઃખી હતો, તે ગાળામાં જ મેં જોયું કે
નિશાન
માત્ર બે પગનાં હતાં.

એટલે
મેં પ્રભુને કહ્યું, “આવું કેવું, નાથ!”
તમે તો મને વચન દીધ્યું હતું કે,
જો હું તમને અનુસરતો રહીશ
તો તમે સદા મારી સાથે જ હશો!
પરંતુ મેં બરાબર જોયું, દેવ
કે મારા જીવનના કપરા સંકટકાળમાં જ
રેતી પર બે પગનાં નિશાન જ છે.
આમ કેમ? જ્યારે મારે તમારી તાતી જરૂર હતી
ત્યારે જ તમે મારો સાથ છોડી દીધો?”

ત્યારે પ્રભુએ જવાબ વાયો,
“તારા દુઃખના દહાડાના કસોટી કાળમાં જ,
જ્યાં તને બે પગનાં નિશાન જ દેખાય છે, તે મારા પગનાં છે,
કારણ,
ત્યારે મારે તને ઊંચકી લેવો પડેલો!”



ઇશરે
આપણ સહુને
અના પોતાના બીબામાં ટાળ્યા.

અનું પોતાનું બધું,
થોડું-થોડું આપણામાં મૂકચું....
અનો પ્રેમ,
અની ભવ્યતા,
અની તાકાત...



કમભાગ્યે,
આ છેલ્લું સ્થાન છે,
જ્યાં
આપણામાંના મોટા ભાગના લોકોને
સૂર્જે છે
આ બધું
શોધવાનું!

– વોલ્ટર સ્ટેપલ્સ

ફેર પાડ્યો મારી પ્રાર્થનાએ!

એક સવારે સફાળો ઉઠીને
તરત જ કામે ચઢી ગયો
એટલાં બધાં કામ ચઢી ગયાં હતાં કે,
પ્રાર્થના કરવાનો સમય જ ન રહ્યો....

પ્રશ્નો ચોમેરથી મને ઘેરી વણ્ણા
અને પ્રત્યેક કામ બોજાલું બનતું ગયું
“ભગવાન કેમ હારે ધાતો નથી?” મને નવાઈ લાગી.
એ બોલ્યો, “તે મદદ કરારે માંગી?”

મને આનંદ અને સૌન્દર્યની ખોજ હતી
પરંતુ દિવસ આખો લોથપોથ;
આશ્વર્ય ઈશ્વર કેમ કશું કરતો નથી?
ત્યાં એ બોલ્યો, “પરંતુ તે માંગ્યું જ કરારે?

ઈશ્વરના સાંનિધ્યને અનુભવવા,
બધી ચાવીઓ અજમાવી જોઈ
પ્રભુ ધીમેથી પ્રેમપૂર્વક ગજાગજાયા,
“તે ખખડાયું નહોતું, મારા બાળ!”

એટલે પછી આજે સવારે વહેલો ઉઠી ગયો,
અને પ્રાર્થના માટે સમય કાઢવો
અને તરત બધું બદલાઈ ગયું,
કારણ આજે, સોનાનો સૂરજ ઉંઘ્યો હતો!

પ્રાર્થના

એ આપણું અંતિમ શરણ બનવાને બદલો...
...આપણી પ્રથમ પસંદગી બનવી જોઈએ!

- મહાત્મા ગાંધી

પ્રાર્થનાના ચમત્કાર!

પ્રાર્થના એ માણસની ભક્તિભાવની સૂક્ષ્મ અભિવ્યક્તિ છે, માણસની શક્તિનો આ સર્વોત્તમ પ્રકાર છે. શરીરમાં રસ જરતા અંગનું જે કાર્ય છે, તેના જ જેવું કાર્ય પ્રાર્થનાનું માનવમન પર છે. પ્રાર્થનાનો પ્રભાવ વિવિધ ક્ષેત્રે મૂલવી શક્ય. એ તમારી તારણશક્તિ પર પણ પ્રભાવ પાડે, તમારી બૌદ્ધિક ક્ષમતાને પણ વધારે, નૈતિક સત્ત્વશીલતા પણ જાળવી શકે અને માનવીય સંબંધોની વાસ્તવિકતાઓ અંગેની ઊંડી સમજ પણ વિકસાવી શકે.

તમે ઉત્કટ પ્રાર્થનાની ટેવ પાડી દો તો તમારું જીવન નખશિખ બદલાઈ જશો. પ્રાર્થના આપણાં કૃત્યો, આચરણ અને વ્યવહાર નીચે સહીસિક્કા કરી આપે છે. માનવીય ચેતનાની ગહરાઈઓમાં એક જ્યોત જળહળે છે અને માણસ પોતે એ અનુભવી શકે છે. એના અજવાળો, એ પોતાનો સ્વાર્થ, પોતાનું અભિમાન, ભયો, લોભ અને પોતાની ભૂલો જોઈ શકે છે. એનામાં નૈતિક કૃતજ્ઞતાનો અને બુદ્ધિનિષ્ઠ નભ્રતાનો ભાવ જાગે છે. આમ આત્માની પરમાત્મા ભણીની યાત્રા આરંભ થાય છે.

પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેવું જ પ્રબળ પરિબળ આ પ્રાર્થના છે. એક ચિકિત્સક તરીકે મેં એવા માણસોને જોયા છે, જે તમામ ચિકિત્સા પદ્ધતિઓ અજમાવીને હાર ખાધા પછી, પ્રાર્થનાના સ્વસ્થ પ્રયોગ દ્વારા રોગ અને ચિંતામાંથી સંદર્ભ બહાર નીકળી આવ્યા હોય! વિશ્વમાં ‘કુદરતના કાનૂન’ને પેલે પાર જવા માટે ફક્ત પ્રાર્થના એક જ શક્તિ છે. પ્રાર્થનાના આવા નાટકીય પ્રભાવને ‘ચમત્કાર’ રૂપે જોવાય છે.

ઘણાં બધાં લોકોને મન પ્રાર્થના એટલે અમુક શબ્દાવલિના રટણનું રોજિંદુ કામ છે, અથવા તો દીનહીન લોકો માટેનો આશરો છે કે પછી ભૌતિક બાબતોની માંગાઝી કરતું મામૂલી અરજ્ઞપત્રક છે. આપણે પ્રાર્થનાને આવી દૃષ્ટિએ જોવા માંડીએ છીએ ત્યારે અતંત દુઃખદ રીતે આપણે પ્રાર્થનાનું અવમૂલ્યન કરીએ છીએ.

પ્રાર્થના એ પૂર્ણ-વિકસિત ચિત્તનો પૂર્ણચંક્ર છે. માત્ર પ્રાર્થનામાં જ, માણસની કાયા, મન અને આત્માનું એક એવું સંપૂર્ણ અને સંચાદમય સંયોજન થાય છે જે માણસના નબળા, હાલકડોલક થતાં રહેતા વ્યક્તિત્વને અડગ અને સ્થિર રહેવાની શક્તિ સિંચે છે.

- એલેક્સીસ કેરેલ

પરમ સૌભાગ્યની અનુભૂતિ!

આજે બસમાં મેં એક સુંદર છોકરી જોઈ,
અને મને થયું કે હું પણ એટલો રૂપાળો હોત!
એ એટલી બધી પ્રસન્ન લાગી, મને એની ઈર્ઝા થઈ!
અને ત્યાં તો અચ્યાનક જવા માટે એ ઊભી થઈ
અને મેં એને લથડાઈને ગબડી જતી જોઈ, મેં જોયું કે,
એને માત્ર એક જ પગ હતો, બીજો હતો બનાવટી
પરંતુ પસાર થઈ ત્યારે એ મલકતી હતી!
હું પ્રભુ! મારા અફસોસ માટે ક્ષમા કર.
મારે તો બંને પગ છે! સાચે જ હું કૃતાર્થ છું! દુનિયા મારી પોતાની છે!

ત્યાર બાદ શેરીમાંથી ગુજરતાં
એક ભૂરી આંખવાળા માણસને મેં જોયો.
પરંતુ એ કેવળ કિનારે ઊભો રહ્યો અને બીજાને રમતાં જોતો રહ્યો!
એટલે ક્ષણવાર થોભીને મેં પૂછ્યું, “તમે રમતમાં કેમ જોડાતા નથી?”
ત્યારે એક પગ શબ્દ બોલ્યા વગર એ સામે જોતો રહ્યો
અને પછી મેં જાણ્યું કે તે બહેરો હતો.
હું પ્રભુ! મારા અફસોસ માટે મને ક્ષમા કર,
મારે તો બેઉ કાન છે! સાચે જ હું ધન્ય છું! પૂર્ખી મારા પગમાં છે!

અને સમી સાંજે, થોડીક મીઠાઈ ખરીદવા હું રોકાયો
મીઠાઈ વેચતો છોકરો ભારે મીઠડો હતો.
મેં એની સાથે વાતો કરી.
મોહું થાય તો પગ મને એની પરવા નહોતી!
પરંતુ જવા માટે જેવો હું ફર્યો, તેણે મને કહ્યું
“ભાઈ, ખૂબ આભાર તમારો. તમે ખૂબ ભલા છો!
તમારા જેવા લોકો સાથે વાત કરવી ગમે છે!
પરંતુ મને માફ કરો, હું અંધ છું!”
હું પ્રભુ! મારા અફસોસ માટે ક્ષમા કર.
મારે બે આંખો છે. સાચે હું ઉપકૃત છું. વિશ્વ મારા હાથમાં છે!

ગમે ત્યાં જવા ચાહું, બે પગ છે મારા
જાણવા ઈચ્છું તે સાંભળવા બે કાન છે મને,
આથમતા સુરજના આધા ઉજાશને જોવા બે આંખ છે મારે,
હું પ્રભુ! મારા અફસોસ માટે ક્ષમા કર.
સાચે જ હું પુરસ્કૃત છું! સૃષ્ટિ મારે હવાલે છે!

- ઓગ મેન્ડિનો

સહન કરનાર માટે જીવન-સંદેશ!

ઈશ્વર પાસે મેં શક્તિ માંગી,

કે હું સિદ્ધિ હાંસલ કરી શકું!

પરંતુ

મને મળી નબળાઈ, જેથી નમ્રતાપૂર્વક હું શરણ માંગી શકું!

મેં ધનવૈભવ માંગ્યા કે હું સુખી થઈ શકું,

મને મળી ગરીબાઈ, જેથી હું શાખો બની શકું!

મેં માંગી સત્તા, જેથી લોકોમાં માન મેળવી શકું,

પણ મને મળી નિર્બળતા, જેથી ઈશ્વરની મને જરૂરત રહે!

મેં ઘણુંબધું માંગ્યુ, જેથી જીવનને હું માણી શકું,

પણ મને મળ્યું જીવન, જેથી બધી ચીજોને હું માણી શકું!

મેં જે માંગ્યું, તે મને કદી ન મળ્યું,

પરંતુ જે માટે આશા રાખી, તે બધું મળી રહ્યું.

મારી ઉપરવટ થઈને,

મારી બધી વણબોલી પ્રાર્થનાઓ સ્વીકારાઈ હતી.

સાચે જ, બધા લોકોમાં, હું સૌથી વધુ કૃતાર્થ છું!

આ જીવનના પરિવર્તન અને તકાને

ભયપૂર્વક ન જૂઓ...

બદકે

એમને શ્રદ્ધા અને આશાની નજરે નિહાળો,

કારણ કે જ્યારે એ ઘટિત થશે ત્યારે,

જેના તમે છો, તે ઈશ્વર

તમને એમાંથી બહાર કાઢશો.

કાં તો સંકટ સામે વાલ બનશો...

અથવા તો,

એને સહેવા તમને પ્રબળ સહનશક્તિ આપશો!

નિષ્ફળતાનો ભાસ થાય ત્યારે...

પ્રભુ! તમે મને કાંઈ કહેવા માંગો છો?

કારણ, હાર તે કાંઈ મારી હાર નથી...

મારે હજુ જીતવાનું બાકી છે, એટલો જ એનો અર્થ છે!

નિષ્ફળતાએ મને કાંઈ નથી આપ્યું એવું થોડું છે?

કાંઈક તો હું જરૂર શીખ્યો છું, એટલો જ એનો અર્થ છે!

પરાજય મને મૂર્ખ થોડો સાબિત કરે છે?

પ્રયોગો માટે મારામાં પૂરતો વિશ્વાસ છે, એટલો જ એનો અર્થ છે!

હાર્યો તેથી મારા પર કશી અવકૃપા થઈ તેવું થોડું છે?

અજમાયશાની હામ ભીડી, એટલો જ એનો અર્થ છે!

નિષ્ફળતા એટલે કાંઈ કાયમ માટે ચોકડી નથી મરાતી,
હવે મારે કાંઈક જુદી રીતે કરવાનું, એટલો જ એનો અર્થ છે!

હારનો અર્થ હું ઉત્તરતો છું, તેવો નથી.

પૂર્ણતા પામવાનું હજુ બાકી છે, એટલો જ એનો અર્થ છે.

પરાજિત થયો એટલે સમય વેડફાયો નથી...

ફરી ફરી આદર્યા કરવાનું છે, એટલો જ એનો અર્થ છે!

હાર્યો તેથી હવે બધું છોડી દેવાનું, તેવું તો કાંઈ નથી...

વધુ મહેનત કરવાની એટલો જ એનો અર્થ છે.

એકવાર હાર્યો તેથી કદી નહીં જતું, એવો એનો અર્થ નથી...

મારે વધુ ધીરજ દાખવવાની છે, એટલો જ એનો અર્થ છે.

પરાજય તે તમે મને છોડી દીધાનો સંકેત નથી...

તમારી પાસે કોઈ વધારે સારો વિકલ્ય હશે,

એટલો જ એનો અર્થ છે!

પ્રારંભ

સમાપ્તિ એ આરંભના બીજ છે.

સમય થયે કાલ ઉગવાની જ.

નિરાશામાં પણ આશાનું બીજ છે,

અને નાના બીજ પણ ઉપર ચડી શકે છે.

પરંતુ નાના બીજે ઉગતા વૃક્ષ તરીકેની તેની યાત્રામાં,

પોતાના પૂર્વરૂપને ખોવું પડે છે.

જીવનમાં ચઢિયાતા થવાના તમારા અનુભવોમાં પણ

તમે અગાઉનાં સ્વખોને ત્યજ નથી દીધાં?

પ્રત્યેક વાદળ ખૂલે છે સૂરજના સ્મિત સામે,

અને ઓટ પણ ભરતીમાં ઉભરાય છે.

અંદર અને બહાર જવાનો દ્વાર તો છે એકજ,

તેમાંથી ગૌરવભેર પસાર થવું એ છે તમારી મૂલ્યપત્રિકા.

ચોરસ બનાવવા માટે બે ત્રિકોણોએ પોતાનું

આત્મસર્પણ કરવું જ પડે.

જીવનની પ્રત્યેક શોધ માટે પણ, તમે કાંઈક

માન્યું હોય તેને જતું કરવું પડે.

પતંગિયું બનવા ઈયણે પણ તેનો કોશેટો છોડવો પડે,

રાજ બનવું હોય તો તમે પણ ભૂતકાળ ત્યજ દો.

પાછું વળીને નથી જોતા તેવાજ અશ્વો શ્રેષ્ઠ દોડે છે,

આગળ ધપીએ જીવનમાં નવી ઊચાઈઓ સિદ્ધ કરવા.

ગગનમાં ઊંચે ઉડવા કાંઈક અગવડો તો વેઠવી જ પડે.

પરંતુ ખોટાનો અંત, શું સાચાની યોગ્ય શરૂઆત નથી?

એટલે અંત જ્યાં શરૂ થાય છે, તે સ્થળે તમે ઉભા છો

ભૂતકાળથી બંધાયેલા કે પછી બંધનમુક્ત,

એક માર્ગ તમે જ્યાં હતા ત્યાંજ તમને લઈ જશે,

તો બીજો બનશે તમારી મુક્તિનો પંથ.

એટલે, ઊગતા સૂર્યની જેમ ઊંચે ચઢતા રહો,

પવન જેમ ઊંચકે છે શાંત દરિયાને.

વસંતની વાવણીની જેમ, અંતરમાં રોપો આશાનું બીજ,

અને માંડો ડગ આગળ, નૂતન નિયતિ ભણી!

કૃપા પરમાત્માની



જીવનમાં

સામનો ઊરવાની પ્રત્યેક આફુતને
બે પાંખ્યિયો રસ્તો છોય છે...

તમારે જ પસંદગી ઊરવાની છે...

આફુત સામે

તમે ભાંગી પડો...

... કે પછી

આફુતને ભાંગી

તમે નીકળો આરપાર!







ਮਣਾ-ਮਾਨਗੋਨੀ ਜੁ ਕਨ ਗਾਥਾ ਸਭਦਾ ਤਰਾਵੇ ਛਰ ਪਲ,
ਓਡੇਤ ਜੁ ਕਨ ਜੁ ਕੀ ਜਾਣੀਐ ਆਪਣੇ ਪਾਂਠਾ ਗੈਰਕ ਸਭਦਾ...



... અને વિદ્યાય લેતા જી વનથી, મૂળી જઈએ પાછળ,
અમીટ નિશાન સાપુણાં પગાસાંનાં સમય તાણી રેત પર!



આપણા જી બન
સૂર્યની ગતિ-દિશા સમાન છે...



સૌથી અંધકારમય એવી ઘડીએ જ...
સૂર્યપ્રકાશનું વચ્ચે આપે છે!

આવિ એમની સાથે જ જોડાયેલું છે...





જે તેમના સ્વર્ણના સૌંદર્યમાં વિશ્વાસ રાખે છે!



તમે જ છો ટાંકણું...
તમે જ શિલ્પભાર...
અને તમે જ છો પથ્થર!
જીવન એ જ છે...
જેવું તમે એને ઘડો!

મન, શરીર અને આત્માના વિકાસ માટે જીવનમાં ‘પ્રેરક વાંચન’ સમું બીજું કોઈ અમૃત નથી! પછી એ અસ્ખલિત ગધનો જાદુ હોય કે મુગધ કરનાર પદ્ધની કાવ્યકલા! એકવાર તમારા અંતરને સ્પર્શી જાય... પછી એ સદાકાળ માટે પરમ આનંદ અને સ્વર્ગીય સુખનો અનન્ય અનુભવ કરાવે છે!

હિતાશ થયેલાઓમાં શક્તિ અને હિંમત સીંચવા, નિરૂત્સાહી બનેલાઓમાં આશા અને આનંદનો સંચાર કરવા તેમજ દુઃખી થયેલા લોકોને સ્વરથતા અને સાંત્વન બક્ષવા... આના જેવું સામર્થ્ય અન્ય કોઈ ચીજમાં નથી!

જુસ્સાસભર વ્યક્તિઓ માટે પણ ‘પ્રેરક વાંચન’... એમને પ્રેરણા, પ્રોત્સાહન તેમજ નવજીવન બક્ષનાર જડીબુઝી બની રહે છે... જેના દ્વારા તેઓ સિદ્ધિના ઉલ્લંઘા શિખરો સર કરી સાર્થક અને પરિપૂર્ણ જીવન જીવવા શક્તિમાન બને છે!

જીવનપ્રેરક ચિંતન રણો

પ્રેરક કાવ્યો, બોધ કથાઓ તેમજ મનનીય ચિંતનકણિકાઓનું
સુંદર અને કલાત્મક સંકલન...

જે તમારા મન તેમજ આત્માના પુષ્ટિકરણ સાયે...
કલ્પનાતીત ક્ષિતિજો ખોલી... તમારા જીવનને સદાબહાર બનાવશે!